

દીપોત્સવી વિશેષાંક

ગુર્જરમાત

વર્ષ : ૨૭ • અંક : ૪૧ • સળંગ અંક : ૧૩૫૭ • મુંબઈ • બુધવાર
તા.૩૦ ઓક્ટોબર - ૫ નવેમ્બર ૨૦૨૪ • કુલ પાના-૫૬ કિંમત રૂ.૬.૦૦

શુભ

લાભ



અંતરમાં ઉજાસ ફેલાવવાનું પર્વ: દીપોત્સવ

સંસ્કૃતિ આંતરબાહ્યને ઉજાસ અને ઉલ્લાસથી ભરી દેનારા ઉત્સવોના રાજા સમાન દીપોત્સવ પર્વની ગુર્જરમાત પરિવાર આ દીપોત્સવી અંકના માધ્યમથી સર્વ વાચકો, જાહેરખબર દાતાઓ અને શુભેચ્છકોને ખૂબ ખૂબ અભિનંદન પાડવે છે. વિક્રમનું નવું વર્ષ આપ સૌ માટે ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને વ્યાપારમાં વૃદ્ધિ કરનારું રહે એવી શુભકામના આપે છે. આપણી ભારતીય સંસ્કૃતિ ઉત્સવો અને તહેવારોથી જીવનને સદાય ધબકતું રાખવાની સંસ્કૃતિ છે. કારતક મહિનાથી તે છેક આસો મહિના સુધી આવતા મકરસંક્રાંતિ, હોળી, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રી જેવા અનેક તહેવારો આપણી રોજાંટી ઘટમાળથી ભરેલી જાંઠગીમાં આપણા તનમનને આનંદ, ઉલ્લાસ ભરી તેને નવપલ્લવિત કરે છે. સમગ્ર વર્ષ દરમ્યાન ઉજવાતા અગણિત ઉત્સવોમાં શિરમોર સમો ઉત્સવ છે દિવાળી કે દીપોત્સવ. ધનતેરસથી ભાઈબીજ સુધીનો આ દીપોત્સવમાં આવતા દરેક તહેવારનું વિશિષ્ટ મહત્વ છે, જે દરેક ઘરના આંગણે અને મનમાં ઉજાસ લઈને આવે છે. આ પાવન ઉત્સવ હજારો વર્ષથી જ્યારે શ્રી રામચંદ્ર ભગવાન આસુરી શક્તિના પ્રતિક સમાન રાવણનો વધ કરીને માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે ૧૪ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પરત આયાં ત્યારથી ઉજવવામાં આવે છે. અયોધ્યાવાસીઓએ તેમનું સ્વાગત કરવા માટે ઘરઘરમાં દીવડા પ્રગટાવ્યાં અનેએ અમાસની રાતે સમગ્ર શહેર ઝળહળતા પ્રકાશથી ભરાઈ ગયું. ત્યારથી આ અસત્ય પર સત્યના વિજયના અવસરને દીપોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો, આ દીપોત્સવ પ્રસંગે આપણે આપણા ઘર અને દિલને રાગ, દ્રેષ જેવા યંદરિપુઓ સમાન અંધકારથી મુક્ત કરી જીવનને સત્ય, પ્રેમ અને કડ્ડણ સમાન પ્રકાશના માર્ગે લઈ જવાનો સંકલ્પ કરીએ.





જયંત ઇડા

તંત્રી સ્થાનેથી

Click Here

વર્ષ આખાનું સરલૈયુ આપે
દિવાળીના દિપકની જ્યોતિ,
નવવર્ષનો આશાવાદ જગાલે
દિવાળીના દિપકની જ્યોતિ...!

આપ સૌને દિવાળી તેમજ નવાવર્ષની શુભેચ્છા



:: સૌજન્ય ::

- શ્રીમાન ચંદ્રકાંત વલ્લભજી ગોગરી
- શ્રીમતી જયા ચંદ્રકાંત ગોગરી
- શ્રીમાન દામજી માણેક ગડા
- શ્રીમતી દીના દામજી ગડા

[Click Here](#)

1 BHK रेडी स्लेट 99 लाख
तदन नवी बिल्डिंगमां
Office Wadhwa The Gateway
Sale/Rent Available
2 BHK 1.50 cr.
3 BHK 1.90 cr.
ओबेरोय 3,4 BHK भाडेथी
तेमज वेयागुथी मणसे
Deepak Kesaria
9707 777 771

गुर्जरमत

f t i /gurjarmat Website : www.gurjarmat.com MNE/420/2024-26



www.namkeenhardin.com

वर्ष : २७ • अंक : ४१ • सणंग अंक : १३५७ • मुंबई • बुधवार • ता.३० ओक्टोबर - ५ नवेम्बर २०२४ • कुल पाना ५६ • किंमत ३.६.००



METRO
GROUP

SARASWATI PARADISE

Only 'SETTLE' for the most exclusive

Book your dream home today and experience a lifestyle of comfort and luxury! Saraswati Paradise offers world-class amenities, designed to elevate your everyday living.

Saraswati
paradise
MULUND WEST

PREMIUM 2 & 3 BHK HOMES

Zaver Road, Mulund West

+91 88 2890 0009

www.saraswatiparadise.in

Site Address: Saraswati Paradise, at Zaver Road, Mulund West - 400080

uptown
ADVISORY

Disclaimer: The plans, specifications, images and other details herein are only indicative and the developers reserve their rights to change any or all of these in the interest of the development. The printed material does not constitute an offer and or contract of any type between the developer and the recipient. Any purchase/lessee of this development shall be governed by the terms and conditions of the agreement for sale/lease entered into between parties and no detail mentioned in this printed material shall in any way govern such transaction.

MahaRERA Registration

No.: P51800051636



Click Here

ઈશ્વર નૂતન વર્ષે આપને
તથા આપનાં પરિવારને
શુભ, શાંતિ, સમૃદ્ધિ અને
ઐશ્વર્ય અર્પે ઐજ શુભકામના



સર્વે મુલુંડવાસીઓને દિવાળી
અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા



0, 62-1-A, Mulund Colony,
Guru Gobind Singh Marg,
Mulund (W) Mumbai- 400082

Website : www.sweetindulgence.in

Email : heena.sweetindulgence@gmail.com

Contact : HEENA SUMARIA +91-9699830446

- Cookies
- Oats Cookies
- Wheat Cookies
- Nutrition Bars
- Date Bars
- Jaggery Bars
- Granola
- Nut Butter



HEALTHYLICIOUS MUNCHING

[Click Here](#)

પોસ્ટ ખાતાની વિવિધ નસત
તેમજ વીમા યોજના માટે

- કિસાન વિકાસ પત્ર (KVP)
- નેશનલ સેવિન્સ સર્ટિફિકેટ (NSC)
- મન્યલી ઈન્કમ સ્કીમ (MIS)
- રીકરીંગ ડિપોઝીટ (RD)
- સુકન્યા યોજના વિગેરે માટે

રાજલ જુગર ચંદે
9920014863

ગુર્જરમાત

f t i /gurjarmat Website : www.gurjarmat.com MNE/420/2024-26

મજાદાન - મહાદાન

આઈડીયલ હોમ વેલફેર
ચેરીટેબલ ટ્રસ્ટ®

@ હેપી ફીજ

સંપર્ક : 79771 17894

વર્ષ : ૨૭ • અંક : ૪૧ • સળંગ અંક : ૧૩૫૭ • મુંબઈ • બુધવાર • તા.૩૦ ઓક્ટોબર - ૫ નવેમ્બર ૨૦૨૪ • કુલ પાના ૫૬ • કિંમત રૂ.૬.૦૦

VIKAS CONSTRUCTIONS

WISHING YOU A
HAPPY DIWALI
& HAPPY NEW YEAR

UNDER CONSTRUCTION

UPCOMING PROJECT

VIKAS
11

2 BHK
CONFIGURATION

3 & 4 BHK

OPP. RATNA SUPER MARKET

MULUND WEST

VIKAS PALAZZO, VALJI LADHA ROAD, MULUND WEST
OC RECEIVED PROJECT

This project has been registered via MahaRERA registration No.: P51800001960 and is available on the website <https://mahaonline.gov.in> under registered projects.

[Click Here](#)

॥ શ્રી ગણેશાય નમઃ ॥



શ્રી માં ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ-નરા (કચ્છ)

મુલુંડ ઓફિસ : એ-૫, મોરેશ્વર ટાવર, એમ.જી. રોડ, સારથી હેલ્થકેરની સામે, મુલુંડ (વે.), મુંબઈ- ૪૦૦ ૦૮૦. (Office) : 8866297562

ગૌશાળા - જીવદયા કેન્દ્ર એવમ્ ગૌમુક્તિ ધામ દ્વારા આયોજિત

આપ સર્વને દિપાવલીની હાર્દિક શુભેચ્છા સાથે નૂતન વર્ષાભિનંદન



મુખ્યઆચાર્ય

શ્રી પ્રવિણ મહારાજ દામોદર જોષી
(નારાયણ સરોવરવાળા)



વ્યાસપીઠપદ : ભાગવત આચાર્ય
શ્રી વિશાલ કૃષ્ણ શાસ્ત્રીજી
(નારાયણ સરોવરવાળા)
(સંસ્કૃત B.A. વ્યાકરણાચાર્ય)

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

ગૌશાળાના લાભાર્થે

મુલુંડને આંગણે ભાગવત સપ્તાહ

તા.૭-૧૧-૨૦૨૪ થી તા.૧૩-૧૧-૨૦૨૪

બુધવારે તા.૬-૧૧-૨૦૨૪ના દેહશુદ્ધિ સાંજે ૬ કલાકે

કથા સમય : રોજ બપોરે ૩.૦૦ થી સાંજે ૭.૦૦
ફક્ત ગુરુવારે સવારે ૧૧ થી ૧૨.૩૦, રવિવારે ૯ થી ૧૨
કથાસ્થળ :

રફર, ઈન્દ્રપ્રસ્થ હોલ, બાલરાજેશ્વર મંદિરની પાછળ, વૈશાલીનગર, તિરૂમલા ટાવરની સામે, મુલુંડ (વેસ્ટ)

ભજન સંધ્યા : શનિવાર, તા.૯-૧૧-૨૦૨૪ના રાત્રે ૮ થી ૧૦ કલાકે પ.પૂ.શ્રી ઋષભનાથ બાપુ દ્વારા

સંપર્ક સૂત્રો

શ્રી ભરતભાઈ માવજી બારૂ (ઠક્કર)
મે. સ્થા. ટ્રસ્ટી-ચેરમેન
9892507373

શ્રી જયેશભાઈ ચાંપશી રૂપારેલ (જય અંબે)
ટ્રસ્ટી - વાઘસ ચેરમેન
9820063989

શ્રી અશ્વિનભાઈ માધવજી ચંદન
ટ્રસ્ટી-મંત્રી
9820043855

કિર્તી કેશવજી ઠક્કર (ધેરાઈ)
ટ્રસ્ટી-બજાનચી
9820047397

હરેશ આઈયા
(કારોબારી પ્રમુખ)
9821735859

શ્રી જીગ્નેશભાઈ મુરલી દૈયા
કારોબારી મંત્રી
9322779933

[Click Here](#)

Yogi Hills-Mulund West
Available 2 BHK For Sale
 Fully Furnished Flat
 Without Electronic Items.
 Full Flat Garden Facing
Carpet : 610' Sq.Feet
 Payment - Full Cheque
 If Required we sending
 Photos and Videos.
Owner : Sanjay Thakker
9833726529, 9223358545

गुर्जरमत

f t i /gurjarmat Website : www.gurjarmat.com MNE/420/2024-26

PRIME PEST CONTROL **BMC Approved**
Pest Control & Also Services For Mosquito & Bird Netting
TO BOOK YOUR SERVICE
 80705 23555 / 666 / 777 / 888 / 999
 primepestcontrolserve@gmail.com
 www.primepestcontrolservices.com
 Branch : Mulund (West), Mumbai - 400 080.
 Head Office : Dadar (West), Mumbai - 400 028.

वर्ष : २७ • अंक : ४१ • संपादक अंक : १३५७ • मुंबई • बुधवार • ता.३० ऑक्टोबर - ५ नवेम्बर २०२४ • कुल पाना ५६ • किंमत ३६.००


ARIHANT BANK

SHRI ARIHANT CO-OP. BANK LTD.

1st July - 31st December 2024



With **LOWEST INTEREST** Rates,
 we are still very much **Co-operative**



*ROI linked to the CIBIL score. Terms & conditions apply

Head Office : GB-10 A&B, Karma Stambh, L.B.S. Marg, Vikhroli (West), Mumbai - 400 083

Bhandup (West) 86526 30381	Borivali (West) 86526 30390	Dombivli (East) 86526 30386	Ghatkopar (East) 86526 30383	Ghatkopar (West) 86526 30385
Masjid Bunder 86526 30384	Matunga 86526 30389	Mulund (West) 86526 30382	Thane (West) 86526 30388	Vashi 86526 30387
				Kamothe 86521 19656



SADA AAPKE SANG, ARIHANT
 For More Details, Call Nearest Branch or
Toll Free : 1800 221 984

Working Hours : 10:30 am to 05:30 pm (Except Bank Holidays)



SADA AAPKE SANG, ARIHANT www.arihantbank.com f t i @ Arihant Bank

Click Here



આશા ઉમંગ અને
પ્રકાશના રંગોથી
આગામી નવા વરસના વધામણા
કરીએ "અંતરનો ખળકાટ"
નૂતન વર્ષના સૌને સાલમુબારક



આપનો શુભચિંતક **હીરાલાલ મૃગ**

[Click Here](#)

2 BHK Available
For Sale Mulund West
Neelam Senroof Society,
Carpet 800, 2 BHK,
Fully well furnished flat
with Parking.
Available to see on
request Interested people
Please call on
9082041567
8928612125

ગુર્જરમાત

f t i /gurjarmat Website : www.gurjarmat.com MNE/420/2024-26

કિંજલ ફૂડ
વિદેશમાં ઉપયોગી
રેડી ટુ ઈટ, ડીહાઈડ્રેટેડ,
ફ્રીઝડ્રાઈડ, ફ્રોઝન ફૂડ
માટે વ્યાપારી પૂછપરછ આવકાર્ય
તેમજ ભારતમાં પ્રવાસ દરમિયાન
ટ્રેન-એરપોર્ટ ઉપર
ફ્રેશ જેન વેજ / સાલ્વિક ફૂડ
92215 06127
website : www.kinjalfood.com

વર્ષ : ૨૭ • અંક : ૪૧ • સળંગ અંક : ૧૩૫૭ • મુંબઈ • બુધવાર • તા.૩૦ ઓક્ટોબર - ૫ નવેમ્બર ૨૦૨૪ • કુલ પાના ૫૬ • કિંમત રૂ.૬.૦૦

મુલુંડ વિધાનસભા બેઠક માટે જામશે ત્રિપાંખિયો જંગ?

મહારાષ્ટ્ર વિધાનસભાની
ચૂંટણી માટે ઉમેદવારી
પત્રક ભરવાની છેલ્લી
તારીખ મંગળવાર,તા.૨૯
(અનુસંધાન પાના ૧૦ પર)



મિહિર કોટેચા



રાકેશ શેટ્ટી



સંગીતા વાજે

વિશેષ નોંધ

આજનો ગુર્જરમાત દીપોત્સવી
વિશેષાંક તરિક પ્રગટ કરેલ છે.
જેની કિંમત રૂ.૬ રાખેલ છે.

ધર્મેશ પ્રોપર્ટી ઘેટીવાલા
ઝવેર રોડ (મુલુંડ)
2 BHK ન્યુ બિલ્ડીંગ 2.15 કરોડ
3 BHK ન્યુ બિલ્ડીંગ 3.25 કરોડ
8169222044

શ્રી વિમલ એસ્ટેટ-મુલુંડ
4 BHK
ફોર સેલ
ઝવેર રોડ
2 પાર્કિંગ સાથે
81040 09694
98198 64456

પરમ પૂજ્ય માં ગીતા ભારતીજી
કા દાર્શનિક પ્રવચન

પરમ પૂજ્ય માં ગીતા ભારતીજી

:- દિનાંક :-
૧૦ નવંબર સે ૧૬ નવંબર ૨૦૨૪

:- સમય :-
રાત કો ૭ બજે સે ૯ બજે તક

દયાનંદ ગ્રાઉન્ડ, ચંદનબાગ રોડ, મુલુંડ વેસ્ટ, મુંબઈ - ૪૦૦૦૮૦.
સમસ્ત ભક્તોંકો હાર્દીક આમંત્રણ હૈ।

Diwali Menu

2nd & 3rd November, 2024

Welcome Drink
Sweets
Fruit Salad
Malvani Halwa
Rajbhog
Farsan
Masala Dahi Wada
Navratna Lifafa
Cheesy Dhokla

Vegetables
Jaipuri Paneer Masala
Shahi Angoori Bhuna
Aloo Achari Sabzi
Masuri Aamti
Roti
Phulka
Puri
Methi Masala Paratha

Rice
Gatta Corn Pulav
Steam Rice
Dal Khichadi
Dal
Sarsu Dal Fry
Gujarati Dal
Gujarati Kadhi

Unlimited Thali @
₹ 650
Inclusive of all taxes

Plus Salad, Papad, Butter Milk & Mukhwas

Tip Top GRAND THALI RESTAURANT

Lunch: 11.30 am to 3.30 pm
Dinner: 7.30 pm to 11 pm
Hotel Tip Top Plaza, L.B.S. Marg,
Near Teen Hath Naka, Thane (W).
Tel.: 88793 12345/98333 78234/022 6793 5301/02
Menu can be changed at any time without prior notice
Order online on **SWIGGY zomato**

THE PALACE BANQUETS

PLAN STARRY SANGEET AT
THE MOST LOVED VENUE ★★★★★
THE PALACE BANQUETS

PACKAGE STARTING RS. 3,60,000/- + MEAL & TAXES
(CAPACITY 175 TO 600+)

LIMITED DATES

Book Now: +917532060708

The Palace Banquets, Vikas Centre, N.S Road, Mulund West

Click Here

જનસંપર્ક અભિયાનમાં મિહિર કોટેયાએ મુલુંડ પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોને આવરી લીધા



મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિના ઉમેદવાર તરીકે નિમાયેલા ભૂતપૂર્વ વિધાનસભ્ય મિહિર કોટેયાએ છેલ્લા બે દિવસ દરમિયાન મુલુંડના અનેક વિસ્તારોની મુલાકાત લીધી અને લોકસંપર્કની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યા હતા.

મુલુંડ પૂર્વમાં એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા હનુમાન ચોક, ગણેશ ટોકીઝ, પ્રશાંત હોટલ, મુલુંડ અશોકા સોસાયટી (એ.પી.માર્ગ) વૃત્તિ સોસાયટી, જીવ્હી સ્કીમ રોડસ, રૂચિ હોટલ, ભોલેવાડી સહિતના વિસ્તારો આવરી લેવામાં આવ્યા હતા.

પદયાત્રામાં અસંખ્ય સમર્થકો હાજર રહ્યા હતા અને તેમણે મિહિર કોટેયાના વિજયના સૂત્રો પોકાર્યા હતા. સમર્થકોના ઉત્સાહ જોઈને મિહિર કોટેયાએ કહ્યું હતું કે તમારા ટેકાના જોરે હું ભવ્ય વિજય મેળવીશ. મિહિર કોટેયાએ પોતાના જનસંપર્ક અભિયાન દરમિયાન મુલુંડ પશ્ચિમમાં તાંબે નગર ગેટ નંબર ૧ અને ૨, સુધીર પાર્ક કોમ્પ્લેક્સ, રિદ્ધિ સિદ્ધિ, સિલ્વર હાઇટ્સ તથા ગવણી પાડા, ગીતાંજલી પંચશીલ એસોશિયેશન, બ્રહ્મા ટાવર અને ઝેનિથ ટાવર ઇત્યાદિ અનેક સોસાયટીઓના રહેવાસીઓને મળ્યા.

લાયન્સ ક્લબ ઓફ મુલુંડ દ્વારા આયોજીત ગ્રાન્ડ દાંડિયા ધમાકા કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.



મુલુંડ વિધાનસભા બેઠક માટે જામશે ત્રિપાંજિયો જંગ... (લમા પાનાથી ચાલુ)

ઓક્ટો. ના બપોરે ત્રણ વાગ્યા સુધી હતી. ૧૫૫ ક્રમાંકની મુલુંડ વિધાનસભા બેઠક માટે છેલ્લા સમાચાર મળ્યા તે મુજબ અંદાજિત કુલ ૧૫ ઉમેદવારો પત્રકો ભરવા ગયા હતા, જેમાં મહાયુતિના ભાજપા ઉમેદવાર અને વર્તમાન વિધાનસભ્ય મિહિર કોટેયાએ ગત ગુરુવારે ઉમેદવારી પત્રક ભર્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (શરદ પવાર)ના સંગીતા વાઝે

મંગળવારે પોતાનું ઉમેદવારીપત્રક ભર્યું હતું. ત્યારબાદ થોડા સમય પછી કોંગ્રેસ પાર્ટીના રોકેશ શેટ્ટીએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આમ મહાવિકાસ આઘાડીના બે ઘટક પક્ષો કોંગ્રેસ અને એનસીપી (શરદ પવાર)ના ઉમેદવારોએ નામાંકન પત્ર ભરતાં મુલુંડની બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે તિરંગી ચૂંટણી જંગ ખેલાય એવી શક્યતા છે. જોકે ઉમેદવારી

પત્રક પાછું ખેંચવાની છેલ્લી તારીખ ૪ નવેમ્બર પછી જ ચિત્ર સ્પષ્ટ થશે. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર રોકેશ શેટ્ટીએ સોશિયલ મિડિયા પર મૂકેલી એક પોસ્ટમાં તેમના પર વિશ્વાસ દર્શાવી તેમને મુલુંડ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકે જાહેર કરવા બદલ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, મહારાષ્ટ્ર



પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ નાના પાટોલે, મુંબઈ કોંગ્રેસની અધ્યક્ષા વર્ષા ગાયકવાડ, ઈન્ચાર્જ રમેશ અને વ્યંકટેશનો આભાર માન્યો




હતો. તદુપરાંત બહુજન સમાજ પાર્ટી વતી સિદ્ધેશ આલ્હાડ, વંચિત બહુજન આઘાડી વતી પ્રદીપ



શિરસાદ અને અપક્ષ ઉમેદવાર તરીકે કેશવ જોશી, સુનંદા સુરેશ પાટીલ, સંજય દેશપાંડે સહિત બીજા લોકોએ પણ ઉમેદવારી પત્રક

[Click Here](#)

કેડીઓ ક્લાસિક પરિવાર દ્વારા પૂજ્ય ડૉ. શ્રી જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રેરક પ્રવચન યોજાયું



કેડીઓ ક્લાસિક પરિવારના ઉપક્રમે રવિવાર, તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ વિશેષ સમારંભ યોજાયો, જેમાં પૂજ્ય ડો. શ્રી જ્ઞાનવત્સલ સ્વામીએ આત્મિક ઉન્નતિ અને જીવનને નવી દિશામાં જતું પ્રેરક પ્રવચન આપ્યું. તેઓ દ્વારા આપેલા વાસ્તવિક જીવનના ઉદાહરણો પ્રત્યેક હાજર વ્યક્તિના જીવન સાથે સહજ રીતે સંકળાયા, અને સૌએ તેમને મંત્રમુગ્ધ થઈને સાંભળ્યા.

કેડીઓ ક્લાસિક પરિવારના પ્રમુખ શ્રી મુકેશ મૈશેરી દ્વારા પરિવારની વિવિધ પ્રવૃત્તિઓ અને ઉદ્દેશ્યો વિશે માહિતગાર કરીને કાર્યક્રમને વધારે ઉજવાણીમય બનાવ્યો. પૂજ્ય સ્વામીજીને આ પ્રસંગે આમંત્રિત કરવા માટે હરેન્દ્રભાઈ (ગિરનાર ટી)ના સહકારનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો અને પરિવાર તરફથી આભાર વ્યક્ત કરાયો.

આ પ્રસંગે શ્રી લક્ષ્મીરાજ (ધરમશી) શાહે સંપૂર્ણ સમારંભનું સુચારૂ સંચાલન ખૂબ જ શાંતિપૂર્વક અને નિપુણતાથી સંભાળ્યું, જેનાથી કાર્યક્રમના દરેક



તબક્કે ઉદ્ધાસ અને આત્મીયતા જળવાઈ રહી. કાર્યક્રમમાં અતિગણમાન્ય

મહેમાનોની ઉપસ્થિતિએ સમારંભને વિશેષ શોભા આપી. આ ઉત્કટ અને ભવ્ય પ્રસંગ

દ્વારા કેડીઓ ક્લાસિક પરિવારે સમાજમાં એકતા અને સંસ્કારના મક્કમ સંદેશનો પરિચય કરાવ્યો. આ પ્રસંગની સફળતાનું શ્રેય

કેડીઓ ક્લાસિકના સ્થાપક સભ્ય શ્રી માણિકાંત હીરજી ઘુલાને જાય છે, જેમણે ૮૦ વર્ષની વયે પણ યુવાનોની જેમ કાર્ય કરી આ ભવ્ય

કાર્યક્રમને સ્મરણીય બનાવ્યો. તેમના અપ્રતિમ પ્રયત્નો અને નિષ્ઠાથી કાર્યક્રમ એક વિશેષ ઉચિત સ્તરે પહોંચ્યો.

YEAR 2025...SOON
INVEST IN YOUR FUTURE.
REBUILD A DYNAMIC & POSITIVE PERSONALITY.
UNIQUE ONE ON ONE COURSE WITH PERSONALITY EXPERT
Mr. ABHIJIT
9867489566
PERSONALITY STUDIO
IN MULUND WEST

Sheth Montana
3 BHK
Flat for Sale
Package Price
2.80 cr
9987700940
7977885488

જૂનામાંથી નવું + ફિએટીવ પિસ
રોજનું નવું-નવુંને ટ્રેડી પીસ પહેરવું ગમે છે પણ કબાટમાં ઘસારો બહુ છે તો જૂનામાંથી નવું ઉચલપાયલ કરી નવું કઈક બનાવીએ. સાડી, સેલા, બાંધણી બધામાંથી નવી સાડી, ચણિયા ચોલી, ઈન્ડો વેસ્ટર્ન બનાવડાવો. ડીઝાઈનર બ્લાઉઝમાં પરફેક્ટ ફીટીંગ ફીનીશીંગ સાથે રીલેબલ રેટની ગેરન્ટી.
હેતલ શાહ
98210 59549

નારી સાડી (જોગેશ્વરી ઈસ્ટ)
ઘરચોળા, બાંધણી, પટોળા, સેલા
દિવાળી ઓફર
50% ડિસ્કાઉન્ટ
M.8097987978
9820207332

PART TIME JOB IN MULUND
A REPUTED MNC REQUIRE Retired / VRS / House Wives / Senior Citizen to Start Second Innings Age 30 to 70 Years Earn Rs.30,000 to 1,00,000+ PF + Medical + Foreign Tour
Call: 98199 11819

મહારાજ બેકરી
નાન ખટાઈ બનાવીને અને બેકડ કરીને મળશે
કમ્પિંગ રોડ, ગાલા કંપની પાસે, મુલુંડ (વેસ્ટ)
99305 11916
88987 86915

જોઈએ છે
મુલુંડ વેસ્ટમાં નવા ખુલેલા **કિંગ વર્લ્ડ Men's** અને Ethnic Wearના શોરૂમ માટે અનુભવી કાઉન્ટર સેલ્સમેન તેમજ મેલ/ફિમેલ કેશીયર તુરંત જોઈએ છે.
કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે.
કિંગ વર્લ્ડ-98929 44090

Nikita Yadav
Mob.: 7021817988
NIKITA MEHENDI
Indian Mehendi
Arabic Mehendi
Floral Mehendi
Home Service Available

Flats For Sale In Redwood, Mulund West
2.5 BHK
Area - 1160 sq ft built up Approx 930 Sq.ft carpet
Price - 2 Cr, Parking available
1 BHK
Area - 575 Sq.ft Built up Approx 450 Sq ft Carpet
Price - 1.0 Cr, Parking Not available
2 BHK
Area - 945 Sq ft Built up Approx 725 Sq ft carpet
Price - 1.6 Cr, Parking available
9082041567
8928612125

અમારા માનવંતા ગ્રાહકોને દિવાળીની શુભેચ્છા તેમજ નૂતન વર્ષાભિનંદન

50% DISCOUNT on making charges for ready Diamond Jewellery

NK JEWELS
Diamond Jewellery beyond imagination...
DIAMOND | GOLD | SILVER | PLATINUM

૫, વિકાસ સેન્ટર, એસ.એલ. રોડ, નાગરિક ડ્રાયક્રુટની સામે, મુલુંડ (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૮૦. ફોન : 25691190

Click Here

મુલુંડના લોકપ્રિય ધારાસભ્ય મિહિર કોટેચાએ ભવ્ય રોડ શો કરી ઉમેદવારીપત્રક ભર્યું

મુલુંડના લોકપ્રિય ધારાસભ્ય મિહિર કોટેચાએ તા.૨૪ ઓક્ટોબર ગુરુવારે ભવ્ય રોડ શો યોજી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભર્યું હતું. મુલુંડ વિધાનસભાની બેઠક માટેનું ફોર્મ ભરવા માટે મહાયુતિના ઉમેદવાર મિહિર કોટેચા મુલુંડ ઈસ્ટના ચૂંટણી કાર્યાલયમાં ગયા ત્યારે ભારતીય જનતા પક્ષ તથા મહાયુતિ તરફથી જબરજસ્ત શક્તિપ્રદર્શન થયું હતું. મિહિર કોટેચાની સાથે ભૂતપૂર્વ સંસદસભ્ય મનોજ કોટક, પ્રકાશ મહેતા, સિનિયર નેતા ડૉ.કિરીટ સોમૈયા, જગદીશ શેટ્ટી, પૂર્વ નગરસેવકો પ્રકાશ ગંગાધરે, સમિતિ કાંબળે, નીલ સોમૈયા વગેરે નેતાઓ હાજર રહ્યા હતા. આ સાથે જ મિહિર કોટેચાના સમર્થનમાં હનુમાન નગરથી આઈટીઆઈ મુલુંડ (ઈસ્ટ) સુધી ભવ્ય રોડશો પણ યોજવામાં આવ્યો હતો. રોડ શોમાં મિહિર કોટેચાના હજારો સમર્થકોએ વિજયોત્સાહ સાથે નારા લગાવ્યા હતા.

ઉમેદવારીપત્રક ભર્યા પછી મિહિર કોટેચાએ ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષો દરમિયાન મેં સતત મુલુંડના વિકાસ માટે કામ કર્યું છે એનાથી સૌ વાકેફ છે. મુલુંડનો વિકાસ હજુ વધુ ઝડપથી થાય એ માટે હું પ્રયાસો કરીશ. કોવિડ દરમિયાન મેં કરેલા અથાગ કામ માટે આજે પણ લોકો મને યાદ કરે છે.



મંગળવારે મુલુંડ પૂર્વમાં મિહિર કોટેચાની જોશીલી પદયાત્રા યોજાઈ

ઘઈ કાલે મંગળવારે સવારે લોકપ્રિય નેતા મિહિર કોટેચાની મુલુંડ ઈસ્ટમાં ભવ્ય પ્રચારયાત્રા યોજાઈ હતી, જેમાં મહાયુતિના અનેક નેતાઓ, કાર્યકરો તથા સમર્થકો જોડાયા હતા. આ પદયાત્રા માનેપાડા ત્રિમૂર્તિ રોડથી શરૂ થઈ હતી અને જયહિંદ કોલોની, મલહારવાડી બાબુ નગર, સાળવીવાડી મીઠાગર રોડ તથા એની આસપાસના કેટલાક વિસ્તારોને યાત્રામાં આવરી લેવામાં આવ્યા હતા.

સમગ્ર પદયાત્રા દરમિયાન મિહિર કોટેચાનું અનેક સ્થળે સ્વાગત થયું હતું અને એમના સમર્થનમાં લોકોએ સૂરોચ્ચાર પોકાર્યા હતા. જનસંપર્કના આ



અભિયાનમાં મિહિર કોટેચા અને એમની શુભેચ્છાઓ પ્રાપ્ત અનેક રહેવાસીઓને મળ્યા હતા કરી હતી.

PRPના પ્રમુખ જોગેન્દ્ર કાવડેએ મિહિર કોટેચાના કાર્યાલયની મુલાકાત લીધી



પીપલ્સ રિપબ્લિકન પાર્ટી (પીઆરપી)ના રાષ્ટ્રીય પ્રમુખ જોગેન્દ્ર કાવડેએ મહાયુતિના ઉમેદવાર મિહિર કોટેચાની ઓફિસની મુલાકાત લીધી હતી અને એમને પૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે અમારા

પક્ષના કાર્યકરો મિહિર કોટેચાના પ્રચારાર્થે કામ કરશે. જોગેન્દ્ર કાવડેની સાથે તેમના પુત્ર જયદીપ કાવડે તથા પક્ષના અન્ય પદાધિકારીઓએ પણ સાથે રહ્યા હતા.

મિહિર કોટેચાએ આ મુલાકાતના સંદર્ભમાં કહ્યું હતું

કે ભીમશક્તિના સમર્થનને લીધે ચૂંટણીમાં મારી તાકાત વધી છે. તેમણે કહ્યું હતું કે સૌને ન્યાય અને સમાનતાનો અધિકાર મળે એ જોવાની મારી ફરજ છે. જોગેન્દ્ર કાવડેનો પક્ષ પીઆરપી અને આરપીઆઈ બંને મહાયુતિના ઘટક પક્ષો છે.

[Click Here](#)



Apno Ki Khushi Hi, Ghar Ki Roshni Hai

Happy Diwali

From Manba Finance Family

Ghar Layein Roshni Aur Financial Security



KIRIT R. SHAH

Chairman

MANISH K. SHAH

Managing Director

MONIL M. SHAH

Executive Director & CBO



Click Here

ક્લાસિકાઈડ્સ

ખાસ નોંધ

આ અખબારમાં પ્રગટ થતી કોઈપણ જા.ખ.ના આધારે કોઈને પણ પૈસા મોકલતા પહેલા, કોઈ અર્થ માથે લેતા પહેલા કે કોઈપણ પ્રકારનો કરાર કરતા પહેલા વાચકો પૂર્વની પુષ્ટપરછ કરી લે એવો તેમને અનુરોધ છે. એડવર્ટાઈઝરો દ્વારા પોતાની પ્રોડક્ટ અને સર્વિસીસ વિશે જે દાવો કરવામાં આવે છે તેના વિશે ગુર્જરમાત્ર કોઈ જવાબદારી સ્વીકારતું નથી. એડવર્ટાઈઝરો પોતાના દાવામાં ખરા ન ઉતરે એવા સંજોગોમાં કોઈપણ પરિણામ માટે ગુર્જરમાત્રના માલિક, તંત્રી, મુદ્રક અને પ્રકાશક જવાબદાર નહીં ગણાય.

- વ્યવસ્થાપક

ક્લાસિકાઈડ્સ

જાહેરાતના દર

ક્લાસિકાઈડ્સ જાહેરાતના

પ્રથમ ૧૫ શબ્દોના

રૂ. ૧૦૦ લેખે

સ્વિકારવામાં આવશે.

હેડીંગના રૂ. ૧૦ એક્સ્ટ્રા

થશે. ૧૫ શબ્દો પછીના

વધારાના દરેક શબ્દ દીઠ

રૂ.૫ તરીકે લેવા આવશે.

+ ૫% જીએસટી અલગ

લેવા આવશે. જાહેરાત

સોમવાર સાંજ સુધી જ

સ્વીકારવામાં આવશે.

જાહેરાતનું લખાણ ઓફિસ

પર ઉપલબ્ધ ફોર્મમાં જ

લખી આપવાનું રહેશે.

જાહેરખબર મોકલાવો -

કાર્યાલયમાં આપો

મુલુંડ ટાઈમ્સ પબ્લિકેશન સેન્ટર

બી-૩, ક્રિષ્ણકુંજ, ગ્રાઉન્ડ ફ્લોર,

વાલજી લધ્યા રોડ, મુલુંડ(વે).

સંપર્ક : 9322257731

gurjarmat@gmail.com

www.facebook.com

gurjarmat

www.gurjarmat.com

Display Advt. Rates

First colour Page
Rs.40/- Per Sq.cm.

Last colour Page
Rs.32/- Per Sq.cm.

Inner Colour Page
Rs.24/- Per Sq.cm.



French Classes

I help you to learn French Language to it's best. Online and offline classes, Weekend Classes too, Academic wise classes, Levels exams till A2, Audio visual sessions and oral practice, Library facility available to borrow books. Call : 9821116175 1163 (1374)

English Grammar Tuitions Board: ICSE/CBSE

Std.: 8th, 9th, 10th. Small Batches of 5-7 students Personalized Attention Regular Assessment and Mock Tests Whats App: 8169587673 Mulund West Batches start from 1st June 2024 1163 (1374)



GROOMING

EMPOWER & GROW. Shape Up Your Personality under Expert Personality Mr. Abhijit Sir - 9867489566 6685 (1357)

એકાઉન્ટ્સ

કંપની સોસાયટી અને પરિનલ એકાઉન્ટ્સ, જી.એસ.ટી., ઈન્ડમટેક્સ સાથે ફાઈનલાઈઝેશન સુધી કરી આપશું. દિલીપભાઈ - 9324203535 499 (1397)
Job in Insurance Sector Call : 9773661090



પૂજા ભરેજ બ્યુરો

મેળાપથી હસ્તમેળાપ સુધી ગુજરાતી, જૈન, કચ્છી, ભાનુશાલી સમાજના યુવક-યુવતીઓ માટે જીવનસાથી મેળવવાનું એકમાત્ર સ્થાન. દીકરીઓ માટે ફી રજીસ્ટ્રેશન સંપર્ક : 88283 52585 કરી તમારા જીવનસાથીની શોધ પુરી કરો. 1227 (1376)



ધર્માધારી

કવર! કવર!! કવર!!!

ટ્રોલી બેગ, ડાઈનિંગ ટેબલ, L.C.D. વોશિંગ મશીન, હોમ થીયેટર, ઓવન, કોમ્પ્યુટર, સાડી, ડસ્ટ પ્રોટેક્ટ કવર ઈન્ડિયન, ઈમ્પોર્ટેડ ટ્રાન્સપરન્ટમાં સંપર્ક : ઈલાબેન પંચ્યા - 9224366624 000 (1404)

વોશિંગ મશીન રીપેરીંગ

શું આપનું વોશિંગ મશીન માર્કેટવેલ ઓવન LCD, LED, T.V., બગડી ગયું છે? બોલાવો પ્રેમલ શાહને ઘરે આવીને રીપેર કરી આપશું. પ્રેમલ શાહ : 9892020358 916 (1365)

પ્રતાપ પેકર્સ એન્ડ મુવર્સ

૪૯ વર્ષથી ઓફીસ ઘર સામાન, કાર, હોમ ટુ હોમ. 9920955291, 98210 70320, 9821543816 લલીતભાઈ ૬૬૬૨ ૦૩૧ (૧૩૭૮)

Jainam Publicity

પેપરોમાં માર્ગદર્શિકા, શ્રદ્ધાંજલિ આપવા દોડાદોડી કરશો નહિં, ફક્ત Whatsapp કરો. 9619160611, 9323804751 621 (1361)

RVS Pest Control

Fast Relief From Termite, Bedbugs, Cockroaches, Rats, General Injection etc. With Full Guarantee. 90048 88384, 98333 31222 6658 (1363)

સનસાઈન કવર્સ

ડાઈનિંગ ટેબલ કવર, વોશિંગ મશીન કવર, સુટકેસ કવર, ઘરઘંટી કવર, માર્કેટવેલ કવર, બ્લેન્કેટ કવર, બ્લાઉઝ કવર, ગીફ્ટ આઈટમ કવર, ગિટાર કવર, કેસીઓ કીબોર્ડ કવર, સાડી કવર, કુર્તિ કવર, અન્ય વિવિધ પ્રકારના કવર તમારા ઘરે, ઓફિસે આવીને બનાવી આપીશું. આલમ - 98924 44436 98924 44413 / શબ્દીર - 87798 49022, 88501 55168. 00 (1357)



1+1 Free

બ્રાઈડલ પેકેજ, બ્યુટી પેકેજ, બ્યુટી પાર્લર શીખો, કાન, કાણા પૂરાવો. ઘર બેઠા કરો. 9867094908, 9224751673 163 (1384)



જ્યોતિશિક્ષા

શ્રી એસ્ટેટ એજેન્સી

ઘર, મકાન, દુકાન, પ્લોટસ લેવા અથવા વેચવા સંપર્ક કરો. 9324017291, 98700 56751 034 (1379)

(મુલુંડ વેસ્ટ, વૈશાલી નગર પાસે)

શ્રીનગર માં 85.50L

1 BHK, 507 (Built Up), 450 (Carpet), ૧ લે માળે,
* શ્રી આદિનાથ દેરાસરની સામે,
* ૩ સાર્થ ઓપન
* હવા ઉજાશ વાળી જગ્યા,
* ૨૪ કલાક પાણી,
* MGL ગેસ લાઈન,
ખરેખર રસ ધરાવનાર સંપર્ક કરે : 93222 19263

Oberoi Eternia

3 BHK Unfurnished/ Semi-Furnished, Ready to move in apartments available for Sale/Rent. Contact : 9224944922, 9833726529 6697 (1383)

મુલુંડ ઈસ્ટ સાઈનાથ એપાર્ટમેન્ટ 2 BHK વેચાણથી એરિયા 621 કારપેટ. નિલેશ : 93239 01171, 87798 97074 632 (1401)

Furnished 2 BHK in Runwal Pride

• Location : LBS Marg, Mulund-W
• Floor : 15th (Higher Floor)
• Area : 940 sq ft
• Covered Parking : 1 Space

Available at Best Price 83948 86622

Follow us on
f /gurjarmat
Website :
www.gurjarmat.com



ધર્માધારી

મુલુંડ વેસ્ટમાં જેન્ટલ વેરનું બમ્પર સેલ સેલ સેલ

પ્લસ સાર્જની કોટન પેન્ટની અદ્ભુત વેરાયટીઓ જોવા ખાસ પધારો. હોલસેલ ભાવમાં રીટેલ જેન્ટલ વેરમાં બ્રાન્ડેડ ફેબ્રીકમાં કોટન પેન્ટ, હોઝીયરી ટ્રેક પેન્ટ, બમ્ડા, જીન્સ (28 to 50), શર્ટ, ટી-શર્ટ (M to 8 XL) સાર્જમાં અનેક વેરાયટીઓ ઉપલબ્ધ. ઓફર શર્ટ રૂ.૩૦૦/-થી શરૂ. સિલેક્શન મેન્સ વેર, ગાલા નં.૫૪, રાજા ઈન્ડસ્ટ્રીયલ ઈસ્ટેટ, પી.કે. સમય ૧૦ થી ૭. સોમવાર બંધ. સંપર્ક : દીપેન ભેદા- 9137501277 (1357)



B-3, Krishna Kunj, Ground Floor, Near Vikas Palazo, Vajji Laddha Road, Mulund(West), Mumbai - 400 080. MAHARASHTRA 98208 90176 / 93222 57731 / 98690 05403

એલ્યુમિનિયમ સ્લાઈડિંગ બારીઓ રીપેરીંગ અને નવી કરી આપશું. સંપર્ક : ભરતભાઈ 0 9 7 3 0 4 0 2 8 7 9 , 79772 67990 6660 (1365)

જુના કપડા વેચાતા લેશું જુના પેન્ટ, શર્ટ, સાડી, પંજાબી ડ્રેસ જુની જરી બોર્ડરની સાડી, શેલા રોકડા પૈસાથી લેશું. અજયભાઈ - 9833237011 491 (1357)



મહિલા માટે

ઘરઘંટીનો ભવ્ય શોરૂમ

૮ વર્ષની ગેરેટી દરેક પ્રકારની ઘરઘંટી ISI-ISO Service તથા Spare Available Bhavana Sales / Service Shop No. 55, Lalan Bldg., P.K. Road, Opp.Manoranjan Showroom, Panch Rasta, Mulund (W). 25933413, 9820055816 1090 (1370)



Oberoi Enigma

3 BHK / 4 BHK Unfurnished/Semi-Furnished, Ready to move in apartments available for Sale/Rent. Contact : 9224944922, 9833726529 6698 (1383)

વનબેડ લીફ્ટ 500+60, કારપેટ 112, તેમજ માસ્ટર બેડ સાથે OC પાર્કિંગ હાથર ફ્લોર 120 સુધી શક્યતા. તેમજ વગર લીફ્ટ ૧ માળે 500 કારપેટ 110 હીરા મોંગી હોસ્પિટલ નજીક/૨ બેડ નવા ટાવરમાં રેડી પહેશન રેમ્પ પાર્કિંગ બધીજ એમીનીટીસ ડેવીલપાલ કોસ રોડ 195. તેમજ ફૂલી ફર્નિશ 30 લાખનું કામ કરેલું 235/૩ બેડ 985 કારપેટ 230-240 સુધી શક્યતા/૪ બેડ 1750 ૨ પાર્કિંગ 4 cr. શક્યતા/૩ બેડ 1275 કારપેટ દેરાસર, ઉપાશ્રય નજીક સેમી ફર્નિશ 325-350 વચ્ચે શક્યતા. તેમજ કમર્શીયલ, રેસીડન્સી ભાડે લેવા આપવા. વેચાણથી પણ. સંપર્ક : અતુલ કતીરા - 9821180931, 8779441915 131 (1382)

જ્યોતિષશાસ્ત્ર

૩૦ વર્ષોના વિશાળ અનુભવી મુંબઈના સુવિખ્યાત અને લોકપ્રિય જ્યોતિષ વિશારદ શ્રી સમીર સેજપાલ દ્વારા તમને મુંઝવતા તમામ પ્રશ્નો અંગે સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન તથા નિરાકરણ મેળવો.

સમીર સેજપાલ

(જ્યોતિષભાસ્કર, હોરાભૂષણ, જ્યોતિષરત્ન, જ્યોતિષજ્ઞાતા, વાસ્તુશાસ્ત્રી) મોબાઈલ : 98192 98404 (ઓપોઈમેન્ટ જરૂરી)

Your Business Advertisement In Our SOCIAL MEDIA Contact :

9322257731

Click Here

હરીશ ખોલડીયા પ્રસ્તુત**ઈશિદ ગઝલ કોર્નર...**

ગુજરાતના સર્વે ભાવકોને દિવાળીની શુભ કામનાઓ

આટલા વર્ષો ગયા છે આકરા સંઘર્ષમાં,

જોઈએ શું થાય છે?

આ આવનારા વર્ષોમાં,

રૂપિયા ખુટશે ની

સ્લેજ પણ પરવા નથી

ખૂટવી ન જોઈએ હિંમત હૃદયના પર્યામાં.

એક પણ સંકલ્પ ને એવોય ક્યાં સંકલ્પ લઈ?

હું મને કેમ બાંધું કોઈ પણ આદર્શમાં.

માત્ર સુખને શું કહું?

બચકા કે પપ્પી ભરું?

જોઈએ પીડા પણ મારે આખરી નિષ્કર્ષમાં.

પાતળી પળની હથેળીઓ વચાળે જીવવું

દિ-મહિના-વર્ષ લઈને કાળનાં સંસ્પર્શમાં..

**અનિલ યાવડા**

સંકલન : હરીશ ખોલડીયા

**સવંત ૨૦૮૦-૮૧ ના
ચોપડા પૂજનના મુહૂર્તો****ધનતેરસ**

આસો વદ તેરસ, બુધવાર, તા. ૩૦-૧૦-૨૦૨૪

સવારે ૦૬:૩૮ - ૦૮:૦૪ (શુભ),

સવારે ૧૦:૫૬ - ૧૨:૨૨ (ચલ),

કાળીચોદસ

આસો વદ ચોદસ, બુધવાર, તા. ૩૦-૧૦-૨૦૨૪

બપોરે ૩:૦૦ - ૪:૩૦ (ચલ),

બપોરે ૪:૩૦ - ૬:૦૦ (લાભ),

સાંજે ૬:૦૫ ગોરજ મુહૂર્ત

રાત્રે ૭:૩૬ - ૯:૦૦ (શુભ)

રાત્રે ૯:૦૦ - ૧૦:૩૦ (અમૃત)

રાત્રે ૧૦:૩૦ - ૧૨:૦૦ (ચલ)

દિવાળી

આસો વદ અમાસ, ગુરુવાર, તા. ૩૧-૧૦-૨૦૨૪

બપોરે ૩:૫૪ અમાવસ્યા પ્રારંભ થાય છે

બપોરે ૪:૪૦ - ૬:૦૫ (શુભ)

સાંજે ૬:૦૫ - ૭:૩૬ (અમૃત)

રાત્રે ૭:૩૬ - ૯:૧૪ (ચલ)

રાત્રે ૧૧:૫૭ - ૧૨:૪૮ (નિશ્ચિત કાળ)

દિવાળી

આસો વદ અમાસ, શુક્રવાર, તા. ૦૧-૧૧-૨૦૨૪

સવારે ૬:૩૦ - ૮:૦૦ (ચલ)

સવારે ૮:૦૦ - ૯:૩૦ (લાભ)

સવારે ૯:૩૦ - ૧૧:૦૦ (અમૃત)

બપોરે ૧૨:૩૦ - ૨:૦૦ (શુભ)

સાંજના ૪:૩૦ - ૬:૦૦ (ચલ)

બેસતું વર્ષ

કારતક સુદ-૧, શનિવાર, તા. ૦૨-૧૧-૨૦૨૪

સવારે ૦૮:૦૫ - ૦૯:૩૧ (શુભ)

બપોરે ૧૨:૨૨ - ૧૩:૪૮ (ચલ)

લાભ પાંચમ / જ્ઞાન પાંચમ

કારતક સુદ ૫, બુધવાર, તા. ૦૬-૧૧-૨૦૨૪

સવારે ૦૬:૪૧ - ૦૮:૦૬ (લાભ)

સવારે ૦૮:૦૬ - ૦૯:૩૨ (અમૃત)

સવારે ૧૦:૫૭ - ૧૨:૨૨ (શુભ)

શ્રી મહાવીર સ્ટોર્સમેવાવાલા નિવાસ, દેના બેંક પાસે, ગણેશ ગાવડે રોડ,
મુહુંડ(૫). ફોન : ૨૫૬૦૦૨૦૩ / ૨૫૬૧૪૬૨૩**Did You Know ?**

Celebrating a grand wedding isn't just a dream anymore !

We've made it a reality for over
1100 happy couples and now it's your turn!**Banquet & Lawn**Host up to
1500 guests,
indoor or
outdoor.**Tailored Services**Décor,
catering and
more -
just for you.**122 Rooms**Luxurious
stays for
your guests.**THE BYKE SURAJ PLAZA**

Book now and enjoy exclusive perks !

☎ **7353922770**

*T&C Apply

📍 Sai Baba Vihar Complex, Anand Nagar, Ghodbunder Road, Thane (W)

Click Here

ધી વોઇસ ઓફ ઇન્ડિયનનો કાર્યક્રમ ઢોલીડા-૨ પ્રકાશ ચંદે, ઉમેશ વીંછી અને હીરાલાલભાઈ મૃગની અથાગ મહેનતથી સફળ થયો

ઇન્ટરનેશનલ એવોર્ડ વિનર શ્રી હીરાલાલ મૃગ તરફથી તા.૨૬ ઓક્ટોબરે પદ્માવતી બેન્કવેટ મુલુંડ ખાતે એક અનોખો ત્રિવેણી સંગમ એવો રંગારંગ કાર્યક્રમ જેમાં નવરાત્રી, શરદપૂનમ અને દિવાળીનું સ્નેહમિલન ઢોલીડા-૨ રાસ ગરબાનું આયોજન કર્યું. ઢોલીડા-૨ કાર્યક્રમની શુભ શરૂઆત માતાજીની આરતી શ્રી હર્ષ મહારાજ અને શીતલ માણેકના સુમધુર કંઠે અને ખૂબ જ ભક્તિ ભાવ પૂર્વક કરી. માતાજીનો કૂલોથી મગમગતો સુંદર અને કલાત્મક મંડપ કાજલ સચદેએ સજાવ્યો હતો અને કાર્યક્રમ ધી વોઇસ ઓફ ઇન્ડિયાના શ્રી પ્રકાશ ચંદે અને શ્રી ઉમેશ વીંછી એ સુપેરે પાર પાડી આવનાર દરેક મહેમાન અને ખેલૈયાઓને રસબોળ કરી દીધા.

ધી વોઇસ ઓફ ઇન્ડિયનના ગાયક કલાકારો શીતલ માણેક, કવિતા સોમૈયા, કાજલ સચદે, પૂર્ણિમા ચિત્રાગાર, જયશ્રી ઠક્કર, સ્નેહા ચંદે, નિર્મલા ચોથાણી, ચેતન રૂખાના, નિકેશ સેજપાલ, ઉમેશ વીંછી, પ્રકાશ ચંદે અને અમિત રાવલ સરે વિપુલ સાવલાના વાદ્ય વૃંદને સથવારે ગરબા રાસની રમઝટ બોલાવી હતી. સંગીતપ્રેમી પ્રેરણા મૂર્તિ શ્રી હીરાલાલ મૃગે મુકેશના અંદાજમાં ગરબો ગાઈને સૌને અચરજમાં નાખી દીધા.

શ્રીમતી સંધ્યાબેન ભીડે એ દરેક ઉંમરના બેસ્ટ ખેલૈયાઓને, બેસ્ટ વેશભૂષા માટે ઇનામોની ખુદા દિલે લહાણી કરી પ્રોત્સાહિત કર્યાં. શ્રીમતી જસ્મીનાબેન જયંત ઇડાએ પોતાની આગવી શૈલીમાં સર્વે ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યાં. શ્રી કચ્છી લોહાણા મહાજન ટ્રસ્ટ મુલુંડના ટ્રસ્ટીગણ અને મહાનુભવોનું માતાજીના ખેશ અર્પણ કરી શ્રી હીરાલાલ ભાઈએ સ્વાગત કર્યું.

ધી વોઇસ ઓફ ઇન્ડિયન પ્રકાશ ચંદે અને ઉમેશ વીંછી શ્રી હીરાલાલ મૃગને તેમની કલાકારોને બિરદાવવા અને સતત પ્રોત્સાહન કરવા માટે એક સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું.

માનનીય જજ સરયુ માલદે, સોના સોમૈયા અને ભાવના શેઠ એ ખૂબ જ જેહમત ઉઠાવી વિજેતાઓની જાહેરાત કરી સર્વેને ઇનામોની લહાણી કરી. ભરત ઠક્કર, નિખિલ કોઠારી તથા સંતોષ ચિત્રાગારનો સહયોગ સારો રહ્યો.

શ્રી કમેલેશભાઈ ઠક્કરે ફોટોગ્રાફીની કમાલથી પોતાની આગવી સૂઝબૂઝ વડે સૌના દિલ જીતી લીધા.

શ્રી રથ કેટરર્સ (શ્રી મિતેશભાઈ પલણ)ના સુંદર ભોજનનો આસ્વાદ લઈ આનંદની ક્ષણોને વાગોળતા સૌ છુટા પડ્યા.



[Click Here](#)



Manufacturers of Statues & Solid Surface Sheets
Since Year 2000

**WISHING YOU A VERY HAPPY DIWALI
& A PROSPEROUS NEW YEAR!**



+91 9892226888

SOLYX SOLID SURFACE

SOLYX SOLID SURFACE

SOLYX SOLID SURFACE, UNIT NO 6, NANDANVAN INDUSTRIAL ESTATE, ASHA NAGAR,
OPP PARMESHWARI CENTRE BUILDING, MULUND WEST MUMBAI 400080



**INTERIOR DESIGN
STUDIO**

SERVICES WE OFFER:

- INTERIOR SMART SPACE PLANNING
- INTERIOR DESIGN AND CONSULTATIONS

OUR SPECIALITIES:

- RESIDENTIAL
- COMMERCIAL
- RETAIL
- RESTAURANTS & LOUNGES

+91 9820292292

NV INTERIOR DESIGN STUDIO

NV INTERIOR DESIGNS



TRENDSETTER AND
FUTURISTIC INTERIOR
DESIGN FIRM OF THE YEAR
2022

REFRESH + RENEW

BRIGHT IDEAS TO FRESHEN UP YOUR HOME

Click Here



દિવાળીનો પ્રકાશ તમારા
જીવનને ખુશીઓ અને
સફળતાના રંગોથી ભરી દે.



તમને દિવાળીની શુભકામનાઓ
અને નવા વર્ષના
નૂતન વર્ષામિનંદન



ઉત્તમ ગિતે


વર્કિંગ પ્રેસિડન્ટ નોર્થ ઈસ્ટ કોંગ્રેસ

આદીત્ય ઉત્તમ ગિતે

(અધ્યક્ષ, યુવક કોંગ્રેસ (મુલુંડ વિધાનસભા)
SEO મહારાષ્ટ્ર શાસન

 Aditya Uttam gite

 adityagite500

 Aditya uttam gite



Click Here



વાર્ષિક રાશિ ભવિષ્ય સંવત વર્ષ ૨૦૮૧



જ્યોતિષ વિશારદ
વાસ્તુશાસ્ત્રી • જેમોલોજિસ્ટ
સમીર સેજવાલ : 9819298404

મેષ (અ.લ.ઈ.)

(નવેમ્બર-૨૦૨૪) : પ્રિયજન જો મુશ્કેલી ઊભી કરતા હોય તો એમને પ્રેમથી સમજવાનો પ્રયાસ કરજો, પરંતુ નમતુ ન જોખશો. યોજનાબદ્ધ રીતે કામ કરશો તો સમયનો અસરકારક ઊપયોગ કરી શકશો એમ જણાય છે. નવુ ઘર શોધવાની દોડઘામ પછી હવે બે પ્રોપર્ટી પર આખરી પસંદગી ઊતરશે. દેશની અંદર અને વિદેશ પ્રવાસની શક્યતા છે. અચાનક જ નોકરીની ઓફર મળે એવી સંભાવના છે. વારસો, શેર કે અન્ય ઈન્વેસ્ટમેન્ટમાંથી ફાયદો થવાની શક્યતા છે. છેવટે શુભ પ્રસંગો આકાર લેશે. સંબંધીઓને મળવાનું થશે અને સામાજિક જીવન સહેજ રફતાર પકડશે. નાની-મોટી ઈજા સંભવે.

(ડિસેમ્બર-૨૦૨૪) : જાતે લાદેલા નિયંત્રણોમાંથી મુક્ત બનવાનું મુશ્કેલ લાગશે. એક મહત્વના સંબંધમાંની સમસ્યા ઊકેલાઈ ન હોવાથી મનમાં ગુસ્સો ધૂંધવાતો હશે અને જીવનમાં આગળ વધી શકતા નહીં હો એમ દેખાય છે. વિદેશ જવા જેવા પ્રસંગોને કારણે થોડો સમય ઘરથી દૂર રહેવું પડે એવી શક્યતા છે. હોલિડે-પ્લાનની ચર્ચા પ્રિયજન સાથે કરી ન હોવાથી તેઓ નારાજ થઈ શકે છે. કીમતી ચીજો અને પૈસાની બાબતમાં સાવધ રહેવાની સલાહ છે. ફરસદમાં સાહિત્ય વાંચશો કે તમારા શોખને આગળ વધારશો તો એનો લાભ મેળવી શકશો. માંદગીના યોગ છે.

(જાન્યુઆરી-૨૦૨૫) : પ્રિયજન જવાબદારીપૂર્વક વર્તતા ન હોવાથી તમે ધીરજ ગુમાવી રહ્યા છો એમ જણાય છે. અહીં ભાવનાત્મક સંઘર્ષ ટાળવાની ખાસ સલાહ છે. જે બાબતમાં ફેરફાર શક્ય નથી એની પાછળ સમય બગાડીને શું મળશે? મારું જો માનતા હો તો જીવનમાં ઊંચ્ય હેતુ માટે ખુદને તૈયાર કરવામાં આ સમયનો ઊપયોગ કરો. જમીન, મકાન કે એકાદ પ્રોજેક્ટ સંબંધમાં મોટો સોદો થઈ શકે છે. માતા-પિતા કે કોઈ વડીલ અસ્વસ્થતા અનુભવે તો તરત ડોક્ટરની સારવાર લેજો. નોકરીમાં બઢતી કે પગાર વધારો મળી શકે છે. પ્રેમમાં હશે તો લગ્ન કરવાનું વિચારી શકો છો.

(ફેબ્રુઆરી-૨૦૨૫) : ઊંડા આત્મમંથન બાદ વિચારો વ્યક્ત કરવાનો સમય છે. બિઝનેસમાં નવું સાહસ શરૂ કરવા હાલ યોગ્ય સમય છે. લેણા નીકળતા પૈસા પાછા મળતા ખૂબ રાહત અનુભવી શકશો. તમારું સામાજિક જીવન અચાનક સક્રિય બની જશે. એક વિજાતીય વ્યક્તિ અચાનક તમારામાં ખૂબ રસ લેવા લાગશે. ફેમિલીનો એક યુવાન મેમ્બર મનોમન ધૂંધવાઈ રહ્યો છે. તેનું રહસ્ય શોધી કાઢવા પ્રયાસ કરો અને પછી તેને મદદરૂપ બનાવવા શક્ય એટલા પ્રયત્ન કરો. એમ કરવાથી તેની સાથેના સંબંધો વધુ દૃઢ બનશે એમ દેખાય છે. અપરિણીતો માટે લગ્નનો યોગ છે. વિદેશ પ્રવાસની શક્યતા છે.

(માર્ચ-૨૦૨૫) : એક સંબંધમાં ત્રિશંકુ જેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા છે એટલે હાલ નરમ અભિગમ અપનાવજો. જ્યારે શું કરવું એની સમજ ન પડતી હોય ત્યારે કંઈ જ ન કરવું બહેતર છે. જીવનનિર્વાહ ઊપરાંત વધુ આવક ઊભી કરી શકશો. પરિવારના એક યુવાન સભ્ય સાથે બિલકુલ દલીલમાં ન ઊતરવાની સલાહ છે. તબિયતનું ધ્યાન રાખવું પડશે અને પૂરતી ઊંઘ લેવાની પણ સલાહ છે. પરણેલા હશે તો સંતાન પ્રાપ્તિની સંભાવના છે. પ્રોપર્ટીમાં રોકાણ લાંબેગાળે લાભદાયી પૂરવાર થશે. જોબ માટેની બે નવી ઓફર મળશે. આ બેમાંથી એકની પસંદગી કરવા સારા મિત્ર તરફથી માર્ગદર્શન મેળવજો.

(એપ્રિલ-૨૦૨૫) : ધીરજ અને પોઝિટિવ અભિગમ એ તમારી તાકાત છે. વધુ સમજદાર અને સહનશીલ બન્યા છો એટલે પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ સુમેળભર્યા રહેશે. કશુક શુભ બનવાનું છે એવી લાગણી મનમાં થતી રહેશે. હાલના ગ્રહયોગો તમને નવી દિશામાં આગળ વધારશે એમ દેખાય છે. દૈવી શક્તિઓ તમારા સપના પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. સામાજિક મેળાવડામાં સમવિચારકો સાથે મુલાકાત થશે. હાલ સમજદારીથી ખર્ચ કરવાની ખાસ સલાહ છે. વાહન લેવાનો વિચાર કરી શકો છો. માતા-પિતાની સંમતિથી લગ્ન કરવા ઈચ્છતા હશે તો પાત્રની પસંદગી કરી શકશો એમ જણાય છે.

(મે-૨૦૨૫) : રોજિંદા જીવનની ટાળી ન શકાય એવી ધાંધલધમાલથી દૂર સંપૂર્ણ રિલેક્સ થઈ શકો એવા સ્થળે ચાલ્યા જવાની ઈચ્છા જોર પકડશે. કોઈ દૂરના સ્થળે આરામ કરવા કે ફરવા જવું હોય તો પહેલેથી જ શિસ્તબદ્ધ પ્લાનિંગ કરી લેવાની સલાહ છે. એકાદ નવા સંબંધમાં સામેની વ્યક્તિ અપેક્ષા મુજબની નહીં હોવાનો સમજાઈ રહ્યું છે. પરિવારના સભ્યો અને પ્રિયજનથી કેટલીક બાબતો તમે ગુમ રાખી રહ્યા છો એમ દેખાય છે. આવી પરિસ્થિતિમાં જલ્દીથી કોઈ મિત્ર કે શુભેચ્છકથી સલાહ લેવાની સલાહ છે. હાલ ખુદના પ્રત્યે પ્રામાણિક રહેશો તો યોગ્ય માર્ગ અવશ્ય મળી જશે. અચાનક શરદી-ખાંસી થવાની શક્યતા છે.

(જુન-૨૦૨૫) : શાંત અને સ્વસ્થ રહીને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. પરંતુ આસપાસની પરિસ્થિતિઓ તમને મૂંઝવી રહી છે એમ દેખાય છે. હાલના સમયમાં પોઝિટીવ બનો અને સમસ્યાઓના ઊકેલ માટે સતત પ્રયત્નશીલ રહો. આમ કરવાથી ચોક્કસ યોગ્ય માર્ગ મળી રહેશે. હાલની વ્યસ્તતા વધુ થોડો સમય ચાલુ રહેશે. પણ તમારે હવે થોડા ધીરા પડવું જોઈએ અને પરિવારના સભ્યો માટે પણ સમય ફાળવવો જોઈએ એવી મારી ખાસ સલાહ છે. પરિવારમાં કોઈ નવા પાત્રના આગમનની શક્યતા છે. પડવા-વાગવાથી ઈજા થઈ શકે છે અને ફેકચરની પણ

શક્યતા છે. વાહન ચલાવતા સમયે સાવધ રહેજો.

(જુલાઈ-૨૦૨૫) : કાર્યસ્થળે કે અંગત જીવનમાં નિર્ણયો લેવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છો એમ દેખાય છે. ખચકાટને પરિણામે પ્રણયજીવનમાં કોઈક વ્યક્તિનો સાથ ગુમાવી બેસશો. ખાલી શબ્દોથી કશુ જ નહીં વળે. તમે જે કંઈક બોલો છો એને પૂર્ણ કરવા સક્રિય પણ બનવું પડશે. તમારા માટે પ્રગતિની ઊજળી તકોની શક્યતા છે. બીજા લોકો પર હવે આધાર ન રાખો. તમારી સર્જનાત્મક શક્તિ પર વિશ્વાસ રાખશો તો આશ્ચર્યજનક પરિણામ મેળવી શકશો. લાંબા સમયથી વેકેશન ગાળવાની ઈચ્છા આગળ જતા પૂરી થઈ શકશે પણ તે માટે પહેલેથી જ પ્લાનિંગ કરી લેવાની સલાહ છે. યુવાનોએ પ્રવાસ કે વિદેશમાં વ્યવસાયની યોજનાને પ્રથમ પસંદગી આપવી જોઈએ.

(ઓગસ્ટ-૨૦૨૫) : તમારી બડાશની અને મોટાઈ બતાવવાની આદત પ્રિયજનને પસંદ નહીં પડે. હાલ ખર્ચ વધી રહ્યો હોય તો પરિવારના સભ્યો સાથે બેસીને ચર્ચા કરી લેવાની સલાહ છે. કોઈ અણધારી ઓફરને પૂરતી તપાસ્યા વિના નકારી ન કાઢો. ભૂતકાળના સંપર્કોથી અલિપ્ત બની જાઓ અને નવા સાહસની તૈયારી શરૂ કરી દો. કરીઅરમાં મહત્વના પરિવર્તનની જરૂર છે. કાર્યસ્થળે એક ડગલુ આગળ અને એક ડગલુ પાછળ જેવી સ્થિતિ તમને હતાશ બનાવી રહી છે. થોડા વખતમાં જ તમને એક મહત્વનો નિર્ણય લેવો પડશે. એ માટે માનસિક તૈયારી રાખજો. કામકાજ અને પ્રણયજીવન

વચ્ચે સમતુલા જાળવવાનો પ્રયાસ કરો.

(સપ્ટેમ્બર-૨૦૨૫) : હૈયુ હરખાય અને અંતર પ્રસન્ન બને એવા આનંદમય સંબંધોનો આ સમય છે. કોઈની સાથે સમય વિતાવવાની જે તક મળી છે એને જરા પણ ચિંતા કર્યા વિના ભરપૂર માણી લો. તમે જેને મહત્વની ગણતા હશે તેવી વ્યક્તિને મદદની જરૂર છે. તેઓ સ્વમાની હોવાથી સીધી મદદ નહીં માગે. આથી અણસાર મળતા જ સમજી જજો કે તેમને ખરેખર તમારા મદદની જરૂર છે. ઈન્વેસ્ટમેન્ટની બાબતમાં કોઈક તમને લોભામણી ઓફર કરે એવી શક્યતા છે. આથી લાલચથી દૂર રહેજો. નવી જોબની ઓફર સ્વીકારતા પહેલા ફરી એકવાર વિચાર કરી લેવાની સલાહ છે. મિલકતનું વેચાણ, જમીનની ખરીદી માટે ઊજળા સંજોગો છે.

(ઓક્ટોબર-૨૦૨૫) : જીવનસાથીની જરૂરિયાત સમજીને ચાલવાનો સમય છે. આમ કરશો તો લગ્નજીવનમાં સ્થિરતા આવશે અને પ્રેમની ગાંઠ મજબૂત બનશે એમ જણાય છે. ન બોલ્યામાં નવ ગુણ એ કહેવત જીવનમાં ઊતારો એવી મારી સલાહ છે. તમને જે ખરૂં લાગે એ કામ પાર પાડવા તમે ભલે આક્રમક રીતે મંડી પડો છતાં અત્યારે પરિણામ જોવા નહીં મળે. હળવે હલેસે આગળ વધશો તો જ લાભ થશે એમ દેખાય છે. આ રાશિની અપરિણીત વ્યક્તિ માટે લગ્નયોગ શરૂ થઈ ગયો છે. તમારામાંથી ઘણાખરા ઘરથી જુદા થવાનું વિચારી શકે છે. અચાનક યાત્રાના યોગ છે. તબિયતનું ધ્યાન રાખો અને આહારમાં પ્રમાણ જાળવો, સમજ્યાને?

આપ સર્વેને દિવાળી તેમજ
નવા વર્ષની હાર્દિક શુભેચ્છા

આપના પ્રસંગોને યાદગાર બનાવો

- લગ્નગીત
- સંગીતસંધ્યા
- હલ્દી/મહેંદી
- ડોલી
- બર્થ કે પાર્ટી
- જૈન સ્તવન
- પ્રાર્થના સભા

તેમજ
સ્પે.એન્ટ્રી ફોર ડપલ

હિના ઠક્કર

9221240755, 9769305488

[Click Here](#)

જ્યોતિષ વિશારદ • વાસ્તુશાસ્ત્રી • જેમોતોજિસ્ટ
વાર્ષિક રાશિ ભવિષ્ય સંવત વર્ષ ૨૦૨૧
સમીર સેજપાલ-9819298404

વૃષભ (બ.વ.ઉ.)

(નવેમ્બર-૨૦૨૪) : સાચી દિશામાં આગળ વધવા અંતરના અવાજને અનુસરવાનો સમય છે. ધીરજ રાખતા શીખો અને જે થોડી ઘણી સમસ્યાઓ દેખાય છે એ હવે દૂર થઈ જશે. વેપારમાં વિસ્તરણ કરવાનો કે આગળ જતાં ટકી રહે એવી પાર્ટનરશિપ કરવાનો યોગ્ય સમય છે. જોકે એ માટે સખત કામ કરવાની તૈયારી પણ રાખવી પડશે. સ્થળાંતર કરવા કે અન્ય સ્થળે રહેવા જવાની ઈચ્છા હશે તો થોડા વખતમાં જ શુભ સમાચાર મળશે. લાંબા સમયથી જે પ્રવાસ વિચાર્યો હશે એ હવે સાકાર બનશે એમ જણાય છે. પડવા-વાગવાના યોગ છે. **શ્રીવર્ગ માટે** : સંતાનો પાછળ સમયનો ભોગ આપવો પડશે. લોકો પર શંકા ન કરો, તેમને મદદ કરો, સમજ્યાને?

(ડિસેમ્બર-૨૦૨૪) : એક તરફ કામનો ભારે બોજો હશે અને બીજી તરફ ઊંકેલી ન શકાય એવી પરિસ્થિતિનો સામનો પણ કરવો પડશે. હાલ તમારા વ્યક્તિત્વના ઊચ્ચ પાસાંઓને ખીલવવાનો સમય છે. એકાંતમાં બેસી વિચારવામાં, ધ્યાન અથવા પ્રેરણાત્મક સાહિત્ય વાંચવા પાછળ વધુ સમય ગાળવાનો પ્રયાસ કરો. ગેરસમજ દૂર કરી સત્ય કેમ શોધવું એ જાણવા આધ્યાત્મિક દુનિયાદારીની સમજનો સહારો લેતા રહો એવી મારી ખાસ સલાહ

છે. કામકાજની વ્યસ્તતા અને ભાવનાત્મક સંબંધો વચ્ચે સમતુલા જાળવો. ફેમિલી મેમ્બરોની ભૂલ સુધારવા પ્રેમથી શિખામણ આપજો. **શ્રીવર્ગ માટે** : તમારી લાગણીશીલતાનો લાભ કોઈ ઊઠાવે નહીં એનું વિશેષ ધ્યાન રાખો.

(જાન્યુઆરી-૨૦૨૫) : આમ તો તમે ખૂબ સહનશીલ છો, પણ એક વખત ગુસ્સો આવી જાય તો તમે એને કાબૂમાં રાખી નથી શકતા એનું આશ્ચર્ય છે. જે સ્થિતિ બદલી નથી શકતા એને જતી કરવામાં આટલો વિલંબ શા માટે? ભૂતકાળના વિચારોમાં ડૂબેલા રહેવાને બદલે મક્કમ પગલા સાથે આગળ વધો એવી મારી ખાસ સલાહ છે. બિનજરૂરી કાર્યો પર લક્ષ આપવાને બદલે મહત્વના કાર્યો પર ધ્યાન આપો. તમારી તમામ શક્તિને કામકાજ પાછળ કામે લગાડો. આમ કરશો તો ધારતા હશે એ કરતા પણ ઝડપથી સારા પરિણામો મળશે અને તમારો ઊત્સાહ વધી જશે. **શ્રીવર્ગ માટે** : સમજદારી અને શાંત અભિગમથી દાંપત્યજીવનમાં સમગ્રપણે સુધારો લાવી શકશો.

(ફેબ્રુઆરી-૨૦૨૫) : હાલના પરિવર્તન અને પ્રગતિના સમયને કુદરતી રીતે આગળ વધવા દો. જીવનાસીથી સાથે સંબંધો દૃઢ બનાવવા આ સમય પોઝિટિવ છે. સહનશીલ બનશો તો ટેન્શન દૂર રાખી શકશો. તમારી આંતરિક શક્તિ અને વ્યવહારુતા સાથે પ્રેમ તેમજ અન્યની કાળજી લેવાની ભાવનાથી અન્યને આકર્ષી શકશો. અને સંબંધીઓ પણ સ્પષ્ટ સલાહ મેળવવા માટે પ્રથમ તમારી તરફ નજર દોડાવતા રહેશે એમ જણાય છે. સલામત યોજનાઓમાં

થોડા પૈસા ઈન્વેસ્ટ કરી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા તરફ ધ્યાન આપજો. વડીલોના સ્વાસ્થ્ય તરફ પણ લક્ષ આપજો. **શ્રીવર્ગ માટે** : અહમ્ને છોડશો તો મુશ્કેલ સમસ્યા ઊંકેલી શકશો.

(માર્ચ-૨૦૨૫) : હાલનો સમય આત્મમંથનનો છે. નુકસાનકારક આદતમાંથી છુટકારો મેળવીને અને ભૂલોનું પુનરાવર્તન ન કરવાની પ્રતિજ્ઞા કરી યોગ્ય માર્ગ પર આગળ વધી શકશો. જોખમોનો સામનો કરવા શક્તિઓનું સંયોજન કરો અને સમસ્યા વણસે એ અગાઉ તમારી બુદ્ધિને કામે લગાડો એવી મારી સલાહ છે. ફેમિલીની ફાઈનેન્સની સમસ્યાઓ ઊંકેલવાની અને કાનૂની દસ્તાવેજોનું અધ્યયન જેવી બાબતોમાં વ્યસ્ત રહેવું પડશે. જેમના પર ભરોસો હોય તેવા મિત્રોનું માર્ગદર્શન મેળવો તો સારું. અપરિણીતોને રસપ્રદ હશે એવી વિજ્ઞાતીય વ્યક્તિ સાથે મુલાકાત થશે. **શ્રીવર્ગ માટે** : તમારા પ્રિયજનને કોઈક ચિંતા સતાવી રહી છે. એનો ઊપાય શોધી કાઢો.

(એપ્રિલ-૨૦૨૫) : તમારી ચીવટની આદતને કારણે પ્રત્યેક કામ જાતે કરવાનો આગ્રહ રાખી રહ્યા છો. અત્યારે તમે કેવી રીતે કામ કરી રહ્યા છો એના પર હવે પછીની કર્મની ગતિનો આધાર છે. નિયમોનું કડકાઈથી પાલન કરવાનું અને વધુ પડતી ટીકા કરવાનું ટાળો. અનેક કાર્યો બાકી હોવાથી અન્ય લોકોને પણ કામ ફાળવો એવી મારી સલાહ છે. જોખમી અને લલચામણું વળતર આપે એવી સ્કીમો કરતા સલામત અને લાંબાગાળાનું રોકાણ કરજો. એકાદ વડીલ સાથે મતભેદ થશે. પણ પછી તમને સમજાશે કે તેઓ સાચા હતા. વાહન અકસ્માતમાં ઈજા થઈ શકે છે. **શ્રીવર્ગ માટે** : સહેજ ચેન્જ ખાતર તમારા વિશે વિચારો. લોકો શું કહેશે એવી ચિંતા ન કરો, સમજ્યાને?

(મે-૨૦૨૫) : હાલનો સમય હસી-મજાકનો, મિત્રોને મળવાનો, નવા મિત્રો બનાવવાનો અને લોકો પર પ્રભાવ પાથરવાનો છે. આવા સમયમાં એકધારુ યંત્રવત્ કામ કરવાનો કંટાળો આવશે. નોકરી માટેની નવી ઓફર સ્વીકારવાની લાલચને વશ ન થશો. હાલ શેર-સટ્ટામાં ઈન્વેસ્ટ કરવા યોગ્ય સમય નથી. અચાનક વધારાની આવક ઊભી થઈ જતા બચત કરવાની ખાસ સલાહ છે. નજીવુ ઈન્ટરિયર ડેકોરેશન કરો એવી શક્યતા છે. એની ખરીદીમાં થોડો સમય વ્યતીત થશે એમ દેખાય છે. નવું વાહન ખરીદી શકો છો અને વિદેશ પ્રવાસના યોગ પણ છે. **શ્રીવર્ગ માટે** : ભૂતકાળના વિચારો કરવાને બદલે હાલ તમારી પાસે જે છે એનો આનંદ માણો.

(જુન-૨૦૨૫) : ભૂતકાળમાં જે પ્રયાસો કર્યા હશે એની સંપૂર્ણ અસર હવે તમે જોઈ રહ્યા છો. એ પ્રયાસોના પરિણામે હાલના સ્થાને પહોંચ્યા છો એમ જણાય છે. અંતરના ઊંડાણથી સાચો પ્રેમ અને લાગણીઓ પ્રગટ કરવાનો સમય છે. જેને અત્યંત ચાહતા હશે એવી વ્યક્તિ સાથે વિદેશ પ્રવાસ શક્ય છે. કર્મની હાલની ગતિમાં પ્રિયજન તમને લાડ લડાવશે અને તમારી કાળજી લેશે. એ જોઈને તમારું મન આનંદથી ઝૂમી ઊઠશે. ખાસ તો ફાઈનેન્સની બાબતમાં તમારાથી તદ્દન જુદા વિચારો ધરાવતા લોકોના વિચારો સાંભળવા પ્રયાસ કરો. એકાદ સોદો પાર પાડવાની ઊતાવળમાં કદાચ એકાદ-બે મુદ્દા ધ્યાન બહાર રહી જવાની શક્યતા છે. **શ્રીવર્ગ માટે** : હાલ ધીરજ અને સમજદારીપૂર્વક અભિગમ

જાળવવાની સલાહ છે

(જુલાઈ-૨૦૨૫) : હાલના ખતેલવાળા તબક્કામાં એક કદમ આગળ રહી શકશો અને રમૂજવૃત્તિ જાળવી શકશો એમ દેખાય છે. ઈશ્વરે પ્રદાન કરેલી શક્તિને કારણે પ્રિયજનની વણકહી લાગણીઓને અંતરની પ્રેરણાથી સમજી શકશો. જાણે કે તમારું ત્રીજુ નેત્ર ખૂલી ગયું હોય એમ લાગશે. અચાનક તમારા વિશેનું વિશાળ ચિત્ર નજર સમક્ષ તરવરવા લાગશે. મન અને વાણી પર સંયમ રાખી શકતા હોવાથી આગળનો માર્ગ એકદમ સરળ બની જશે. તમારા આશ્ચર્ય વચ્ચે પરિવારનો એક સભ્ય અચાનક એકદમ સ્વતંત્રતાથી વર્તવા લાગશે. એને પ્રેમથી સમજાવવાનો આગ્રહ રાખજો. **શ્રીવર્ગ માટે** : મહિલાઓની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થશે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.

(ઓગસ્ટ-૨૦૨૫) : હાલનો સમય હળવાશભર્યો અને રોમેન્ટિક છે. તમે અભિપ્રાયોનું પારસ્પરિક આદાનપ્રદાન કરતા હોવાથી ભાવનાત્મક જીવન સરળતાથી આગળ વધતું રહેશે. બિઝનેસ સંબંધી વિચાર વિશે મનમાં કોઈ ખચકાટ હોય તો કાઢી નાખજો. લોકો શું બોલે છે એની ચિંતા કર્યા વિના મસ્તીથી જીવવાનો સમય છે. કાળજી લેવાના સ્વભાવને લીધે માતા કે સાસુ સાથેના સંબંધો સારા રહેશે. પૂરતી ઊંઘ તથા આરોગ્યપ્રદ ખોરાક લો એવી મારી ખાસ સલાહ છે. પ્રવાસનો કાર્યક્રમ વિલંબમાં મુકાતા નક્કી કરેલા દિવસે નીકળી નહીં શકો એમ જણાય છે. **શ્રીવર્ગ માટે** : અણધારી ભેટ કે પૈસાની બક્ષિસ મળવાની શક્યતા છે. સોના-ચાંદી કે ઘરેણાની ખરીદી શક્ય બને.

(સપ્ટેમ્બર-૨૦૨૫) : અત્યાર સુધીમાં મળેલી સફળતા તેમજ કેટલા મોરચે વિજય મેળવવાનો બાકી છે એનું વાસ્તવિક મૂલ્યાંકન કરશો તો આગામી રણનીતિ ઘડી શકશો. કીર્તિ પ્રાપ્તિનો સમય શરૂ થઈ ગયો છે. ઘરના મેમ્બરો સાથે સંઘર્ષ ટાળવાની ખાસ સલાહ છે. સંબંધોની બાબત અને ઓફિસમાં અગત્યના નિર્ણયો લેવા પડશે. સલામત અને અગાઉ પ્રસ્થાપિત માર્ગે આગળ વધવું કે સમસ્યાઓનો પટારો ખોલે એવા પડકારોનો સામનો કરવો એની મૂંઝવણ રહેશે. કશુંક આશ્ચર્યજનક બનવાની શક્યતા છે. તમારી પ્રેરણાક્તિ પર શ્રદ્ધા રાખો અને સંપૂર્ણ આત્મનિર્ભર બનવાના ઊદ્દેશ સાથે આગળ વધો. **શ્રીવર્ગ માટે** : મિત્રો કે સંબંધીઓ ઘરે આવતા ભારે ખર્ચની શક્યતા છે.

(ઓક્ટોબર-૨૦૨૫) : તમારે સંપૂર્ણ ડૂબેલા રહેવું પડશે. નજીકના ભવિષ્યમાં એમાંથી કોઈ છુટકારો નહીં મળે અને તમને એનો અફસોસ પણ નહીં હોય. નિરર્થક વિધિઓમાં અટવાયેલા રહીને મહત્વની કામગીરીને અસર ન પહોંચે એનું વિશેષ ધ્યાન રાખજો. ફેમિલીના યુવાન મેમ્બરોમાં સમજદારી કેળવાય એટલા માટે અવારનવાર તેમને સમજાવવાનો પ્રયાસ કરતા રહેજો. સટ્ટો કરશો તો આ સમયમાં પૈસો ગુમાવો એવી શક્યતા છે. એક ખાસ મૈત્રીમાં સંઘર્ષ ઊભો થવાની શક્યતા છે એટલે એ જાળવી રાખવા ઈચ્છો છો કે નહીં એ વિશે મનોમન નક્કી કરી લો. **શ્રીવર્ગ માટે** : એકાદ નબળી પળ તમને સમાધાન કરવાની સ્થિતિમાં લાવી દેશે. કઈ દિશામાં આગળ વધવું એ વિશે સહેજ વિમાસણ ઊભી થશે.

આપ સર્વેને
દિવાળી ની
દાઢિક શુભેચ્છાઓ
અને નવા વર્ષના
જીવન વર્ષાભિનંદન

જીગર આનંદ ચંદે
ઈશાન્ય મુંબઈ જિલ્લા મંત્રી ભાજપ

[Click Here](#)

જ્યોતિષ વિશારદ • વાસ્તુશાસ્ત્રી • જેમોતોજિરત

વાર્ષિક રાશિ ભવિષ્ય સંવત વર્ષ ૨૦૨૧
સમીર સેજપાલ-૯૮૧૯૨૯૮૪૦૪

મિથુન (ક.ઇ.ધ.)

(નવેમ્બર-૨૦૨૪) : હાલ તમારા કાર્યો આગળ વધતા ન હોવાનું લાગશે પરંતુ, આવનાર સમયમાં જીવનનો સંપૂર્ણ નકશો બદલાઈ જવાની શક્યતા છે. ત્યાં સુધી હાથ પરના કાર્યો પાર પાડવા સખત પ્રયાસો કરતા રહેજો એવી મારી સલાહ છે. પરિવારમાં અચાનક ઊગ્ર દલીલ શરૂ થઈ જાય તો તમે એને શાંત પાડવાનું કામ કરજો, પરંતુ કોઈની તરફેણ કરવાનું રહેવા દેજો. ઘર્ષણ અને અથડામણ નિરર્થક છે એ વાત સૌના ગળે ઊતારવાનો પ્રયાસ કરો. તમે પોતાની શક્તિને કેમ આટલી ઓછી આંકો છો? જાત પર વિશ્વાસ રાખી આંતરિક શક્તિને બહાર લાવો અને તમારી ક્રિએટિવ ટેલેન્ટને ખીલવા દો, સમજ્યાને?

(ડિસેમ્બર-૨૦૨૪) : વિખવાદ અને સંઘર્ષની સ્થિતિનો અંત આવતા તમે રાહત અનુભવશો. તમારી નજીકની વ્યક્તિના સ્વભાવ સાથે તમારો મેળ બેસતો નથી એટલે ઘર્ષણ થાય છે. આ મતભેદ અને મનભેદ ટાળવાનો પ્રયાસ કરો. જીવનમાં અણધાર્યા અને ઓચિંતા ફેરફાર માટે તૈયાર રહેજો. જોકે આ ફેરફારની તમને સીધી કે ખોટી અસર થશે, છતાં એમાંથી તમને ઘણું શીખવા મળશે. ઘણા સામાજિક પ્રસંગોમાં હાજરી આપવી પડશે. આથી મસાલાવાળો કે તળેલો ખોરાક લેવાનું ટાળજો. તમારી સલાહ એક મિત્રના ઘણા પૈસા બચાવી શકશે. એ મિત્રને વાસ્તવિક દૃષ્ટિકોણ અપનાવવા સમજાવો. યાત્રા-પ્રવાસની શક્યતા છે.

(જાન્યુઆરી-૨૦૨૫) : હાલ નિર્ણયો લેવાની ઘટના જીવનમાં મહત્વની બની રહેશે. સાચો નિર્ણય લેવાય એની કાળજી લેવાનો સમય છે. દૈવી શક્તિઓ સહાય કરવાના મૂડમાં છે. આથી લોન માટે અરજી કરો કે પગાર વધારા માટે રજૂઆત કરી શકો છો. પોતાની કાબેલિયત પુરવાર કરવા ઊતાવળે ભાગદોડ કરવાની જરૂર નથી. બિઝનેસ સાહસ માટે થોડો સમય થોભી જવાની ખાસ સલાહ છે. એક આકસ્મિક ભેટ મળી શકે છે. કોઈ નિકટના મિત્રને પ્રણય બાબતમાં તમારી સલાહ અને સહાયની જરૂર પડશે. મિત્રતા રાખો પણ વધુ પડતા લાગણીશીલ ન બનો. તબિયતનું ધ્યાન રાખો અને આહારમાં પ્રમાણ જાળવો, સમજ્યાને?

(ફેબ્રુઆરી-૨૦૨૫) : એક અત્યંત આકર્ષક ઓફર મળશે. તમારે એ સ્વીકારવી કે રિજેક્ટ કરવી એનો નિર્ણય કરવો પડશે. ભવિષ્યને નજર સમક્ષ રાખીને શાંતિથી વિચાર કરી લેવાની સલાહ છે. હાલની કોઈ સમસ્યા ભવિષ્યના પ્રોજેક્ટોમાં અડચણરૂપ બની શકે છે. જોકે તમે એનો ઊકેલ લાવી શકશો એમ દેખાય છે. નિકટની કોઈક વ્યક્તિ સાથે સમાધાન કરી લેવાની બાબત હાલ

તમે વિચારી રહ્યા હો તો એ માટે પહેલ કરવામાં વાંધો નથી. ફાઈનેન્સ અને પરિવારના સભ્યોના ખર્ચની બાબતમાં ઘરમાં ચર્ચા થવાની શક્યતા છે. આ બાબતે સાચી દિશા મેળવવા જૂની ઘરેડમાંથી બહાર આવવું પડશે. અકસ્માતના યોગ છે.

(માર્ચ-૨૦૨૫) : તમારી મરજી મુજબ કામકાજ આગળ વધતું નથી એમ લાગ્યા કરે. લાગણીઓ ઘવાશે અને તમે સંયમ ગુમાવી બેસો એવી શક્યતા છે. ભૂતકાળના સંબંધો કે મિત્રોને અલવિદા કરીને ભવિષ્ય માટેના પાયાની રચના કરવાનો સમય છે. હાલ ધ્યેય સિદ્ધ કરવા સખત પરિશ્રમ કરવો પડશે. સંઘર્ષ કે દલીલોમાં ન ઊતરો, પણ જે સાચુ લાગતું હોય એને વળગી રહો એવી મારી સલાહ છે. કામકાજ કે બિઝનેસ સંબંધી પ્રવાસ કરવો પડશે. પરિવારમાં નવા મેમ્બરના આગમનની શક્યતા છે. યુવાનોએ અભ્યાસ માટે વધુ સમય ફાળવવો પડશે એમ દેખાય છે. પડવા-વાગવાથી ઈજાની સંભાવના છે.

(એપ્રિલ-૨૦૨૫) : પારિવારિક સમસ્યાઓ ઊકેલવા હઠાગ્રહ છોડીને બાંધછોડની નીતિ અપનાવવી પડશે. જતુ કરવાનું વલણ અપનાવશો તો શક્તિનો પુષ્કળ વ્યય અટકાવી શકશો એમ જણાય છે. હાલ જીવનની કેટલીક ગુમ બાબતોને જાહેર કરવાને બદલે એને ગુમ રાખવાનું જ પસંદ કરો એવી મારી સલાહ છે. મહત્વની વ્યક્તિઓ સાથેની નવેસરથી થતી વાતચીત કરીઅર માટે ઘણી ઊપયોગી ઠરશે. ભવિષ્ય માટે રોકાણ કરવા યોગ્ય સમય છે. જે દસ્તાવેજ પર સહી કરવાના છો એનું શું પરિણામ આવશે એ બરાબર સમજી લેજો અને જરૂર પડે તો વિચારવા થોડો સમય પણ માગી લેજો.

(મે-૨૦૨૫) : કામનું અને અન્ય બાબતોનું ભારે દબાણ રહેશે. આથી મિત્રો કે પરિવારના મેમ્બરોને મળવાનું ટાળી રહ્યા છો એમ દેખાય છે. હાલના સમયમાં દૃષ્ટિકોણ સંકુચિત ન બનાવો અને વિશાળ દૃષ્ટિકોણ અપનાવો એવી મારી ખાસ સલાહ છે. હાલના વ્યસ્ત સમયમાંથી થોડોક આરામ મેળવશો તો સારા વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો એમ જણાય છે. દેશ કે વિદેશમાં વધુ અભ્યાસના સ્વપ્નને પૂર્ણ કરવા આગળ વધો. કોઈને પણ પૈસા ઊછીના આપવાનું ટાળજો. નવા કોન્ટ્રેક્ટ પર સહી સિક્કામાં થોડો વિલંબ થઈ શકે છે. અર્થ પર નિયંત્રણ રાખવાની વિશેષ સલાહ છે.

(જુન-૨૦૨૫) : સંબંધોની બાબતમાં તમે વધુ પડતા આશાવાદી બની રહ્યો છો એમ દેખાય છે. આવી બાબતોમાં દિલનો નહીં દિમાગનો ઊપયોગ કરતા શીખો એવી મારી સલાહ છે. એકાદ સર્જનાત્મક પ્રોજેક્ટને અમલમાં મૂકતા થોડો સમય લાગશે. જોકે એ પ્રોજેક્ટ ભવિષ્યમાં તમને નામ અને દામ બન્ને અપાવશે. શિખર પર કેમ પહોંચવું એનું પ્લાનિંગ તમે શરૂ કરી દીધું છે એ સારી વાત છે. હાલ ખુદ પર ભરોસો રાખી પ્રેરણાઓને અનુસરવાનો સમય છે. અવરોધ ઊભો કરે એવા લોકોની વાતો ન સાંભળો તો સાચું.

જીવનસાથીની શોધમાં લાગણીઓના પ્રવાહમાં તણાઈ જવાને બદલે પ્રેક્ટિકલ બનજો. માંદગીના યોગ છે.

(જુલાઈ-૨૦૨૫) : લોકોના કામ માટે ભલે સમય ફાળવો, પરંતુ અન્ય લોકોની બાબતમાં વધુ પડતુ માથુ ન મારશો. લાગણીઓથી દૂર ભાગવાને બદલે એને સમજવાનો પ્રયાસ કરો. પ્રણયજીવનમાં તમે પહેલ કરશો તો મૂંઝવણની સ્થિતિ દૂર કરી શકશો અને પ્રણયના સંબંધોને તમારી અપેક્ષા કરતા પણ વધુ ઉત્સાહપૂર્ણ બનાવી શકશો એમ દેખાય છે. આગામી થોડા સમયમાં તમારું દેવું ચૂકવી શકશો અને ફાઈનેન્સ સંબંધી મહત્વનો નિર્ણય લઈ શકશો. આગસુ પાર્ટનરથી છુટકારો મેળવવાનો આ યોગ્ય સમય છે. હાલ નાનકડુ રોકાણ મોટું વળતર આપી જશે. ટૂંક સમયમાં જ એકાદ પ્રવાસ હાથ ધરવો પડશે.

(ઓગસ્ટ-૨૦૨૫) : જે માર્ગ પર આગળ વધી રહ્યા છો એમાંથી જરાય ચલિત ન થશો. આગામી થોડા દિવસ તમારી કોઈ પણ નબળાઈ જાહેર ન થઈ જાય એની કાળજી રાખજો. કોઈ વ્યક્તિ બદલવાપૂર્વક ખોટી માહિતી તમારા સુધી પહોંચાડે એવી શક્યતા છે, સાવધ રહેજો. તમારી મહત્વની કોઈ માહિતી જાહેર ન કરવાની વારંવાર સલાહ છે. જો ભૂલથી પણ એમ કરશો તો લોકો એનો ગેરલાભ ઊઠાવશે એમ જણાય છે. આવકની નવી યોજના વિલંબમાં મુકાવાની શક્યતા છે. જોકે મોટું જોખમ ઊઠાવ્યા વિના પૈસા ઈન્વેસ્ટ કરવાની

યોગ્ય તક મળશે. પ્રવાસની યોજનામાં વિલંબની શક્યતા છે.

(સપ્ટેમ્બર-૨૦૨૫) : કોઈ મોટી સમસ્યા વિના જીવન સરળતાથી અને ટોપ ગિયરમાં આગળ વધી રહ્યું છે. ભૂતકાળમાં અજમાવી ચૂક્યા હો એવા વિચારો અમલમાં મૂકતા રહેજો. મનના વિચારો ભલે વ્યક્ત કરો, પરંતુ સમજી વિચારીને શબ્દો પસંદ કરજો. તમારી પ્રેરણા પર શ્રદ્ધા રાખવાનો સમય છે. પૈસા કે ગ્રાન્ટના સ્વરૂપમાં અણધાર્યાં લાભ મેળવી શકશો. તમારા પોઝિટીવ કર્મનું એ પરિણામ છે એ સમજીને ચાલજો. વિદેશથી ટૂંકમાં જ એક મિત્ર મળવા આવશે અને લાંબો સમય તમારી સાથે રોકાશે. શહેર બહાર પ્રવાસ કરશો તો લાભ મેળવી શકશો. અપરિણીત હો તો બોલતી વખતે વધુ આક્રમકતા ન દાખવો.

(ઓક્ટોબર-૨૦૨૫) : આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ન ઊતરો. તમારા જિંદી અભિગમમાં પરિવર્તન લાવવાની ખાસ સલાહ છે. સમાધાન જરૂરી લાગતું હોય તો સમસ્યાઓ પર ફરી વિચાર કરો. માત્ર મર્યાદાઓ ધ્યાનમાં લેવાને બદલે વિકાસ અને શક્યતાઓને નજર સમક્ષ રાખો. આમ કરવાથી જીવનમાં અદ્ભૂત પરિવર્તન આવશે. ઘરમાં નજીવું સમારકામ કે રિ-ડેકોરેશન પાછળ ઘણો સમય આપવો પડશે એમ દેખાય છે. અનિવાર્ય ખર્ચાઓ વધી રહ્યા છે એના પર કન્ટ્રોલ રાખો. અપરિણીતો માટે લગ્ન કે સગાઈની શક્યતા છે. ખાસ મિત્રો માટે સમય ફાળવજો.

અસત્ય અને અહંકાર પર વિજય મેળવી
રામ અયોધ્યા પઠાર્યા એટલે
લોકોએ ઉજવી દિવાળી...
સૌને શુભેચ્છા કે એમની મંજીલ બને અજવાળી
સર્વેને દિપાવલી તેમજ તવાવર્ષની
હાર્દિક શુભેચ્છાઓ

મનિષ તિવારી
 અધ્યક્ષ : ભાજપા, મુલુંડ વિધાનસભા

[/bjpmanishtiwariofficial](https://www.facebook.com/bjpmanishtiwariofficial) [/bjpmanishtiwari](https://www.instagram.com/bjpmanishtiwari) [/bjpmanishtiwari](https://www.youtube.com/channel/UC...)

Click Here

જ્યોતિષ વિશાર્દ • વાસ્તુશાસ્ત્રી • જેમોલોજિસ્ટ

વાર્ષિક રાશિ ભવિષ્ય સંવત વર્ષ ૨૦૨૧
સમીર સેજપાલ-૯૮૧૯૨૯૮૪૦૪

કર્ક (૬.૯.)

(નવેમ્બર-૨૦૨૪) : એકલા પડી ગયો છો કે લોકો તમને વીસરી ગયા છે એવી મનોદશા ઊભી થશે. અત્યારે જે છે એનો આનંદ માણો અને ખોટા વિચારોથી દૂર રહો એવી મારી સલાહ છે. ઘરમાં અચાનક સમારકામને પરિણામે આણંદાર્યો ખર્ચ પણ આવી પડે એવી સંભાવના છે. પ્રોપર્ટી વેચીને એ પૈસાથી આર્થિક સમસ્યા ઊકેલી શકશો એમ દેખાય છે. કામકાજ સંબંધમાં પ્રવાસની શક્યતા છે. વધુ પડતુ કામ કરવુ પડે છે એ ખાતર નોકરી બદલવાના વિચારથી દૂર રહેજો. પૈસા અને કિંમતી ચીજો વિશે વિશેષ કાળજી રાખવાનો સમય છે. માતા પિતા સાથેની સમજદારીમાં વધારો થઈ શકે છે. **શ્રીવર્ગ માટે** : પોઝિટિવ બનો, અન્ય લોકો કરતા પહેલા વિચારો અને ધીરજ રાખો. લાગણીઓ અને પ્રત્યાઘાતો પર નિયંત્રણ રાખો.

(ડિસેમ્બર-૨૦૨૪) : અગાઉના નિર્ણયોને વળગી રહેશો તો સમસ્યાઓ સુમેળતાપૂર્વક ઊકેલવામાં સહાયતા મળશે. વધુ પડતી જવાબદારી અને ડેડલાઈનને પહોંચી વળવાની તકેદારીને કારણે મોડો સુધી કામ કરવું પડશે. અત્યારે તમે થોડી ધીરજ રાખો, ઋણ ચુકવવાનો સમય શરૂ થવાની તૈયારીમાં છે. પ્રોપર્ટીની સમસ્યા પર ચર્ચા કરવા માટે હાલનો સમય યોગ્ય જણાય છે. આર્થિક રીતે સધ્ધર બનવા નિયમિત

ઈન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ છે. સોના-ચાંદીમાં રોકાણ કરવાનો વિચાર સારો છે. અપરિણીતોની મુલાકાત કોઈક રસપ્રદ વ્યક્તિ સાથે થઈ શકે છે. ધીમી ગતિએ આગળ વધી રહેલા કાનૂની કેસનો હવે અંત આવી શકે છે. **શ્રીવર્ગ માટે** : પોતાના આંતરસૂઝથી સત્ય સમજી શકે એવી વ્યક્તિની સલાહ લેજો.

(જાન્યુઆરી-૨૦૨૫) : એક લક્ષ સિધ્ધ કર્યા પછી બીજા લક્ષ તરફ આગળ વધવાનો સમય છે. ગમે એટલું કામ હોય કસરતનું રૂટીન જાળવવાની સલાહ છે. અત્યારની અત્યંત પ્રેક્ટિકલ વિચારધારામાં તમે કરી શકો એના કરતા વધુ ખાતરી ન આપો, અન્યથા આગળ જતા સમસ્યા ઊભી થશે એ નક્કી છે. કામકાજનું દબાણ વધે તો પણ વાતચીત વખતે શું બોલો છો એની કાળજી અવશ્ય લેજો. વિદ્યાર્થીમિત્રો માટે આગળના અભ્યાસનો સમય શરૂ થઈ ગયો છે. એક નવો મિત્ર બનાવો એવી શક્યતા છે. એ મૈત્રી મહત્વના માનવીય મુદ્દાઓ સપાટી પર લાવશે એમ જણાય છે. **શ્રીવર્ગ માટે** : પરિવારના સભ્યો સાથે જે ઊજવાણીની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ હવે વાસ્તવિકતા બનશે. પ્રસંગને માણવાની તક ઝડપી લો.

(ફેબ્રુઆરી-૨૦૨૫) : ભૂતકાળમાં જે બાબતમાંથી આનંદ અને સંતોષ મળ્યા હતા એ માર્ગ પર આગળ વધવા પ્રયાસ કરો. પોઝિટિવ વિચારસરણી ધરાવતા મિત્ર તેમજ સંબંધીઓ સાથે સમય પસાર કરવાની સલાહ છે. અત્યારની ફાણોમાં જે જાણીતા કાર્યો છે એજ હાથ પર લો અને થોડા વખતમાંજ ભવિષ્ય સ્પષ્ટ બની જશે એમ જણાય છે. પરિવારના કેટલાક સભ્યો થોડા દિવસ રજા ગાળવા બહારગામ જવા આતુર છે.

જોકે તમારે ઘણા કામ પતાવવાના હોવાથી તમે તેમની સાથે નહી જઈ શકો એમ દેખાય છે. કાર ખરીદીની લાંબા સમયની ઈચ્છા પૂરી કરવા ગંભીરતાપૂર્વક વિચારી શકો છો. **શ્રીવર્ગ માટે** : લાગણીવશ ન બનો અને વધુ પડતા ભોળા ન બનો, સમજ્યાને?

(માર્ચ-૨૦૨૫) : તમારા વિરોધીઓ અને શત્રુઓ વધી રહ્યા છે. ભવિષ્યના પ્લાન વિશે એકમદમ ચૂપકીદી સેવો. માત્ર થોડા વિશ્વાસુ લોકો સાથે જ એની ચર્ચા કરો એવી મારી સલાહ છે. નવા ડાયટ અને કસરતના સમયપત્રકને અનુસરશો તો વિચારોની નવી પદ્ધતિને વિકસાવી શકશો એમ જણાય છે. આગામી થોડા દિવસો લાગણીશીલ નહી, પણ પ્રેક્ટિકલ બનીને કામ કરો. આમ કરવાથી અશક્ય લાગતા કાર્યો પણ પાર પાડી શકશો એ નક્કી છે. અવિવાહિતોને લગ્ન માટે થોડી રાહ જોવાની ભલામણ છે. નોકરીમાં ટ્રાન્સફર માટે તૈયાર રહેજો. **શ્રીવર્ગ માટે** : વર્તમાન પરિસ્થિતિમાં તમને માનસિક શક્તિની જરૂર છે. મુશ્કેલીના સમયમાં તમે બધુ ખામોશીથી સહન કરી લીધું હોવાથી હવે કુદરત એનો અનેક ગણો બદલો આપશે.

(એપ્રિલ-૨૦૨૫) : તમે જિંદી અને ગુસ્સાવાળા છો. હવે તમારા સ્વભાવને બદલવાનો સમય આવી ગયો છે. મૈત્રીના સંબંધોની સમીક્ષા કરો અને સંબંધોમાં ઊભી થયેલી તિરાડ દૂર કરવા સામે ચાલીને પહેલ કરો. તમારા અભિગમમાં આવેલા આવા બદલાવથી તમારી આસપાસના લોકોને આશ્ચર્ય જરૂર થશે. નવો પ્રોજેક્ટ શરૂ કરો એવી શક્યતા છે. થોડા સમયમાં અગત્યના દસ્તાવેજોની જરૂર પડશે એટલે બધુ હાથવગુ રાખજો. સર્વ શક્તિમાન તમારી સાથે જ છે એ વાતને યાદ રાખીને જે સતત પ્રયાસ કરતા રહેશો તો સફળતા અને સમૃદ્ધિ તમારા કદમોમાં હશે એ નક્કી છે. **શ્રીવર્ગ માટે** : પરિવારની અવગણના ન કરો અને ખોલતા પહેલા પૂરતો વિચાર કરી લેવાની સલાહ છે.

(મે-૨૦૨૫) : અત્યારે જે આઈડિયા સૂઝતા હોય એને મનમાં જ રાખો અને એમાં ક્યા પ્રકારનો સુધારો કરી શકાય એમ છે એ વિશે વિચારો. તમારી શક્તિને પિછાણવાનો સમય છે અને સાથેસાથે લાંબાગાળાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ છે. હાલ કામકાજની ડેડ લાઈનને પહોંચી વળવું પડશે. અતિ વ્યસ્તતાથી તમારા જીવનસાથી નારાજ થાય એવી પૂરેપૂરી શક્યતા છે. તમારા માટે સારો હોય એવો ખોરાક લેતા રહેજો અને કામકાજની સાથેસાથે જીવનસાથી માટે પણ સમય ફાળવજો. પ્રવાસમાં એક એવી વ્યક્તિ સાથે મુલાકાત થશે જે પછીથી તમારા માટે ખાસ બની જશે. ટ્રાફિક ન હોય તો પણ વાહન ચલાવવામાં ધ્યાન રાખજો અન્યથા અકસ્માત થશે. **શ્રીવર્ગ માટે** : કરીઅર આગળ વધારવા કદાચ વધુ અભ્યાસ કરવાનું વિચારો એવી શક્યતા છે.

(જુન-૨૦૨૫) : આધ્યાત્મિક વિકાસની શક્યતા છે. તમારા માટે ખાસ હશે એવી કોઈક વ્યક્તિને ગુમાવો એવી શક્યતા છે. એવા આઘાતમાંથી જ દિવ્ય સમજણ પ્રગટશે જે તમને ચેતનાના ઊંચા સ્તર પર લઈ જશે. સમય સમય પર વાહન કે કારની બ્રેક પણ ચેક કરાવતા રહેજો. વિદેશના પ્રવાસે જવાના હો તો પાસપોર્ટ, અન્ય કિંમતી દસ્તાવેજો અને પૈસાનું અવશ્ય ધ્યાન રાખજો. ઓછું જોખમ તથા સલામત સ્કીમમાં પૈસા રોકો અને આર્થિક સ્થિતિ મજબૂત બનાવો એવી મારી સલાહ છે. યુવાનો માટે એક વર્તમાન સંબંધ માત્ર સારી મૈત્રી માટે યોગ્ય છે. લાગણીશીલતા અને ખાસ પ્રકારના સંબંધ માટે એ પાત્ર યોગ્ય નથી

લાગતું. **શ્રીવર્ગ માટે** : એવી પરિસ્થિતિ સર્જશે જેમાં તમે પ્રિયજનના અંતરની લાગણીને સમજી શકશો.

(જુલાઈ-૨૦૨૫) : પરિવારનો એક સભ્ય કોઈ બાબતે અશાંત અને ગુસ્સામાં છે. તેની પીડાનું સાચુ કારણ જાણવા પ્રયાસ કરો અને પછી તેને મદદ કરવા આગળ વધો. નવા ઘરમાં કેવુ ઈન્ટિરિયર કરવું અને કેવો કલર કરવો એ ત્યારથી નક્કી કરવાનો આઈડિયા સારો છે. આગામી સમયમાં નસીબ ચારી આપી રહ્યાનું કે નસીબ બદલાવાનું લાગશે. આ સમયમાં પ્રવાસની ઈચ્છા પૂરી કરી શકશો એમ દેખાય છે. જરાપણ શરદી-ખાંસી જેવું લાગે તો તરત ડોક્ટરી સારવાર લેવાની સલાહ છે. યોગ્ય ડાયટ જાળવો, નિયમિત કસરત કરો અને રોજ ઓછામાં ઓછી આઠ કલાક ઊંઘ લો. સમજ્યાને? વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે વર્તમાન સમયનો સંપૂર્ણ સદુપયોગ કરવો. **શ્રીવર્ગ માટે** : અચાનક કરેલી ખરીદી ધારણા કરતા વધુ આનંદ આપશે.

(ઓગસ્ટ-૨૦૨૫) : તમે જેવા છો તેવા સ્વીકારી લેતા લોકો તરફથી પ્રેમાળ અભિગમની અપેક્ષા રાખી શકો છો. શહેર બહારનો એક પ્રવાસ વિલંબમાં મુકાયો હોય તો એ સમયનો ઊપયોગ અગત્યના મુદ્દાઓ ઊકેલવા કરો. પુષ્કળ કામ પાર પાડવાનું હશે એમ દેખાય છે. સફળતાની ખાતરી રાખો. ધાર્યું નહી હોય એવા વર્તુળમાંથી મદદ મળતા આત્મવિશ્વાસ વધશે. તમારી અત્યંત વ્યસ્તતાને કારણે પરિવારના સભ્યો નારાજ ન બને એની કાળજી અવશ્ય લેજો. તમારી કાળજી લેતા હોય તેમની સાથેના અભિગમમાં બદલાવ લાવો એવી મારી સલાહ છે. થોડા વખત પછી વાહન ખરીદવાનો વિચાર સારો છે. તકલીફ થાય એવો ખોરાક લેવાનું ટાળો. **શ્રીવર્ગ માટે** : કેટલાક સત્યો જાણવા આ સમય યોગ્ય જણાય છે.

(સપ્ટેમ્બર-૨૦૨૫) : ગાઢ રીતે ઓળખતા હશે એવી કોઈ વ્યક્તિ સાથેની સમજૂતી ઊપર છલ્લી હશે. શુભ આશય ધરાવતા મિત્રોની સલાહ સાંભળશો તો સત્ય શું છે એ જાણવામાં સહાયતા મળશે. ચોક્કસાઈપૂર્વક કામ કરવાની તમારામાં આવડત તો છે, માત્ર કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જીવનમાં મોટા પરિવર્તન માટે તૈયાર રહેજો. જોકે મળતી તકનો કેવો ઊપયોગ કરો છો એના પર એ પરિવર્તનનો આધાર છે. નોકરીમાં બદલી મળતી હોય તો બીજા જોબની ઓફર નકારી કાઢજો. નિવાસસ્થાન બદલો કે અન્યત્ર રહેવા જાઓ એવી પ્રબળ શક્યતા છે. ખાવાપીવામાં વિશેષ કાળજી રાખજો. **શ્રીવર્ગ માટે** : પરિવારમાં ઘર્ષણ લાવે એવી દલીલો ટાળવાની સલાહ છે.

(ઓક્ટોબર-૨૦૨૫) : વધુ પડતા જિંદી ન બનો અને બદલાતા સમય સાથે આગળ વધતા રહો. સમતુલા જાળવવા તમારે પરિવારના સભ્યો પ્રત્યે ન્યાયી અને યોગ્ય રીતે વર્તવું જોઈએ. તેમની સાથે સમસ્યાની ચર્ચા કરવા અને તેમની મુશ્કેલી સમજવા તૈયાર રહો એવી મારી સલાહ છે. બેદરકાર રહેશો તો ફાઈનન્સના મુદ્દાઓમાં ફસાઈ જાવ એવી શક્યતા છે. કોઈ પણ નવા સંબંધમાં સામેની વ્યક્તિને બરાબર ઓળખી ન લો ત્યાં સુધી એમના પર આંધળો વિશ્વાસ ન મૂકો. કેટલાક નાનકડા પ્રવાસોનું પરિણામ મનને પ્રસન્ન બનાવશે અને ભવિષ્યની કામગીરી માટેનો માર્ગ સ્પષ્ટ બનશે. એક વડીલના સૂચનને ખાસ ધ્યાનમાં લેજો. **શ્રીવર્ગ માટે** : ઝઘડી રહેલી બે વ્યક્તિઓ વચ્ચે સુલેહ કરવાનો પ્રયાસ કરતા કોઈ રસપ્રદ મુદ્દો જાણવા મળી શકે છે.

ESTD 1982

JSG જૈન સોશ્યલ ગ્રુપ-મુલુંડ

૧૦૧, સાફલ્ય, ડૉ.આંબેડકર રોડ, મુલુંડ (વે), મુંબઈ-૮૦.

આપ સર્વેને દિવાળી બી
હાર્દિક શુભેચ્છાઓ
અને તમા વર્ષના શાદ મુબારક

શુભેચ્છક

જયંતીલાલ મૈશેરી પ્રમુખ
હિરેન શાહ ઉપપ્રમુખ
દિલીપ શેઠ માનદ મંત્રી
કિમ્પલ કોરડીઆ માનદ મંત્રી
લહેરચંદ ગાલા ખજાનચી
વિરેન્દ્ર શાહ કોર્મર પ્રમુખ

નોમીનેટ્સ : કિરીટ આર. શાહ • નરેન્દ્ર એ. શાહ • દિનેશ પી. દોશી
કમિટી મેમ્બર્સ : ભોગીલાલ શાહ • દિવ્યા ગાંધી • જ્યોતિ સંઘવી • રેખા શાહ • શૈલેષ શાહ

Walk To Gether... Talk To Gether... Act With One Mind...

Click Here

જ્યોતિષ વિશારદ • વાસ્તુશાસ્ત્રી • જેમોતોજિરટ

વાર્ષિક રાશિ ભવિષ્ય સંવત વર્ષ ૨૦૨૧
સમીર સેજપાલ-9819298404

સિંહ (મ.ટ.)

(નવેમ્બર-૨૦૨૪) : હાલના સમયમાં કેટલાક ગૂઢ રહસ્યો બહાર આવવાની શક્યતા છે. તમારી અતિરિક્ત શક્તિનો ઊપયોગ કરો અને પોઝિટિવ પ્રતિસાદ આપી શકો એ માટે કાળજી રાખો. કોઈપણ દસ્તાવેજ પર આંખ બંધ કરીને સહી કરવાને બદલે એનો બરાબર અભ્યાસ કરી લેવાની સલાહ છે. જો તમે નવા ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા હો તો ત્યાં તમને વિચિત્ર પડકારોનો સામનો કરવો પડશે, એ માટે તૈયાર રહેજો. અગાઉ જે ઓફર રિજેક્ટ કરી હશે એ ફરી આવશે. તમારી શરતોને વળગી રહેવું કે નહીં એનો આધાર તમારા પર છે, સમજ્યાને? વાહન અકસ્માતના યોગ છે. **શ્રીવર્ગ માટે** : મનની બધી શંકાઓ ફગાવી દો અને આગળ વધો.

(ડિસેમ્બર-૨૦૨૪) : હાલનો સમય પ્રણય અને મિલનનો છે. કર્મની વર્તમાન ગતિમાં સાનુકૂળ પાત્રને તમારા પ્રત્યે આકર્ષી શકશે એમ દેખાય છે. જોકે આગળ વધવામાં ઊતાવળ ન કરવાની સલાહ છે. કેમિલીના શુભ પ્રસંગોમાં ઊત્સાહથી ભાગ લઈ શકશો. તમારી અંદર પરિવર્તન આવી રહ્યાનું અનુભવી રહ્યા છો અને એના કારણે જીવનને એક નવા પરિપ્રેક્ષ્યમાં નિહાળી શકશો એ નક્કી છે. અમૂક મિત્રો પડકારની માફક તમારી પડખે ઊભા રહેશે. ખરાબ સમય લગભગ પૂરો થઈ ગયાનું જણાય છે એટલે રાહતનો શ્વાસ લઈ શકો છો. નવી ખરીદી શક્ય બને અને ખર્ચાઓ વધશે. **શ્રીવર્ગ માટે** : મુશ્કેલી ઊભી કરતા લોકોથી દૂર રહો.

(જાન્યુઆરી-૨૦૨૫) : જુસ્સો ઘટી ગયો હોય એવું લાગશે. વાસ્તવમાં તમને લક્ષ્ય સિદ્ધિ માટે ઊત્સાહ, આક્રમકતા અને જુસ્સાની જરૂર છે. લડાયક જુસ્સો જાળવો અને પડકારોનો સામનો કરો એવી મારી સલાહ છે. મિત્ર સાથે રજા ગાળવાનું શક્ય બને, પરંતુ લાંબી રજા પર ન ઊતરશો. હૃદયને સ્પર્શતી એક પરિસ્થિતિ ઊભી થશે. સમજદારીપૂર્વક આગળ વધવામાં ખચકાટ થાય ત્યારે સાવધ બની જજો. મહત્વના નિર્ણયો લેવામાં તકલીફ થતી હોય તો પુરાણા દોસ્તની સલાહ લો તો સારું. હાડકા સંબંધી તકલીફ થઈ શકે છે. **શ્રીવર્ગ માટે** : સંબંધીઓ અગાઉથી જાણ કર્યા વિના આવી ચડે તો આતિથિ દેવો ભવની ભાવનાથી તેમનું સ્વાગત કરજો.

(ફેબ્રુઆરી-૨૦૨૫) : રોજબરોજના કામકાજ અને જવાબદારીઓનું દબાણ તથા તાણ તમને થકવી નાખતા હશે. મન શાંત રહે એ માટે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મો જુઓ કે ધ્યાનની સાધના કરો એવી મારી સલાહ છે. બધો વખત કામમાં ડૂબેલા રહેવાને બદલે થોડી મોજ પણ માણતા શીખો. એકાદ સંબંધ તમારી ધારણા મુજબ આગળ નહીં વધે. જોકે નકારાત્મક પ્રત્યાઘાતો ટાળવા લાગણીઓ પર સંયમ રાખજો. ક્યારેક મળવાનું થતું હશે એવા મિત્રો સાથે સમય પસાર કરવાનો હાલ યોગ છે. જેનો કોઈ સરળ ઉત્તર ન મળતો હોય એવા ફિલસૂફીના પ્રશ્નોની તેમની સાથે ચર્ચા કરી શકશો. **શ્રીવર્ગ માટે** : સ્ટેમિના ઘટી

ગયાનું લાગે તો તબીબી તપાસ કરાવી લો.

(માર્ચ-૨૦૨૫) : ભૂતકાળના સાચા-ખોટા નિર્ણયોમાંથી જે કંઈ શીખ્યા છો એના આધારે પરિપક્વ બની ગયા છો. આધ્યાત્મિક પ્રગતિને કારણે શું કરવું અને શું બોલવું એ સહેલાઈથી નક્કી કરી શકશો એમ જણાય છે. તમારું હિત જેમના હૈયે હશે એવા લોકોની સલાહ સાંભળશો તો બિઝનેસનો એકાદ નવો વિચાર કારગત બનશે. જેમના માટે તમે આદર અને પ્રેમ ધરાવતા હશો એવા કોઈ સંબંધી અચાનક તમને મળવા આવશે. પ્રેમની ગાંઠ વધુ મજબૂત બનાવવા આ સમય શ્રેષ્ઠ છે. એકાદ ભોજન સમારંભને કારણે પેટ બગડશે, પૌષ્ટિક ખોરાક અને પૂરતી ઊંઘ લેવાની સલાહ છે. **શ્રીવર્ગ માટે** : બધું એની જગ્યાઓ વ્યવસ્થિત ગોઠવાયેલું હોય એવું વળગણ ન રાખો.

(એપ્રિલ-૨૦૨૫) : બિઝનેસ કરવાનો વિચાર સહેજ અપરિપક્વ અને કસમયનો છે. જોકે આવતા સમયમાં એ અમલી બની શકે છે. અતિ કડવી વાણી રાખશો તો તમને જ નુકશાન થશે. તાણ ઘટાડવા પ્રયાસ કરો અને હાલ ઓફિસમાં શું વ્યવસ્થિત કરી શકાય છે એના પર લક્ષ્ય કેન્દ્રિત કરો એવી મારી સલાહ છે. પરિવારના મેમ્બરો અને મિત્રો તમને ઈમોશનલી બ્લેકમેલ કરશે. તેઓ પોતાનો હેતુ સાધી લેવા આવી ચાલાકીઓ અજમાવતા રહેશે. તેમની વાતમાં આવી ન જશો અને તેમની ટીકા કરવાની બાબતમાં પણ સાવધ રહેજો. થોડા દિવસ શાંત રહો, પ્રેક્ટિકલ બનો અને કેવળ પોતાના કામકાજ પર લક્ષ્ય કેન્દ્રિત કરો. **શ્રીવર્ગ માટે** : સંતાનો માટે ચિંતા રહેશે.

(મે-૨૦૨૫) : હાલ તમે થોડા દિવસ વધુ પડતા સંવેદનશીલ બની જશો. અપેક્ષાઓમાં વધારો થશે અને તમે બાંધછોડ કરી નહીં શકો એમ દેખાય છે. ગરમ મિજાજ અને સ્પષ્ટ વક્તાપણાથી તમે કોઈની પ્રશંસા મેળવી નહીં શકો. હાલ શાંત રહેવામાંજ સમજદારી છે. પરિવારની કોઈક વ્યક્તિ સાથે સમાધાન કરતા અચકાશો નહીં. પ્રિયજન સાથે વિસંવાદિતા નિરાશામાં વધારો કરશે. જો સંબંધોનો અંત લાવી દેશો તો ભવિષ્યમાં પરતાવું પડશે. હળવે હલેસે કામ લઈ અથડામણમાં ઊતરવાનું ટાળો. તમે હાથથી ગુમાવેલો સમજતા હતા એવો કોઈ સુયોગ સાંપડશે, એનો લાભ લઈ લેવાની સલાહ છે. **શ્રીવર્ગ માટે** : આગામી દિવસોમાં સામાજિક અને રોમેન્ટિક સંબંધોની ઈચ્છામાં વધારો થશે.

(જુન-૨૦૨૫) : આગામી દિવસો કામકાજના જ વિચારો મન પર કબજો જમાવશે. ખુલ્લા મને જીવનના અન્ય વિકલ્પો પર નજર રાખવાની તૈયારી હશે તો નવા ચીલે આગળ વધી શકશો અને નવી જ દિશા ખૂલી જશે એમ દેખાય છે. બિઝનેસનો એક નવો વિચાર સંપૂર્ણપણે અમલમાં મૂકી શકાય એવો છે. તમારા જીવનમાં હાલ નવો વળાંક આવવાની તૈયારીમાં છે. એટલે આગામી પગલા વિશે સમજદારીપૂર્વક વિચાર કરો અને આગળ વધો એવી મારી સલાહ છે. સંબંધો સ્થિર રહેશે અને તમે જેને ચાહતા હશો એ વ્યક્તિ લાંબા સમય પછી તમારા માટે સમય ફાળવશે. કાયમ રિલેક્સ રહેતા શીખો અને જીંદગીને માણો, સમજ્યાને? **શ્રીવર્ગ માટે** : સ્પષ્ટતાપૂર્વક વાસ્તવિકતાનો સામનો કરો.

(જુલાઈ-૨૦૨૫) : વિચારોનું ફલક વિસ્તરશે. કોઈક એવી વ્યક્તિના સંપર્કમાં આવશો જે ભવિષ્યમાં અદ્ભૂત પાર્ટનર બની શકશે. ચર્ચા વિચારણાનો પૂરો અવકાશ રાખી પ્રેમપૂર્વક વર્તવાથી હુંફાળા સંબંધો બંધાશે એમ દેખાય છે. ફાઈનેન્સ કે બિઝનેસ લોન માટે અરજી કરવા આ સમય સારો છે. વિદેશમાં કે અન્ય શહેરમાં નોકરી સ્વીકારવી કે નહીં એ વિશે ટૂંક સમયમાંજ નિર્ણય લેવો પડશે. મિત્રોને હળવામળવા, એકાદ મોલની મુલાકાત લેવા કે ફિલ્મ જોવા ઊપડી જાઓ એવી શક્યતા છે. કોઈને પણ ઊધારે પૈસા આપવાનું ટાળો. દાઝવાના યોગ છે. **શ્રીવર્ગ માટે** : આર્થિક અસલામતીનો અંત આવશે. ઈચ્છા અને જરૂરિયાત વચ્ચે સમતુલા જાળવવાનો પ્રયાસ કરો.

(ઓગસ્ટ-૨૦૨૫) : તમે ભૂતકાળની કોઈક બાબતમાં અટવાયેલા છો અને એના લીધે હાથમાં આવેલી તક ગુમાવી બેસો એવી શક્યતા છે. ખર્ચમાં ભારે કાપ મૂકવાનો સમય છે. અનાવશ્યક ખરીદી ટાળવાની સલાહ છે. કોઈ મિત્ર તમને પાર્ટનરશિપની ઓફર કરે તો એ સ્વીકારતા નહીં. હઠાગ્રહ છોડીને પ્રિયજનને આપેલા વચનોનું પાલન કરો અને ખાતરીઓ પૂરી કરો, આમ કરવાથી તમારી વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે. દેશ કે વિદેશમાં વધુ અભ્યાસના સ્વપ્નને પૂર્ણ કરવા આગળ વધી શકો છો. એકાદ જૂના મિત્ર સાથે મુલાકાત શક્ય છે. **શ્રીવર્ગ માટે** : આડેઘડ કામ કરશો તો પકડ ગુમાવી બેસશો. તમારા બદલે હાલ કોઈને નિર્ણય લેવા ન દો.

(સપ્ટેમ્બર-૨૦૨૫) : ઊષ્માપૂર્ણ વર્તાવને કારણે નિકટની વ્યક્તિ સાથે સંબંધો સુધરી રહ્યા છે. પ્રિયજન અને મિત્રો સાથે સારો સમય વિતાવી શકશો અને ભૂતકાળની કોઈ યાદ મનમાં તાજી થશે એમ જણાય છે. નવા પ્રોજેક્ટો હાલ તમને લલચાવી રહ્યા છે. તમારી વર્તમાન કામગીરીને નવો વળાંક આપવો જરૂરી છે. તમામ ક્ષેત્રોમાં તમે પરિવર્તનની અપેક્ષા રાખી શકો છો. એ પરિવર્તનો આગામી દિવસોમાં તમારી લાઈફસ્ટાઈલ બદલી નાખશે એ નક્કી છે. કોઈપણ એગ્રીમેન્ટની કોપી પર સહી કરતા અગાઉ બરાબર તપાસી લેવાની સલાહ છે અન્યથા તકલીફ થઈ શકે છે. **શ્રીવર્ગ માટે** : કોઈપણ પગલુ ભરતા અગાઉ સામેની વ્યક્તિની વિશ્વસનિયતા વિશે પૂરતી તપાસ કરી લો.

(ઓક્ટોબર-૨૦૨૫) : તમારી લાગણીશીલતાને કારણે લાંબા સમયથી દફનાવી ચૂકેલા વિવાદો ફરી સપાટી પર આવી શકે છે. કોઈની પણ મીઠી વાતોમાં આવીને ભોળવાઈ ન જાઓ. લાગણીઓના વમળમાં અટવાશો તો સંબંધોમાં ખળભળાટ ઊભો થશે અને જુદાઈની નોબત આવશે. દીર્ઘદ્રષ્ટિ વાપરો અને પ્રેક્ટિકલ બની નિર્ણય લો એવી મારી સલાહ છે. બહાર નીકળીને ઊત્સાહિત લોકોને મળવાનો આ યોગ્ય સમય છે. આવા લોકો તમને કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ બનશે. પોઝિટિવ કલ્પનાઓ, ધ્યાન કે યોગની સહાયથી નિષ્ફળતાઓનો કાલ્પનિક ડર દૂર કરી શકશો. **શ્રીવર્ગ માટે** : હાલ ગુસ્સો વ્યક્ત કરવા સમય યોગ્ય નથી. તમારામાં રસ જગાવે એ વિચારમાં નિસંકોચ આગળ વધો.



SHUBH DIWALI!!

INNER WHEEL CLUB OF MULIND

WISHES YOU

May the divine light of Diwali spread peace, prosperity, happiness, and good health in your life. Happy Diwali!

President: Nutan Dhulla

Vice President: Rita Thakkar

IPP: Aparna Rane

Secretary: Sharda Lala

Treasurer: Reeta Dave

ISO: Neelu Sachdev

CC: Ravinder Kaur Luggani

PDC: Dr. Kanak Saxena

PDC: Sunita Deodhar

Founder Member: PP Ansuya Shah

All the Past President & Members

Click Here

જ્યોતિષ વિશારદ • વાસ્તુશાસ્ત્રી • જેમોતોજિરત

વાર્ષિક રાશિ ભવિષ્ય સંવત વર્ષ ૨૦૨૧
સમીર સેજપાલ-૯૮૧૯૨૯૮૪૦૪

કન્યા (૫.૬.૧૯.)

(નવેમ્બર-૨૦૨૪) : આગામી થોડા દિવસ કોઈપણ પ્રકારનું ઘર્ષણ ટાળવાની સલાહ છે. પરિવારના અગત્યના મુદ્દાઓ પર ચર્ચા દ્વારા નિરાકરણ લાવી શકશો એમ દેખાય છે. જીવનમાં મુશ્કેલીના સ્થાને ખુશીઓ લાવવા દૈવી માર્ગદર્શન માટે પ્રાર્થના કરવાનો સમય છે. એક વળગણમાં છુટકારો મેળવવો તમારી માટે બહુ જ જરૂરી છે. કરેલા કાર્યોનું એવોર્ડ અને કદરના રૂપમાં વળતર મળતા ખુદની શક્તિમાં વિશ્વાસ દૃઢ બનશે. શરૂ થઈ રહેલા સુવાણ સમયની આ તો હજુ શરૂઆત છે. આર્થિક અને ભાવનાત્મક સલામતી પ્રાપ્ત થશે એ માટેના જોરદાર પ્રયત્નો ચાલુ રાખો. થોડા દિવસ મિત્રો પણ અગ્રસ્થાને રહેશે. કેટલાક મિત્રોને મળવા શહેર કે પરદેશ જવાનો પ્રસંગ ઊભો થશે. **શ્રીવર્ગ માટે** : બિઝનેસ અને મૈત્રીની ભેળસેળ ન કરો.

(ડિસેમ્બર-૨૦૨૪) : ધૂંધવાઈને બેસી રહેવાને બદલે મુશ્કેલીનો સામનો કરો. નવેસરથી આંતરસૂઝ કેળવવા તમારી શક્તિ અને નબળાઈઓનું ઉદ્દેશ્યાત્મક મૂલ્યાંકન કરો. કરીઅરમાં આગળ વધવાનો સમય શરૂ થઈ ગયો છે. પરિવારના સર્પોટથી વધુ ઊંચાઈને સહેલાઈથી આંબી શકશો એમ દેખાય છે. જોકે સ્પષ્ટ પરિણામ દેખાતા થોડો સમય તો લાગશે. બિઝનેસમાં કેટલાક નવા પરિચયો થશે અને એમાંના કેટલાક

પાસેથી થોડો ઘણો બિઝનેસ પણ મેળવી શકશો. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો અને ભૂતકાળમાં ખોવાયેલા રહી નસીબને દોષ દેવાને બદલે તમને જે મળ્યું છે એનાથી સંતોષ માનો એવી મારી સલાહ છે. **શ્રીવર્ગ માટે** : જે નિર્ણય લીધો હોય એના પર જ ધ્યાન કેન્દ્રિત રાખો. મનની ચંચળતાને કંટ્રોલ કરો.

(જાન્યુઆરી-૨૦૨૫) : કોઈ અજાણ્યા ભયને કારણે સ્પષ્ટ માર્ગ અપનાવવા મન આનાકાની કરતુ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. વાસ્તવમાં હતાશા અને અવરોધો તમારા વિચારોની પધ્ધતિમાં બદલાવ લાવીને નવા જીવન તરફ દોરી જશે એમ દેખાય છે. મિત્રોને મળવામાં સહેજ વિલંબની શક્યતા છે. બીજી નોકરી શોધવા વિચારો એવી સંભાવના છે. કદાચ નવી કરીઅર પણ શરૂ કરી શકો છો. લાંબાગાળાના ઈન્વેસ્ટમેન્ટના જાણકાર પ્રોફેશનલની સલાહ લઈ ઓછા જોખમવાળુ રોકાણ કરવાની સલાહ છે. વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે કાળજીપૂર્વક પસંદગી કરવી પડશે. **શ્રીવર્ગ માટે** : તમે ભલાઈની પ્રકૃતિ ધરાવતા હોવાથી આજન્મમાં શક્ય તેટલા લોકોને સહાય કરવાની વૃત્તિ રહેશે. પરંતુ, અમૂક નિર્ણયોમાં પ્રેક્ટિકલ બનવાની સલાહ છે.

(ફેબ્રુઆરી-૨૦૨૫) : ઘણી બધી રીતે વર્તમાન સમય વિજયી બનવાનો અને સ્મિત સાથે આગળ વધવાનો છે. જીવનમાં ઘણી બધી શુભ બાબતો બનવાની તૈયારીમાં છે. જોકે એ માટે તમારે થોડી રાહ તો જેવી પડશે. એક સમસ્યાને નવા એન્ગલથી હાથ ધરો. એ સમસ્યાને સમજી જશો એટલે અચાનક નવી તકોના દ્વાર ખૂલી જશે એમ દેખાય છે. કુદરતના ગુપ્ત

સ્પંદનો સમજીને આગળ વધો એવી મારી સલાહ છે. એક કાનૂની કેસનો ચૂકાદો તમારી તરફેણમાં આવવાની શક્યતા છે. કામકાજ અર્થે લાંબા અંતરનો પ્રવાસ કરવો પડે એવી સંભાવના છે. ઘરમાં નવા પાત્રના આગમનની શક્યતા દેખાય છે. **શ્રીવર્ગ માટે** : મૈત્રી અને સંબંધોમાં વધુ પડતી અપેક્ષા રાખ્યા વિના જેવા હોય તેવા સ્વીકારી લો.

(માર્ચ-૨૦૨૫) : ભૂતકાળમાંથી ઘણા પાઠ શીખવાને કારણે સહેજ લાગણીશીલ બની ગયા છો. જોકે જીવનમાં કઈ રીતે આગળ વધવું એ વિશે હવે કોઈ મૂંઝવણ નથી. જીવનમાં લગભગ બધા ક્ષેત્રોમાં સુધારો જોઈ શકશો એમ દેખાય છે. જેને ખૂબ ચાહતા હશો એ વ્યક્તિ સાથેના સંબંધો સહેજ પ્રતિકૂળ બન્યા હોય તો સમસ્યાના મૂળમાં ઉતરીને એમાં સુધારો લાવવાનો પ્રયાસ કરો. તમારા પોઝિટિવ અભિગમને કારણે ઊદ્દાસીનતા અને કંટાળા જેવા શબ્દો થોડા વખતમાં ભૂતકાળ બની જશે. આર્થિક પ્રગતિના માર્ગમાં ઊભી થયેલી રૂકાવટો ચમત્કારિક રીતે દૂર થઈ જશે એ નક્કી છે. વાહન લેવાનું વિચારી શકો છો. **શ્રીવર્ગ માટે** : મિત્રોને ઈમોશનલી બ્લેકમેઈલિંગ કરવાની તક ન આપો.

(એપ્રિલ-૨૦૨૫) : સહેજ અસ્વસ્થતા અનુભવો એવી સંભાવના છે. પરિવારના સભ્યો હાલ તમારી વધુ પડતી ટીકા કરી રહ્યા છે. જોકે તમારી લાગણીશીલતા એમને ઊગ્ર પ્રત્યાઘાત વ્યક્ત કરતા રોકી રહી છે એમ જણાય છે. એક મહત્વના સોદામાં થોડા વિલંબની શક્યતા છે. ઝઘડી રહેલા બે મિત્રો કે પરિચિતો વચ્ચેની સ્થિતિ હાથ બહાર જવાની શક્યતા છે, એટલે બંને વચ્ચે સમાધાનનો પ્રયાસ ન કરો. પાચનતંત્રની કે પેટની કોઈ સમસ્યા હોય તો ડોક્ટરને જલ્દી કન્સલ્ટ કરવાની સલાહ છે. સારી તંદુરસ્તી માટે યોગની પ્રેક્ટિસ કરો. વર્તમાન સમય વાહન ખરીદી માટે સાનુકૂળ છે. **શ્રીવર્ગ માટે** : એક નજીકની વ્યક્તિ પૈસા માગશે. આપતા પહેલા પૂરતો વિચાર કરી લેજો.

(મે-૨૦૨૫) : હાલ તમારી સામે સત્ય આવી જશે અને સાચા શુભેચ્છકો નહીં હોય એ લોકો ખુલ્લા પડી જશે એમ દેખાય છે. એક આદતમાંથી છુટકારો મેળવવા વર્તમાન સમય સાનુકૂળ છે અને એ માટેની ઈચ્છા શક્તિ પણ તમે ધરાવો છો. જોકે હમણા થોડો વખત પાર્ટીઓમાં જવાનું ટાળવાની સલાહ છે. એક કાનૂની પરિસ્થિતિને કાળજીપૂર્વક હાથ ધરવી પડશે. બીજા લોકો વિશે ન્યાય તોળવાનું એકદમ સહેલું છે. પરંતુ ખુદને એ પરિસ્થિતિમાં મૂકો અને પછી તમારા વિચારોમાં કેવું પરિવર્તન આવે છે એ જુઓ. ગુમાઈ ગયાનું માનતા હશો એવી કોઈ કિંમતી ચીજ મળી આવે એવી સંભાવના છે. **શ્રીવર્ગ માટે** : તમને રસ પડે એવી પ્રવૃત્તિમાં પરોવાઈ જાવ તો સાડું.

(જુન-૨૦૨૫) : તમને માત્ર ગેરમાર્ગે દોરવાનો ઈરાદો રાખતા હોય એવા લોકો સાથે વધુ પડતું હળવા-મળવાનું ટાળો. નવા મિત્રો અને અમૂક સંબંધીઓ પાછળ સમય ન વેડફો એવી મારી ખાસ સલાહ છે. પૂરતું આત્મમંથન કર્યા પછી તમારા વિચારો અને માન્યતાઓને અમલમાં મૂકો. શું બોલો છો અને ક્યાં અને કોની સાથે વાત કરો છો એનું બરાબર ધ્યાન રાખો, અન્યથા મુશ્કેલી સર્જશે. હાલની પરિસ્થિતિને પૂરી પીઠતાથી હાથ ધરો અને તમારા વર્તનમાં બદલાવ લાવવાની જરૂરિયાતને સમજો. વર્તમાન સમયમાં બલ્ડ પ્રેશર નોર્મલ રહે એ માટે કાળજી રાખો. **શ્રીવર્ગ માટે**

: મનની શાંતિના ભોગે લોકોને ખુશ કરવા પ્રયાસ ન કરો, સમજ્યાને?

(જુલાઈ-૨૦૨૫) : ભવિષ્યમાં મહત્વના પુરવાર થનારા લોકો તમારા જીવનમાં પ્રવેશવાની તૈયારીમાં છે. સમયના વર્તમાન ચક્રમાં લક્ષ્યને પ્રાપ્ત કરવા મળતી તકોનો ઊપયોગ કરી લો. તમને ચાહતી કોઈ ખાસ વ્યક્તિ પ્રવાસનું આમંત્રણ આપશે. આગામી સમયમાં મનની શાંતિ મેળવી શકશો અને ઈચ્છા પ્રમાણે જીવનમાં આગળ વધી શકશો એમ દેખાય છે. ઘર બદલો કે અન્ય શહેરમાં સ્થળાંતર કરો એવી શક્યતા છે. અપરિણીતોની મુલાકાત કોઈક રસપ્રદ વ્યક્તિ સાથે થશે. માત્ર ઊમરનો તફાવત નડશે. બહાર ખાવાનું હોય તો ચટણી, સોસ, ગ્રેવી જેવી ચીજો ટાળજો. **શ્રીવર્ગ માટે** : સાચી લાગણીઓને છુપાવો નહીં. કોઈ બાબતમાં દલીલો ટાળવા ખાતર સંમત ન થવાની સલાહ છે.

(ઓગસ્ટ-૨૦૨૫) : હાલ કામકાજ એક તરફ મૂકીને થોડા દિવસ રજા માણવાનો પ્લાન બની શકે છે. ઓછું બોલશો તો તમારી વાતને લોકો ગંભીરતાથી સાંભળશે અને મુત્સદ્દીપણાથી એક ઘટનાનું પરિણામ તમારી તરફેણમાં પલટાવી શકશો એમ જણાય છે. અત્યારે જ્યાં રહેતા હશો ત્યાંથી દૂર લઈ જતી જોબની એક ઓફર લાભદાયી હોવાથી સ્વીકારી લેવાની સલાહ છે. વિદેશમાં રહેતા એક મિત્ર સાથે સમાધાનની શક્યતા છે. એક સ્વપ્ન સાકાર થશે અને ઈશ્વર પણ તમને સહાય કરી રહ્યો છે એનો એ પુરાવો હશે. નવો મોબાઈલ કે લેપટોપ લેવાનો વિચાર સારો છે. **શ્રીવર્ગ માટે** : આગળ અભ્યાસ કરવાનો નિર્ણય લઈને લાંબા સમયની ઈચ્છા પૂરી કરવાનો સમય છે.

(સપ્ટેમ્બર-૨૦૨૫) : નિકટના લોકોને હજુ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છો એમ દેખાય છે. અંતરાત્માના અવાજને ઓળખીને નિર્ણયો લો અને એ મુજબ આગળ વધો એવી મારી સલાહ છે. શહેર બહારના કેટલાક પ્રવાસોમાંથી એકનું અણધાર્યું પોઝિટિવ પરિણામ આવશે. લાંબા સમય પછી એક મિત્ર સંપર્ક કરવા માગતો હોય તો તેના ઈરાદા વિશે શંકાશીલ ન બનો. પોતાનું ઘર વસાવો કે દાંપત્યજીવનમાં પદાર્પણ કરો એવી શક્યતા છે. છેવટે જીવનસાથી મળી જતા મનમાં શાંતિ અને સંતોષનો અનુભવ કરી શકશો. આ સમયમાં વાહન ઝડપથી ન ચલાવો, કોઈ નુકસાન થઈ શકે છે. સોના-ચાંદીમાં રોકાણ લાભદાયી રહેશે. **શ્રીવર્ગ માટે** : તમને ગમે એવી મીઠી વાતો કરતા લોકોથી ભોળવાઈ ન જાઓ.

(ઓક્ટોબર-૨૦૨૫) : મનમાં જે કંઈ હોય એ સ્પષ્ટપણે અભિવ્યક્ત કરવાની તમારી આદત આસપાસના લોકો હવે સ્વીકારતા થઈ ગયા છે. કુરસદનો સમય શોખની પ્રવૃત્તિ પાછળ ગાળો અથવા થોડા સમયથી એક તરફ મૂકી રાખેલા પરચૂરણ કાર્યો આટોપી લો એવી મારી સલાહ છે. શ્રીમંત વ્યક્તિ, મિત્ર કે પછી તમારી સાથે પ્રોજેક્ટમાં જોડાવા ઈચ્છતા હોય એવા પાર્ટનર પાસેથી આર્થિક સહાય મેળવવા માટે યોચ્ય સમય છે. ઘરમાં નવેસરથી સજાવટ કરો એવી શક્યતા છે. આગામી થોડા દિવસ અસ્વસ્થતાભર્યા રહેશે. પૂરતી ઊંઘ અને આરામ લેતા રહેજો. શક્તિ વધારવા નિયમિત અંતરે થોડું થોડું ખાતા રહો. **શ્રીવર્ગ માટે** : અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા આંતરસૂઝનો ઊપયોગ કરો.

ખુશીઓનું, પ્રકાશનું, લક્ષ્મીનું પ્રતિક
એટલે દિવાળી આ દિવાળી તમારી જીંદગી
ખુશી, પ્રકાશ અને લક્ષ્મીથી ભરપૂર રહે
તેવી શુભકામનાઓ.

સર્વેને દિવાવલીની
શુભકામના અને નવા વર્ષના
નૂતન વર્ષાભિનંદન

શ્રી ગાયત્રી ઉપાસક સમિતિ • ગીતા જ્ઞાન કેન્દ્ર
શ્રી લોહાણા સ્નેહમિલન, મુલુંડ
આર્ય નિવાસ ટ્રસ્ટ, મુલુંડ

Click Here

જ્યોતિષ વિશારદ • વાસ્તુશાસ્ત્રી • જેમોલોજિસ્ટ

વાર્ષિક રાશિ ભવિષ્ય સંવત વર્ષ ૨૦૨૧
સમીર સેજપાલ-૯૮૧૯૨૯૮૪૦૪

તુલા (૨.ત.)

(નવેમ્બર-૨૦૨૪) : હાલ તમે લાગણીઓ સાથે સમજૂતી કરી શકતા નહીં હો એમ દેખાય છે. જીવનની ફિલસૂફી વિશે વિચારવાના દિવસો છે. ખુદને સારી રીતે સમજવાના પ્રયાસમાં અંતરના ઊંડાણમાં ઊતરી શકશો. મિત્રો તરફથી સર્પોટ મળી રહેશે. તમારી સમસ્યાનો તદ્દન જુદો જ ઉકેલ તેઓ બતાવી શકશે. મક્કમતાથી કાર્ય કરવા વર્તમાન સમય એકદમ શુભ જણાય છે. પહેલુ સુખ તે જાતે નર્ચાની કહેવત યાદ રાખજો. ભાગદોડ ઓછી કરી, તબિયતનું ખાસ ધ્યાન રાખવાની સલાહ છે. નવા વાહનને ખરીદવાનો વિચાર સારો છે. **શ્રીવર્ગ માટે** : જેના પર તમારો અધિકાર હોય એ માટે લડત ચલાવો, સમજ્યાને?

(ડિસેમ્બર-૨૦૨૪) : વર્તમાન સમય દીર્ઘકાલિન સંબંધોનો પાયો રચવાનો છે. ફેમિલીની કાળજી અને ધ્યાન રાખવા તૈયાર રહેજો. હાલ ફેમિલીના સભ્યો સાથે સ્પષ્ટ અને નિખાલસતાપૂર્વક વાત કરવાનો પ્રસંગ ઊભો થશે. સારુ શું અને ખરાબ શું એ ન જાણતા લોકોને હૃદયપૂર્વક માફ કરો એવી મારી સલાહ છે. આગામી સમય દરમિયાન આર્થિક સ્થિતિ સ્થિર રહેશે. યોગ્ય નિર્ણય લઈ શકશો અને આર્થિક સ્થિતિ વધુ સધધર બનાવી શકશો એમ જણાય છે. જીવનના દરેક ક્ષેત્રમાં સ્થિરતા અને સમતુલા સ્થપાતી જશે. અવારનવાર શરીર કે પગ દુખે તો ડોક્ટરને કન્સલ્ટ કરો. **શ્રીવર્ગ માટે** : માત્ર જરૂર પૂરતો જ ખર્ચ કરો.

(જાન્યુઆરી-૨૦૨૫) : તમારી માનસિક નબળાઈને લીધે ભૂતકાળ તમને મૂઝવી રહ્યો છે. આધ્યાત્મિક વિકાસ અવરોધતી લાગણીઓને ઓળખી લેવાનો સમય છે. મક્કમ નિર્ણયો સાથે લક્ષ્યો પાર પાડવા ખુદને તૈયાર કરો એવી મારી સલાહ છે. બ્રહ્માંડની શક્તિઓ નવી તકો અને વિકલ્પો ઊભા કરી રહી છે એનો ઊપયોગ કરો. કેવળ વાતો કરવાથી કે વિચારવાથી નહીં ચાલે. યુવાનોને જેમના સંગાથમાં સારુ લાગણું હોય તેમની સાથે ભલે સમય વિતાવે પણ ખોટી આદતો શીખવતા મિત્રોથી દૂર રહેવું. અચાનક યાત્રા-પ્રવાસના યોગ છે. **શ્રીવર્ગ માટે** : હાલનો સમય વિલંબનો છે માટે પરિણામ મેળવવામાં ઊતાવળ ન કરો.

(ફેબ્રુઆરી-૨૦૨૫) : માર્ગમાં આમ તો કોઈ અવરોધ નથી, પણ તમારા પ્લાનમાં આગળ વધતા કોઈ રોકી રહ્યું છે એમ લાગ્યા કરે. આ માત્ર તમારો વહેમ છે કે ખરેખર બ્રહ્માંડની શક્તિઓ તમને કોઈ સંકેત આપી રહી છે, તે જાણવા પ્રયાસ કરો. તમારા પ્લાનને ફરી યોગ્ય પ્રકારે ઘડો અને એને લગતી બાબતો ગુમ રાખો. આમ કરવાથી હાથ બહાર ચાલી ગયેલી એક પરિસ્થિતિ ઊકેલાઈ જશે એમ દેખાય છે. વધારાના પૈસા આવશે અને પ્રોપર્ટી ખરીદવા માટે પણ યોગ્ય સમય છે.

બ્લડપ્રેશર ચેક કરાવતા રહેજો અને ખોરાક અને કસરત વચ્ચે સમતુલા જાળવજો. **શ્રીવર્ગ માટે** : અન્ય લોકોની સમસ્યામાં સામેલ ન થશો.

(માર્ચ-૨૦૨૫) : તમારા શ્રેષ્ઠ આઈડિયાને લોકો ધારણા મુજબનો પ્રતિસાદ ન આપે તો માફ ન લગાડશો. કેટલાક લોકો અચાનક પરિવર્તનો સ્વીકારી નથી શકતા. બળથી નહીં કળથી કામ કરવાનો સમય છે. છેલ્લા ઘણા વર્ષોથી જે સંપર્કો જાળવ્યા હશે એ મનસૂબાઓ પાર પાડવામાં મદદરૂપ બનશે. હાલ તમારી માટે કેવળ લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખવાનું અત્યંત મહત્વનું રહેશે. ફાઈનેન્શિયલ સ્થિતિ મજબૂત બનાવવા નિયમિત રોકાણ કરતા રહેવાની સલાહ છે. જોકે ઝડપથી પૈસાદાર બનાવે એવી સ્કીમોમાં ઈન્વેસ્ટ કરવાનું કોઈપણ ભોગે ટાળજો. **શ્રીવર્ગ માટે** : કોઈ સમસ્યા ન હોય ત્યાં કાલ્પનિક ભયથી પીડાશો નહીં.

(એપ્રિલ-૨૦૨૫) : અગાઉ ઘણી વખત હાથ દાઝ્યા હોય પછી ફરી એ જ ભૂલ કરવામાં કોઈ શાણપણ નથી એ સમજી લેવાનો સમય છે. કામકાજમાં હાલ અત્યંત વ્યસ્ત રહેશો. તમારા માટે સમય ફાળવવાનો મુદ્દો યુદ્ધના ધોરણે હલ કરવાની સલાહ છે. ફેમિલીમાં એક યુવાન મેમ્બરની આ સમયે ખાસ કાળજી લેવી પડશે. તેમની સાથે ઊંચેરાટથી નહીં પરંતુ પ્રેમથી વાત કરશો તો સારા પરિણામો મળી રહેશે. લોકો સાથે વધુ સાવચેતીથી અને ફૂનહેથી વર્તશો તો સંબંધો સુધરશે એમ જણાય છે. અણધાર્યાં વર્તુળોમાંથી મદદ મળી રહેશે. **શ્રીવર્ગ માટે** : જે મળ્યું છે એનો આનંદ માણો અને ઈશ્વરનો ઋણ સ્વીકારો.

(મે-૨૦૨૫) : હાલ કોઈ પણ સમસ્યાનો તાર્કિક ઉકેલ ટાળશો તો આગમાં ફૂદી પડવા જેવું થશે. ફાઈનેન્સ સંબંધી કોઈપણ અગત્યનો નિર્ણય ઊતાવળે ન લેજો એવી મારી સલાહ છે. બિઝનેસમાં પ્રતિસ્પર્ધાઓથી આગળ રહેવા હરીફાઈનો સામનો કરવો પડશે. લોકોને શીખામણ આપવાના અને માગે ત્યારે સલાહ આપવાના અભિગમને કારણે નવા મિત્રો બનાવી શકશો એમ દેખાય છે. એક તરફ નવા ઘર કે જગાની શોધ શરૂ થશે અને બીજી તરફ પૈસા છૂટા થવામાં વિલંબ થશે. આરોગ્યની ખાસ કાળજી લેજો. **શ્રીવર્ગ માટે** : ભૂલી જાઓ અને માફ કરી દો ની ભાવના રાખો, સમજ્યાને?

(જુન-૨૦૨૫) : કેટલીક હકીકતો પ્રત્યે અવાસ્તવિક બનો એવી શક્યતા છે. મહત્વકાંક્ષાઓ વિશે સમાધાન કરીને જીવનમાં નવી શરૂઆત કરો એવી મારી સલાહ છે. નોકરીમાં પગાર વધારાની અપેક્ષા રાખી શકો છો. કામકાજ અર્થે વિદેશ પ્રવાસનું પ્લાનિંગ થઈ શકે છે. અપરિણીતોને એક નવો મિત્ર મળવાની શક્યતા છે. યોગ અને ધ્યાનની સાધના મૈત્રી અને તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ બનશે. કલ્પના પણ ન હોય એવા લોકો તરફથી તમને મદદ મળી રહેશે. ચર્ચાઓ કરવાને બદલે હાલનો સમય કાર્ય કરવાનો છે, સમજ્યાને? **શ્રીવર્ગ માટે** : નાહકની ટીકાટિપ્પણી કરવાને બદલે સર્પોર્ટિવ નેચર રાખો તો સારું.

(જુલાઈ-૨૦૨૫) : હાલનો સમય આત્મમંથનનો છે. કર્મના સિદ્ધાંતમાં માનતા હો તો ધ્યાનમાં રાખજો કે પ્રત્યેક એક્શનનું રિએક્શન હોય જ છે. ખુદને સાચી રીતે ઓળખી લેવાનો સમય છે. અન્ય લોકો શું કરે છે એને મહત્વ ન આપો. તમે હાલ શું કરી રહ્યા છો એ વધુ અગત્યનું છે. જીવન મૃત્યુના આ અનંત ફેરામાંથી મુક્તિ મેળવવા સદ્કર્મો કરતા રહેવાની સલાહ છે. પરિવારમાં એક પ્રસંગની ઉજવણીથી સંબંધો દૃઢ બનશે એમ દેખાય છે. બિઝનેસમાં અગાઉ અજમાવી ચૂકેલા આઈડિયા સારું પરિણામ આપશે, કોઈ નવા અખતરા માટે યોગ્ય સમય નથી. **શ્રીવર્ગ માટે** : લાગણીઓ સમતોલ રાખો અને પ્રેક્ટિકલ બનો.

(ઓગસ્ટ-૨૦૨૫) : તકો ઝડપીને સ્વપ્નો પૂરા કરવા ઈચ્છી રહ્યા છો. સાથોસાથ શું અવાસ્તવિક છે અને શું ઊપયોગી છે એ પણ તમે જાણો છો. જીવનમાં પ્રણયના નવા અંકુરો ખીલશે. બંને પક્ષે એક સરખું આકર્ષણ રહેશે એમ દેખાય છે. વેપારમાં વધારો થશે અને અચાનક ધનલાભ થવાની શક્યતા છે. જીવનમાં હાલનો સમય લડી અને સંતોષજનક રહેશે. રિયલ એસ્ટેટની ખરીદી, ઈન્ટીરિયર ડેકોરેશન કે પછી સમારકામ માટે ખર્ચ કરવો પડશે. યોગ્ય પ્લાનિંગ અને સૂઝબૂજ દ્વારા સફળતા મેળવી શકશો. મિત્રો સાથે સારો સમય વિતાવી શકશો. **શ્રીવર્ગ માટે** : મૂંઝવણ ઊભી થાય ત્યારે તમારી પ્રેરણાનો સહારો લેજો.

(સપ્ટેમ્બર-૨૦૨૫) : મનમાં જે વિચારો રમી રહ્યા હોય એમાં આગળ વધી શકો છો. જોકે પહેલા એના આર્થિક પાસાની પાકી ગણતરી કરી લેવાની સલાહ છે. કર્મની નવી ગતિ શરૂ થઈ રહી છે અને એની સાથે કેટલાક સારા-નરસા પરિવર્તનો પણ આવશે. કેટલાક સમયથી મૂંઝવી રહેલી એક સમસ્યાનો ઉકેલ સૂઝી આવશે. અત્યાર સુધીમાં તમે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એની સમીક્ષા કરીને નવા બિઝનેસની શક્યતાઓ વિશે વિચારવું પડશે. અસ્વસ્થતાનો સમય પૂરો થયો છે. પ્રિયજન અને પરિવારના સભ્યો ફરી તમારી નિકટ આવશે એમ જણાય છે. **શ્રીવર્ગ માટે** : કાળજી લેવાના ગુણને અસરકારક રીતે વ્યક્ત કરો.

(ઓક્ટોબર-૨૦૨૫) : સામેની વ્યક્તિ ભલે આકરા વેણ ઊચ્ચારતી હોય, તેના હૃદયમાં પ્રેમ ભરેલો છે એ તમે જાણો છો. અમંગળ વિચારો ન કરો અને કોઈપણ ઊગ્ર પ્રત્યાઘાત આપવાનું ટાળો એવી મારી સલાહ છે. તમારા પ્રયાસો અને સૂઝબૂજથી યોગ્ય સોદા કરીને સફળતા મેળવી શકશો. હાલ ખુદના અધિકાર માટે ઊભા રહેવાનું વલણ યોગ્ય જ છે. જોકે કોઈપણ વલણ અપનાવતા પહેલા સંપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં લેવા પ્રયાસ કરવાની સલાહ છે. નરમ વલણ લાંબાગાળે વધુ ફાયદો અપાવશે એમ જણાય છે. કાર કે લેપટોપ ખરીદવાનો વિચાર સારો છે. **શ્રીવર્ગ માટે** : ઝઘડાળુ વૃત્તિ ધરાવતા લોકોને ટાળજો અને પોઝિટીવ વિચારો કરતા રહેજો.

CA Ketki Dagha

Wish you a very
Happy Diwali
& Prosperous New Year

Ketki Dagha & Associates
Chartered Accountants

[Click Here](#)

જ્યોતિષ વિશારદ • વાસ્તુશાસ્ત્રી • જેમોતોજિસ્ટ

વાર્ષિક રાશિ ભવિષ્ય સંવત વર્ષ ૨૦૨૧
સમીર સેજપાલ-૯૮૧૯૨૯૮૪૦૪

વૃશ્ચિક (ન.ય.)

(નવેમ્બર-૨૦૨૪) : થોડા સમયથી સતાવી રહેલી સમસ્યાનો અચાનક ઊકેલ આવતા થોડી રાહત થશે. કામકાજમાં અત્યાર સુધીમાં જે સફળતા મેળવી હોય એનું વાસ્તવિક મૂલ્યાંકન કરશો તો આગળ જતા સ્થિતિતા ટાળી શકશો એમ દેખાય છે. બાકી રહેલું કામકાજ ઝડપથી પૂરું કરીને શહેર બહારના પ્રવાસનું આયોજન કરો અને પ્રિયજન સાથે આનંદની પળો માણો એવી મારી સલાહ છે. અણધાર્યો ખર્ચ આવી પડશે એ માટે તૈયાર રહેજો. પરિણીતોના ઘરે પારણું બંધાવાની શક્યતા છે. અને જો તમે અપરિણીત હો તો લગ્નના યોગ શરૂ થયા છે. **શ્રીવર્ગ માટે** : તમારો શોખ પૂરો કરો કે ઘરમાં સાફસફાઈ અથવા વાંચન વગેરે કાર્ય હાથ ધરો તો સારું.

(ડિસેમ્બર-૨૦૨૪) : અત્યંત વ્યસ્ત સમય છે પરિણામે જીવનના અન્ય પાસાંઓની અવગણના કરી રહ્યા છો એમ દેખાય છે. વિદેશથી આવનારો એક સંદેશો કામનો બોજો વધારશે. લાંબાગાળાના ધ્યેય પર નજર રાખો અને કાળજીપૂર્વક લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો એવી મારી ખાસ સલાહ છે. એકાદ મોટો સોદો પાર પડતા વિજય મેળવ્યાનો સંતોષ થશે. ઊંઘીના પૈસા લઈ ગયેલો એક મિત્ર

લાંબા સમય પછી એ પાછા આપવાનું વિચારી શકે છે. અણધારી ભેટ કે ઘનલાભ મળવાની શક્યતા છે. સોના-ચાંદીમાં રોકાણ લાંબેગાળે લાભદાયી રહેશે. **શ્રીવર્ગ માટે** : ગમે એટલા પ્રયાસો કરશો તો પણ પ્રવાસનો પ્લાન વિલંબમાં મૂકાઈ શકે છે.

(જાન્યુઆરી-૨૦૨૫) : મનને નિયંત્રણમાં રાખવાથી અને કલ્પનાશક્તિને કામે લગાડવાથી પોઝિટિવ માર્ગ પર તમારી શક્તિને કેન્દ્રિત કરી શકશો. તમને એકાદ મુદ્દા પર પીછેહઠ કરવી પડે તો ચિંતા ન કરો. હાલ ભલે એક ડગલુ પાછા હટવું પડે, પણ ભવિષ્યમાં સુખ છલાંગ લગાવી શકશો એમ દેખાય છે. તંદુરસ્તી સારી રહેશે તે છતાંય ખાવા-પીવામાં કાળજી લેવી પડશે. ઓફિસની જગ્યા બદલો, નવી જગ્યા ખરીદો કે ભાડેથી આપો એવી શક્યતા છે. પ્રતિકૂળ સમયમાં કામ લાગે એ માટે થોડી બચત કરવાની સલાહ છે. અપરિણીત હો તો કરીઅર પર જ ધ્યાન આપો તો સારું. **શ્રીવર્ગ માટે** : જે સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ છેવટે મળશે.

(ફેબ્રુઆરી-૨૦૨૫) : તમે માનસિક રીતે તો રજાઓ માણવાના મૂડમાં છો. જોકે આ મહિનો શરૂ થતાં જ તમને લાગશે કે અહીંથી જરા પણ ખસી શકાય એમ નથી. તમારા જીવનમાં અત્યંત નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યું છે. અણધારી ઘટના માટે તૈયાર રહેજો. આસપાસમાં આવી રહેલા પરિવર્તનો વિશે મનમાં કોઈ ભય રાખવાની જરૂર નથી. આવા પરિવર્તનો તમારામાં નવી સમજદારી લાવશે એમ જણાય છે. નવી નોકરીમાં શરૂઆતમાં

સહેજ નિયંત્રણો જેવું લાગશે પરંતુ, જરૂરી કાર્યો પર લક્ષ્ય કેન્દ્રિત કરશો તો થોડા દિવસમાં બધું સરળ બની જશે. **શ્રીવર્ગ માટે** : ખોટી દિશામાં આગળ વધી રહ્યાનું લાગતું હોય તો ત્યાં જ અટકી જવાની સલાહ છે.

(માર્ચ-૨૦૨૫) : તમે અનેક પ્રકારના આશ્ચર્યજનક અનુભવોમાંથી પસાર થઈ રહ્યા છો. હાલના સમયમાં તમને ઘણા બધા પાઠો શીખવા મળી રહ્યા છે. આમાંનો એક પાઠ ઈચ્છાઓ પૂર્ણ કરવા અવિરત પ્રયાસ કરતા રહેવાનો છે. તમારા અંતરના અવાજને અનુસરો અને એક વખત લક્ષ્ય દેખાવા લાગે એટલે પ્રેક્ટિકલ બનજો, પણ ધ્યેય ઊંચુ જ રાખજો એવી મારી સલાહ છે. બહારગામથી ઓચિંતા મહેમાનો આવી શકે એવી શક્યતા છે. અણધારી ભેટ મળવાના યોગ છે. ઘરના એકાદ યુવાન સાથે ઝઘડો ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. **શ્રીવર્ગ માટે** : તહેવારો નજીક આવે છે છતાં શોપિંગનો વિચાર કેમ નથી કરતા?

(એપ્રિલ-૨૦૨૫) : બીજા લોકો હાલ તમારી વાત માનવાના મૂડમાં નથી. તમે જો તેમના માટે વિશ્વાસુ ઠરશો અને ધીરજ રાખશો તો સૌ સારા વાનાં થશે. સમય એવો છે કે કામનો ભાર લાગશે અને આરોગ્યની સમસ્યા પણ ઊદ્ભવશે. તમારી પ્રાથમિકતાઓ નક્કી કરી લો અને પછી મંડી પડો તો વાંધો નહીં આવે એમ જણાય છે. ઘર બદલવાની વેતરણમાં હશે તો શુભ સંકેત મળવાના યોગ છે. એ ઊપરાંત પરિવારમાં સારો પ્રસંગ ઊજવાશે. ઘરના વૃદ્ધોની તબિયતનું ધ્યાન રાખવાની સલાહ છે. યુવાનો માટે પ્રેમકરણના મુદ્દે કંઈક રંધાવાની શક્યતા છે. **શ્રીવર્ગ માટે** : બપોરે એકાદ ઝોકું ખાવાનો વાંધો નથી, પણ માથાનો દુખાવો કદાચ સૂવા નહીં દે.

(મે-૨૦૨૫) : હાલ તમારી પ્રામાણિકતાની કદર નહીં થાય. આમ ઘણા સમયથી ચાલી રહ્યું છે. એક ક્ષણ માટે તમને એવું લાગશે કે સારા થવામાં માલ નથી. પણ ઊતાવળા ન થતા. થોડા જ દિવસોમાં સારા સમાચાર મળશે અને તમારી કદર પણ થશે. નોકરી કે બિઝનેસ સંબંધિત કોઈ નવી વેતરણ કરી હોય તો આગળ વધવાના ચાન્સ છે. બધું કામ જાતે જ કરવાનો આગ્રહ તમને થકવી નાખશે. ક્યારેક બીજા પર પણ જવાબદારી ઢોળી દેતા શીખો એવી મારી સલાહ છે. એકાદ જૂના મિત્રની અણધારી મુલાકાત તમને આનંદિત બનાવી દેશે. પડવા-વાગવા કે દાઝવાની સંભાવના છે. **શ્રીવર્ગ માટે** : પ્રિયજન પ્રત્યે નરમ અને સમજદારીથી વર્તવાની સલાહ છે.

(જુન-૨૦૨૫) : જીવન દિશાવિહીન જણાતું હોય તો એમાં તમારો નહીં, પણ ગ્રહોનો વાંક છે. કોઈ તમને પ્રેમ કરે એવું ઈચ્છી રહ્યા છો, પણ સામેવાળાને આકર્ષિત કરવા માટે તમે કેમ કંઈ કરતા નથી? તમે એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો જ્યાં ફક્ત તમે સપનામાં જ કાર્યરત છો. તમારી લાગણીઓ અને સંવેદના બહુ ઊંડી છે. આત્મવિશ્વાસ કેળવો અને સપનામાંથી બહાર આવીને આગળ વધો એવી મારી સલાહ છે. આ સમયે તમારી પ્રેમકથામાં વળાંક આવે એવી શક્યતા છે. બહાર ખાવાના હો તો સંભાળજો, રોગોનો યોગ

છે. **શ્રીવર્ગ માટે** : બીજાઓ માટે તમે ઘણું કર્યું, હવે પોતાની માટે જીવો. શરમ છોડીને પોતાની વાત બરાબર રજૂ નહીં કરો તો પસ્તાશો, સમજ્યાને?

(જુલાઈ-૨૦૨૫) : તમારી કોઈ ખાનગી વાત જાહેરમાં આવી શકે છે. જેના પર અતૂટ વિશ્વાસ હોય તેણે જ દગો આપ્યો હોય એવી શક્યતા છે. નકામા લોકો ઘણા વખતથી તમારી આજુબાજુ જમા થઈ ગયા છે. તેમની ટોળકીમાં ભળવાની શી જરૂર છે? આજે જ તેમને રુખસદ આપી દો તમારી જિંદગીમાંથી, સમજ્યાને? કામના કાગળ ક્યાંક મુકાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાની સલાહ છે. સામાજિક જીવન સહેજ મંદ ગતિએ આગળ વધશે. ભવિષ્ય પ્રત્યે આશાવાદી બનશો તો તમારી યોજનાઓને સારી રીતે આગળ વધારી શકશો એમ જણાય છે. **શ્રીવર્ગ માટે** : ચટાકેદાર ખાવાપીવાનું ટાળો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

(ઓગસ્ટ-૨૦૨૫) : હાલ થોડા દિવસો પહેલા તમે જેને મળ્યા છો તેના પ્રત્યે પ્રેમ અને આકર્ષણ થઈ શકે છે. કોઈને કોઈ બહાને એને મળતા રહો. આમ કરવાથી મિત્રતા વધશે અને મનમેળ સ્થાપિત કરી શકશો એમ દેખાય છે. તદ્દન નવા જીવનનો અનુભવ મેળવવા ઊત્સાહપૂર્વક આગળ વધો અને ભૂતકાળને પાછળ મુકી દો એવી મારી સલાહ છે. અશક્ય લાગતું લક્ષ્ય પાર પડી જતા મનમાં આશા અને ઊત્તેજનાની લાગણી જાગશે. વર્તમાન પર લક્ષ્ય કેન્દ્રિત કરો અને ભૂતકાળમાં ભટકતા મનને વર્તમાનમાં સ્થિર કરો, સમજ્યાને? **શ્રીવર્ગ માટે** : અચાનક શહેર બહારનો પ્રવાસ અવિસ્મરણીય બની રહેશે.

(સપ્ટેમ્બર-૨૦૨૫) : છેલ્લા ઘણાં સમયથી તમે સતત કાર્યરત છો અને ભાગદોડ કરી રહ્યા છો. થોડા સમય માટે કામકાજમાં બ્રેક લો અને રજા માણવા ઊપડીજાઓ એવી મારી સલાહ છે. ભાવનાત્મક સમસ્યા ઊભી થઈ હશે તો હવે તમને માનસિક શાંતિ મળશે એમ જણાય છે. નવી પાર્ટનરશિપનો નિર્દેશ મળી રહ્યો છે. જોકે અસહમતીને કારણે ઝડપથી નિર્ણય લઈ નહીં શકો. માતાપિતાની સંમતિથી લગ્ન કરવાના હો તો થોડા વખતમાં જ યોગ્ય માગું આવશે. તમારા માટે યોગ્ય પાત્ર શોધવામાં સંબંધીઓની મદદ લો તો સારું. **શ્રીવર્ગ માટે** : નવા વાહનના યોગ છે. માર્ગી મદદ મળશે. એટલે હકનું મેળવવા આગળ વધો.

(ઓક્ટોબર-૨૦૨૫) : સક્રિય બનશો તો જીવનમાં સારા પરિવર્તનો આકાર લેશે. તમારા ફાયદા વિશે કાળજી નહીં લો તો ફાઈનેન્શિયલ નિર્ણયો તમારી તરફેણમાં કદાચ નહીં આવે. જીવનમાં ઘરમૂળથી પરિવર્તન, નવા જીવનની શરૂઆત, ભાવનાત્મક અને આર્થિક સધ્ધરતા, આ બધી ભેટો સ્વીકારવા માટે તમારે સજાગ રહેવું પડશે. તમે જેમા માનતા ન હો એવી અજાણી દિશામાં આગળ વધવાના યોગ છે. તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતી વ્યક્તિ સાથે આગળ વધવાથી જીવનનો રાહ બદલાઈ જશે એમ જણાય છે. નવી કાર ખરીદવાનો સારો સમય છે. વિદેશયાત્રા સંભવે. **શ્રીવર્ગ માટે** : હિતશત્રુઓ અડચણ ઊભી ન કરે એ માટે અમૂક માહિતી તમારા પૂરતી સીમિત રાખો.

Wish You a very
Happy વૈશ્વકો
& Prosperous New Year

With best compliments from:

CA Bakulesh Kotecha & Family

Click Here

જ્યોતિષ વિશારદ • વાસ્તુશાસ્ત્રી • જેમોતોજિરટ

વાર્ષિક રાશિ ભવિષ્ય સંવત વર્ષ ૨૦૨૧
સમીર સેજપાલ-૯૮૧૯૨૯૮૦૪

ધન (ભ.ધ.ફ.ટ.)

(નવેમ્બર-૨૦૨૪) : ભવિષ્યમાં કોઈક તબક્કે સત્તાશાહી અભિગમ જીવનસાથી સાથે મતભેદ ઊભા કરી શકે છે. તમારા પ્રિયજન ભાવુક છે અને તેમનું વર્તન પડકારરૂપ લાગશે. તમારી સમજદારી પર ભરોસો રાખી હાલના ભાવનાત્મક મુદ્દાનો સામનો કરો. શાંતિથી અને સ્પષ્ટતાપૂર્વક તમારા વિચારો વ્યક્ત કરો એવી મારી સલાહ છે. ધીરજ રાખશો અને સમય પસાર થઈ જાય ત્યાં સુધી રાહ જોશો તો ફાયદો અવશ્ય થશે. પ્રોપર્ટીની સમસ્યા બાબતે ઘર કે પરિવારના કોઈ યુવાન સભ્ય અલગ થવા ઈચ્છી રહ્યા છે એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. **શ્રીવર્ગ માટે** : નુકસાનની શક્યતા છે. કિંમતી જણાસ અને પૈસાની બાબતમાં વધુ સાવધ રહેજો.

(ડિસેમ્બર-૨૦૨૪) : વર્તમાનમાં જીવણો તો સમયને પારખવાની શક્તિનો તમે લાભ ઊઠાવી શકશો. એના કારણે તમારામાં રહેલી છૂપી શક્તિઓને ઓળખી શકશો એમ દેખાય છે. ભૂતકાળમાં ખોવાયેલા રહેવાને બદલે ભવિષ્ય તરફ મીટ માંડો એવી મારી ખાસ સલાહ છે. વિશ્વાસુ લોકો સાથે વિચારોની આપ-લે કરવાથી મંત્રણામાં ફાયદો થશે. હાલ માત્ર વાતો કરવાને બદલે નિર્ણાયક પગલા લેશો તો અસરકારક પરિણામ મળી રહેશે. અન્ય લોકો ભલે ગમે એ કહે, પણ જીવનસાથી પર ભરોસો રાખો. શંકાશીલ સ્વભાવ હાલ કામ નહીં લાગે, સમજ્યાને? **શ્રીવર્ગ માટે** : વધુ અભ્યાસની તમારી ઈચ્છા પૂર્ણ કરવા આગળ વધો.

(જાન્યુઆરી-૨૦૨૫) : ઈશ્વરે જે કંઈ આપ્યું છે એ બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માનવાનો સમય છે. ભૂતકાળના કર્મો તમને ભવિષ્ય તરફ દોરી જશે એમ દેખાય છે. આત્મનિરીક્ષણના નવા અભિગમ સાથે આવતી કાલ તરફ મીટ માંડો એવી મારી સલાહ છે. આ સમયે ભારે કામગીરી બજાવવી પડશે અને પરિણામે તાણ દૂર કરવા પ્રયાસો કરવા પડશે. રોજ એકાદ-બે જરૂરી કામો જ હાથ પર લો. એ રીતે કાર્યો પાર પાડી શકશો અને તમારો ઊત્સાહ પણ જળવાશે. ભાઈ, બહેન કે સંતાનને અચાનક પ્રસિધ્ધિ મળશે. **શ્રીવર્ગ માટે** : જેમના પ્રત્યે પ્રેમ હોય એ વ્યક્તિને તમારી સંવેદનશીલતાનો પરિચય કરાવો.

(ફેબ્રુઆરી-૨૦૨૫) : દુનિયા તમારા વિશે શું વિચારે છે એની ચિંતા કર્યા વિના તમારામાં મસ્ત દેખાઈ રહ્યા છો. હમણા-હમણા તમે થોડા આળસુ પણ થઈ ગયા છો. બિઝનેસમાં થોડા સમયની નિષ્ક્રિયતા પછી ફરી કામ મળવા લાગતા મન પ્રસન્ન બનશે. અત્યાર સુધી ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને ધીરજ ધરી હતી એનું હવે ફળ મળવા લાગશે એમ જણાય છે. પરિવારનો એક યુવાન સભ્ય સહેજ મૂંઝાયેલો છે. એની સાથે નાજુકાઈથી અને કુનેહથી વર્તજો એવી મારી સલાહ છે. ઇલ્લા

કેટલાક સમયથી જે પ્રોપર્ટી વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ હવે વેચાઈ જશે. **શ્રીવર્ગ માટે** : એકાદ રસપ્રદ વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે.

(માર્ચ-૨૦૨૫) : થોડો સમય એક તરફ બેસી આગામી રણનીતિ પર વિચાર કરવાનો સમય છે. હાલ તમને સખત મહેનત કરવી પડશે. ખાસ તો જે કાર્ય કરો એ શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરજો. દેશની અંદરનો એક નાનકડો પ્રવાસ નસીબને ચમકાવી શકે છે. શેરબજારમાં ઈન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરતા હો તો કાળજી રાખવાની સલાહ છે. વાહન ચલાવતી વખતે ઈજા થવાની શક્યતા છે. નોકરીમાં સ્પર્ધાત્મક વાતાવરણ ઊભુ થયું છે એનાથી તમને જ લાભ થવાનો છે. એવા સંકેત મળે છે કે પગારમાં વધારો થશે. **શ્રીવર્ગ માટે** : તમે જૂના વિચારોને વળગી રહેશો તો શાંતિ માણી શકશો એમ જણાય છે.

(એપ્રિલ-૨૦૨૫) : અત્યાર સુધીના કપરા સમયમાં તમારી ધીરજની કસોટી ઘણી થઈ છે. જીવનમાં મહત્વનો વળાંક આવી રહ્યો છે. એક સાથે ઘણા બધા પરિવર્તનો આકાર લઈ રહ્યા છે ત્યારે પ્રિયજન માટે પણ સમય કાઢતા રહેજો. તમારું જીવન સરળતાથી આગળ વધારવામાં તેમનો સિંહફાળો છે એ ભૂલશો નહિ. એક મિની બ્રેક લઈ નજીકમાં છુટ્ટી મનાવી આવો. પાછા ફરશો ત્યારે આર્થિક બાબત વિશે એક શુભ સમાચાર અવશ્ય મળશે એમ દેખાય છે. અચાનક લોન કે વારસો મળતા આર્થિક મુશ્કેલી દૂર થઈ જશે. તબિયતનો ખ્યાલ રાખો. પૂરતી ઊંઘ, સત્વવાળો ખોરાક અને કસરત કરતા રહો એવી મારી સલાહ છે. **શ્રીવર્ગ માટે** : અનાવશ્યક ખર્ચ ટાળો.

(મે-૨૦૨૫) : તમારા ભવિષ્યના પ્લાન વિશે સહેજ ગુપ્તતા રાખવાનો સમય છે. ઘરમાં કોઈ વ્યક્તિ પોતાનો જ કક્કો ખરો કરવા માગતી હોય તો તેની સાથે જીભાજોડી કરવાથી અળગા રહો. અત્યાર સુધી તમે મેળવેલી સિધ્ધિ અને કરેલા કામોનું સરવૈયું કાઢવાથી ભવિષ્યની સ્પષ્ટ દિશા મળી રહેશે એમ દેખાય છે. આર્થિક દશામાં સુધારાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે, પરંતુ હાલ તમે કોઈ નવું કામ કરતા પહેલા એના પરિણામોનો અવશ્ય વિચાર કરી લેજો એવી મારી સલાહ છે. પોતાનો વ્યવસાય હોય તો લોન માટે અરજી કરી શકો છો. **શ્રીવર્ગ માટે** : હાલમાં જ કોઈ ચાહિતી વ્યક્તિને મળ્યા હો તો એની સાથે ફરી મુલાકાત થવાની સંભાવના છે.

(જુન-૨૦૨૫) : તમે સાચી લાગણીઓને પ્રામાણિકતાથી વ્યક્ત કરવામાં માનો છો. જોકે હાલ તમારા પ્લાન અને વિચારો તમારા પૂરતા સીમિત રાખો એવી મારી સલાહ છે. સંબંધો બાબત તેમજ કામકાજની દિશામાં મહત્વના નિર્ણયો લેવા માટે તૈયાર રહેવું પડશે. તમારી આંતરિક સૂઝ અને સહજવૃત્તિ પર વિશ્વાસ રાખીને આગળ વધો. જીવનમાં પરિવારજનો અને મિત્રોનું બેશક મહત્વ છે અને તમારી તેઓ ફિક્કર કરે એ પણ સ્વાભાવિક છે, પરંતુ એક વાત યાદ રાખો કે સલાહ બધાની કાને ધરો, પણ આગળ વધવા માટે પોતાનું જ મગજ દોડાવો,

સમજ્યાને? **શ્રીવર્ગ માટે** : આરોગ્યપ્રદ ખોરાક લઈને તંદુરસ્તીની કાળજી લો.

(જુલાઈ-૨૦૨૫) : એકાદ નાની માંદગીમાંથી બેઠા થયા છો અને હવે તમને ઘણું સારું લાગી રહ્યું હશે. શું ખાવું અને શું ન ખાવું એ વિશે ચીવટાઈ રાખવાનો સમય છે. આ સમયે ફરી કામ પર ચડી જવા તૈયારી કરો એવી મારી સલાહ છે. તમારામાં બુધ્ધિપ્રતિભા, રચનાત્મક વિચારો, વ્યવહારું અભિગમ અને લાગણીને સમતોલ રાખવાના ગુણોનો સમન્વય થયો છે. મન પર અંકુશ રાખીને અને કલ્પનાશીલતાથી કામ કરવાથી સ્વપ્નો અને મહત્વકાંક્ષા સાકાર થશે એમ દેખાય છે. બિઝનેસનો નવો વિચાર વહેતો મૂકવા માટે યોગ્ય સમય છે. **શ્રીવર્ગ માટે** : નિકટના સંબંધો નવેસરથી બાંધવાની અને દૃઢ બનાવવાની તક મળશે.

(ઓગસ્ટ-૨૦૨૫) : તમે સતત કામમાં રોકાયેલા રહો છો અને નજીકના ભવિષ્યમાં કુરસદ મળે એવા સંજોગો દેખાતા નથી. તમે જીવનના અત્યંત સંતોષજનક અને સર્જનાત્મક તબક્કામાં પ્રવેશી ચૂક્યા છો. આ સમય દરમિયાન સ્પર્ધાત્મક શક્તિમાં વધારો થશે. તમારી જબરદસ્ત ઈચ્છા શક્તિને જાગૃત કરો અને કેવળ તમારા લક્ષ્ય પર નજર રાખી આગળ વધો એવી મારી સલાહ છે. વારસો મળવાથી કે પ્રોપર્ટી મળવાથી સમાંતર આવક શરૂ થવાની શક્યતા છે. લાંબા પ્રવાસે નીકળતા અગાઉ વાહન ટોપ કંડિશનમાં હોય એની કાળજી લેજો. **શ્રીવર્ગ માટે** : સુષુપ્ત મનમાં

રહેલી વાત હવે જાગૃત મનની સપાટી પર આવશે. (સપ્ટેમ્બર-૨૦૨૫) : તમારું લક્ષ્ય અને મહત્વકાંક્ષા તમે સમજી ચુક્યા છો. ઈશ્વરીય સંકેતો સામે શંકા કર્યા વિના પ્રવાહ સાથે આગળ વધતા રહો. સંજોગોની ઊજળી બાજુને ધ્યાનમાં લેવા પ્રયાસ કરશો તો તમને ઊતારી પાડવા ઘડાઈ રહેલા છૂપા કારસ્તાનો અટકાવી શકશો એમ દેખાય છે. કામકાજ સંબંધી શહેર બહાર પ્રવાસની વાતથી તમે ફરી જુસ્સામાં આવી જશો. ઓફિસમાં તમારી કાબેલિયત પુરવાર કરવા સ્પર્ધાનો સામનો કરવો પડશે. સંપૂર્ણ આત્મનિર્ભર અને સ્વતંત્ર બનવાનો પ્રયાસ કરો એવી મારી ખાસ સલાહ છે. **શ્રીવર્ગ માટે** : ખૂબ પ્રેમ કરતા હો તેના વિશે નિર્ણય બાંધવામાં ઊતાવળ ન કરો.

(ઓક્ટોબર-૨૦૨૫) : તમે અત્યંત ગતિશીલ મૂડમાં છો પરંતુ નકારાત્મક પરિસ્થિતિને કારણે તમે પ્રગતિમાં અવરોધ સહન કરી નથી શકતા એમ દેખાય છે. જીવનના કેટલાક ક્ષેત્રોમાં ભાવનાત્મક મૂંઝવણની સ્થિતિ ઊભી થવાની સંભાવના છે. લાગણીશીલતામાં ખેંચાઈ ન જાઓ. શાંત મન રાખીને વિચાર કરશો તો પરિસ્થિતિનો આસાનીથી સામનો કરી શકશો એ નક્કી છે. જીવનસાથી પ્રત્યે વધુ સમજદારીથી વર્તવાનો પ્રયાસ કરો. પરિણામે દાંપત્યજીવનના સંબંધો વધુ દૃઢ બનશે. પરિવારમાં નવા વ્યક્તિના આગમનની શક્યતા છે. **શ્રીવર્ગ માટે** : આતિથ્ય પાછળ ખર્ચ થશે.

JAIN SOCIAL GROUPS INTERNATIONAL FEDERATION
SANGINI FORUM
MULUND

દિવાળીના આ ખાસ અવસર પર, તમારું જીવન પ્રેમ અને આધ્યાત્મિક પ્રગતિથી ભરેલું રહે.

સંગિની ફોરમ મુલુંડ

હિનાબેન પારેખ (પ્રમુખ)	સમિતિના સભ્યો	
ગીતાબેન શાહ (સ્થાપક પ્રમુખ)	સરોજબેન શાહ	ભાવના શેઠ
દિવ્યાબેન ગાંધી (ઉપપ્રમુખ)	પારૂલબેન દોશી	રૂપલ સંઘવી
કિમ્બલબેન કોરાડિયા (સચિવ)	દમયંતીબેન શેઠ	બીના શાહ
દર્શનાબેન શાહ (સચિવ)	કેટકીબેન મહેતા	બીના શાહ
જીજ્ઞાબેન શાહ (ખજાનચી)	સ્મિતાબેન શાહ	મયણા સંઘવી

Click Here

જ્યોતિષ વિશારદ • વાસ્તુશાસ્ત્રી • જેમોલોજિસ્ટ

વાર્ષિક રાશિ ભવિષ્ય સંવત વર્ષ ૨૦૨૧
સમીર સેજપાલ-9819298404**મકર (ખ.જ.)**

(નવેમ્બર-૨૦૨૪) : તમારી આસપાસ પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને તમે મૂંઝવણ અનુભવી રહ્યા છો એમ જણાય છે. જોકે આશાનો તંતુ નબળો ન પડે એની કાળજી અવશ્ય રાખજો. હજુ તમને ઘણા કામો પાર પાડવાના બાકી છે. બધી જ નિરાશાને ખંખેરી નાખી દીર્ઘકાલીન લક્ષ્યો પર નજર રાખો. હાલ તમારો જુસ્સો વધારે એવા લોકોને શોધી કાઢો એવી મારી ખાસ સલાહ છે. મિત્રો માટે પૂરતો સમય ન ફાળવતા તેઓ નારાજ બને એવી સંભાવના છે. અણબનાવો દૂર કરવા સામેથી પહેલ કરવામાં કોઈ વાંધો નથી. **શ્રીવર્ગ માટે** : મનમાં આવેલો એક વિચાર સારો છે, પણ તે અમલમાં મૂકવા લાયક નહીં હોય.

(ડિસેમ્બર-૨૦૨૪) : નિરાશા સાથે શરૂ થયેલો સમય અચાનક પ્રસન્નતામાં ફેરવાઈ જશે. તમે અચાનક બધાના આકર્ષણનું કેન્દ્ર બની જશો. આથી મિત્રો અને શુભેચ્છકોની કંપનીમાં આનંદ માણી શકશો એમ જણાય છે. હાલ એકાદ બાબતમાં તમને ભલે પીછેહઠ કરવી પડે, પણ અત્યારે એક ડગલુ પાછળ હટવાનો અર્થ ભવિષ્યમાં મોટી છલાંગ લગાવવી એવો કરી શકો છો. સારું ઘર ખરીદી શકશો. અત્યારથી જ મનગમતું ઘર

શોધવાની શરૂઆત કરી શકો છો. તંદુરસ્તી અને ફિટનેસની કાળજી લેતા રહેજો. વાહન અકસ્માત શક્ય છે. **શ્રીવર્ગ માટે** : અવગણના થતી હોવાનું લાગે તો રજૂઆત કરો.

(જાન્યુઆરી-૨૦૨૫) : દરેક વ્યક્તિ બાહ્ય અને આંતરિક જીવંતી જીવતી હોય છે. તમારી આંતરિક જીવંતી એવો નિર્દેશ કરે છે કે તમે આત્મખોજ કરી રહ્યા છો. હાલ વાણી અને વિચારો વચ્ચે અંતર રાખશો નહીં. વધુ સંતોષપ્રદ અને સારી જીવંતી જીવવા ભૂતકાળને ભૂલી જાવ અને જાતે જ ઊભા કરેલા વાતાવરણમાંથી બહાર નીકળો એવી મારી સલાહ છે. પૈસા ઊછીના લઈ ગયેલો મિત્ર એ પાછા આપવા આવતા તમે આશ્ચર્યમાં પડી જશો. અપરિણીતોએ કોઈ અફેરની બાબતમાં ઊતાવળ ન કરવી. આવા સંબંધો કાયમી સ્વરૂપના હોય છે. આથી એને ધીરે-ધીરે પરિપક્વ બનવા દો. **શ્રીવર્ગ માટે** : મહેમાનો-શોપિંગમાં વ્યસ્ત રહેવું પડશે.

(ફેબ્રુઆરી-૨૦૨૫) : અર્થ વિનાની નકામી વિધિઓમાં અટવાયેલા ન રહો. અન્યોની વધુ પડતી ટીકાઓ કરવાથી દૂર રહો. સંબંધોની બાબતમાં કાળજીપૂર્વકનો અને સંવેદનશીલ અભિગમ અપનાવો. પ્રિયજન પ્રત્યેની વફાદારી પ્રદર્શિત કરશો તો લગ્નજીવન વધુ દૃઢ બનશે એમ જણાય છે. હાલ ફાઈનેન્શિયલ લાભ મેળવવા કરતા સંતોષ-આનંદને વધુ મહત્વ આપજો. બાકી રહેલા કામો પાર પાડ્યા પછી પ્રિયજન સાથે મોજ માણવા ટ્રિપનું આયોજન કરો એવી મારી

સલાહ છે. ભાવનાત્મક ખાલીપો થોડા વખતમાં જ ભૂતકાળની બિના બની જશે એ નક્કી છે. **શ્રીવર્ગ માટે** : ફેમિલીનો કોઈ સભ્ય તમારી સલાહ માંગશે.

(માર્ચ-૨૦૨૫) : જ્યારે સખત કામ કરવાનો સમય આવે ત્યારે સંગ્રહી રાખેલી શક્તિને બહાર લાવો. એમ કરવાથી મુશ્કેલ કાર્યો પાર પાડી શકશો એમ જણાય છે. અચાનક જ જાણે કે ત્રીજું નેત્ર ખૂલશે અને તમે કોણ છો તેમ જ ક્યાં જઈ રહ્યા છો એ વિશેની સમજદારી આવી જશે. ઈશ્વરની સૃષ્ટિમાં તમારું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ઘરમાં ઈન્ટિરિયર કે સજાવટ પાછળ સમયનો ભોગ આપવો પડશે. ઊપયોગી બને એવા સર્જનાત્મક આઈડિયા માટે એકાદ મિત્રને કન્સલ્ટ કરવો પડશે. કોઈ ખાસ વ્યક્તિને મળવા પ્રવાસની શક્યતા છે. **શ્રીવર્ગ માટે** : ઈશ્વર પાસે સમજદારીપૂર્વક ઈચ્છા વ્યક્ત કરજો.

(એપ્રિલ-૨૦૨૫) : હાલ થોડા સમયની સ્થગિતતા પછી હવે જીવનની ગાડી ફરી દોડવા લાગશે એવો અણસાર મળી રહ્યો છે. પહેલા લાસરિયાપણું દાખવીને પછી પસ્તાવુ પડે એવું ન કરો. સખત પરિશ્રમ માટે તૈયારી રાખો અને જવાબદારીવાળુ કામ સામે ચાલીને ઊપાડી લો એવી મારી સલાહ છે. મન અને વાણી પર સંયમ રાખતા શીખી ગયા હોવાથી આગળનો માર્ગ સરળ બનશે એમ જણાય છે. ભવિષ્યની સલામતી માટે ફરજિયાત બચત કરવા આ સમયનો ઊપયોગ કરો અને સમય-પૈસો બરબાદ કરે એવી આદતોનો ત્યાગ કરો, સમજ્યાને? **શ્રીવર્ગ માટે** : સાચી પસંદગી કરજો અને શ્રેષ્ઠ મળે નહીં ત્યાં સુધી ઝંપણો નહીં.

(મે-૨૦૨૫) : ભૂતકાળના અનુભવોમાંથી તમે ઘણું શીખ્યા છો. હવે એ દિવસો વીસરીને વર્તમાનમાં જીવતા શીખો. તમે એકાંતમાં રહેવા ઈચ્છો છો, પરંતુ ફેમિલીના સભ્યો તમારી સાથે વધુ સમય વિતાવવાની ઈચ્છા કરી રહ્યા છે. માત્ર તમને જ નહીં, પરંતુ તમારા પરિવારને અસર કરતો હોય એવો કોઈ પણ નિર્ણય લેતા પહેલા એના ભાવિ પાસાંઓનો વિચાર અવશ્ય કરજો. હાલ પ્રામાણિકપણે આત્મનિરીક્ષણ કરો. પોતાનો બચાવ કરવાના બહાના કાઢવાનું છોડી દો. દરેક ઘરના વિશે ફિલસૂફની માફક વિચારો અને એમાંથી ઈશ્વર કયો બોધપાઠ ગ્રહણ કરવાનું કહે છે એ સમજો. **શ્રીવર્ગ માટે** : સત્યને વળગી રહો, સમજ્યાને?

(જુન-૨૦૨૫) : જીવનમાં ધીમે-ધીમે આધ્યાત્મિક, ભાવનાત્મક અને ફાઈનેન્શિયલ સમતુલા આવી રહી છે. લાંબાગણે તમારા માટે જે સારું હશે એનો સ્વીકાર કરવા માનસિક રીતે તૈયાર રહેજો. નવા વિચારોને આવકારવા મન ખુલ્લુ રાખો અને પડકારરૂપ સંજોગોનો સામનો કરવા તૈયાર રહો એવી મારી સલાહ છે. હાલ વધુ પડતા ઊંચ બનવાનું ટાળો. મન અને લાગણીઓને શાંત રાખો. આવો અભિગમ આપમેળે જ યોગ્ય નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે એમ જણાય છે. જમીન-મકાનની ખરીદી, ઈન્ટિરિયર ડેકોરેશન અને રિપેરિંગને કારણે ખર્ચમાં વધારો થશે. **શ્રીવર્ગ માટે** : શ્રદ્ધાનો વિષય કદાચ તમારા માટે

વિવાદાસ્વરૂપ બનશે.

(જુલાઈ-૨૦૨૫) : નવો પ્રારંભ અને ધીમો અંત તમારા જીવનમાં હવે પોઝિટિવ પરિવર્તનની શરૂઆત કરશે. શાંત મુખવટા પાછળ મનમાં અનેક વિચારો ચાલી રહ્યા છે. એમાં જે ઊપયોગી નહીં હોય એને એક પછી એક રદ કરો. ટાઈમ મેનેજમેન્ટ અને અમૂલ્ય પ્લાનિંગને કારણે લાંબો સમય શાંતિ અને સ્વસ્થતા માણી શકશો એમ જણાય છે. હાલના સમયમાં ખાસ મિત્રો સાથે ભાવનાત્મક સંબંધો ગાઢ બનશે. સમજદારીની ઊંડી લાગણીઓ અને એકબીજાને સમજી શકવાની ભાવનાને કારણે વીતચીતના વ્યવહારમાં સરળતા રહેશે. માથાના દુખાવાની કે એસીડીટીની ફરિયાદ રહે. **શ્રીવર્ગ માટે** : સાચા અર્થમાં કેમ અલિપ્ત બનવું એ શીખો એમ ઈશ્વર પણ ઈચ્છે છે.

(ઓગસ્ટ-૨૦૨૫) : મનમાં તમને રસ પડે એવો વિચાર જાઓ હોય તો એનો અમલ કરી શકો છો. કર્મની શક્તિને સમજવાની આત્મસૂઝને કામે લગાડશો તો સારા કર્મ પર લક્ષ્ય કેન્દ્રિત કરી શકશો. જીવન પરિવર્તનશીલ છે અને ચડતી તેમજ પડતી એ જીવનનો ક્રમ છે એ સમજી લેવાનો સમય છે. એક અણધારી ઘટનાને પહોંચી વળવા શાંત અને વ્યવહારુ અભિગમ અપનાવવો પડશે. ભાવનાત્મક જીવનમાં આશ્ચર્યજનક ઘટનાઓ બનવાની સંભાવના છે. આ સમયે કિંમતી ચીજો કે પૈસાની બાબતમાં સંભાળજો. નિવાસસ્થાન બદલવાનું વિચારી શકો છો. **શ્રીવર્ગ માટે** : કોઈ સમસ્યા ન હોય ત્યાં એ વિશે કલ્પનાઓ કરી સમય ન બગાડો.

(સપ્ટેમ્બર-૨૦૨૫) : આંખો સામેથી ભ્રમનું ધુમ્મસ દૂર થતા જ અત્યાર સુધી જે જોઈ નહોતા શકતા એ ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે. પ્રિયજનની વાત સાંભળશો તો પરિસ્થિતિને તમારા નિયંત્રણ હેઠળ લાવી શકશો એમ દેખાય છે. લાગણીશીલ બનીને ભલે આગળ વધો પણ વધુ પડતા આક્રમક ન બનો અને પોતાના અભિપ્રાયો વ્યક્ત કરવામાં સાવચેતી રાખો એવી મારી સલાહ છે. પડદા પાછળની પ્રવૃત્તિઓને ઊંડાણથી સમજવાની જરૂર છે. પૂરતી ખાતરી હોય ત્યારે જ બોલવાનો આગ્રહ રાખો એવી મારી સલાહ છે. સોના-ચાંદીની ખરીદી શક્ય બને કે નવું વાહન લેવાનું વિચારી શકો છો. **શ્રીવર્ગ માટે** : તમને ગણતરીમાં ન લેતા લોકોને નમ્રતાથી ના કહેતા શીખો.

(ઓક્ટોબર-૨૦૨૫) : ઘર, કુટુંબ અને ભાવનાત્મક બાબતો પર લક્ષ્ય કેન્દ્રિત કરવા થોડો સમય ફરસદ મેળવવા વિચારી રહ્યા છો. કેટલાક નિર્ણયો લેવા અત્યંત આવશ્યક છે એ તમે જાણી ચૂક્યા છો. માફ જો માનતા હો તો હાલ લાગણીશીલ બનવાને બદલે પ્રેક્ટિકલ બનો. શું મેળવવું છે એ વિશે નક્કી કરીને કેવળ એના પર જ ધ્યાન કેન્દ્રિત કરો, તો લાભમાં રહેશો. નોકરિયાતોને બઢતી કે પગાર વધારાની શક્યતા છે. પ્રવાસનો પ્લાન વિલંબમાં મુકાવાની શક્યતા છે. વિદેશથી મિત્રો કે બહારગામથી સંબંધીઓ ટૂંક સમયમાં મળવા આવશે એમ દેખાય છે. **શ્રીવર્ગ માટે** : યોગ ધ્યાનના અભ્યાસથી આધ્યાત્મિક માર્ગ પર આગળ વધી શકશો.

As the Dawn Marks the Arrival of Light in the World of Darkness, May the Lights of the Diwali Mark the Beginning of a Shining New Year in Your Life.

Happy Diwali
&
Prosperous New Year!

With best compliments from



Bharat Dodecha - Mohankumar Dodecha - Dhyan Dodecha

Click Here

જ્યોતિષ વિશારદ • વાસ્તુશાસ્ત્રી • જેમોલોજિસ્ટ

વાર્ષિક રાશિ ભવિષ્ય સંવત વર્ષ ૨૦૨૧
સમીર સેજપાલ-9819298404

કુંભ (ગ.સ.શ. પ.)

(નવેમ્બર-૨૦૨૪) : કામના દબાણમાં વધારો થશે અને એના પર લક્ષ આપવું પડશે. આરામથી બેસી રહેશો તો એકાદ સુવર્ણ તક ગુમાવી બેસશો. આત્મવિશ્વાસથી આગળ વધો અને પ્રેસર સહન કરવાની કાબેલિયત બતાવો એવી મારી સલાહ છે. લાંબાગાળાના લક્ષ્યાંકો નક્કી કરવામાં હાલનું વાતાવરણ તમને મદદરૂપ બનશે એમ દેખાય છે. કોઈ આમંત્રણ મળશે કે મનગમતા લોકો વચ્ચે સમય પસાર કરવાની તક મળશે. વિદ્યાર્થીઓ માટે એક નવો અને પોઝિટિવ તબક્કો શરૂ થઈ ગયો છે. હાલ તમે જે પ્રેમની લાગણી અનુભવી રહ્યા છો એ બીજું કંઈ નહીં પણ વળગણ છે. આવા સંબંધમાંથી બહાર આવી જાઓ અને એ પ્રત્યે નિર્લેપ બનો, સમજ્યાને?

(ડિસેમ્બર-૨૦૨૪) : પ્રેક્ટિકલ રહેવું એ તમારો હંમેશનો મંત્ર છે. અંતરમાં જાગતી પ્રેરણાને કારણે દૂરદેશી અભિગમ અપનાવી રહ્યા છો એમ દેખાય છે. હાલની મંદી પછી હવે ફરી કામ મળવા લાગ્યું છે એ સારી વાત છે. પહોંચી શકો એ કરતા પણ વધુ જવાબદારીઓ સ્વીકારી રહ્યા છો. રિલેક્સેશન અને મનોરંજન પણ એટલા જ મહત્વ છે એ ન ભૂલશો. ઈતર પ્રવૃત્તિઓ માટે પણ સમય ફાળવતા રહેવાની સલાહ છે. હાલ કોઈ ભાગીદારીની પણ ઓફર આવી શકે છે. પરિવાર માટે મેળાવડાનું આયોજન કરવું પડશે. પડવા-વાગવાથી ઈજાની સંભાવના છે. ડ્રાઈવિંગના નિયમોનું ખાસ પાલન કરજો, સમજ્યાને?

(જાન્યુઆરી-૨૦૨૫) : નિરાશાજનક પળોમાં સક્રિય રહો. આર્થિક અસલામતીની ભાવના મહિનાના અંત સુધીમાં દૂર થઈ જશે. બિઝનેસ વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરો એવી મારી ખાસ સલાહ છે. નોકરી બદલવાથી સ્થળાંતર કરવું પડશે એ ઘરના સભ્યોને સમજાવવા બધી શક્તિને કામે લગાડવી પડશે, એમ દેખાય છે. એક મિત્ર વારંવાર ન મળવાની ફરિયાદ કરશે. એક નવો રોમેન્ટિક સંપર્ક થવાની પૂરેપૂરી શક્યતા છે. વ્યક્તિગત જીવનમાં લક કરતા સમય અને ડહાપણથી આગળ વધો. તમારી પ્રેરણાને અનુસરશો તો સાચી દિશામાં આગળ વધી શકશો. અકસ્માતના કે ફેક્ટર થવાના યોગ છે.

(ફેબ્રુઆરી-૨૦૨૫) : જીવનમાં ધીરે-ધીરે ભાવનાત્મક અને ફાઈનેન્શિયલ સમતુલા આવતી જશે. નાનપણથી જે લક્ઝરી માટેના સ્વપ્નો સેવ્યા હશે એ હવે હકીકત બનશે. મેળવેલી સિધ્ધિઓનું મૂલ્યાંકન કરો અને નવા ક્ષેત્રો વિશે વિચારો એવી મારી ખાસ સલાહ છે. મોટા ભાગના લોકો સ્વપ્ન સેવી રહ્યા છે એવી નોકરીની ઓફર મળશે. નવી નોકરીમાં અવારનવાર વિદેશ કે બહારગામ જવાની તક પણ મળશે એમ દેખાય છે. તમને ખૂબ જ ગમતા વિષયના અભ્યાસમાં મંડી પડવાનો આ યોગ્ય સમય છે. ભાગીદારીના ધંધામાંથી હટી

જવામાં જ લાભ છે. તબિયતનું ધ્યાન રાખજો. ઊંઘાને પાણી પીવું, સત્તવાળો ખોરાક લેવો અને તાજા ફળ ખાવા, સમજ્યાને?

(માર્ચ-૨૦૨૫) : હૃદયની ખૂબ નજીક હોય એવી વ્યક્તિ સાથે લાગણીભર્યો વ્યવહાર કેમ કરવો એ તમે શીખી રહ્યા છો. સાથોસાથ સ્વમાન જાળવવાની બાબતને તમે વધુ મહત્વ આપી રહ્યા છો એમ દેખાય છે. કોઈ આર્થિક તકલીફ નથી છતાં મનમાં કેમ મૂંઝવણ રહ્યા કરે છે એનું કારણ શોધી સ્વસ્થ રહો. પરિવારના કોઈ સભ્ય પ્રત્યે અણગમો રાખવાને બદલે પ્રેમ અને સમજદારીથી કામ લો એવી મારી સલાહ છે. જીવનસાથીની બગડેલી તબિયત સુધરે એટલા માટે એમને આરામની જરૂર છે, હજી થોડો વખત સંભાળ રાખવી પડશે. વાહન ચલાવતી વખતે સાવધ રહેજો, અકસ્માતના યોગ છે.

(એપ્રિલ-૨૦૨૫) : તમે સ્વભાવે સરળ છો અને સહેલાઈથી બીજાની વાતે દોરવાઈ જાઓ છો અને ખોટી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકો છો એ યોગ્ય નથી. ખોટી પંચાતથી અળગા રહેવાનું શીખો એવી મારી સલાહ છે. લાંબા સમયથી જે વ્યસનમુક્તિ ઈચ્છતા હતા એનો આજથી જ અમલ કરો. આરોગ્યની બાબતમાં આ સમયે વધુ સાવધાની રાખી પડશે. સહેજ પણ તબિયત ખરાબ હોય તો ડોક્ટરની સલાહ લઈ લેજો. બિનજરૂરી ખર્ચ ટાળજો. થોડા વખતમાં સામાજિક જીવનની ગાડી પાટા પર ચડી જશે એમ દેખાય છે. વ્યવસાય કે અભ્યાસ માટે વિદેશ પ્રવાસનો પ્લાન મનમાં ઊત્તેજના જગાવશે.

(મે-૨૦૨૫) : અચાનક શરૂ થયેલા ઝઘડાથી આશ્ચર્ય થશે. પરિસ્થિતિને થાળે પાડવા ધીરજ અને કુનેહથી વર્તવું પડશે. ચૂપ રહેવાનું તમારા સ્વભાવથી વિરૂદ્ધ છે. આથી જ્યારે પણ કોઈ વિષય પર બોલવાની તીવ્ર ઈચ્છા જાગે ત્યારે બોલી નાખજો. મનમાં ઈર્ષાની ભાવના રાખશો તો કોઈ ફાયદો નહીં મેળવી શકો એ વાત હવે તમે સારી રીતે સમજી ગયા છો. કોઈપણ પ્રકારની રમત રમવાનો પ્રયાસ ન કરો અને સરળ બનો એવી મારી ખાસ સલાહ છે. ખાવાપીવામાં ધ્યાન રાખજો અન્યથા બીમાર પડી શકો છો. આગામી થોડા દિવસ છેતરપિંડીથી સાવધ રહેજો. ખાસ કરીને પ્રવાસ દરમ્યાન માલ-સામાનનું ધ્યાન રાખજો.

(જૂન-૨૦૨૫) : તમારી આસપાસ ઊભી થયેલી વિચિત્ર પરિસ્થિતિ મનમાં મૂંઝવણ ઊભી કરશે. પરિણામે તમે કોઈ ખોટો નિર્ણય લો એવી સંભાવના છે. પ્રિયજન સાથે જીદથી અને કડકાઈથી વર્તો એવું પણ બને. જેમના પર વિશ્વાસ હોય એવી કોઈ વ્યક્તિની સલાહ જરૂર લેજો. તમારી અસ્વસ્થતા ઓફિસમાં કે સંબંધોમાં કટોકટી ઊભી કરશે. આક્રમક કે ઊદ્ધત બનશો તો દુશ્મનો ઊભા થશે. સમાધાનકારી વલણ એ આજના સમયનો તકાજો છે એ સમજી લેવાનો સમય છે. બાકી રહેલા કાર્યો પૂરા કરવાની જવાબદારી પાર પાડવી પડશે એ માટે તૈયાર રહેજો. અકસ્માતના કે માંદગીના યોગ છે.

(જુલાઈ-૨૦૨૫) : સક્રિય બનીને કાર્યોને

આગળ વધારવાનો સમય આવી ગયો છે. મનમાં ભરપૂર વિચારો ઊઠી રહ્યા છે. જોકે કોઈક કારણસર તમે એનો અમલ વિલંબમાં મૂકી રહ્યા છો, જે યોગ્ય નથી. જવાબદારી લેતા ડરો નહીં અને ઊત્સાહથી આગળ વધો એવી મારી સલાહ છે. એકાંતમાં રહેવાની તમારી વૃત્તિને પરિણામે ઘરમાં સમસ્યા ઊભી થઈ છે. જોકે સ્થિતિસ્થાપક-સમાધાનકારી વલણ અપનાવશો તો ફાયદામાં રહેશો. એકાદ સંબંધમાં સામેની વ્યક્તિ કદાચ તમારી ઊદારતાનો ગેરલાભ ઊઠાવે એવી શક્યતા છે. વધુ પડતી ત્યાગની ભાવના ન રાખો અને પ્રેક્ટિકલ બનો. વાહન લેવાનું વિચારી શકો છો.

(ઓગસ્ટ-૨૦૨૫) : જીવન આગળ વધી રહ્યું છે અને આસપાસ પુષ્કળ કાર્યો હાથ ધરવાના બાકી છે. વ્યવસાયમાં વિગતો પ્રત્યે ધ્યાન આપવાની તમારી કુશળતા અને તાર્કિક અભિગમ ધારી સફળતા અપાવશે એમ દેખાય છે. હાલ નવા લોકોને મળવાની તક ઝડપી લેજો. નોકરીની અન્ય એક ઓફર સ્વીકારી લેવા મનમાં ઊંડો-ઊંડો ઈચ્છી રહ્યા છો. જોકે હાલની કંપની પ્રત્યેની વફાદારીને કારણે ઓફર સ્વીકારતા નહીં હો. પરિવારમાં ઊજવણીનો કોઈ પ્રસંગ ઊભો થશે. જોકે આવી ઊજવણી વિશેનો તમારો અભિપ્રાય અન્ય એક મેમ્બરને નહીં ગમે. એકાદ દિવસ માટે તમારા મતભેદને બાજુએ મૂકી દેવાનો પ્રયાસ કરો. માતા કે પિતાની તબિયત સહેજ અસ્વસ્થ રહેશે.

(સપ્ટેમ્બર-૨૦૨૫) : સંઘર્ષના સમય પછી હવે રાહતના અણસાર મળી રહ્યા છે. સહેજ નબળા બનેલા સંબંધો કે લાગણીઓને દૃઢ બનાવવા આ સમય પરિવાર માટે ફાળવજો. આધ્યાત્મિક વિકાસની દિશામાં મોટી છલાંગ લગાવી શકશો. હવે મનમાં કોઈ ભ્રમ રહ્યો નહીં હોય. સાચો આનંદ તમારી અંદર જ છે એ તમે હવે જાણી ચૂક્યા છો. ખુદમાં અને તમારી સર્જનશક્તિમાં વિશ્વાસ રાખો અને આગળ વધો એવી મારી સલાહ છે. સટ્ટાનો ધંધો તમારા માટે નથી એટલું તો તમે હવે સમજી ગયા છો. સલામત સ્કીમોમાં રોકાણ કરી સંપત્તિ ઊભી કરશો તો લાભમાં રહેશો. અપરિણીતો માટે લગ્નની દશાનો સમય શરૂ થઈ ચૂક્યો છે.

(ઓક્ટોબર-૨૦૨૫) : ખરેખર જરૂર છે એ કરતા વિશેષ ઈશ્વર તમને આપશે. જેટલું લાણ્ય એટલું લાણી લેવાનો આ સમય છે. નિકટની કોઈ વ્યક્તિના બદલાયેલા અભિગમને કારણે સંઘર્ષનું વાતાવરણ ઊભું થયું છે. તમારે મન પૈસા કરતા પણ પરિવાર વધુ મહત્વનો હોવાથી પીડા અનુભવશો. મગજ સમતોલ રાખશો અને કલ્પનાશક્તિનો ઊપયોગ કરશો તો શક્તિને ઈચ્છા મુજબ વાળી શકશો. ધીરજ ધરવાથી અને મોટું મન રાખવાથી પણ ભાવનાત્મક જીવનમાં લાભ થશે એમ દેખાય છે. ભવિષ્ય માટે ફરજિયાત બચત કરવાનો નિર્ણય ડહાપણભર્યો રહેશે. ખાવાપીવામાં કાળજી રાખો અને કસરત કરો તો સારું.



Jain Social Group - Mulund

101, Safalya, 1st Floor, Near Jain Temple, Dr. Ambedkar Road, Mulund (W).

જૈન સોશ્યલ ગ્રુપ મુલુંડ

આયોજીત
(નીરવ દુર્સના સથવારે)

ઉત્તર પ્રદેશ યાત્રા પ્રવાસ

૧૦ રાત્રી ૧૧ દિવસ

- ✦ લખનઉ
- ✦ ચિત્રકુટ
- ✦ અયોધ્યા
- ✦ બૌદ્ધગયા

- ✦ ૧૬ કલ્યાણક
- ✦ વારાણસી
- ✦ પ્રયાગરાજ
- ✦ ગયા

Departure
29th Nov.

વિમાન દ્વારા
૩/૪ સ્ટાર હોટલમાં આવાસ
સ્વતંત્ર રસોડું (રાજસ્થાની મહારાજ)
સાઈટસીંગ By A/c Bus અને TT A/C દ્વારા
ગાર્ડ સર્વિસ
બધું જ સામેલ (No Hidden Charges)
જૂજ સીટો બાકી

CONTACT

જયંતીલાલ મૈશેરી પ્રમુખ 98197 48250	દિલીપ શેઠ માનદ્ મંત્રી 98206 96848	કિમ્પલ કોરડીઆ માનદ્ મંત્રી 98696 60290
---	---	---

Click Here

જ્યોતિષ વિશારદ • વાસ્તુશાસ્ત્રી • જેમોલોજિસ્ટ

વાર્ષિક રાશિ ભવિષ્ય સંવત વર્ષ ૨૦૨૧
સમીર સેજપાલ-9819298404

મીન (દ.ચ.ઝ.થ.)

(નવેમ્બર-૨૦૨૪) : થોડા સમયથી અટકી ગયેલું જીવન ફરી આગળ વધી રહ્યાનું લાગશે. સામાજિક જીવન અત્યંત વ્યસ્ત અને ઊત્સાહિત રહેશે. વિદેશ જવા ઈચ્છતા હો તો નોકરી માટે અરજી કરી શકો છો. હાલ એ માટેનો સમય અનુકૂળ છે. હાલ પૈસાની બાબતમાં સહેજ ચિંતા રહેશે એમ જણાય છે. એક ખાસ વ્યક્તિ તમને રાહ જોવાડાવી રહી છે. તે વ્યક્તિ એવું વર્તન કેમ કરી રહી છે એનો જવાબ તમારી અંદર આત્મમંથન દ્વારા શોધવા પ્રયાસ કરો. પરિવારની મોટી વયની એક વ્યક્તિને તમારા લાગણીસભર ટેકાની જરૂર પડશે. તબિયત સારી રહેશે પણ તીબુ-તળેલુ ખાવાનું ટાળો. **શ્રીવર્ગ માટે** : સાચો મિત્ર કોણ છે એ આ મહિને તમને સમજાઈ જશે.

(ડિસેમ્બર-૨૦૨૪) : મનની શાંતિ માટે કેટલીક બાબતો જતી કરતા શીખો. બિનજરૂરી ટીકા કરવાનું ટાળો અને લોકોને સર્પોટ આપતા શીખો એવી મારી સલાહ છે. અચાનક જીવનમાં નવા લોકોનો પ્રવેશ થશે અને તેમના જીવનમાં પરોવાઈ ગયાનું લાગશે. એક મિત્ર સાથે બિઝનેસ પાર્ટનરશિપનો વિચાર પસંદ પડી જશે. શક્ય એટલા વધુ પ્રવાસથી તમારી ક્ષિતિજો વિસ્તારવાનો સમય છે. કર્મની વર્તમાન

ગતિમાં નવા અનુભવો મેળવી શકશો અને નવી તકો ઊભી થશે એમ જણાય છે. હાલના પોઝિટીવ સમયનો લાભ ઊઠાવવા તમારી પ્રેરણાને અનુસરો. એસિડીટી કન્ટ્રોલમાં રાખવા પૂરતું પાણી પીઓ. **શ્રીવર્ગ માટે** : તમારી કાળજી લેતા લોકો પ્રત્યે ગુસ્સે ન થાઓ.

(જાન્યુઆરી-૨૦૨૫) : એક વ્યક્તિ સાથેનો સંબંધ દૃઢ બનશે. એક બીજાની નિકટ રહેવાની અને કાળજી લેવાની લાગણીઓ પ્રબળ બનશે. માફ જો માનતા હો તો હાલ તમારા કરીઅર કે બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરો. ફાઈનેન્શિયલ લોસ જવાની શક્યતા છે આથી શેર-સટ્ટાથી દૂર રહેવાની સલાહ છે. નોકરી કરતા હશો તો વ્યાવસાયિક પ્રવાસ કે પગાર વધારાની અપેક્ષા રાખી શકો છો. ફરજિયાત બચત માટે યોગ્ય સમય છે. પારિવારિક વારસો મળી શકે છે. વિદ્યાર્થીઓએ નિષ્ઠાપૂર્વક અભ્યાસ પાછળ ધ્યાન આપવું પડશે. હાલ જે મહેનત કરશો એનો બદલો ભવિષ્યમાં મેળવી શકશો. **શ્રીવર્ગ માટે** : ખાવા પીવામાં વિશેષ કાળજી લેવાનો સમય છે.

(ફેબ્રુઆરી-૨૦૨૫) : આધ્યાત્મિક વિકાસ-ચેતનાશક્તિ પ્રાપ્ત કરવાનો સમય છે. વિકાસની એક નવી સાઈકલ શરૂ થશે. ઊશ્વેરાટ જન્માવે એવા મુદ્દાઓ પર પ્રતિસાદ આપવાનું ટાળશો તો પછી પસ્તાવું નહીં પડે. બોલતા પહેલા વિચાર કરો એવી મારી ખાસ સલાહ છે. ઊપર-ઊપરથી મીઠું બોલતી વ્યક્તિ સાથે મનમેળ કરશો તો પણ તેનું હૃદય પરિવર્તન કરી નહીં શકો એમ જણાય છે. એક

મિત્ર પૈસા રોકવા માટે તમને મૂલ્યવાન સલાહ આપી શકશે. અન્ય દેશમાં સ્થળાંતર કરવાનો વિચાર હોય તો એ માટેના પેપર્સ ફાઈલ કરવા હાલનો સમય યોગ્ય છે. ટૂંકમાં જ નોકરીમાં બદલી, પગાર વધારો મળી શકશે. **શ્રીવર્ગ માટે** : પાર્ટીમાં મોડે સુધી મોજ માણવાની લાલચમાં ન પડશો, અન્યથા ખીમાર પડી શકો છો.

(માર્ચ-૨૦૨૫) : ધારેલી દિશામાં આગળ વધવા હિંમતભરે શરૂઆત કરો. તકોનો કેવી રીતે લાભ ઊઠાવી શકો છો એના પર તમારી પ્રગતિનો આધાર રહેશે. મનમાંથી બિનજરૂરી વિચારોને બહાર ફગાવી દો અને તમારી અંદર રહેલી નવતર ખૂબીઓમાંથી શક્તિ પ્રાપ્ત કરો એવી મારી સલાહ છે. આ સમય રોમેન્સનો, નવી વ્યક્તિ સાથે અને દોસ્તો સાથે મુલાકાતનો યોગ છે. પ્રોપર્ટી વેચવા કે ખરીદવા ઈચ્છતા હો તો એજન્ટ સાથે વાતચીત કરવાનો યોગ્ય સમય છે. ફેમિલીની ફાઈનેન્સની સમસ્યા કે કાનૂની દસ્તાવેજોના અભ્યાસ માટે સમય કાઢવો પડશે. **શ્રીવર્ગ માટે** : ખાવા પીવામાં કાળજી રાખવાનું અને નિયમિત કસરત કરવાનું જરૂરી બનશે.

(એપ્રિલ-૨૦૨૫) : સાવધ કેમ રહેવું એ અગાઉના અનુભવોથી તમે શીખી ગયા છો અને સમસ્યાઓનો સામનો કરવા તૈયાર છો એમ દેખાય છે. થોભો અને રાહ જુઓની નીતિ યોગ્ય વ્યાવસાયિક અભિગમ નક્કી કરવામાં મદદરૂપ થશે. પ્રિયજનને કોઈક ચિંતા સતાવી રહ્યાનો અણસાર આવી જતા એમને શાંત કરવાનો પ્રયાસ જરૂરી બનશે. પરિણીતોને દામ્પત્યજીવનના સંબંધો દૃઢ બનાવવા તરફ વિશેષ ધ્યાન આપવું પડશે. વિશ્વાસુ મિત્રો સાથે તમારી મૂંઝવણ વિશે ચર્ચા કરશો તો પરિસ્થિતિના નવા પાસાની જાણકારી મળી રહેશે. કાનૂની સમસ્યામાં ઊતરવાનું ટાળજો, નહીતર ખર્ચના ખાડામાં ઊતરી જશો. **શ્રીવર્ગ માટે** : ભૂતકાળને પાછળ મૂકી ભવિષ્ય તરફ આગળ વધો. (મે-૨૦૨૫) : હાલનો સમય નવા પ્રારંભનો છે. આથી જીવનમાં જે નકામું હોય એની સાફસફાઈ કરવી જરૂરી છે. વાસ્તવિક સ્તરે લાગણીઓ શાંત થતી જશે અને તમે પ્રેક્ટિકલ અભિગમ અપનાવી શકશો એમ જણાય છે. અણધાર્યાં ધનલાભ કે આશ્ચર્યજનક ભેટ મળવાની શક્યતા છે. તમારું ધ્યેય સિદ્ધ કરવા માટે કામ પાછળ બહુ જ ધ્યાન આપો એવી મારી સલાહ છે. તમારી તંદુરસ્તીમાં સુધારો થવા માંડ્યો છે એટલે આહાર અને કસરત ચાલુ રાખો, પણ અતિરકે ન કરો. નોકરીમાં વધુ જવાબદારીઓ સ્વીકારતા અચકારો નહીં. આવી જવાબદારીઓ દ્વારા પ્રગતિ કરી શકશો એમ દેખાય છે. **શ્રીવર્ગ માટે** : સલાહ સ્વીકારવાની તૈયારી રાખો.

(જુન-૨૦૨૫) : ઘણા લોકોએ તમને દુઃખ પહોંચાડ્યું છે અને તમે શાંતિથી બધું સહન કર્યું છે, પરંતુ હવે નસીબ તમારી તરફેણમાં હોવાથી તમને આઘાત પહોંચાડનારની સામે થવાનો પ્રયાસ ન કરો. દયા અને માનવતાથી લાભ થશે એમ જણાય છે. તમારે બિઝનેસને લગતા અમુક એવા નિર્ણયો લેવા પડશે જેની અસર પારંપરિક જીવન પર પડશે. પરિણામે ભૂતકાળ અને ભવિષ્યને નજર સામે રાખીને નિર્ણય કરો. મીઠા બોલા માણસોથી ખાસ ચેતીને ચાલવાનો સમય છે. અપરિણીત વ્યક્તિએ

ભાવિ સાથી સાથે ચર્ચા કરીને કોઈ બાબત ખટકતી હોય તો આપસમાં ચર્ચા કરી નિવેડો લાવવો જોઈએ. **શ્રીવર્ગ માટે** : લાગણીવશ નિર્ણય લેવાનું ટાળો અને વ્યવહારુ નિર્ણય લેતા શીખો.

(જુલાઈ-૨૦૨૫) : ધીમી ગતિથી, પરંતુ ખાતરીપૂર્વક અત્યંત પોઝિટિવ તબક્કા ભણી આગળ વધી રહ્યા છો. જીવનમાં ખૂબ જ આધ્યાત્મિક પ્રગતિ સાથે ભાવનાત્મક અને ફાઈનેન્શિયલ સંતોષ પણ મળશે. જીવનસાથી અને સંતાનો પ્રત્યે વધુ પ્રેમ દાખવજો. વાસ્તવમાં તેમની કાળજી લઈ રહ્યા છો એવી લાગણી વ્યક્ત કરશો તો વધુ સમજદારી ઊભી કરી શકશો એમ દેખાય છે. વિદ્યાર્થીઓએ વધુ અભ્યાસ કરવા જેમના પર વિશ્વાસ હોય તેમની સાથે ચર્ચા કરવી જરૂરી છે. સંતાનોને અને પરિવારના યુવાનોને ફરજિયાત માસિક બચત કરવા સમજાવવાનો સમય છે. **શ્રીવર્ગ માટે** : ફેમિલી અને ગાઢ મિત્રો સાથે સમજદારીથી વર્તવાની સલાહ છે.

(ઓગસ્ટ-૨૦૨૫) : કોઈ સંબંધો બાંધવા માટે આ યોગ્ય સમય નથી એટલે લાગણીને કાબૂમાં રાખો. તમારા ધ્યેયને સિદ્ધ કરવા માટે કામ પાછળ બહુ જ ધ્યાન આપો અને વ્યવહારુ નિર્ણય લો એવી મારી સલાહ છે. તાણ મુક્ત ભવિષ્ય માટે પૂરતી બચત કરવાનું પગલું યોગ્ય રહેશે. થોડા સમયથી મૂંઝવી રહેલી સમસ્યાઓ હવે ઊકેલાઈ જશે એમ દેખાય છે. કાનૂની સમસ્યાઓ અને એગ્રીમેન્ટ પર સહીસિક્કા કરવાનું હાલ મુલતવી રાખજો. ચાલીસી વટાવી ચૂકેલાઓએ તબિયતની કાળજી લેવી પડશે. પરિવારનો મેળાવડો કે દરિયાઈ પ્રવાસની શક્યતા છે. **શ્રીવર્ગ માટે** : સ્પર્ધામાં ટકી રહેવા તમારે શ્રેષ્ઠ કામગીરી બજાવવી પડશે.

(સપ્ટેમ્બર-૨૦૨૫) : નવા મિત્રો બનશે જે આગળ જતા જીવનનો એક ભાગ બની રહેશે. જાણીતા અને અનુકૂળ લાગે એવા લોકોના સંગાથમાં રહો. સંતુષ્ટતાનો અભિગમ ટાળો અને હાલના પોઝિટિવ સમયનો લાભ ઊઠાવો એવી મારી ખાસ સલાહ છે. આર્થિક બાબતમાં અને ખાસ કરીને લાંબાગાળાની બચત તરફ વધુ ધ્યાન આપો. તમારી પાસે પૈસાની સગવડ છે એટલે બચત કરી શકો એમ છો. ઓચિંતા કોઈ મહત્વના સમાચાર મળતાની સાથે જ દોડધામ થશે અને દીર્ઘદષ્ટિ રાખીને નિર્ણય લેવા તૈયાર રહેવું પડશે એમ દેખાય છે. તમારામાં રહેલી રચનાત્મક શક્તિ બહાર આવશે. **શ્રીવર્ગ માટે** : વિદેશમાં જોબની ઓફર સ્વીકારતા પહેલા ખૂબ વિચારીને પછી આગળ વધજો.

(ઓક્ટોબર-૨૦૨૫) : વાતાવરણને ડહોળવા ઊશ્વેરાણીજનક વિધાનો કરવામાં તમને આનંદ આવી રહ્યો છે. જોકે હાલના તબક્કે આવું વલણ લાભદાયી નહીં ઠરે. આના બદલે મન ખુલ્લુ રાખી વર્તવા પ્રયાસ કરો. પૈસાની બાબતમાં પહોંચ બહારના વચનો ન આપશો એવી મારી સલાહ છે. સ્થિતિસ્થાપક અને સહનશીલ અભિગમ અપનાવશો તો તમામ વ્યાવસાયિક સંબંધો દૃઢ બનાવી શકશો. કેટલીક લાગણીઓ તમારા પૂરતી જ સીમિત રાખશો તો ફાયદામાં રહેશે. આરોગ્ય સારું રહેશે. અચાનક પ્રવાસે જવાનું થશે. **શ્રીવર્ગ માટે** : વધુ પડતું આત્મમંથન ટાળશો તો સાનુકૂળ નિર્ણયો કરી શકશો.

દીપો નો આ પાલન તહેવાર
આપને માટે લાવે ખુશીઓ હજાર,
લક્ષ્મીજી બિરાજે આપને દ્વાર,
અમારી શુભકામનાઓ કરો સ્વીકાર.

દિવાળીની શુભકામના
તેમજ નવા વર્ષના
સાલમુબારક



Stitch-El
GENT'S BOUTIQUE

3, Sheetal Chhaya, J.N. Road, Mulund (W), Mumbai - 400 080.

E-mail : stitch_ell@hotmail.com • Ph. : 022-2564 6238 • 98671 67387

[Click Here](#)

દીપાવલી નિમિત્તે રંગબેરંગી રંગોળી



ગણેશજીનો સાથ રહે,
સરસ્વતીનો નિવાસ રહે અને
મહાલક્ષ્મીનો અખંડ ભાવ રહે
જેથી કુબેરજીની કૃપા રહે
એજ શુભકામના સાથે આગામી



દીપ પુમાનિયા



સીમા મનોજ કોટક
(મેન્ટર)



જાગૃતિ મનીષ ધામે
(સપોર્ટર)

ફાઉન્ડર્સ



કોમલ જીજ્ઞેશ મહેતા



મેઘના જતીન ભાનુશાલી



જિજ્ઞાસા નિલેશ ધામે

આપ સૌને શુભ અને
સમૃદ્ધ દિવાળીની શુભકામનાઓ
અને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન



સ્થાપના: ૨૦૧૯
omaniya
aa jee le apni zindagi....

[Click Here](#)

દિવાળી નિમિત્તે અવનવા ફરસાણના વાનગીઓની રેસીપી

પાપડ પૌંવા ચેવડો

સામગ્રી :- ૧ કપ પાતળા પૌવા(શેકેલા), ૧ કપ ઝીણી સેવ, ૧ કપ અડદના પાપડ (શેકેલા), ૧ ટે.સ્પૂ દળેલી સાકર, અડધો ટી.સ્પૂ હળદર, ૧ ટી.સ્પૂ લાલ મરચાંનો પાવડર, ૧/૪ ટી.સ્પૂ આમચૂર પાવડર, ૨ ટે.સ્પૂ તેલ, મીઠું સ્વાદઅનુસાર.



રીત :- કડાઈમાં ૨ ટે.સ્પૂ તેલ ગરમ કરો. તેમાં પતલા પૌંવા ઉમેરો. વ્યવસ્થિત મીક્સ કરો. ગેસ બંધ કરી સેવ અને પાપડ ઉમેરો. વ્યવસ્થિત મિક્સ કરી પછી સૂકો મસાલો બધો ભભરાવો. એરટાઈટ ડબ્બામાં ભરી લો.

ડ્રાયફ્રૂટ કચોરી

સામગ્રી :- અડધો કપ તીખા ગાંઠીયા, ૧ ટી.સ્પૂ સાકર, અડધો ટી.સ્પૂ લીંબુનો રસ, ૨ ટે.સ્પૂ શેકેલી ચોપ કરેલું ડ્રાયફ્રૂટ (બદામ-કાજુ), અડધો ટી.સ્પૂ શેકેલી વરીયાળી, અડધો ટી.સ્પૂ શેકેલા ઘાણા.



પડ માટે :- ૧ કપ મેંદો, ૪ ટે.સ્પૂ ડાલડા ઘી, જરૂર મુજબ મીઠું અને પાણી.

રીત :- સૌ પ્રથમ એક બાઉલમાં ગાંઠીયાને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને લેવા. તેમાં સાકર, ડ્રાયફ્રૂટ, વરીયાળી, ઘાણા, લીંબુનો રસ બધુ ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરવું. સાઈડમાં રાખવું. ત્યારબાદ

મેંદો, મીઠું, ઘી અને પાણી ઉમેરી રોટલી કરતાં થોડો કડક લોટ બાંધવો. હવે નાની નાની પૂરી વણી તેમાં સ્ટર્કીંગ ભરી પેક કરવું. બધી કચોરી તૈયાર થઈ ગયા પછી તેલમાં કાચી પાકી તળીને કાઢી લેવી. ઠંડી થાય પછી ફરી વખત તળવી. ઠંડી કરી એરટાઈટ ડબ્બામાં ભરી લેવી.

મસૂર મિક્સ

સામગ્રી :- ૧ કપ મસૂર દાળ, ૧ કપ મગની દાળ, અડધો કપ જાડી સેવ, અડધો કપ દાળીયા, ૧/૪ કપ શીંગદાણા, ૩ લીલા મરચાં, ૧/૪ કપ કીશમીશ, ૧ ટે.સ્પૂ લાલ મરચું પાવડર, ૧ ટી.સ્પૂ આમચૂર પાવડર, ૨ ટે.સ્પૂ દળેલી સાકર, મીઠું સ્વાદઅનુસાર, તળવા માટે તેલ.



રીત :- સૌ પ્રથમ મસૂર દાળ અને મગની દાળને આખી રાત પાણીમાં પલાળવી. સવારે પાણી કાઢી દાળને કપડાં પર કોરી કરી લેવી. હવે વાટકી વાળા જરામાં બંને દાળ અલગ અલગ તળી લેવી. પછી દાળીયા તથા શીંગદાણા તળી લેવા. કીશમીશ તળવી, મરચાં તળવા, હવે એક બાઉલમાં બધી તળેલી સામગ્રી, સેવ તથા સૂકો મસાલો ભભરાવી ઠંડુ કરી. એરટાઈટ ડબ્બામાં ભરવું.

સાત પડી પૂરી

સામગ્રી :- ૧ કપ મેંદો, અડધો ચમચી મીઠું, ૨-૩ ચમચી ચોખાનો લોટ, તળવા માટે તેલ.

રીત :- મેદામાં ૪ ટે.સ્પૂ ગરમ તેલ તથા મીઠું ઉમેરી કડક લોટ બાંધવો. હવે બાંધેલા લોટમાંથી પતલી પતલી રોટલીઓ વણવી.

હવે દરેક રોટલી પર તેલ સ્પ્રેડ કરવું, ચોખાનો લોટ ભભરાવવો. આમ એક પછી એક એમ ૭ લેયર કરવા. પછી તેને રોલ કરી લેવું. દોરાની મદદથી લુચા કટ કરવા. પછી નાની નાની પૂરી બનાવવી. બધી પૂરી બની જાય પછી તેને મીડીયમ તાપ ઉપર તળી લેવી. તળેલી પૂરી પર લાલ મરચું અને સંચળ ભભરાવી શકાય અથવા પ્લેન પણ ખવાય.

ભાજણી ચકલી (મહારાષ્ટ્રીયન સ્ટાઈલ)

સામગ્રી :- ૧ કપ ચણાની દાળ, ૧/૪ કપ અડદની દાળ, ૧/૪ કપ પીળી મગની દાળ, દોઢ કપ ચોખા, ૧/૪ કપ સાબુદાણા, ૨ ટે.સ્પૂ જીરૂ, ૨ ટે.સ્પૂ આખા ઘાણા, ૧ ટે.સ્પૂ બટર, ૧ ટી.સ્પૂ લાલ મરચું, મીઠું સ્વાદ અનુસાર, તળવા માટે તેલ.



રીત :- બધી દાળ અને ચોખાને અલગ અલગ ૪ થી ૫ કલાક પલાળવા. પછી પાણી કાઢી જાડા કપડા પર કોરી કરવી. પાણી સૂકાઈ જાય એટલે દરેક દાળ અને ચોખા જાડા લોચામાં અલગ અલગ શેકવા. જીરૂ અને ઘાણા પણ શેકી લેવા. હવે બધી દાળ, ચોખા, સાબુદાણા, જીરૂ, ઘાણા બધુ જ સાથે પીસી લેવું. હવે તેમાં બટર, મીઠું અને મરચું ઉમેરી લોટ બાંધવો. ચકલી બનાવવી અને તળી લેવી. ઠંડી કરી એરટાઈટ ડબ્બામાં ભરી લેવી.

This Festival is a symbol of hope for humankind.
May it bring universal compassion, inner joy of peace, love and the awareness of unity to all.



PARESH BHARAT MEISHERI
+91 99200 58048

DHAIRYA KHATRI
+91 86576 71355

With Best Wishes From

Centrally Located Broeking House From Last 22 Years

PAREECHA STOCK BROKERS PVT. LTD.
PAREECHA CONSULTANTS

BSE/NSE/FGO TERMINAL • IPO (Primary Market) • Depository Participants of ISS ENTERPRISE LTD.

4, Ratneshwar Darbar Gadh, Eknath Apts. Nx., 1st Floor, M. G. Road, Near Panch Rasta,
Mulund (W), Mumbai - 400 080. T: 022 2562 0231 | 2561 7375 | E: pareecha2001@gmail.com

[Click Here](#)

દિવાળી નિમિત્તે અવનવા ફરસાણના વાનગીઓની રેસીપી

લાજવાબ ભાખર કારેલી

સામગ્રી :- ૧ વાટકો મેંદો, ૫ થી ૬ નંગ પાલકના પત્તાં, મીઠું, મોણ

પૂરણ માટે :- તલ, તાજા કોપરાનું ખમણ, ૨ નંગ લીલા મરચાં, કોથમીર, ચાટ મસાલો, આમચૂર પાવડર, ગરમ મસાલો, મીઠું.

રીત:- મેંદાની અંદર મીઠું, મોણ અને પાલકના પતાને મિક્સરમાં પીસી, ગાળીને તેના રસ વડે લોટ બાંધવો. ૫ મિનિટ ઢાંકી રાખવો. લંબગોળ પૂરી જેવું વણી હાથની ચપટીથી દબાવીને શેઈપ આપી પૂરણ મૂકી પાણી વડે આંગળી ભીની કરી બંધ કરીને ચપટી જેવો આકાર આપીને સરખી રીતે દબાવી મીડીયમ ગેસ રાખી તળી લેવા. ભાખર કારેલી તૈયાર.

મલ્ટીગ્રેન પંચરત્ન ચીઝી પીઝા

સામગ્રી - બાજરાનો લોટ- ૧ કપ, ચોખાનો લોટ ૧/૨ કપ, પીસેલા ઓટ્સ ૧ કપ, ચણાનો લોટ ૧/૨ કપ, ઘઉંનો જાડો લોટ ૧/૨ કપ, તેલ ૨ ચમચી, આદુ, મરચા, દહીં ૨ ચમચી, હીંગ ચપટી, કોથમરી ૧/૨ કપ, મીઠું પ્રમાણસર ચીઝ ૨ ક્યુબ, લાલ મરચાની પેસ્ટ ૧/૨ કપ.

રીત - સૌ પ્રથમ બધા લોટને બરાબર મીક્સ કરી ઉપર આપેલા બધા મસાલા નાખી મોણ માટે તેલ નાખી દહીં અને પાણીથી લોટ બાંધો. લોટને ૧૦ મિનિટ ઢાંકી પછી તેના મોટા લુઆ કરી



થોડો મિડીયમ સાઈઝનો મોટો રોટલો કરી તેના ઉપર લાલમરચાને લસણની તૈયાર કરેલી પેસ્ટ લગાવી થોડો ઓરેંગાનો વેરી તેના ઉપર ચીઝ ખમણી ઉપરથી એટલે એક સાઈડથી ફોલ્ડ કરી બરાબર પેક કરો પછી તેને ટ્રાઈંગલ શેપ એટલે કે પીસા શેપમાં કટ કરી તેલમાં ઘીમાં તાપે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો આ ગરમ અને ઠંડા બન્ને સરસ લાગે છે. પછી ખાલી એરટાઈટ ડબ્બામાં ભરી લો.હેલ્થી ખાઓ હેલ્થી રહો

હરીયાલી નીમ-રાગી પૂરી

સામગ્રી - ૧/૨ કપ ઘઉંનો લોટ, ૨ ટે.સ્પૂન, નાચણીનો(રાગીનો)લોટ, ૨ ટે.સ્પૂન, મેથીની ભાજી, ૨ ટે.સ્પૂન કોથમરી, ૨ ટે. સ્પૂન લીમડો, ૧ ટી. સ્પૂન કાળા તલ, ૧/૪ ટી સ્પૂન અજમો, ચપટી હળદર, ૧/૪ ટી સ્પૂન આદુ-મરચાની પેસ્ટ, મીઠું, ૧ ટે.સ્પૂન તેલ.

રીત - કોથમરી, મેથીની ભાજી, લીમડો બારીક કાપી લો અથવા મિક્સરમાં અધકચરો વાટી લો. ઘઉંના લોટમાં નાચણીનો લોટ, આદુ-મરચાની પેસ્ટ, કાળા તલ, અજમો, કોથમરી, મેથી ભાજી-લીમડાની અધકચરી પેસ્ટ, મીઠું, તેલ, હળદર નાખી કઠણ લોટ બાંધો. તેની પૂરી વણી લો પૂરીને મિડીયમ ગેસ પર તળી લો. તૈયાર છે હરી યાલી નીમ-રાગી પૂરી.

મરચાના ભજ્યા

સામગ્રી - ૧ ચમચી તેલ, ૧ કપ ચણાનો લોટ, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી ઘાણાજીરું, મીઠું સ્વાદ પ્રમાણે, ૧/૨ લીંબુ, ૫

ભાવનગરી મરચા/ ૧ કારેલું, ૧ કપ પાણી, ૧ ચમચી સાકર.

રીત - ભજ્યા બનાવાની રીત- ૧ તપેલી ચણાનો લોટ, ૧ કપ પાણીમાં મિક્સ કરો. મીઠું સ્વાદ પ્રમાણે નાખી હલાવો એ ખીરૂને, રેડી કરી સાઈડમાં રાખો. એક કઢાઈમાં તેલ મૂકી ગરમ થાય ત્યારે, મરચા (કારેલા) કટ કરી એમા ઘાણાજીરું, ગરમ મસાલો એમાં લીંબુ, સાકર નાખી મિક્સ કરો મરચામાં ભરીને અને તેલમાં તળી બાહર કાઢી. તીખી, મીઠી ચટણી સાથે સર્વ કરો.

દૂધીના મૂઠિયા

સામગ્રી - મોણ માટે તેલ. ખમણેલી દૂધી, લીલા મરચાની પેસ્ટ, મીઠું સ્વાદ અનુસાર, દળેલી સાકર સ્વાદ અનુસાર, હળદર ૫ ચમચી, ત્રણ ટેબલ સ્પૂન લીંબુનો રસ, ચપટી સોડા, ઘઉંનો જાડો લોટ, ડેકોરેશન માટે ખોપરું, ખમણેલું કોથમીર.

વધાર માટે - તેલ, રાઈ, જીરું, તલ અને હીંગ

રીત - સૌ પ્રથમ દૂધી ખમણી લેવી, ત્યારબાદ તેમાં લીલા મરચાની પેસ્ટ, તેલ, સોડા, મીઠું, સાકર, હળદર અને લીંબુનો રસ તથા ઘઉંનો લોટ નાખી મસળી લેવું. પછી તેના મૂઠિયા વાળી મોટા તપેલામાં મૂકી બાફવા મૂકવા. ૧૦ મિનિટ સુધી બાફવા પછી તે મૂઠિયાના ટુકડા કરી તેલ મૂકી તેમાં રાઈ, જીરું અને તલ અને હીંગ નાખી વધારી લેવા પછી તેને ડીશમાં સર્વ કરી તેના ઉપર ખોપરું અને કોથમીર ભભરાવવું.



અમારા માનવંતા ગ્રાહકોને

દિવાળીની શુભેચ્છા લેમજ નૂતન વર્ષાભિનંદન



Temple of Faith

LALJIBHAI
JEWELLERS

Call : 8369779513 - 9004008156

A-8, Pranav Commercial Plaza, M.G. Road, Near Shivsena Office, Mulund (W), Mumbai - 400 080.

Click Here

દિવાળી નિમિત્તે અવનવા ફરસાણના વાનગીઓની રેસીપી

નાચણીની ચકરી

સામગ્રી - ૨ વાટકી નાચણી લોટ, આદુ મરચા પેસ્ટ, તેલ.

રીત - ૨ વાટકી નાચણીનો લોટ બાંધવો એમાં આદુ મરચાની પેસ્ટ અને પછી મશીનમાં ચકરી પાડવી અને તેલમાં તળવી.



ફળશી પૂરી

સામગ્રી - ૧ વાટકી મેંદો, જીરો ૧ ચમચી, ૧ ચમચી મરી, ૧ ચમચી ઘી, સ્વાદ મુજબ, મીઠું.

રીત - ૧ વાટકી મેંદો લેવો પછી એમાં પાણી, ઘી, મરી, જીરૂ નાખી લોટ બાંધવો. થોડીવાર લોટ બાંધી રાખવો. પછી તેની પૂરી વણીને તળી નાખો.



ઈડલી વડા

સામગ્રી - ઈડલી, ચણાનો લોટ, તળવા માટે તેલ

રીત - ગરમ તેલ નાખી ચણાનો લોટનું ખીરૂ લઈને ઈડલીના વડા ઉતારવા પ્લેટમાં વડા ગોઠવી ઉપર લીલીચટણી, ખજૂરની ચટણી, જીરૂ પાવડર, લાલ મરચું, મીઠું, ચાટ મસાલો, ગાજર બીટ, કોથમીર ખમણીને સર્વ કરવું.



ચીઝ દૂધી ઢોકળા

સામગ્રી - ઢોકળાનો લોટ, દૂધી, ચીઝ, લીંબુ, સાકર, મીઠું, મરચુ બધુ મિક્સ કરી એક થાળીની અંદર તેલ લગાડી લોયાની અંદર બાફવા મૂકો વગેરે.

રીત - ઢોકળાના લોટને લઈ થાળીમાં તેલ લગાડી ગેસ ઉપર મુકો. ૧૫ મિનિટ બાદ તેને નીચે ઉતારો ત્યાર બાદ કાપા પાડી તેલનો વધાર કરો. તેલની અંદર રાઈ તલનો વધાર કરો. તેલની અંદર રાઈ, તલ, કડીપતા, લીલા મરચા નાખી ઉપર વધાર નાખો તે પછી ચીઝ ખમણીને નાખવી, કોથમીર ભભરાવી ડીસની અંદર કાપા પાડી ગોઠવો. સ્વાદ મુજબ ચીઝ દૂધી ઢોકળા તૈયાર થયા. ચટણી સાથે ખાવા.



રતાળુ લઘા ડ્રાયફ્રૂટ નમકીન

સામગ્રી - રતાળુ ગાજરના લઘા, તેલ, તળેલા શીંગા, કિસમીસ, બદામ, કાજૂ, સુકો ખોપરો, મીઠું, લાલ મરચું, આમચુર પાવડર, સાકર, ગરમ મસાલો.

રીત - રતાળુ ગાજરના લઘાને ડીપ ફાય કરી લેવા, શીંગદાણા, સુકો ખોપરો અને બધા ડ્રાયફ્રૂટને તળીલેવા, પછી એક બાઉલમાં ગાજરના લઘા, શીંગદાણા અને તળેલા ડ્રાયફ્રૂટ લઈ એમાં સ્વાદ અનુસાર મીઠું અને બધા



મસાલા નાખ્યા ત્યાર બાદ બધાને મિક્સ કરી લેવો સ્વાદિષ્ટ રતાળું લઘા ડ્રાયફ્રૂટ નમકીન તૈયાર.

ફરાળી નમકીન રોલ

સામગ્રી - ફરાળી ચેવડો ૧૦૦ ગ્રામ, (નવરત્ન લેવો) ખજૂરની પેસ્ટ- ૪ ટેબલ સ્પૂન, એલચીનો ભૂકો ચપટી, કેળાની વેફરનો ભૂકો જરૂરત મૂજબ.

રીત - ફરાળી ચેવડો લઈ તેને મિક્સરમાં ભૂકો કરવો અને થોડા ચેવડો હાથેથી ક્ષ કરવો. પછી તેમાં ખજૂરના બી કાઢી તેમાં ૨ ચમચી જેટલું દૂધ નાખી તેની પેસ્ટ બનાવી ચેવડાના મિશ્રણમાં નાખવી. એલચી પાવડર નાખવો પછી તેને રોલનો શેઈપ આપી કેળાની વેફરનો ભૂકો કરી રોલને તેમાં રગદોળી પછી તેને કેળાની વેફર પર મૂકી સર્વ કરવું. આ રેસીપી ઝટપટ બની જાય છે અને ઉપવાસમાં પણ ચાલે એવી છે.

કચોરી પૂરી

સામગ્રી - ૧૦૦ ગ્રામ મેંદાનો લોટ, મીઠું, અજમો, તેલ, ફરસાણ, સાકર, લીંબુ, ગરમ મસાલો ચાટ મસાલો, તળવા માટે તેલ, તલ, લીમડો.

રીત - સૌ પ્રથમ લોટમાં તલ અજમો, તેલ મોણ માટે. મીઠું સ્વાદ અનુસાર નાખી લોટને બાંધી ઢાંકી દેવો. ત્યાર બાદ ફરસાણને મીક્સરમાં પીસી નાખવા એક તપેલીમાં એક ચમચી તેલ મૂકી તલ, લીમડો નાખી ફરસાણનો ભૂકો નાખવો ત્યારબાદ તેમાં ફરસાણનું પૂરણ ભરીને તેની ફરીથી નાની પૂરી વણવી ને ધીમા તાપે તેલમાં તળવી.



ગરમા ગરમ ક્લાઉડ કિચન

GARMA GARAM CLOUD KITCHEN

Restaurant

CELEBRATING SUCCESS,
ONE BITE AT A TIME!

પંજાબી ડિશ

- ચણા મસાલા
- આલુ ગોબી
- આલુ મટર
- આલુ ટોમેટો ફાય
- ભીંડી ફાય
- વેજ/પનીર કોલ્હાપુરી
- વેજ/પનીર હાંડી
- વેજ/પનીર કડાઈ
- ગ્રીન પીસ પાલક
- પનીર મટર
- પનીર બટર મસાલા
- પનીર ટીકા મસાલા

- ચાઈનીઝ રાઈસ
- ચાઈનીઝ ચોપસી
- ચાઈનીઝ નુડલ્સ
- પાઉભાજી (બટર, પનીર, ચીઝ)
- પીલ્ડા એન્ડ ફાઈસ
- ચીઝ કોફતા
- કાશ્મીરી કોફતા
- લંચમાં પુલાવ
- લંચમાં પંજાબી થાળી
- સેન્ડવીચ
- દાલ ફાય
- દાલ કોલ્હાપુરી
- દરેક પ્રકારના સૂપ
- ચાઈનીઝ
- વેજ બિરચાની
- પાલક બિરચાની
- હૈદ્રાબાદી બિરચાની
- પનીર ટીકા બિરચાની

નાસ્તામાં ગરમા ગરમ ઈડલી, પૌઆ, ઉપમા, મિસળ પાઉ, ઉસળ, છોલે ભટુરે, મિક્સ વેજ પકોડા, સાબુદાણા વડા વગેરે


ઢોસા - (સાદા, મસાલા, ચીઝ, મૈસુર, પેપર મસાલા, સ્પ્રીંગ મસાલા)

ચાઈનીઝ ડિશમાં

- વેજ સ્પ્રીંગ રોલ
- વેજ મન્યુરીયન
- પનીર મન્યુરીયન
- ઈડલી સેજવાન
- વેજ લોલીપોપ
- પનીર ચીલી
- પનીર સ્પ્રીંગ રોલ
- મસરુમ મન્યુરીયન

- જ્યૂસ
- લસ્સી
- ફાલુદા
- ચોકલેટ શેક

અમારા ક્લાઉડ કિચનમાં ફ્રી હોમ ડિલિવરી તેમજ ટિફિન સર્વિસ પણ ઉપલબ્ધ છે



Shop No 2. NEERA ENCLAVE, Dr. RP ROAD, MULUND (WEST), MUMBAI 400 080.

Cell: 91364 36473/90043 32955

[Click Here](#)

દિવાળી નિમિત્તે અવનવા ફરસાણના વાનગીઓની રેસીપી

સ્પ્રાઉટેડ પેટલ્સ બાઈટ્સ

સામગ્રી - ૨ કપ શેકેલા ઓટ્સનો પાવડર, ૧ કપ નાચણીનો લોટ, ૧/૨ કપ અળસી પાવડર, ૧ કપ ઉગાડેલા મગ, આદુ, મરચા, લસણ, એરેગાનો, મેગી મસાલો, મીઠું સનફલાવર તેલ, મેથી.



રીત - સૌ પ્રથમ બધા લોટને મિક્સ કરી ઉપર આપેલા બધા મસાલા નાખી ૧ ચમચી તેલનું મોણ નાખી બરાબર મિક્સ કરી હળવા હાથે લોટ બાંધી ૧૦-૧૫ મિનિટ ઢાંકી ઘો, પછી તેને બરાબર મસળી તેના લુઆ, કરી મોટો રોટલો વણો પછી તે રોટલોને સ્કેવરમાં કાપી બરાબર તેના એક સરખા સ્કેવરમાં પીસ કપ કરી લ્યો હવે એક પીસને હાથમાં લઈને સામસામેની બાજુ પાણી લગાવી બન્ને ખૂણા જોઈન્ટ કરો પછી તેને ઉલ્ટુ કરી બીજી સાઈડના ખૂણા જોઈન્ટ કરી પેટલ્સ જેવો શેપ આપી બધી તૈયાર કરી તેને સનફલાવર ઓઈલ અથવા ઓલીવ ઓઈલ એકદમ ઓછા તેલમાં તળીલો અથવા ૧૮૦ C ઉપર ૧૦ થી ૧૫ મિનિટ બેક કરો. પછી ઉપર ચાટ મસાલો સ્પ્રેકલ કરી સર્વ કરો ગમે તે શેપમાં સર્વ કરા કરો.

કારેલાના ભજ્યા

સામગ્રી - ૧ ચમચી તેલ તળવા માટે, ૨ કપ ચણાનો લોટ, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી ઘાણા જીરૂ, મીઠું સ્વાદાનુસાર, ૧/૨ લીંબુ, ૧ નંગ કારેલા.

રીત - એક કપ ચણાના લોટમાં પાણી પ્રમાણસર મેળવી ખીંટ મિક્સ કરો. કારેલાના ભજ્યા તળવા. તીખી મીઠી ચટણી સાથે સર્વ કરો. લીંબુની ચટણી તૈયાર થઈ ગઈ સર્વ કરો.

સેઝવાન બનાના સ્કેવર

સામગ્રી - કાચાકેળા ૩ નંગ, સેઝવાન સોસ - ૨ ચમચા, મીઠું, સેઝવાન પાવડર ઉપર ભભરાવવા માટે.



રીત - કાચાકેળાને ફૂકરમાં બાફી તેનો માવો કરી તેમા મીઠું અને સેઝવાન સોસ નાખી બરાબર મસળી પછી તેને વળી તેને મનગમતા શેપમાં કાપી પછી તેને હાફફાય કરી પછી તેને ઓવનમાં ૨૦૦ ડીગ્રી સે. પર ૧૦ થી ૧૫ મિનિટ બેક કરી ઉપર સેઝવાન પાવડર નાખવો. આ વાનગીટિફીનમાં પણ બાળકોને આપી શકાય છે.

વ્હોલ વ્હીટ મઠરી

સામગ્રી - ઘઉંનો લોટ ૧ વાટકો, અજમો ૧/૨ ચમચી, મીઠું, તેલ ૧/૨ ચમચી, લાલ મરચું ૧ ચમચી.

રીત - ઘઉંના લોટમાં અજમું, મીઠું, લાલ મરચું, તેલ દળેલી સાકર નાખો મીક્ષ કરો. પાણીથી લોટ બાંધો. ૧૦-૧૨ મિનિટ રેસ્ટ આપો એના લુવા બનાવીને પૂરી જેવી ગોલ મઠરી વણી લો. ચપ્પુથી ટ્રીક કરો અને ગરમ તેલમાં તળી લો.

મેથી ફૂલવડી

સામગ્રી :- ૧ કપ ચણાનો લોટ, અડધો કપ ઘઉંનો લોટ, ૨ ટે.સ્પૂ રવો, અડધો ચમચી અધકચરા વાટેલા મરી, ૨ ટે.સ્પૂ કસૂરી મેથી, અડધો ચમચી અધકચરા ઘાણા, ૧



ચમચી તલ, ૧ ચમચી સાકર, મીઠું સ્વાદાનુસાર, ચપટી સોડા, તળવા માટે તેલ, લોટ બાંધવા પાણી.

રીત :- લોટ, રવો, મરી, કસૂરી મેથી, ઘાણા, સાકર, મીઠું તથા ચપટી સોડા મિક્સ કરવા. ૪ ટે.સ્પૂ તેલ ગરમ કરી તેમાં ઉમેરવું. પછી પાણીની મદદથી લોટ બાંધવો. હવે લૂવા કરી પાટલા પર હાથેથી રોલ કરવા. ચાફૂની મદદથી કટ કરી ફૂલવડીનો શેપ આપી. મીડીયમ આંચ પર તળી લેવી. ઠંડા કરી એરટાઈટ ડબ્બામાં ભરવી.

લેન્ટન

સામગ્રી :- મેંદો ૧ વાટકી, ઘઉંનો લોટ ૧/૨ વાટકી, મીઠું સ્વાદ અનુસાર, તેલ તળવા માટે, ઓરેંજ કલર ૧ ટી.સ્પુ., નુડલ્સ મસાલો જૈન ૨ ટે.સ્પુ., ભુંગળી (ફાયમ્સ) કાચા, ૮ થી ૧૦ પીસ.

રીત:- મેંદો, ઘઉંનો લોટ, મીઠું, નુડલ્સ મસાલો, ઓરેંજ કલર, મુઠ્ઠી પડવું મોણ નાખી લોટ બાંધવો. તેનો બનાવી નાની પુરી વણવી એમા બધે લાંબા કાપા કરવા અને વચમાં ફાયમ્સનો એક પીસ નાખી બન્ને સાઈડની કીનારી પર પાણી લગાડી બન્ને સાઈડ જોઈન્ટ કરવી ને શેપ આપવો. લેન્ટનનો પછી વળી લેવું ત્યારબાદ ઉપરથી નુડલ્સ મસાલો ભભરાવવો.

પ્રકાશ પર્વ દીપોત્સવની ઉજવણી આંતર અને
બાહ્ય મનને આજવાળીને કરીએ.

દિવાળીની સૌને શુભકામના
નૂતનવર્ષની શુભેચ્છા

બટુકભાઈ પી.શાહ

મૂઢલાબેન બી.શાહ

[Click Here](#)

દિવાળી નિમિત્તે અવનવા ફરસાણના વાનગીઓની રેસીપી

Thai Bajra Falafal

Ing. - For Falafal Mixture - 1 cup bajra soaked boiled, 1 Onion roughly chopped, 1 tbsp garlic roughly chopped, 1 tbsp thai red curry paste, coriander leaves.

For Falafal Tikki - Falafal mixture, 1 tbsp coriander powder, 1 tsp cumin powder, 1 tbsp Sesame seeds, Oil for frying.

Method - Soak bajra overnight & then cook in pressure cooker for 10-12 whistle. When cool down remove bajra in stainer. Add all falafal mixture in the blender and blend coarse mixture. And then add all dry spice and mix well. Make small tikkis and deep fry them into hot oil until golden brown. Serve with Tomato Ketchup.

Diet Puri

Ing. - Ragi, Oats, Corn Flacks, Chillies, Ginger, Curd, Olive Oil.

Method - Mix up the all flour, add chill, ginger, curd, Olive Oil. Make a dough. Make small puris, Fry the puris in olive oil or Bake it in an oven.

નટેલા પીઝા ફૂડી :-

સામગ્રી :- ચોકો ચીપ કુર્કીઝ પ્રમાણે જ બનાવવું. શેપ ગોળ બનાવી બેક કરવું. ઠંડુ થવા પછી કુર્કી પર નટેલા ચોકલેટ સ્ટ્રેડ, પાથરવું. કલરફૂલ સ્પ્રિંગલર થી ગાર્નિશ કરવું.



ગુલકંદ બાઈટ્સ

સામગ્રી - ૨ કપ મેંદો, એક મોટો બાઉલ ગુલકંદ, ૧/૨ કપ કોપરાનું ખમણ, દૂધ ૧/૨ કપ, તળવા માટે ઘી, એલચી પાવડર, વરીયાળી પાવડર, ૨ ચમચી માવો અથવા રવો.

રીત - સૌ પ્રથમ મેંદામાં ૨ ચમચી થીઝેલા ઘીનું મોણ આપી તેનો દૂધથી લોટ બાંધો, ૧૦-૧૫ મિનિટ લોટને ઢાંકી બરાબર મસળી તેના લુચા કરી તેનો રોટલો વણો.

સ્ટર્ફીંગ માટે - કોપરાનું ખમણ, ગુલકંદ, એલચી પાવડર, વરીયાળી પાવડર, બધુ બરાબર મિક્સ કરી ૨ ચમચી શેકેલો માવો અથવા શેકેલો રવો બધુ બરાબર મિક્સ કરી સ્ટર્ફીંગ તૈયાર કરે.

એસેમ્બલીંગ : મેંદાનાલોટમાંથી રોટલો વણી તેના ઉપર તૈયાર કરેલું ગુલકંદનું સ્ટર્ફીંગ મૂકી પછી તેના ઉપર બીજો રોટલો વણી તેના ઉપર માવો અને ટોપરાનું સ્ટર્ફીંગ લગાવી બન્નેને ફ્રોલ્ડ કરી રોલ વાળી પાતરાની જેમ કટ કરી ગરમ ઘીમાં ઘીમા તાપે તળી લો.

કાજુનું સીતાફળ :-

પાન બીડા પ્રમાણે ગોળો તૈયાર કરવો. પાન એસેન્સના બદલે સીતાફળ એસેન્સ ઉમેરવું. પછી તેની નાની નાની ગોળીઓ બનાવવી ભેગી કરતાં જવું. અને સીતાફળ તૈયાર કરવું ઉપર વિંગ લગાડવું. બ્રશથી બ્રાઉન ફૂડ કલરના સ્ટ્રોક્સ આપવી.



સફરજન આમળાના પેંડા

સામગ્રી :- ૧ કપ સફરજનનું છીણ, ૨ ચમચી ઘી, ૧ ચમચો મિલ્ક પાવડર, ૫ ચમચી તજ પાવડર, ૩ કપ મલાઈવાળું દૂધ.

આમળાનો જેમ :- ૧ કપ

આમળાનું છીણ, ૧ કપ ખાંડ, ૧ ચમચી લીંબુનો રસ, ૫ ચમચી એલચીના દાણા, ૫ ચમચી કેસર, ચપટી મીઠું. **સજાવટ માટે :-** લવિંગ, સફરજનની ચીર

રીત :- ૧ જ્વાસ પાણી ઉકળે પછી તેમાં મીઠું, આમળાનું છીણ નાખો, ૨ મિનિટ પચી છીણને બહાર કાઢી લો. કડાઈમાં આ આમળાનું છીણ, ખાંડ ઉકાળો, ઘટ્ટ થાય પછી લીંબુનો રસ, એલચી, કેસર મિક્સ કરો, ઠંડુ કરો. કડાઈમાં ઘી, સફરજનને સાંતળો, ૨ મિનિટ પછી દૂધ, તજ પાવડર, મિલ્ક પાવડર નાખો, ઉકાળો, ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરો, ઠંડુ કરો, પેંડા વાળો, વચ્ચે ખાડો કરો. આમળાનો જેમ મૂકો, લવિંગ ભરાવો, પ્લેટમાં ગોઠવો, શ્રીચીને ધરાવો.

રતાળુ લઘા ડ્રાયફ્રૂટ નમકીન

સામગ્રી - રતાળુ ગાજરના લઘા, તેલ, તળેલા શીંગ, કિસમીસ, બદામ, કાજૂ, સુકો ખોપરો, મીઠું, લાલ મરચું, આમચુર પાવડર, સાકર, ગરમ મસાલો.

રીત - રતાળુ ગાજરના લઘાને ડીપ ફ્રાય કરી લેવા, શીંગદાણા, સુકો ખોપરો અને બધા ડ્રાયફ્રૂટને તળીલેવા, પછી એક બાઉલમાં ગાજરના લઘા, શીંગદાણા અને તળેલા ડ્રાયફ્રૂટ લઈ એમાં સ્વાદ અનુસાર મીઠું અને બધા મસાલા નાખ્યા ત્યાર બાદ બધાને મિક્સ કરી લેવો સ્વાદિષ્ટ રતાળું લઘા ડ્રાયફ્રૂટ નમકીન તૈયાર.



ઝગમગતા દીવાળી ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.

સમસ્ત જ્ઞાતિજનોને દિવાળીની શુભેચ્છાઓ તથા નૂતન વર્ષાભિનંદન

શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ (દરિયાસ્થાન)

૩૩, દરિયાસ્થાન સ્ટ્રીટ, વડગાદી, મસ્જીદબંદર, મુંબઈ - ૩.

ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુ જ નામ,
ગુણ તારા નીત ગાઈએ, થાય અમારા કામ
હેત લાવી હસાવ તુ, સદા રાખ દિલ સાફ,
ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ.

શુભેચ્છક

શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ વતી

નિતીન ગોદાવરીબેન ગંગારામ ઠક્કર (પાંધી) - સેવક પ્રમુખ

ડ્રસ્ટ મંડળ

દિનેશ કે. ઠક્કર (મે.ટ્ર.)
મચુરભાઈ એચ. સોતા
નિલેશભાઈ જે. ચંદન
ભાવિકભાઈ કે. તન્ના
હરેશભાઈ આર. મજેઠિયા

ઉપપ્રમુખશ્રી

કલ્પેશભાઈ આર. ઠક્કર
ગૌરવભાઈ એચ. ઠક્કર

મંત્રીશ્રી

પંકજભાઈ ગણાત્રા
અમીતભાઈ ઠક્કર
હર્ષદભાઈ સોમૈયા (સહમંત્રી)

ખજાનચીશ્રી

કેલેશભાઈ ઠક્કર
કિર્તીભાઈ ઠક્કર
રાજેશભાઈ ધીરાવાણી

તથા સમસ્ત કારોબારી સભ્યો

Click Here

દીપાવલી નિમિત્તે વિશેષ ફરસાણનો રસથાળ

ચોળા ફળી ચાટ

સામગ્રી :- ચોળા ફળી તળેલી, નાના બે ત્રણ બાફેલા બટેટા, ૧/૪ કપ બાફેલા છોલે, ૨ કપ વલોવેલું દહીં, ૧ ટેબલ સ્પૂન ચાટ મસાલો, ૧ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, આમલી ખજૂરની મીઠી ચટણી, કોથમીર કુદીનાની તીખી ચટણી, કાંદા સમારેલા, થોડી ઝીણી સેવ, કોથમરી સમારેલી.



રીત :- એક ડિશમાં તળેલી ચોળાફળી ગોઠવો. એના ઉપર બાફેલા બટેટાના ટુકડા, બાફેલા છોલે, સમારેલા કાંદા, મીઠી ચટણી, તીખી ગ્રીન ચટણી, વલોવેલું દહીં એની ઉપર ચાટ મસાલો અને લાલ મરચાનો પાવડર, સેવ અને કોથમરી સમારેલી નાખવીને ખાવા માટે ઉપયોગમાં લઈ શકો. આ આઈટમ સ્પેશિયલી દીવાળીમાં બનાવી શકાય કારણ ચોળાફળી લગભગ દિવાળીમાં વધુ ઉપયોગ કરીએ છીએ.

ફરસી પૂરી

સામગ્રી :- મેંદો ૫૦૦ ગ્રામ, રવો ૧૫૦ ગ્રામ, અજમો ૨ ચમચી, બેકિંગ પાઉડર અડધી ચમચી, મીઠું સ્વાદ મુજબ મોણ માટે તેલ ૧ ચમચો તેલ તળવા માટે.



બનાવવાની રીત :- સૌ પ્રથમ કડાઈમાં તેલ ગરમ કરી પછી ઠંડું થવા દો, મેંદો અને રવાને ભેગા કરી ચાળી લો. તેમાં અજમો, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચા તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધો. તેમાંથી જાડા

લૂઆ લઈ જાડી પૂરી વણી ઉપર બે-ત્રણ વાર તેલવાળો હાથ લગાવી ફરીથી લૂઓ બનાવો. તે પછી નાના નાના લૂઆ કરી તેમાંથી જાડી ગોળ પૂરી વણો. આ પૂરીને અંગૂઠાથી વચ્ચે દબાવી દો. આ રીતે બધી પૂરી વણીને પછી ગરમ તેલમાં તળીને ટેસ્ટી પૂરીનો સ્વાદ માણો.

કંડીલ

સામગ્રી :- ૧ વાટકી ઘઉંનો લોટ, ૧ વાટકી મેંદો, ૨ ચમચા તેલ - મોણ માટે, ૧/૨ ચમચી જીરુ પાવડર, ૧/૨ ચમચી મરી પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે.



રીત :- બંને લોટ, તેલ, જીરું, મરી, મીઠું નાખીને પૂરી જેવો લોટ બાંધવો. કણક ને ૧/૨ કલાક ઢાંકી ને રાખી મુકવી. ત્યારબાદ, પૂરીની સાર્થક ના લુઆ કરી બધી પૂરી વણી લેવી. તળવા માટે તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય ત્યાં સુધી પૂરી માથી કંડીલ ના શેપ બનાવી લેવા. કંડીલ નો શેપ બનાવવા માટે, પૂરી ની વચ્ચે ચપ્પુ વડે ઉભા કાપા મુકવા પણ ધાર સુધી જવું નહીં. પછી ના બે છેડા પકડી એને હલકે હાથે ટવિસ્ટ કરતા જવું. બંને છેડાને છેલ્લે દબાવી દેવા. મધ્યમ આંચ પર બધા કંડીલ ગુલાબી થાય ત્યાં સુધી તળી લેવા. ઉપર થી સ્વાદ મુજબ ચાટ મસાલો અથવા સંચળ અથવા પેરી પેરી મસાલો ભભરાવી શકાય.

પ્રોટીન ચકરી

સામગ્રી :- ૧૦૦ ગ્રામ અડદની દાળ, ૧૦૦ ગ્રામ પીળી દાળ, ૩૫૦ ગ્રામ ચોખાનો લોટ, આદુ મરચાની પેસ્ટ ૨ ટેબલ.સ્પુ., તલ ૧ ટેબલ સ્પુ., અડધો કપ છાસ, બટર (માખણ) ૨ ટી.સ્પુ., તળવા માટે તેલ, સ્વાદ અનુસાર નમક.

બનાવવાની રીત :- દાળને અડધો કલાક પલાળી કુકરમાં ડુબે એટલું પાણી નાખી ૫ સીટી કરી લેવી. પછી દાળને કાઢી થોડી ઠંડી થાય એટલે એમાં ચોખાનો લોટ, આદુ મરચાની પેસ્ટ, નમક નાખી મીક્સ કરવું.



લોટ બાંધવા પાણીને બદલે છાસનો ઉપયોગ કરવો અને સોફ્ટ લોટ બાંધવો. લોટ બાંધી તરત જ ચકરી વાળી મીડીયમ ફ્લેમ પર ડીપ ફાય કરવી.

સ્પીના કોપીટા

સામગ્રી :- ફીલો પેસ્ટ્રી કપ, ૧ કપ બાફેલી પાલક, અડધો ટી.સ્પૂ પીસેલું લસણ, ૧/૪ કપ લીલો કાંદો, ૨ ટે.સ્પૂ.સેફૂ ભાજી, ૨ ટી.સ્પૂ. પાર્સલી, ચપટી જાયફળ, અડધો ટી.સ્પૂ. લેમન ઝેસ્ટ, અડધો ટી.સ્પૂ. ઓરેગાનો, ડધો કપ ફેટા ચીઝ અથવા પ્રોસેસ ચીઝ, ૩ ટે.સ્પૂ.ફશ કરેલી મકાઈ, ૧ ટે.સ્પૂ. ઓલીવ ઓઈલ.



બનાવવાની રીત :- કડાઈમાં તેલ ગરમ કરી કાંદો, લસણ સાંતળવું, પછી ફશ મકાઈ ઉમેરવી, ૨ મીનીટ સાંતળી ગેસ બંધ કરવો. હવે બાકીની બધી સામગ્રી મીક્સ કરવી. ઠંડુ કરી પાલક વાળુ સ્ટર્ફીંગ ફીલો પેસ્ટ્રીમાં ભરવું. ઓવનમાં ૮ થી ૯ મીનીટ 160°C પર બેક કરી ગરમા ગરમ સર્વ કરો.

Club ID # 131028-026139 | Dist. 3231-A2 | Region V | Zone I | L.Y. 2024-2025

LIONS CLUB OF MULUND

Chartered as : LIONS CLUB OF BOMBAY MULUND. Chartered on : 15-3-1964

આપ સૌને સમૃદ્ધ દિવાળીની
શુભકામનાઓ અને નવા વર્ષના
નૂતન વર્ષાભિનંદન



President
Lion Bharat
Chheda



Secretary
Lion Pallavi
Agrawal



Treasurer
M.J.F. Lion Jitendra
Chhabra



LL Meenal Naik
Secretary



L L Rajul Chheda
President



LL Neepa Lakhani
Treasurer

લાયન્સ ક્લબ ઓફ મુલુંડ તેમજ લાયન્સ લેડી ઓફિસરીના સર્વે પદાધિકારીઓ તથા મેમ્બર્સ

[Click Here](#)

દીપાવલી નિમિત્તે વિશેષ ફરસાણનો રસથાળ

મઠિયા-ફાફડા-ચોળાફળી

સામગ્રી :- મઠિયાનો લોટ, ૫૦૦ ગ્રામ મઠની દાળનો લોટ તથા ૧૦૦ ગ્રામ અડદની દાળ, બન્ને દાળ તડકે તપાવી બારીક લોટ હળવો.



ફાફડા-ચોળાફળીનો લોટ

:- ૧ કિલો ચણાની દાળ, ૨૦૦ ગ્રામ અડદની દાળ, ૨૦૦ ગ્રામ મગની દાળ, ૨૦૦ ગ્રામ ચોળાની દાળ, બધી દાળ મિક્સ કરી તડકે તપાવી બારીક લોટ દળવો.

બનાવવાની રીત :- ૧ લીટર પાણીમાં ૧ ટી.સ્પૂ., પાપડખાર અને ૨ ટેબલ સ્પૂ. મીઠું નાખી પાણી ગરમ કરવા મૂકવું. ૧ ઉભરો આવે એટલે ગેસ બંધ કરવો. પાણી ઠંડુ થવા દેવું. આ પાણી એક બોટલમાં ભરી લેવું. જ્યારે મઠિયા-ફાફડા-ચોળાફળી બનાવવી હોય ત્યારે આ પાણીથી કઠણ લોટ બાંધવો.

ફાફડા બનાવવાની રીત :- ૫૦૦ ગ્રામ ફાફડાના લોટમાં ૨ ચમચી ઘીનું મોણ, ૨ ચમચી અજમો, ૧ ચમચી હીંગ નાખી કઠણ લોટ બાંધવો, ખાંડવો, ચપ્પુથી મિડિયમ સાર્ઠઝના લુઆ કરવા. ચોખાના અટામણથી રોટલી જેટલી સાર્ઠઝના પાતવા વણવા. ઢાંકીને રાખવા. ગરમ તેલમાં તળવા. ઉપર લાલ મસાલો છાંટવો. ચોળાફળીમાં ફક્ત હીંગ નાખી કઠણ લોટ બાંધવો. રોટલીની સાર્ઠઝના લુઆ કરવા. ચોખાના અટામણથી રોટલીથી સહેજ મોટા વણવા. એકની ઉપર એક ચપ્પી કરવી. વચમાં લાંબા કાપા પાડીને તળવા. ઉપર લાલ મસાલો છાંટવો.

સ્પીનેચ પનીર રેપ્સ વીથ ટોમેટો ચટણી

સામગ્રી :- ૨ કપ ઘઉંનો લોટ અથવા મેંદો, ૧ ટી.સ્પૂન તેલ, ૧

ટી.સ્પૂ., દહીં, મીઠું સ્વાદઅનુસાર, ૨ થી ૩ ટેબલ સ્પૂન સ્પીનેચ પેસ્ટ, ૧ ટેબલ બેકીંગ પાવડર.

સ્ટર્ફીંગ માટેની સામગ્રી :- ૧ ટે.સ્પૂ. તેલ, ૧ નંગ કેપ્સીકમ લાંબા સમારેલા, ૩ ટે.સ્પૂ. મકાઈ, ૭૫ ગ્રામ પનીર લાંબા પીસ, ૨ ટે.સ્પૂ. બ્રોકલી અથવા ગાજર, બટેટા, ૧ ટે.સ્પૂ. આદુ મરચાની પેસ્ટ, ૨ થી ૩ ટે.સ્પૂ. સ્પીનેચ પાલક સમારેલી, ૧ ટે.સ્પૂ. કોથમીર, ૨ ટે.સ્પૂ. ઓરીગેનો પ્રેપ્રીકા, મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત :- બધી વસ્તુ મીક્સ કરી લોટ બાંધવો પછી તેની રોટલી વણી અને કાચી પાકી શેકી લેવી.

રોટલી કાચી પાકી શેકીને પુરણ ભરવાનો. ચટણી લગાડીને પછી પાછી શેકીને બટર અથવા ઘીથી શેકવાની અને સર્વ કરો.

ટોમેટો ચટણી - સામગ્રી :- ૧ ટે.સ્પૂ. તેલ, ૨ થી ૩ ટમેટા બારીક સમારેલા, ૨ ટે.સ્પૂ. ટમેટો સોસ, કાંઠા, લસણ નાખવા હોય તો ૧ ટે.સ્પૂ. સાકર, ૧ ટે.સ્પૂ. લાલ મરચુ, ૧ ટે.સ્પૂ. ઓરીગેનો પ્રેપ્રીકા,

બનાવવાની રીત :- તેલ ગરમ કરી ટમેટાને સાંતળી લેવા પછી તેમાં બી વસ્તુ નાખી ચટણી તૈયાર કરવી. આદુ મરચાની પેસ્ટ. **રેપ્સ બનાવવાની રીત :-** રોટલી ઉપર ટમેટો ચટણી લગાડી સ્ટર્ફીંગ રાખીને તેને રોલ કરી બટર નાખી શેકી લેવું. પછી તેને ગરમ સર્વ કરો.

પૌઆનો ખાટોમીઠો ચેવડો

સામગ્રી :- પૌઆ ૨૦૦ ગ્રામ, સીંગદાણા ૨૦૦ ગ્રામ, તેલ તળવા માટે, હળદર-૧/૩, ખાંડ ૨ ચમચી, ટાટરી-ચણા દાણાના દાણા



જેટલું, કિસમિસ, બેસનની સેવ, **બનાવવાની રીત :-** કઠાઈમાં તેલ ગરમ કરો. જ્યારે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો તેજ ગરમ તેલમાં પૌઆ નાખી તળી લો. તળેલા પૌઆ એક ચાળણીમાં કાઢી લો જેથી તેનો વધારાનું તેલ નિકળી જાય. બધા પૌઆ કાઢી લો. હવે સીંગદાણાને પણ તળી લો.



ખાંડ, મીઠું અને લીંબુના ફૂલને મિક્સ કરી વાટીને પાઉડર કરી લો. કઠાઈમાં તેલ ગરમ કરી ગરમ તેલમાં હળદર અને કઢી લીમડો નાખી, ઘીમા તાપે પૌઆ નાખો અને સારી રીતે પીળા કરો. અને ઠંડા થવા માટે રાખી દો. ઠંડા પૌઆમાં સીંગદાણા, બેસનની સેવ અને કિસમિસ નાખો. હવે દળેલી ખાંડ પાવડર નાખી સારી રીતે મિક્સ કરો ખાટો-મીઠો પૌઆ ચેવડો તૈયાર છે.

દહીંથરા

સામગ્રી :- ૨ વાટકી મેંદો, ૧ વાટકી રવો, અડધો વાટકી ગરમ ઘી, દહીં ૨ ટેબલ સ્પૂ., દૂધ અડધો કપ, તળવા માટે ઘી.



બનાવવાની રીત :- મેંદો અને રવો કથરોટમાં મિક્સ કરી ઘી નાખી લોટ મસળવો. પછી દહીં નાખવું. જરૂર પૂરતું દૂધ નાખી કઠણ લોટ બાંધવો. ઢાંકીને એકાદ કલાક રાખવો. પણ મસળીને મોટી પૂરી જેવા લુવા કરવા. ચારે બાજુ હાથેથી પ્રેસ કરી હળવા હાથે બે વેલણ ફેરવવા. જાડી પૂરી વણવી. ચપ્પુથી એક બે કાપા કરવા. ગરમ ઘીમા ઘીમા ગેસ પર તળવા. બન્ને બાજુ ગુલાબી થાય એટલે બહાર કાઢી લેવા. ઠંડા પડે પછી બરણીમાં ભરવા.



MAX SHINE LAUNDRY



FREE PICKUP & DELIVERY SERVICE AVAILABLE IN MULUND & THANE
(Coming Soon in Other Areas)
Minimum order value of Rs 200/-

3 years of work experience in Hotels, Resorts & Spa

CUSTOMERS HAVE STARTED REPEATING ORDERS

- FACTORY SET-UP OF 2000 SQ.FT. • WASHING IN FACTORY WASHERS.
- DRY STEAM PRESSING IN BED ROLL HEAVY MACHINES.
- DELIVERY EXPECTED IN 2-3 DAYS.

Items	SINGLE BEDSHEET / BLANKET (Size approx-90cmx190cm)	DOUBLE BEDSHEET / BLANKET (Size approx - 137cm x 190cm)	PILLOW COVER	CURTAIN
Regular Rate	Rs. 49/- Per Piece	Rs. 79/- Per Piece	Rs. 15/- Per Piece	Rs. 99/- Per Kg
Inaugural offer Rate (offer valid upto 15th Nov. 2024)	Rs. 39/- Per Piece	Rs. 59/- Per Piece	Rs. 11/- Per Piece	Rs. 79/- Per Kg

CUSTOMER CARE - 9930559996 PICKUP & DROP - 9930559992



AASHV ETHNICS
THE CELEBRATION WEAR

Designer Collection for Groom

- Bespoke Tailoring
- Sangit Sandhya
- Marriage
- Reception
- Mahendi Designer Clothes

Suit Kurta

Sherwani Indowestern

Jodhpuri Jacket Kurta

Customized Clothes will also be Provided to Match Your Partner's Dress.

Aashv ethnic, 15/c. Ground Floor, Shanti industry, Tambe Nagar, Mulund-West

8169873626
022-35134493

f aashv. Ethnic @ aashv. Ethnic

Click Here

દિવાળી નિમિત્તે અવનવી મીઠાશવાળી વાનગીઓની રેસીપી

ચોકલેટ ગુલાબજાંબુ

સામગ્રી :- ૧ કપ મિલ્ક પાવડર, ૧/૩ કપ મેંદો, ૧/૪ નાની ચમચી બેકિંગ સોડા, ૨ નાની ચમચી ચોકલેટ પાવડર, ૨ મોટી ચમચી, મેલ્ટેડ બટર, દૂધ જરૂર પ્રમાણે, તેલ જરૂર પ્રમાણે, ૨ કપ ખાંડ ચાસણી માટે, ૧ કપ પાણી, ૪-૫ પીસેલી એલચી, ૮-૧૦ કેસરના તાંતણા, ચોકલેટ સોસ માટે, ૬ વાઈટ ચોકલેટ, ૩ કપ કીમ ગાર્નિશિંગ માટે ફીણેલું. કીમ, ચોકલેટ સિરપ.



રીત :- સૌથી પહેલાં મિલ્ક પાવડર, દૂધ અને બટરને મિક્સ કરીને લોટની જેમ ગૂંદી લો. તેના નાના બોલ્સ બનાવો અને પ્લેટમાં મૂકીને કોરા કપડાથી ઢાંકી દો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને બોલ્સને ડીપ ફાઈ કરીને અલગ મૂકી દો. ગુલાબજાંબુ તૈયાર છે. એક પેનમાં ખાંડમાં પાણી સાથે કેસર અને પીસેલી એલચી નાખો. હવે આ મિશ્રણને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી ખાંડ પાણીમાં ઓગળી ન જાય. તે પછી ચાસણીને એક વાસણમાં કાઢી લો અને તેમાં ગુલાબજાંબુ મૂકી દો. હવે વાઈટ ચોકલેટને મેલ્ટ કરી લો અને તેમાં કીમ મિક્સ કરી લો. તે પછી ગુલાબજાંબુ ચાસણીમાંથી કાઢીને આ મિશ્રણમાં નાખી દો. ચોકલેટ સોસમાં ગુલાબજાંબુ ડિપ કર્યા પછી તેમને પ્લેટમાં મૂકીને ચોકલેટ સોસ અને કીમથી ગાર્નિશ કરો.

રાજભોગ

સામગ્રી :- ૧૦૦ ગ્રામ માવો, ૧ મોટી ચમચી માવો, થોડાંક ટીપાં કેસર ફૂડ કલર, ૧ નાની ચમચી મેંદો, ૧ મોટી ચમચી પિસ્તા બારીક કાપેલા, ૧ મોટી ચમચી બદામ બારીક કાપેલી, ૧ મોટી ચમચી ખાંડ, પાંચ કેસરના તાંતણા, ૧/૪ નાની ચમચી એલચી પાવડર, ૧ કપ ખાંડ ચાસણી માટે, પાણી જરૂર પ્રમાણે.



રીત :- માવો અને કેસર ફૂડ કલરને વ્યવસ્થિત રીતે મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરી લો અને અલગ મૂકી દો. એક થાળીમાં મેંદો ભભરાવો. પછી મેંદામાં પાણી મિક્સ કરીને ઘોળ બનાવીને બોલ્સ મૂકો. આ ઘોળને અલગ મૂકીને એક પેનમાં પાણી અને ખાંડ મિક્સ કરીને આંચ પર ચડાવો અને ચારણી બનાવો તેમા મેંદાનું ભાગનું ઘોળ નાખો. પછી રાજભોગ ને ચારણીમાં નાખો. પાતળું થાય એટલે બધું ઘોળ ચાસણીમાં મિક્સ કરી દો હવે તેને ૨૦ મિનિટ સુધી પકાવો. પરતને હટાવવા માટે સતત પાણીના છાંટા મારતા રહો. પછી ૩ થી ૪ કલાક ઠંડુ થવા દો અને સર્વ કરો.

ચોકલેટ બરફી

સામગ્રી :- ૪ કપ મિલ્ક પાવડર, ૧ કપ ખાંડ, ૧ નાની ચમચી એલચી પાવડર, ૨-૩ ચપટી કેસર, ૧ મોટી ચમચી ઘી, ૧/૩



કપ દૂધ, ૩૦૦ ગ્રામ કુર્કીંગ ચોકલેટ.

રીત :- એક પેનમાં ૩ કપ પાણી અને ખાંડ નાખીને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય. ખાંડ ઓગળી ગયા પછી તેમાં મિલ્ક પાવડર મિક્સ કરો. પછી તેમાં દૂધ અને ઘી નાખો પછી વ્યવસ્થિત મિક્સ કરો. આ મિશ્રણમાં કેસર એલચી પાવડર નાખો અને આંચ પરથી લઈ લો. હવે એક પ્લેટમાં સામાન્ય ઘી લગાવીને આ મિશ્રણને તેમાં ફેલાવી દો. થોડીવાર ઠંડુ થવા દો. એક પેનમાં પાણી ગરમ કરો અને તેમાં ચોકલેટના ટુકડા નાખો. વ્યવસ્થિત રીતે મેલ્ટ થાય પછી ચોકલેટને બરફી પર નાખી દો હવે ૬-૭ કલાક સુધી ઠંડુ થવા દો અને કાપીને સર્વ કરો.

માવા અંજીર બરફી

સામગ્રી :- ૧/૨ કપ સૂકા અંજીર બારીક સમારેલા, સવા કપ માવો છૂટો પાડેલો, ૧ ચમચો સાકર, ૨ ચમચા ઘી પીગાળેલું, ૧/૪ ચમચી એલચીનો ભૂકો. ડેકોરેશન માટે ચાંદીનો વરખ



રીત :- એક વાસણમાં ૧/૨ કપ પાણી અંજીર અને સાકર નાખી મધ્યમ તાપે ૫ થી ૭ મિનિટ હલાવો જેથી સાકર ઓગળી જાય. તેમાં માવો ઉમેરી હલાવતા રહો જેથી તે લાઈટ બ્રાઉન રંગનો થાય તેમાં ઘી અને એલચીનો ભૂકો, મીક્સ કરો અને હલાવો. ગેસ ઉપરથી ઉતારી ઘી લગાડેલી થાળીમાં પાથરો ઉપર ચાંદીનો વરખ લગાડો. આના ૧૬ ચોરસ ટુકડા કરો અને પીરસો.

ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ



સ્વ. જ્યોતિબેન (અરુણાબેન) ખુશાલચંદ ધરમશી

કચ્છ - છાદુરા

અરિહંત શરણ :

તા. ૨૪-૧૦-૨૦૨૪

હાલે - દુબતી

વાણીમાં વાત્સલ્યતા,
ધર્મમાં આસ્થા,
દિલમાં ઉદારતા,

પરોપકારીમાં પ્રભુતા અને જીવદયા પ્રેમી જેવા અલંકારોથી ઓપતું આપનું જીવન સદા યાદ બનીને દિલમાં બિરાજશે

-: શ્રદ્ધા સુમન :-

માતૃશ્રી નવલબાઈ લક્ષ્મીચંદ ધરમશી પરિવાર, છાદુરા
માતૃશ્રી કુંવરબાઈ શામજી પદમશી પરિવાર, સુથરી
માતૃશ્રી લક્ષ્મીબેન વિસનજી છેડા પરિવાર, નસિયા

આપ સર્વેને દિવાળી તેમજ
નવા વર્ષની હાર્દિક શુભેચ્છા

8879753249 / 9323953249

Roxy
Since 1967
ISO 9001 : 2015 certified

LIBRARY
PRESERVING THE HABIT OF READING

Just Pay Rs. 500/-
Read as many Books
as you want*

Shop No. 21, Trivrdi Tower,
J. N. Road, Station Road,
Mulund (West), Mumbai - 400 080.

Follow On Instagram

@roxytoylib @roxybooksandlibrary

** Our Branches Mulund / Thane / Dadar

Click Here

દિવાળી નિમિત્તે અવનવી મીઠાશવાળી વાનગીઓની રેસીપી

કાજુનું ટાકોઝ :-

સામગ્રી :- ૧ કપ કાજુના ભૂક્કો, ૧/૨ કપ દળેલી સાકર, ૧/૪ કપ પાણી, જરાક ઘી, પીળો ફૂડ કલર, ડ્રાયફ્રૂટ, ટૂટીફ્રૂટી



રીત :- કડાઈમાં સાકર અને પાણી મીક્સ કરી ૧ તારની ચાસણી તૈયાર કરવી. તેમાં કાજુનો પાવડર ઉમેરવો. વ્યવસ્થિત મીક્સ કરવું હાથ પર ઘી લગાડી થોડું મસળવું. ગોળાના ૨ ભાગ કરવા, એક એમ જ રાખવું. એકમાં પીળો કલર ઉમેરવો. હવે પીળા કલર માંથી લંબગોળ રોપ બનાવી તેને ડ્રાયફ્રૂટ અને ટૂટીફ્રૂટીમાં ફેરવવું પ્લેન ભાગની પૂરી બનાવી તેમાં વચ્ચે લંબગોળ ગોળો મૂકી ફોલ્ડ કરી સર્વ કરવું.

ચોકો ચીપ કુકીઝ :-

સામગ્રી :- ૧/૨ કપ મેંદો, ૧/૨ કપ દળેલી સાકર, ૩ ટે.સ્પૂ બટર, ૨ ટે.સ્પૂ કોકો પાવડર, ૧ ટે.સ્પૂ ઘી, ૧/૪ ટી.સ્પૂ વેનીલા એસેન્સ, ચપટી બેકીંગ પાવડર, ડેકોરેશન માટે ચોકો ચિપ્સ.



રીત :- સાકર, બટર અને ઘીને ૭ થી ૮ મીનીટ ફેટવું પછી તેમાં બેકીંગ પાવડર, વેનીલા એસેન્સ અને કોકો પાવડર ઉમેરી ફેટવું. પછી મેંદો ઉમેરી લોટ બાંધવો હવે લોટને વણી તેવું અને ચોરસ કટ કરવું. ફોર્કની મદદથી

લાઈન્સ કરવી ઉપર ચોકો ચિપ્સથી ગાર્નિશ કરવું ૧૮૦ ડી.સે. પર પ્રીહીટિડ ઓવનમાં લગભગ ૧૦ મીનીટ બેક કરવું.

ટૂટી ફ્રૂટી બીસ્કીટ :-

સામગ્રી :- ૧ કપ મેંદો, ૩/૪ કપ દળેલી સાકર, ૧/૨ કપ ઘી અથવા બટર, ૪ ટે. સ્પૂ રવો, ૨ ટે.સ્પૂ ટૂટી ફ્રૂટી, ૧/૨ ચમચી ઓરેન્જ અથવા મીક્સ ફ્રૂટ એસેન્સ.



રીત :- ઘી અથવા બટરને દળેલી સાકર સાથે ૭ થી ૮ મીનીટ ફેટવું પછી એસેન્સ ઉમેરવું, ૨ મીનીટ ફેટવું. હવે તેમાં મેંદો તથા રવો ઉમેરી લોટ બાંધવો. તેને હાથેથી ચોરસ રોપ આપવો ટૂટીફ્રૂટીથી ગાર્નિશ કરવું. પ્રી હીટિડ ઓવનમાં ૧૮૦ ડી.સે. પર લગભગ ૧૦ મીનીટ બેક કરવું.

હર્બ ઈટાલીયા બીસ્કીટ :-

સામગ્રી :- ૩/૪ કપ મેંદો, ૧ ટે.સ્પૂ રવો, ૩ ટી.સ્પૂ બટર, ૧ ક્યુબ ચીઝ, ૧ ટી.સ્પૂ ઓરેગાનો અથવા મીક્સ હર્બ્સ (ઈટાલીયન), ૧/૪ ટી.સ્પૂ પ્રેપ્રીકા, ૧/૨ ટે.સ્પૂ ટબેસ્કો સોસ, ૧/૪ ટી.સ્પૂ બેકીંગ પાવડર, જરૂર મુજબ દૂધ.



રીત :- બધી સામગ્રી મીક્સ કરવી, ચીઝ સીવાય. લોટ બાંધવો. પાટલા પર વણવું. ભાખરી જેવી જાડાઈ રાખવી. કુકી કટરથી કટ કરવું ઉપર ચીઝ ગ્રેટ કરવું. ૧૮૦ ડી.સે. પ્રીહીટિડ ઓવનમાં લગભગ

૧૦ મીનીટ બેક કરવું. ઠંડુ કરી ડબ્બામાં ભરવું.

દાળના લાડું

સામગ્રી :- ૨ કપ મેંદો, ૧ કપ બુરું અથવા દળેલી સાકર, ૧ કપ દેશી ઘી, અડધી ચમચી એલચી પાવડર, સાડા ચાર ચમચી દૂધ



રીત :- સૌ પ્રથમ મેંદાને બારીક આંક વડે ચાળી લો. હવે તેમાં દૂધ નાખી સારી રીતે મિશ્રણ કરી લો અને દબાવીને ઢાંકીને રાખી દો (દ્રાખો દેવો) અડધા કલાક પછી તેને પણ દબાવીને ચાળી લો ન થાય તો મીક્સરમાં કરી ચાળી લો જેથી એક સરખો લોટ મળે. હવે આ લોટને ગેસ પર મધ્યમ તાપ પર શેકો. શેકતી વખતે ખાસ ખ્યાન રાખો કે તેનો રંગ ન બદલાય. પણ તેમાં સુગંધ જરૂર આવશે અને આ લોટને ઘી વગર જ કોરો શેકવાનો છે. હવે તેને ઠંડો થવા બાજુ પર રાખી દો. હવે એક થાળી (નાંસ કે કથરોટ વધુ સારું) લો તેમાં ઘીને ફીણો. એકદમ ફીણ થઈ જાય કલર બદલાય એટલે તેમાં સાકર નાખી કરી ફીણો અને નરમ થાય ત્યાં સુધી કીમી થાય ત્યાં સુધી ફીણો. હવે તેમાં એકદમ જ ઠંડો થઈ ગયેલો લોટ મિક્સ કરો. એલચી પાવડર નાખો અને બનેલા લોટના એક સરખા લાડુ બનાવો તેના પર સજાવવા માટે એલચીનો એક દાણો કે લવિંગ રાખી શકાય. બાકી આ શ્વેત લાડુ સ્વયં જ ખૂબ જ આકર્ષક લાગે છે. સ્વાદિષ્ટ તો ખરા જ અને આપણું આર્યુવેદ તો એમ કહે છે કે આ શરદઋતુમાં બુરું સાકર, દેશી ઘી અને મેંદાનું કોમ્બીનેશન આરોગ્ય માટે સારું પણ સાથે ચેતવણી આપતા કહે છે 'અતિની ગતિ' નહીં.

BUY 1 GET 1

FREE on Frames & Sunglasses

FREE EYE CHECKUP

by Qualified Optometrist

Blueseyes

Make Eye Care a Priority

+91 97695 82393
79770 11355

A-2/14, Pranav Commercial Plaza, M. G. Road, Near Shiv Sena Office, Mulund (W).

*Terms and Condition Apply. (Not For Contact Lenses & International Brands)

આઈડિયલ હોમ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ

સંચાલિત

હેપી ફીઝ દાતા પરિવારો, શુભેચ્છકો અને નિઃસ્વાર્થ ભાવે સેવા આપનાર કાર્યકરોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવે છે તેમજ આવનાર વર્ષ આપ અને આપના પરિવાર માટે મંગલમય બની રહે એવી શુભેચ્છા.

કેન્દ્ર ૧

બપોર - સાંજ સ્વાદિષ્ટ ભોજન
(ચંદન બાગ, મહાત્મા ગાંધી રોડ,
મુલુંડ-પશ્ચિમ)

કેન્દ્ર ૨

બપોર સ્વાદિષ્ટ ભોજન
(ખંડોબા મંદિર પાસે,
મુલુંડ-પૂર્વ)

ટુંક સમયમાં સર્વોદય નગર, મુલુંડ-પશ્ચિમમાં ત્રીજો કેન્દ્ર શરૂ થઈ રહ્યો છે. સ્વચ્છાચે સેવા આપવા ઈચ્છતા વ્યક્તિઓએ દિનેશ હેમરાજ વિસરીયાને ૯૩૨૨૨૧૩૮૭૭ પર સંપર્ક કરવા વિનંતી.

Pay +917977117894 (૮૦જી અંતર્ગત ઈન્કમ ટેક્ષમાં રાહત મળે છે)

વિશેષ માહિતી અને દાન માટે સંપર્ક:
મહેશ મોતા : 9029676718
ધર્મેશ ખાંટ : 9987680600
જીતેન્દ્ર હેમરાજ વિસરીયા : 9892288822
આઈડિયલ હોમ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ : 7977117894

Click Here

દિવાળી નિમિત્તે અવનવી મીઠાશવાળી વાનગીઓની રેસીપી

હીટ જંજર બીસ્કીટ :-

સામગ્રી :- ૧/૨ કપ ઘઉંનો લોટ, ૧ ટે સ્પૂ. સુંઠનો પાવડર, ૧/૪ ટી સ્પૂ. બેકીંગ પાવડર, ૩ ટે-સ્પૂ. ઘી અથવા બટર, ૧/૨ ટી સ્પૂ. વેનીલા એસેન્સ, ૧/૨ કપ દળેલી સાકર, ૧/૨ ટી. સ્પૂ. કેરેમલ કલર.



રીત :- સૌ પ્રથમ બટર અથવા ઘી અને દળેલી સાકરને હાથેથી ૭ થી ૮ મીનીટ ફેટવું. પછી તેમાં અસેન્સ, કલર સુંઠનો પાવડર, મીક્સ કરવો. ૨ મીનીટ ફેટવું. પછી બેકીંગ પાવડર ઉમેરી ફેટવું. છેલ્લે લોટ ઉમેરી વ્યવસ્થિત મીક્સ કરી લોટ બાંધવો. જરૂર પડે તો થોડું દૂધ ઉમેરવું. પછી તેને પાટલા પર વણી કુકી કટરથી શેપ આપી, ગ્રીસ કરેલી બેકીંગ ટ્રેમાં ગોઠવવું. ઓવનને ૨૨૦° પર ગરમ (પ્રી હીટ) કરવું પછી તેમાં બેકીંગ ટ્રે મૂકી ૧૮૦ ડીગ્રી સે. પર ૧૦ થી ૧૨ મીનીટ બેક કરવું. ઠંડુ થાય પછી એરટાઈટ ડબ્બામાં ભરી લેવું.

નાન ખટાઈ :-

સામગ્રી :- ૧ કપ મેદો, ૧/૨ કપ ઘી, ૧/૨ કપ દળેલી સાકર, ૨ થી ૩ ટે.સ્પૂ. રવો, ચપટી બેકીંગ પાવડર, ૧/૨ ટી.સ્પૂ. એલચી પાવડર, જરૂર મુજબ દૂધ, ચારોળી અથવા બદામ સજાવટ માટે.



રીત :- સૌ પ્રથ ઘી અને

સાકરને ૭ થી ૮ મીનીટ હાથેથી ફેટવું. પછી તેમાં ચપટી બેકીંગ પાવડર અને એલચી પાવડર ઉમેરી ૨ મીનીટ ફીણવું. હવે તેમાં મેદો ઉમેરી લોટ બાંધવો. નાની નાની નાન ખટાઈ બનાવી ગ્રીસ કરેલી બેકીંગ ટ્રેમાં થોડો થોડો ગેપ રાખી ગોઠવવી. ૨૨૦° સે. પર ઓવન ગરમ કરવું. પછી ટ્રે આવનમાં મૂકી ૧૮૦ ડીગ્રી.સે. પર ૧૦ થી ૧૨ મીનીટ એક બેક કરવું.

ઓટ્સ કોકેનટ કુકીસ :-

સામગ્રી :- ૧ કપ ઘઉંનો લોટ, ૪ ટે.સ્પૂ. પ્લેન ઓટ્સ, ૧/૨ કપ બટર, ૧/૨ કપ દળેલી બ્રાઉન શુગર, ૨ ટે.સ્પૂ. ડેસીકટેડ કોકોનટ, ચપટી બેકીંગ પાવડર જરૂર પ્રમાણે દૂધ.



રીત :- બ્રાઉન શુગર અને બટર ૭ થી ૮ મીનીટ ફેટવું. પછી તેમાં બેકીંગ પાવડર ઉમેરવો હવે તેમાં ઓટ્સ અને કોકોનટ પાવડર ઉમેરવું. છેલ્લે ઘઉંનો લોટ ઉમેરી લોટ બાંધવો. કુકીઝનો શેપ આપવો. પ્રી હીટેડ ઓવનમાં ૧૮૦ ડી.સે. પર ૧૦ થી ૧૨ મીનીટ બેક કરવું.

કાજુ પીઝા :-

સામગ્રી :- ૧ કપ કાજુ પાવડર, ૧/૨ કપ દળેલી સાકર, ૧/૪ કપ પાણી. પ્લાસ્ટીક શીટ, ઘી.



સ્પ્રેડ કરવા માટે :- ૧ ટે.સ્પૂ. ગુલકંદ, ૧ ટે.સ્પૂ. કાજુ-

બદામ-પીસ્તાના ટુકડા, ૧ ટે.સ્પૂ. લાલ-લીલી ટૂટી ફૂટી, ૧/૪ ટી.સ્પૂ. દળેલી સાકર બધી સામગ્રી બાઉલમાં વ્યવસ્થિત મીક્સ કરવી.

રીત :- સાકર અને પાણી મીક્સ કરી દોઢથી ૨ તારી ચાસણી તૈયાર કરવી. તેમાં કાજુપાવડર ઉમેરવો ઝડપથી મીક્સ કરવું. થોડું જ ઠંડુ કરી હથેળી પર ઘી લગાડી મસળવું. ગ્રીસ કરેલી પ્લાસ્ટીક શીટ પર ગોળી મૂકી વણવું. થોડું જાડું રાખવું ઉપર સ્પ્રેડ કરવાની સામગ્રી પાથરવી ઉપર. છાલ કાઢેલી બદામની કતરણ અને ચેરીથી સજાવવું. ડ્રાયફ્રૂટ પીઝા તૈયાર.

કાજુનું પાનબીડું :-

સામગ્રી :- ૧ કપ કાજુ પાવડર, ૧/૨ કપ દળેલી સાકર, ૧/૪ કપ પાણી, લીકવીડ લીલો ફૂડ કલર, ૨ થી ૩ ટીપાં પાન એસેન્સ.



સ્ટફીંગ :- ૨ ટે.સ્પૂ. કાજુ-બદામ-પીસ્તા ટુકડા, ૨ ટી.સ્પૂ. ગુલકંદ, ૧/૪ ટી.સ્પૂ. શેકેલી ખસખસ, ૧ ટે.સ્પૂ. ટૂટીફૂટી, ૧ ટી.સ્પૂ. ખજૂરના નાના ટુકડા, ૧ ટી.સ્પૂ. ખારેકના નાના ટુકડા, બધી સામગ્રી બાઉલમાં વ્યવસ્થિત મીક્સ કરવી.

રીત :- સાકર અને પાણી મીક્સ કરી એકતારી ચાસણી તૈયાર કરવી. તેમાં લીલો કલર તથા પાનનું એસેન્સ ઉમેરવું હવે તેમાં કાજુ પાવડર ઉમેરવો. વ્યવસ્થિત મીક્સ કરવું હથેળીમાં ઘી લગાડી નાની નાની પૂરી થેપવી. વચ્ચે ૧ ચમચી સ્ટફીંગ લગાડી ફોલ્ડ કરી સર્વ કરવું.

R.K. Shah Family (Palitana wala) wishes you a Happy Diwali and a Prosperous New year

AMEE
ENTERPRISE

K&N

JBL

Customize Your car Interior



Marathon Monte Vista, Monte Plaza, Shop No. 4,
Next To Dalvi Motors, Hotel Achija Lane,
Mulund (West), Mumbai - 400 080.

Contact : 98209 67333 | 99209 67333

Click Here

દિવાળી નિમિત્તે અવનવી મીઠાશવાળી વાનગીઓની રેસીપી

ગુલકંદ આઈસ હલવો

સામગ્રી :- એક વાટકો મેંદો, એક વાટકી દૂધ, એક વાટકી ઘી, ૧ ૧/૨ વાટકી સાકર, ગુલકંદ

રીત:- એક કડાઈમાં એક વાટકી ઘી, ૧ ૧/૨ વાટકી સાકર નાખીને બધું મિક્સ કરવું પછી ગેસ ઉપર ગરમ-કરવા મૂકવું. બધુ એકરસ થઈ જાય અને કિનારી છુટે ત્યાર બાદ ગેસ બંધ કરવાનું અને કડાઈ નીચે ઉતારી લેવી થાળીમાં ઘી લગાડીને આ મિશ્રણ થાળીમાં પાથરવું.

હંડુ થાય ત્યારે તેના ટુકડા કરવાના નીચે એક ચોરસ આઈસ હલવાનો ટૂકડો રાખી તેના ઉપર ગુલકંદ પાથરવાનું. પછી ઉપર એક ટુકડો આઈસ હલવાનો મૂકવાનો આ રીતે સ્વાદિષ્ટ ગુલકંદ આઈસ હલવો તૈયાર.

ટ્રેગન આઈટ્સ

સામગ્રી - ૧ કપ ટ્રેગન ફૂટનો પલ્પ(સફેદ), ૧/૨ કપ કોર્નફ્લોર, ૩ કપ ગાયનું દૂધ, ૩ ચમચી સૂકા નાળિયેરનું છીણ, ૨ ચમચી વ્હીપીંગ ક્રીમ, ૧/૨ કપ ખાંડનો પાવડર, ૩ ચમચી કાજુનો પાવડર, ૨ ટીપા રોઝ એસન્સ



સજાવટ - કાળા તલ

રીત - પેનમાં કોર્નફ્લોર, દળેલી ખાંડ, મિક્સ કરી હલાવો દૂધ ઉમેરો, મિક્સ કરો, તેમાં નાળિયેરનું છીણ, વ્હીપીંગ ક્રીમ

મિક્સ કરો. ધીમા ગેસ પર હલાવતા રહેવું એક ઉભરો આવે પછી ટ્રેગનનો પલ્પ ઉમેરો, મિક્સ કરો ઘટ્ટ થાય પછી કાજુનો પાવડર ઉમેરો, સરખી રીતે મિક્સ કરો. પેનની સાઈડ છોડી દેશે મિશ્રણ ત્યારે ગેસ બંધ કરો. ઘી લગાવેલી થાળીમાં પાથરો. અડધા કલાક પછી ૧ કલાક માટે ફ્રિજમાં રાખો, કાપા પાડો સૂકા નાળિયેરના છીણમાં રંગદોળો શ્રીજીને ધરાવો.

નોંધ - સફેદ ટ્રેગન ફૂટ લો ત્યારે ૨ ટીપા પીંક રેડ ફૂડ કલર નાખવો.

ચીકુ સૂરણ શીરો

સામગ્રી - ૧ ચમચા ચીકું છીણ, ૨ ચમચા સૂરણ(બાફીને મેશ કરેલું), ૧ ચમચો ખાંડ, ૧ ચમચો મિલ્ક પાવડર, ૩ કપ ભેંસનું દૂધ, ૨ ચમચી ઘી, ૧ ચમચા કાજુનો પાવડર.



સજાવટ - ફૂલ, કલરફૂલ વર્મિસલી

રીત - પેનમાં ઘી મૂકીને ચીકું સાંતળો, ૨ મિનિટ પછી દૂધ ઉમેરો, ૧૦ મિનિટ પછી સૂરણ, મિલ્ક પાવડર, ખાંડ કાજુનો પાવડર ઉમેરો, ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરો, ઠંડો કરો, શ્રી જીને ધરાવો.

પોષ્ટિક ચીકડી

સામગ્રી - મખખના ૫૦ ગ્રામ, ૫૦ ગ્રામ તલ, ઘી ૫૦ ગ્રામ. ૨૦ ગ્રામ દાળિયા, સુંઠ, કાજુ, બદામ, ૧૦-૧૦ પીસ, ૨૦૦ ગ્રામ

સાકર, ગુંદર ૫૦ ગ્રામ.

રીત - મખખના તેલ દાળિયા ગુંદર ચાસણી કાજુ, બદામ બધીજ વસ્તુને શેકીલો ત્યાર બાદ ચાસણી કરી લો. અલગી કરી લો. અને પહેલા ગુંદરને ધીમાં તળીને રાખો ચાસણીમાં નાખીને હલાવી દો ત્યાર બાદ વણીને તે હંડુ થાય ત્યારે ટબ્બામાં ભરી લો. ૧૫ થી ૨૦ દિવસ સુધી રહેશે.



મખણા લાડુ

સામગ્રી - મખણા ૧ વાટકો, ગોળ ૧/૨ વાટકો, ઈલાયચી પાવડર, ડ્રાયફ્રૂટ (કાજુ-બદામ-પિસ્તા) ઘી.

રીત - કઢાઈમાં મખણા શેકો ઠંડા થાય એટલે મિક્સરમાં પીસો. ચાળણીથી ચાળી લો. ડ્રાયફ્રૂટ મિક્સરમાં પીસી કઢાઈમાં ઘી નાખી, ગોળનો પાથો કરો મખણાના ભૂકામાં નાખો મિક્સ કરો. ઈલાયચી નાખો ડ્રાયફ્રૂટ પીસેલા નાખો બધુ મિક્સ કરો. પલાળેલો ઘી આમાં નાખો. લાડુ વળે એટલું ઘી નાખો મિક્સ કરો. લાડુ બનાવી લો. ઉપર ડ્રાયફ્રૂટથી ગાર્નીશ કરો. સાકર વાપરવાની હોય તો દળેલી સાકર નાખી શકાય.



Throw your Pool parties & Birthday parties
at

THE FLOAT HOUSE

Make your special occasion beautiful & memorable
with us!!

BOOK NOW!!

☎ 9324 666 209

📍 MULUND WEST

[Click Here](#)

દિવાળી નિમિત્તે અવનવી મીઠાશવાળી વાનગીઓની રેસીપી

બદામ ચીક્કી

સામગ્રી - ૧ કપ સાકર, ૧ કપ બદામ

રીત - ૧ કપ સાકર નાખી એને હલાવું પછી બદામ નાખી એને પાથરી નાખો રેડી છે. બદામ ચીક્કી.



બેસન નાળિયર બર્ફી

સામગ્રી - ૧૦૦ ગ્રામ બેસન, ૧૦૦ ગ્રામ નાળિયર પાવડર. ૨૨૫ ગ્રામ સાકર, ૩/૪ કપ દૂધ, ૧૨૫ ગ્રામ ઘી, કાજુ બદામના ટુકડા સજાવટ માટે, ૪ થી ૫ ઈલાયચી પાવડર



રીત - સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકો તેમાં બેસન શેકી લેવાનું. કલર હલકો થાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકવાનો અને તેને એક પ્લેટમાં રાખવાનું. એજ પેનમાં નાળિયરનો પાવડર શેકી લેવાનો સુગંધ આવે ત્યાં સુધી, એક પેનમાં દૂધ લેવાનું તેની અંદર સાકર નાખવાની સત હલાવાનું એક વાટકી પાણી લઈને ચાસણી નાખવાનું ચાસણી પાણીમા ઘટ્ટ થઈ જાય તો સમજવાનું કે ચાસણી થઈ ગઈ છે. તે જ પેનમાં શેકેલો લોટ, નાળિયર શેકેલું અને બદામ પિસ્તાની કતરણ, ઈલાયચી પાવડર નાખીને હલાવાનું. કડાઈ છોડશે. એટલે ગ્રીસ કરેલ થાળીમાં પાથરવાનું. ઉપરથી પિસ્તાની તેમજ બદામની કતરણ ચમચી વડે દબાવાની. ઠંડુ થયા બાદ તેના ટુકડા કરવાના. તૈયાર છે “બેસન નાળિયર બર્ફી.”

સુગર ફી હલવાસન

સામગ્રી - ૧૦૦ ગ્રામ તલ, ૧૦૦ ગ્રામ શીંગદાણા, ૧૦ નંગ કીસમીસ, ૨૦૦ ગ્રામ કાળી ખજૂર, અપટી એલચી (પીસેલી).

રીત - તલને મિક્સરમાં પીસી લેવા. શીંગદાણાને થોડીવાર ભીંજવી છોતરા કાઢીને પીસવા. ખજૂરને પણ ઝીણું પીસી લેવું. ત્યાર બાદ બધી વસ્તુ મિક્સ કરીને કણકની જેમ લાટીને ઈલાયચી તથા કિસમિસ ભેળવીને મનગમતો આકાર આપી દેવો ઉપર ડેકોરેશન માટે બદામ લગાવી.



અનોખી પાન ચોકો મટકી

સામગ્રી - નાગરવેલના પાન ૧૫ થી ૨૦ નંગ, મિલ્ક પાવડર ટેબલ સ્પૂન., ખડીસાકરનો ભૂકો ૩ ટેબલ સ્પૂન., શેકેલા ઓટ્સ, ૨ ટેબલ સ્પૂન, સૂકા ટોપરાનું ખમણ, ૨ ટેબલ સ્પૂન, ડાર્ક ચોકલેટ સ્લેબ ૫૦ ગ્રામ. ચોકો ચિપ્સ અને બદામના ટુકડા ૧ ટે.સ્પૂન.



રીત - સૌ પ્રથમ પાન ધોઈને કોરા કરી દાંડી કાપી ટૂકડા કરવા. મિક્સરમાં પાનના ટૂકડા, સાકર, મિલ્ક પાવડર, ખમણ બધું, શેકેલા ઓટ્સ કશ કરવું તેમાંથી મટકીનો શેપ આપી અંદર બદામ અને ચોકો ચિપ્સનું સ્ટર્ફીંગ કરવું ડાર્ક ચોકલેટને પીગળાવી મોલ્ડમાં નાખી ઢાકણા બનાવી પાન મટકાની ઉપર અને નીચે લગાડી શેપ આપી

ઉપરથી કલરફૂલ ચોકલેટથી ડેકોરેશન કરવું “લો તૈયાર છે ઝટપટ બની જાય, જમ્યા પછી આપવા માટે માઉથ રીફ્રેશીંગ પાન મટકી”.

બીટ રોઝ ડ્રેગન હલવો

સામગ્રી - ડ્રેગન ફૂટ ૧ નંગ, બીટ - ૧ નંગ, ઘી ૧ ચમચી, માવો ૨ ચમચી, કોર્નફ્લોર - ૧/૪ કપ, દળેલી ખાંડ - ૧/૪ કપ, દૂધ - ૧/૪ કપ, કોકોનેટ મિલ્ક - ૧/૪ કપ, રોઝઈમ્બલસન - ૧/૨ ટેબલ સ્પૂન, ગુલાબની પાંદડી - સજાવવા માટે અને અંદર નાખવા માટે કોપરાનું છીણ ડેકોરેશન માટે



રીત - ડ્રેગન ફૂટને મિક્સરમા કશ કરવું. એક નોનસ્ટીક પેનમાં ૧/૪ કપ દળેલી ખાંડ, ૧/૨ કપ, કોર્નફ્લોર, ૧/૨ કપ, કોકનટ મિલ્ક, દૂધ ૧/૪ કપ નાખી હલાવી બરાબર મિક્સ કરવું પછી ગેસ ચાલું કરી તેને સતત હલાવતા રહેવું પછી તેમાં ડ્રેગન ફૂટના પલ્પ નાખવો અને રોઝ રેડ ઈમ્બલસન અને ગુલાબની પાંદડી નાખવી.

બીજા પેનમાં ઘી ગરમ કરવું પછી તેમાં ખમણેલું બીટ નાખવું. તેને ૧ થી ૨ મિનિટ સાંતળી તેમાં દળેલી ખાંડ નાખો અને જરા ઘટ્ટ થવા દેવું. પછી બીટના મિશ્રણને ડ્રેગન ફૂટ વાળા મિશ્રણમાં મિક્સ કરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું. ઘટ્ટ થાય પછી તેને પ્લાસ્ટીકના કન્ટેનરમાં કાઢી તેને ફીજમાં સેટ કરવા મૂકવું. ૨ કલાક પછી કાઢી તેના પર ગુલાબની પાંદડી લગાવી અને સૂકા કોપરાના ખમણમાં રગદોળીને સર્વ કરવું.

Dry Paper Dosa Khakhra

- Schezwan Dosa
 - Maggi Dosa
 - Pav-Bhaji Dosa
 - Tomato Chilly Dosa
 - Cream n Onion
 - Jain Chatpata Dosa
 - Butter Sada Dosa
 - Peri Peri Jin Dosa
 - Cheese Dosa
- and Many more Variety Available

JAMNAGRI FARSAN
Vardhman Nagar, Mulund (W)
Bhavin-7208379811



Specially for Khakhra



Jain
Khakhra
Available

Business Enquiry
will be solicited

www.kinjalfood.com

MITA SPA AND SALON Presents

DIWALI SPECIAL OFFER

RS.499/-

BLEACH
CLEANUP
FULL HAND WAX
U.ARMS

RS.599/-

EYEBROW
UPPER LIPS
U. ARMS WAX
HAND WAX
HAIR CUT

RS.1000/-

THREADING
UPPER LIPS
FORHEAD
D-TAIN
GLOW FACIAL
WAX
(FH+HL+UA)

RS.1200/-

THREADING
U.LIPS
FORHEAD + SHINER
GOLD FACIAL
WAX
(FH+UA+HL)
FULL BACK
POLISHING



Venue: 2, Ground Floor, Shriniwas Building,
RHB Road, opp. Nalanda Building, Mulund West.

Contact Us On: 098199 53534

[Click Here](#)

દિવાળી નિમિત્તે અવનવી મીઠાશવાળી વાનગીઓની રેસીપી

ઓરેંજ પનીયારન

સામગ્રી :- ૬ નંગ ઓરેંજનો જ્યુસ, ૧ લીટર દૂધ, ૧ મોટી ચમચી આરાલોટ, ૧ વાટકી સાકર, બદામ, કાજુ અને પીસ્તાની કતરણ.

ડેકોરેશન માટે :- ૧ નંગ ઓરેંજ, સફેદ સીલ્વર બોલ, કાજુ-બદામ

રીત:- ઓરેંજ જ્યુસ તૈયાર કરવો.

દૂધની અંદર સાકર નાખીને ઉકળવા દેવું પછી ૧ વાટકીમાં આરાલોટ દૂધમાં ઓગાળી થોડું થોડું નાંખતાં જવું અને દૂધને સતત હલાવતા રહેવું. દૂધ ઘટ્ટ થવા માટે ત્યારે છેલ્લે ઓરેંજ જ્યુસ નાંખી દેવું. પાણીનો ભાગ એકદમ બાળી નાંખવો અને બરાબર મીક્સ કરી દેવું ગેસ બંધ કરવો. થોડું હુંફાળું ગરમ રહે ત્યારે હાથમાં ઘી લગાડીને પેંડા જેવો શેપ આપી પીસ્તા કતરણ, બદામ-કાજુથી ડેકોરેશન કરી સ્ટીકમાં ૧ની ઉપર ૧ ભરીને પનીયારન તૈયાર કરવાં.



ખજૂર-પનીરના સ્વીટ પાત્રા

સામગ્રી - ૧૦૦ ગ્રામ પનીર, ૨૫૦ ગ્રામ ખજૂર, મીક્સ ડ્રાયફ્રૂટ-કાજુ-બદામ-પીસ્તાનો ભૂકો. ૨ ચમચા, પીસેલી સાકર, ૨ ટે. સ્પૂન, ઘી, ૧ ટે.સ્પૂન, રોઝ એસેન્સ ૨ થી ૩ ટીપાં. **ડેકોરેશન માટે :-** ચેરી.

રીત:- ખજૂરનાં બી કાઢી તેના બારીક ટુકડા કરો. પેનમાં ૧ ટે.સ્પૂન. ઘી લઈ તેમાં ખજૂર સાંતળો.

ગોળો થાય પછી તેને ગેસ ઉપરથી નીચે ઉતારી લો. બીજા બાઉલમાં



પનીર છીણી લો તેમાં પીસેલી સાકર, રોઝ એસેન્સ નાખી મીક્સ કરી લો.

ખજૂરના પૂરણને પાટલા ઉપર પ્લારસ્ટીક મૂકીને તેનો રોલ વાળો અને તેને ફીજમાં થોડીવાર રાખો. રોલ કડક થઈ જાય પછી તેના ગોળ પીસ કરો. તૈયાર છે ખજૂર-પનીરના સ્વીટ પાત્રા. દરેક પાત્રાની સ્લાઈસ ઉપર અર્ધી ચેરી મૂકીને સજાવટ કરો.

મખખાના બદામ કાજુ પૂરી

સામગ્રી - બદામ ૨૦ થી ૨૫ નંગ, કાજુ ટુકડા ૧૫ નંગ, શેકેલા મખખાના ૨૦ થી ૨૫ નંગ, પીસેલી ખડી સાકર ૨ ટે.સ્પૂન., ચોકો ચિપ્સ ૧૦ થી ૧૫ નંગ, એલચીનો ભૂકો પા ટી.સ્પૂન., દૂધમાં ઘોળવું કેસર ૨ ટી. સ્પૂન અથવા જરૂર મુજબ.

રીત - બદામ કાજુ મખખાનાનો મિક્સરમાં ઝીણો ભૂકો કરવો. તેમાં પીસેલી ખડી સાકર. ચોકો ચિપ્સ અને કેસર વાળા દૂધથી લોટ બાંધવો. પછી તેના ગોળાવાળી પૂરી બનાવી ઉપર નીચે બટર પેપર લગાડી નોનસ્ટીક તવા ઉપર ગુલાબી રંગની શેકવી. ઠંડી થઈ ગયા બાદ બટર પેપર કાઢી પીરસવું.

ખજૂર રોલ

સામગ્રી - ૨૦૦ ગ્રામ ખજૂર, ૧૦૦ ગ્રામ ખોપરાનું ખમણ, એક વાટકી સાકર, એક કપ દૂધ, ઈલાયચી પાઉડર, ડ્રાયફ્રૂટ, જરૂરીયાત અનુસાર ઘી

રીત - સૌ પ્રથમ ખજૂરના ઠંડીયા કાઢી ઝીણા સમારવા એર કડાઈમાં ૧ ચમચી ઘી નાખી ખજૂરની કટકી નાખી ગરમ કરવું નરમ ના પડે



ત્યાં સુધી. બાદ એક થાળીમાં ઘી લગાડી પૂરણ પાથરવું. બીજી કડાઈમાં એક વાટકી દૂધમાં એક વાટકી સાકર નાખી ઉકાળવું. દૂધ અરધુ થાય ત્યાં સુધી ઉકાળી તેમાં કોપરાનું ખમણ નાખવું. બાદ ચોકલેટના ૨ પીસ નાખવા.

મિશ્રણ ઠાલવી ખજૂરના પાથરેલા પૂરણમાં આ પૂરણ ભરી રોલ વાળવાં. રોલ વાળી ડ્રાયફ્રૂટના ભુક્કા પર રોલ ફેરવવો જેથી ડ્રાયફ્રૂટ ચોટી જાય રોલને થોડુંદુંડું થયા બાદ રોલના જરૂરીયાત મુજબ કટીંગ કરવા ને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવાં.

રવા ચમચમ

સામગ્રી - ૧ કપ બારીક રવો, ૧ ૧/૨ કપ દૂધ, ૨ ચમચી ઘી, ૩/૪ કપ ખાંડ દળેલી, ૧/૨ કપ સૂકા નાળિયેરનું છીણા + કાજુ પાવડર.

સજાવટ - કલરવાળી વર્મીસલી.

રીત - કડાઈમાં ૨ મિનિટ રવો શેકી લો. ગેસ બંધ કરો. થોડો રવો ઠંડો કરો, તેમા દૂધ ઉમેરીને ઘટ્ટ થાય સુધી હલાવો. ચમચાથી મિશ્રણને મસળો, ૨-૩ મિનિટ ઢાંકીને ચડવા દો. મિશ્રણ થોડું ઠંડું કરો, હાથ પર ઘી લગાવીને મસળો, પછી નરમ મિશ્રણ થશે, સફેદ ગુલાબ એસેન્સના ૨ ટીપાં ઉમેરો, દળેલી ખાંડ ઉમેરો, મિક્સ કરો હવે તેમાં નારિયેળનું છીણા અને કાજુ પાવડર, એલચી પાવડર, ઉમેરો, મિક્સ કરો હાથ પર ઘી લગાવીને ૨ મિનિટ વરાળમાં બાફી લેવા, ચમચમને ઠંડા કરો, સૂકા નાળિયેરના છીણામાં રંગદોળો, શ્રીજીને ઘરાવો.



“જૈન માટે દીપોત્સવી સાધના, આરાધના અને ઉત્સવનો પર્વ”

દિવાળી શબ્દનો ઉદ્ભવ સંસ્કૃત શબ્દ દીપાવલી માં થયો છે જેનો અર્થ થાય છે પ્રકાશની પંક્તિ. દીપનો અર્થ પ્રકાશ અને અવલી નો અર્થ પંક્તિમાં થાય છે. દિવાળીનું અવલોકન કરતા ઘણા સમુદાયોમાં, તહેવારને પ્રકાશના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે.વાળી, એક અરેબર રાષ્ટ્રીય તહેવાર, ધાર્મિક સીમાઓને પાર કરે છે અને વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક જૂથો દ્વારા ઉજવવામાં આવે છે. જે કે, જ્યારે પ્રકાશના તહેવાર ના તહેવારો સમાન દેખાઈ શકે છે, આ જૂથોમાં, દરેક સમુદાય દિવાળીને તેના પોતાના અનન્ય આધ્યાત્મિક મહત્વ સાથે રંગિત કરે છે.

આમ દિવાળી પાંચ ઉત્સવોનું મધુર મિલન છે. પણ જૈનો માટે એ ઉત્તમ પર્વ છે.

શ્રી મહાવીર સ્વામી નિર્વાણનો મહોત્સવ એટલે દીપાવલી અને ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન એટલે નૂતન વર્ષ.

જૈન પરંપરામાં તીર્થંકરના જીવનના પાંચ મહત્વના પ્રસંગો કલ્યાણક દિવસ તરીકે ખૂબ ભક્તિભાવપૂર્વક ઊજવાય છે. આ પાંચ પ્રસંગો છે- ચવન (માતાના ગર્ભમાં જીવનો પ્રવેશ), જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ. ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ દિવસ આસો વદ અમાસને જૈન સમુદાય દીપકોની હારમાળા પ્રગટાવીને નિર્વાણ મહોત્સવ તરીકે ખૂબ આસ્થાથી ઊજવે છે. આ દિવસે તેમનો ઉત્સાહ અનેરો હોય છે. આ દિવસે દેરાસરોમાં મહાવીર સ્વામીની મૂર્તિને ભવ્યાત્મિક આંગી કરવામાં આવે છે અને ભાવિકજનો ખૂબ ભક્તિભાવપૂર્વક



સંગિની સૌરભ સંકલન - હિના પારેખ મો.૯૯૬૭૪૫૯૫૧૫
- બીના કીર્તિ શાહ



તેમની આરાધના કરે છે.

આજથી લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં શ્રી વીરે બિહારની પાવાપુરી નગરીમાં આસો વદ અમાસની રાત્રિના છેલ્લા પહોરે શેષ ચારઅઘાતી કર્મોનો વિનાશ કર્યા પછી, કાયાનો અત્યંત વિયોગ કરીને પોતાના પૌદ્ગલિક દેહનો ત્યાગ કર્યો અને શાશ્વત મુક્તિસમું નિર્વાણ પ્રાપ્ત કર્યું. એ સમયથી ભારત અને વિદેશમાં વસતા તમામ જૈનો આ દિવસને દીપકોની હારમાળા પ્રગટાવીને દીપોત્સવી પર્વ તરીકે ઉત્સાહથી ઊજવે છે. સમગ્ર વિશ્વના તમામ જીવો પ્રત્યે અપાર કષ્ટણા ધરાવતા, તપ-ત્યાગ-અહિંસા-અપરિગ્રહ અને અનેકાન્તવાદના પ્રણેતાની વિદાયથી શ્રુતજ્ઞાનનો પ્રજ્જ્વલિત દીપક બૂઝાઈ ગયો. તેની કર્મી પૂરવા માટે ત્યાં ઉપસ્થિત અસંખ્ય ઉપાસકોએ ધીના અગણિત દીપક પ્રગટાવીને અમાસની અંધકાર ઘેરી રાત્રિને પ્રકાશથી ઝળહળતી કરી. સેંકડો વર્ષોથી દીપાવલીના પાવન અવસરે આ નિર્વાણ સ્થળ આસપાસ નિર્વાણ મહોત્સવનો મેળો ભરાય છે. ભાવિક યાત્રીગણ પ્રભુના ગુણગાન ગાતાં ગાતાં રાત્રિ પસાર કરે છે અને પ્રભુના નિર્વાણ સમય મળસકે પ્રભુને નિર્વાણ લાડુ અર્પણ કરીને જીવનની કૃતકૃત્યતા અનુભવે છે.

જૈન સમુદાય માટે દીપોત્સવી પછીનો નૂતન વર્ષનો દિવસ ખૂબ મહત્વ ધરાવે છે. શ્રી વીરના પ્રથમ અને પરમ શિષ્ય ગૌતમ સ્વામીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યાનો આ મંગળ દિવસ હોઈ, ભાવિકજનો આ દિવસને ખૂબ ભક્તિભાવ અને ઉત્સાહથી ઊજવે છે. મહાવીરસ્વામીના પ્રિય શિષ્ય ગૌતમ ગણધરને તેમના ગુરુ પ્રત્યે અત્યંત રાગયુક્ત મોહ હોવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થવામાં વિલંબ સર્જાતો હતો. આથી શ્રી વીર પ્રભુએ પોતાના પૌદ્ગલિક દેહનો ત્યાર કરતાં પહેલાં શિષ્યના કલ્યાણને નજર સમક્ષ રાખીને પોતાના પ્રત્યેનું રાગબંધન તોડાવવા માટે ગૌતમ સ્વામીને દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ આપવા માટે દૂર મોકલી આપેલ. ગૌતમ ગણધર બોધ આપીને પરત આવે તે પહેલાં વીર પ્રભુના નિર્વાણના સમાચારથી આઘાત અનુભવીને ગૌતમ ગણધર તત્વનો વિચાર કરતાં કરતાં કેવળજ્ઞાનને વર્ચા. આમ દીપોત્સવી અને નૂતન વર્ષ એમ બંને દિવસ પ્રત્યેક જૈન માટે સાધના, આરાધના અને ઉત્સવનો દિવસ બની રહે છે.

અજ્ઞાનતાના અંધકારને દૂર કરીને ફરી પાછા શુદ્ધતા અને નવા જ્ઞાન સાથે આવનાર ભવિષ્યની જીવન માટે સુસજ્જ બનવું. જીવનમાં જે પણ મળ્યું હોય તે બદલ શ્રી તીર્થંકર ભગવંતોનો આભાર માની નવા દિવ્ય ભાવિ માટે શ્રી તીર્થંકર ભગવંતોને પ્રાર્થના કરવી. અને તે માટે શ્રીગણેશ, મા લક્ષ્મી, મા સરસ્વતીની ઉપાસના કરવી. અંતરને ઉજાગર બનાવવું. જીવનની દરેક પ્રકારની કડવાશ દૂર કરીને આવનાર જીવનને મીઠાશથી ભરી દેવું

[Click Here](#)

દિવાળી નિમિત્તે અવનવી મીઠાશવાળી વાનગીઓની રેસીપી

કોકોનટ રસમલાઈ

સામગ્રી - ગાયનું દૂધ પનીર માટે ૧ લી., લીંબુના ફૂલ-ચાસણી માટે - ખાંડ અને ૫ કપ પાણી નાખી ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી દેવો



બાકીની સામગ્રી રબડી માટે - દૂધ ગાયનું ૧ લી. સૂકા કોપરાનું છીણ, ૨ ટે.સ્પૂન, લીલા કોપરાનું છીણ ૨ ટે.સ્પૂન, નાળિયેર પાણીની મલાઈ ૧ટે.સ્પૂન, ખાંડ ૫ ટેબલ સ્પૂન.

રીત - પ્રથમ રસમલાઈ માટે ગાયના દૂધમાં ૧ ચમચી લીંબુના ફૂલમાં ૬ ચમચી પાણી નાખી તેને ઓગાળી પછી દૂધ ઉકળે એટલે તેમાં એક એક ચમચી લીંબુના ફૂલનું પાણી નાખતા જવું. દૂધ ફાટે એટલે તેને ચાળણીમાં કાઢી પછી તેને ઠંડા પાણીથી ઘોઈ લેવું અને બધુ પાણી નીતારી પછી તેને મસળી લેવું. સુકૂ કોપરું અને લીલાન નાળિયેરને ખમણી તેને થોડું શેકી તેમાં ૧ ચમચી જેડલી મલાઈ નાખી પનીર માંથી લાંબા ગોળા વાળી પછી તેમાં કોપરાનું સ્ટર્ફીંગ ભરવું.

ખાંડની ચાસણી જે ઉકાળી હતી. તે જરા ઉકળે એટલે તેમાં સ્ટર્ફીંગ કરેલું પનીર નાખી ઢાંકણ ૧૦ મિનિટ ઉકાળવું. પછી તેને ખોલી તેમાં ૫ થી ૬ બરફના ટુકડા નાંખવા અને તેને ઠંડુ થવા દેવું.

રબડી : રબડી માટે દૂધને ગરમ કરવા મૂકવું અડધું થાય એટલે તેમાં ૫ ચમચી ખાંડ, સૂકા કોપરાનું ખમણ, લીલા કોપરાનું ખમણ અને નાળિયેર પાણીની મલાઈને કસ કરીને તેમાં નાખી જરા ઘટ્ટ થવા દેવું. પછી તેમાં જે રસમલાઈ બનાવી હતી તેને ખાંડના પાણી માંથી કાઢી તે માંથી પાણી કાઢી તેને રબડીમાં નાખવી. પછી તેને

ફીજમાં ૪ થી ૫ કલાક ઠંડી કરી ઉપર કોપરું બદામ પીસ્તાનો ભૂકો નાખી સર્વ કરવું.

મગજના લાડુ

સામગ્રી - ૧ કપ ચણાનો કરકરોલોટ, ૧ કપ ઘી (જરૂરીયાત મુજબ), ૧ ૨/૧ કપ સાકર

રીત - સર્વ પ્રથમ લોટને ઘી-દૂધનો ઘાબો દઈને ચાળીને પછી શેકવો. સર્વ પ્રથમ એક કડાઈમાં ઘી મૂકી તેમાં ઘી ગરમ થાય પછી તેમાં ચણાનો લોટ નાખી. ૧૦ થી ૧૨ મિનિટ ઘીમાં ગેસ પર બદામી કલર થાય ત્યાંસુધી શેકવાનો, પછી એક થાળી કે ત્રાસમાં ઠંડો પડે ત્યાં સુધી રાખવાનો પછી તેમાં સાકરને પીસીને મિક્સ કરવાના અને નાના મિડીયમ કદના લાડું બનાવવા અને એક બાઉલમાં સર્વ કરવા. ઉપર ડેકોરેટ માટે કાજુ ચાતો ફૂલની પાંદડી આપણી અનુકુળતા મુજબ ડેકોરેટ કરવી.

પાન પેંડા બહાર

સામગ્રી - ૧ કપ મોળો માવો, ૧/૨ કપ દળેલી ખાંડ, ૨ ચમચી સમારેલા નાગરવેલના પાન, ૨ ચમચી ગુલકંદ અને પૂના પાન મસાલો, ૧/૨ ચમચી ખસખસ, ૪ ચમચી કાજૂનો ભૂકો, ૨ ચમચી મિલ્ક પાવડર, ૩ ચમચી, સૂકા નાળિયેરનું છીણ, ૨ ટીપાં પાર્થનેપલ એસેન્સ.



સજાવટ - કલરફૂલ વરિયાળી, નાગરવેલના પાન.

રીત - મોળા માવાને ખમણીને ગેસ પર ૨ મિનિટ શેકી લો. તેને ઠંડો કરો, તેમાં દળેલી ખાંડ, સમારેલા નાગરવેલના પાન, કાજૂનો

પાવડર, સૂકા નાળિયેરનું છીણ, મિલ્ક પાવડર, પાર્થનેપલ એસેન્સ મિક્સ કરો, મનગમતો શેપ આપો. માઠાઈને દરેક મીઠાઈને વચ્ચે ગુલકંદ અને પાનનો મસાલો ભરો, ખસખસ. સૂકા નાળિયેરનું છીણ છાંટો, શ્રીજીને ધરાવો.

કાંટરાના લાડુ

સામગ્રી - ૧ કપ જાડો ઘઉંનો લોટ, ૧ કપ ઘી, એક કપ ગોળ, ૧ ચમચી દૂધ, ૨ ચમચી કાંટરો.

રીત - પહેલા ઘી નાખવું પછી જાડો ઘઉંનો લોટ નાખવું અને શેકવું. ઠંડુ પડે ત્યારે ગોળ નાખવું અને પછી કાંટરો, ગુંદર નાખવું. લોટ શેકાઈ જાય દસમિનિટ સુધી શેકવું અને ગોળ નાખ્યા પછી થાળીમાં પાથરી ઠંડું થવા દેવું.



ગોળ પાપડી

સામગ્રી - ઘી, ઘઉંનો લોટ, ગોળ, ગુંદર.

રીત - ઘી ગરમ કરીને ઘઉંનો લોટ નાખવો પછી લોટને શેકી નાખવાનો શેકાય પછી ગોળ નાખવાનો. ગોળનાખીને મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવાનો. પછી નીચે ઉતારીને થાળીમાં પાથરી દેવાનો ઉપર બદામ અથવા ગુંદર તળીને ગાનીસ કરવો.



કોન્ટેક્ટ લેન્સ સેફ્ટી મહિનો : આપની અમૂલ્ય દષ્ટિનું રક્ષણ કરો

ઓક્ટોબર એ કોન્ટેક્ટ લેન્સ સુરક્ષા મહિના તરીકે મનાવવામાં આવે છે, એટલે કે જવાબદારીપૂર્વક કોન્ટેક્ટ લેન્સ પહેરવાના મહત્વની યાદ અપાવવાનો યોગ્ય સમય. જોકે કોન્ટેક્ટ લેન્સ જેવી નાનકડી, દ્રષ્ટિ વધારતી અજાયબી અદ્ભુત રીતે અનુકૂળ હોય છે, છતાં તેના દ્વારા ઉદભવી શકે તેવા સંભવિત જોખમોથી વાકેફ રહેવું અને તમારી આંખના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે સલામત પદ્ધતિઓ અપનાવવી ખૂબ જરૂરી છે.

કોન્ટેક્ટ લેન્સ શું છે?

કોન્ટેક્ટ લેન્સ, અથવા જેને ફક્ત કોન્ટેક્ટ્સ કહેવામાં આવે છે એપાતળા લેન્સ છે જે સીધા આંખોની સપાટી પર મૂકવામાં આવે છે. કોન્ટેક્ટ લેન્સ એ ઓક્યુલર પ્રોસ્થેટિક ડિવાઇસ છે જેનો ઉપયોગ વિશ્વભરમાં ૧૫૦ મિલિયનથી વધુ લોકો દ્વારા કરવામાં આવે છે, અને તેઓ દ્રષ્ટિ સુધારવા, સૌન્દર્યાત્મક(કોસ્મેટિક), અથવા ઉપચારાત્મક કારણોસર પહેરી શકાય છે.

કોન્ટેક્ટ લેન્સનો સલામતીપૂર્વક ઉપયોગ કરવાની રીત

આપનોકોન્ટેક્ટ લેન્સ પહેરવાનો અનુભવ સુરક્ષિત અને આરામદાયક રહે તે સુનિશ્ચિત કરવા માટે નીચેના સૂચનો અપનાવવા જરૂરી છે:

૧. હાથની સ્વચ્છતા : તમારા લેન્સને પહેરતાં પહેલા હંમેશા તમારા હાથને સાબુ અને પાણીથી સ્વચ્છ ઘોઈ લો. ખૂબ ઝીણા ફાઈબર (લિન્ટ) અથવા અન્ય કચરો લેન્સમાં ચોંટતો અટકાવવા માટે લેન્સને લિન્ટ-ફ્રી ટુવાલ વડે સૂકવો.

૨. લેન્સ પહેરીને સૂવાનું ટાળો : તમારા કોન્ટેક્ટ પહેરીને



સૂવાનું ટાળો સિવાય કે લાંબા સમય માટે પહેરવાનું સૂચવવામાં આવ્યું હોય. તમારી આંખોને શ્વાસ લેવા અને ફેશ (રીજુવીનેટ) કરવા માટે સમયની જરૂર છે.

૩. યોગ્ય સફાઈ અને સંગ્રહ : તમારા લેન્સને સાફ કરવા અને સંગ્રહ કરવા માટે તમારા ઓપ્ટોમેટ્રિસ્ટની સૂચનાઓનું પાલન કરો. તેમના દ્વારા ભલામણ કરેલ સોલ્યુશનનો જ ઉપયોગ કરો અને ક્યારેય લાળ અથવા નળના પાણીનો ઉપયોગ કરશો નહીં.

૪. નિયમિત તપાસ : નિયમિત આંખની અને કોન્ટેક્ટ લેન્સ ફીટીંગની તપાસણી કરાવો. તમારા આંખનાનિષ્ણાત ડોક્ટર કોઈપણ સમસ્યાને વહેલી તકે ઓળખી શકે છે.

૫. ડોક્ટરની સલાહ મુજબ લેન્સ બદલો : તમારા લેન્સનું આયુષ્ય તેમના ભલામણ કરેલ રિપ્લેસમેન્ટ શેડ્યૂલથી આગળ વધારશો નહીં. ઘસાઈ ગયેલા લેન્સ ગંભીર જોખમો પેદા કરી શકે છે.



૬. તમારા લેન્સ કોઈ સાથે શેર કરશો નહીં : કોન્ટેક્ટ લેન્સ શેર કરવા એ આંખના સ્વાસ્થ્ય માટે અતિશય જોખમી છે માટે ક્યારે પણ તમારા લેન્સ કોઈ સાથે ક્યારે પણ શેર કરશો નહીં. યોગ્ય રીતે સાફ કરેલા લેન્સ પણ એક વ્યક્તિની આંખમાંથી બીજી વ્યક્તિની આંખમાં બેક્ટેરિયા લઈ જઈ શકે છે.

૭. સ્વિમિંગ અથવા શાવર કરતાં પહેલાં લેન્સ કાઢી નાખો : તમારા લેન્સ પાણીજન્ય રોગના જંતુઓના સંપર્કમાં ન આવે તે માટે સ્વિમિંગ અથવા શાવર કરતાં પહેલાં તેમને કાઢી નાખો.

[Click Here](#)

દિવાળી નિમિત્તે અવનવી મીઠાશવાળી વાનગીઓની રેસીપી

અંજીર બરફી

સામગ્રી - અંજીર, ૧ ચમચી ઘી, કાજુ બદામ.

રીત - અંજીરને પલાળીને મૂકી દો. ત્યાર બાદ તેને મિક્સરમાં પીસીને ઘીમાં શેકીલો અને કાજુ બદામ નાખીને હલાવી દો.



મહુડીની સુખડી

બહુ જ જલ્દી બને અને હોવી પણ ખરી જ

સામગ્રી :- ૧ વાટકો પિગાળેલું ઘી, ગાયનું ઘી જ લેવું, ૧ વાટકો ઝીણો સુધારેલો ગોળ, ૨ વાટકા ઘઉંનો લોટ, ડેકોરેશન (ઓપ્શનલ), ખસખસ, ઝીણા સુધારેલા કાજુ, બદામ, પિસ્તા.



રીત :- સૌ પ્રથમ સ્લો ગેસ પર કડાઈ મૂકો. તેમાં ૧ વાટકો પિગાળેલું ઘી ઉમેરો. ૧ વાટકો સુધારેલો ગોળ ઉમેરો. તવેથાથી હલાવતા રહો. ૨-૩ મિનિટમાં ગોળ પિગળી જશે. ઉપર આવી જશે. એટલે તેમાં ૨ વાટકા ઘઉંનો લોટ એક કરો. યાદ રાખો બધી જ પ્રોસેસ એકદમ ધીમા ગેસ પર કરવાની છે. ૧-૨ મિનિટમાં જ લોટ ગોળ અને ઘી સરસ મિક્સ થઈ જશે. એટલે ઘી વાળી હાથથી ગ્રીસ કરેલી થાળીમાં બધું ઊથલાવી એક વાટકીની પાછળ તળિયામાં ઘી લગાવી ઉપરતી સમતલ કરી લો. ખસખસ, ઝીણા કાપેલા કાજુ-બદામ-પિસ્તાથી ડેકોરેટ કરો. ૫ મિનિટ ઠંડુ થવા દઈ કાપા પાડી લો. પછી થાળીમાં જ રહેવા દો. એકદમ ઠંડુ થાય પછી એરટાઈટ

ડબામાં ભરી લો. શિયાળાની ઠંડીમાં થોડો સૂંઠ પાઉડર પણ લોટ સાથે નાખી શકાય છે.

મીની રસગુલા

સામગ્રી :- ૧/૨ લીટર ગાયનું દૂધ, ૧ લીંબુનો રસ (૨ ચમચા પાણી), ૧ કપ ખાંડ, ૩ કપ પાણી.

રીત :- ગાયનું દૂધ એક

ઊભરો આવે પછી ગેસ બંધ કરો, અડધો કપ પાણી નાખો, પછી થોડું થોડું લીંબુનું પાણી નાખો, ચમચાથી ફેરવો, થોડી વાર પછી દૂધ ફાટી જશે, તેમાં અડધો કપ પાણી નાખો. કપડામાં પનીરને ૧ કલાક લટકાવો. હવે પ્લેટમાં પનીર અને ૧ ચમચી ખાંડ ૫ મિનિટ મસળો, ગોળા વાળો. મોટા તપેલામાં ખાંડ અને પાણી ઉકાળો, ૭ મિનિટ પછી પનીરના ગોળા તેમાં નાખો, ફાસ્ટ ગેસ પર ૧૨ મિનિટ ઉકાળો (ઢાંકીને), ગેસ બંધ કરો, અડધો ગ્લાસ (નાનો) ઠંડુ પાણી નાખો, ૨ કલાક પછી શ્રીજીને રસગુલા ધરાવો, ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ થાય છે.



લીલી હળદરનો શીરો

સામગ્રી :- ૨ ચમચા હળદરનું છીણ (છાલ કાઢો, ખમણી લો), ૩ કપ મલાઈવાળું દૂધ, ૨ ચમચી શેકેલા તલ, દોઢ ચમચો ખાંડ, ૨ ચમચી ઘી.

રીત :- કડાઈમાં ઘી લો, તેમાં હળદરનું છીણ ૨ મિનિટ સાંતળો, પછી દૂધ ઉમેરો, ઉકાળો, ૧૦



મિનિટ પછી ખાંડ ઉમેરો, મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો, શીરો ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરો, તલ છાંટો, ઠંડું કરો, શ્રીજીને ધરાવો. ખૂબજ પૌષ્ટિક છે, રંગ પણ કુદરતી આવશે શીરામાં.

રોઝ મિલ્કી ફજ

સામગ્રી :- ૧૦૦ ગ્રામ વાઈટ ચોકલેટ, ૫૦ ગ્રામ કન્ડેન્સ મિલ્ક, રોઝ એસેસ, ગુલાબની પાંદડી, ટ્રૂટીફૂટી

રીત :- ચોકલેટના નાના

તુકડા કરીલેવા તેને ડબલ બોઈલર મેથડની મેલ્ટ કરવી, નહિ તો માયક્રોમાં ૩૦ સેકન્ડ માટે મેલ્ટ કરવું. પછી તેમાં કન્ડેન્સ મિલ્ક નાખવું, એસેસ નાખવું, બરાબર મિક્સ કરવું. ચોરસ ટ્રેમાં ઘી લગાવી ગ્રીસ કરવું તેના પર ગુલાબની પાંદડી નાખવી, ટ્રૂટીફૂટી નાખવી. ઉપર પિગાળેલી ચોકલેટ નાખવી. અડધો કલાક સેટ કરવું. પછી મોલ્ડ ઉલટું કરી. ફજ કાઢવું તેના નાના પીસ કરવા. બહુ જ સરસ મિઠાઈ બને છે.



સકરપારા

સામગ્રી :- ૫૦૦ ગ્રામ મેંદા, ૨૫૦ ગ્રામ દળેલી સાકર, ૧૨૫ ગ્રામ ગરમ ઘી, ૭૫ મિ.લી. દૂધ, તળવા માટે ઘી.

બનાવવાની રીત :- ગભ્યા સકરપારા મેંદાને ચાળીને તેમાં ગરમ ઘીનું મોણ નાખવું પછી દૂધ અને સાકર બરાબર મિક્સ કરીને મેંદાના લોટમાં નાખવું અને કડક લોટ બાંધીને મોટો જાડા ખાખરો વણીને છરી અથવા કટરની મદદથી કટ કરીને ઘીમાં તળી લેવા.



દિવાળીના લક્ષ્મી પૂજનનો વિવાદ હવે સૌ સમાપ્ત કરે : ડૉ.ગૌતમ શાસ્ત્રી-જોશીનો સ્પષ્ટ સંદેશ

લગભગ દર વર્ષે તહેવારોની તારીખ મુદ્દતના સમય બાબતે કંઈને કંઈ રીતે જાણકારોમાં મતમંતાતર પ્રવૃત્તતા રહે છે. તેમાં સોશિયલ મિડિયા દ્વારા લોકો મેસેજ ફોર્વર્ડ કરી ભ્રમજાળ અને શંકાકુશંકા વહેમનો પ્રસાર કરતાં રહે છે. આ વર્ષે રક્ષાબંધન બાબતે આવો ટ્રેન્ડ રહ્યો હતો. તે જ તર્જ ઉપર દીપાવલિ ઉત્સવના દિવસો બાબતે વિવિધ તર્ક અને આધાર સાથે કચ્છ-ગુજરાત-ઉત્તર ભારતથી લઈને મુંબઈના વિદ્વાનજનો પોતાનો મત જણાવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં પોતાના નામ સાથે ફોર્વર્ડ કરી રહ્યાં છે.



દિવાળી તા.૩૧ ઓક્ટોબર ગુરુવાર કે શુક્રવાર તા.૧ નવેમ્બર એના કન્ફ્યુઝન વચ્ચે કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ, કાશી વિદ્વત પરિષદ અને ઉત્તર ભારતના પંચાંગ નિષ્ણાતો એ દિવાળી ક્યારે મનાવવી એની સ્પષ્ટતા કરી છે. અમાસનો પ્રારંભ ગુરુવાર તા.૩૧ ઓક્ટોબર બપોરે ૩.૫૨ વાચ્યાથી શરૂ થઈ બીજા દિવસે શુક્રવાર તા.૧ નવેમ્બર સાંજના ૫.૧૩ સુધી રહેશે. ગુરુવારે રાત્રે દીપોત્સવ માટે સૌથી શુભ મુરત માનવામાં આવે છે તે પ્રદોષ કાળ અમાસનો યોગ

બને છે. જેને લીધે દિવાળી તા.૩૧ ઓક્ટોબરે હોવાનું જણાવ્યું છે.

કોઈક વિદ્વાનજનો એ શાસ્ત્રોક્ત પ્રમાણો આપી દીપાવલી લક્ષ્મીપૂજન તા.૩૧ ઓક્ટોબરના સાંજ-રાત સમયે કરવાનું કહી તા.૧ નવેમ્બર શુક્રવારે લક્ષ્મીપૂજન કરવું ઠીક નથી એવો દૂરાગ્રહ વ્યક્ત કર્યો છે. તો તેમની વિરૂધ્ધમાં અમુકોએ પોતાના પ્રમાણ પ્રસ્તુત કરી તા.૧ નવેમ્બર જ શાસ્ત્ર સંમત દિવાળી એવો આગ્રહ જણાવી કહ્યું છે કે તા.૩૧ ઓક્ટોબરે ગુરુવારે નહીં.

આ અસંજસ પરિસ્થિતિ બાબતે મુલુંડના સુપ્રસિધ્ધ ન્યોતિષી, વિદ્વાન શાસ્ત્રી, પ્રકાંડ પંડિત અને સુદર્શન કચ્છી અષાઢી પંચાંગના રચયિતા, સંપાદક ડૉ.ગૌતમ વિશ્વનાથ શાસ્ત્રી-જોશીનો મત જાણવા સંપર્ક કરતા તેમણે કહ્યું કે સોશિયલ મિડિયાને કારણે લોકો ભ્રમિત થઈ ગયા છે અને શંકા કુશંકામાં અટવાઈ ગયા છે. દીપાવલી પર્વ ઉત્સવ અને દીપાવલીનું લક્ષ્મીપૂજન, ચોપડા પૂજન બંને વાતો અલગ છે. એ વાત કોઈપણ નિર્ણય કરવા

જાણવા માટે જાણ હોવી જરૂરી છે.

આ વખતે જે પરિસ્થિતિ છે તે કંઈ પહેલી વારની ઘટના નથી એમ જણાવી ચર્ચા આગળ વધરતા તેમણે કહ્યું કે દીપાવલીની દીપમાળા અને ફટાકડાની આતશબાજ તા.૩૧ ઓક્ટોબર સાંજ પછી જ્યારે લક્ષ્મીપૂજન તા.૩૧ ઓક્ટોબર ગુરુવારે સાંજથી બીજા દિવસે ૧ નવેમ્બર શુક્રવારની સાંજે ૬.૧૮ સુધી એટલે કે બંને દિવસ સાંજ-રાત દિવસ દરમ્યાન થઈ શકે એ બાબત શાસ્ત્રોક્ત સંમત છે.

જાણકાર વિદ્વાનો એ જે પ્રમાણ ગ્રંથોના આધારે પોતાનો નિર્ણય જણાવ્યો છે. તેનાથી અધિક ગ્રંથોનું અધ્યન અને અભ્યાસ મેં કર્યો છે. એટલે જેઓ કેવળ તા.૩૧ની સાંજનો આગ્રહ રાખી છે તે માન્ય છે પરંતુ તા.૧ નવેમ્બરની તારીખનો નિષેધ કરવાનો દૂરાગ્રહ કદાપિ માન્ય નથી. એજ રીતે જેઓ તા.૧ નવેમ્બરના લક્ષ્મીપૂજન કરવા સંમત વિદ્વાનજનો તા.૩૧ ઓક્ટોબર માટે શાસ્ત્રોક્ત માન્યતા દર્શાવતા નથી એ પણ નિષેધાત્મક વાત છે.

તેથી મારા ગહન અભ્યાસના આધારે તંત્રોક્ત કમલા જયંતીમાં કરાતી કમલા લક્ષ્મી પૂજા મુદ્દતના મહત્વના આધારે તા.૩૧ ઓક્ટોબર સવારે ૬.૩૯ થી તા.૧ નવેમ્બર સાંજે ૬.૧૮ સુધી બંને દિવસ

સુદર્શન કરછી આષાઢી પંચાંગ Call: 9969814488

સંબંધક: કરછી ગોતમ વિશ્વનાથ શાસ્ત્રી, મુલુંડ મુંબઈ - નવોપ કચ્છ			
દીપાવલી લક્ષ્મીપૂજન - શાસ્ત્રી પૂજન ના મુદ્દતો			
મહત્ત	સ્ટા.	સ્ટા.	સ્ટા.
તા. ૩૧-૧૦-૨૦૨૪	ક	મિ	ક
શુભ ચોઘડિયું	06.39	થી	08.05
વૈશ્વિક સ્થિર લગ્ન	07.55	થી	10.09
ચલ ચોઘડિયું	10.56	થી	12.21
લાભ ચોઘડિયું	12.22	થી	13.47
કુંભ સ્થિર લગ્ન	14.05	થી	15.42
શુભ ચોઘડિયું	16.39	થી	18.05
ઓચ્છ મુદ્દત	18.05	થી	onwards
અમૃત ચોઘડિયું	18.05	થી	19.39
ચલ ચોઘડિયું	19.39	થી	21.13
સ્વામી નાશનયુક્ત અમાવસ્યા ઉત્તમ સુભગ રાત્રે	12.45	થી	પ્રારંભ
લાભ ચોઘડિયું રાત્રે	12.22	થી	01.56
શુભ ચોઘડિયું પસોડે	03.31	થી	05.05
અમૃત ચોઘડિયું	05.05	થી	06.40
શુક્રવાર તા. 01-11-2024			
ચલ ચોઘડિયું	06.40	થી	08.05
વૈશ્વિક લગ્ન	07.51	થી	10.55
લાભ ચોઘડિયું	08.05	થી	09.31
અમૃત ચોઘડિયું	09.31	થી	10.56
અભિજિત મુદ્દત	12.10	થી	12.24
શુભ ચોઘડિયું	12.22	થી	13.47
કુંભ સ્થિર લગ્ન	14.01	થી	15.38
ચલ ચોઘડિયું	16.38	થી	18.04

આમ આ 20 મુદ્દતો અણિશુદ્ધ શાસ્ત્રીય છે.

દરમ્યાન શુભયોગમાં પ્રાદેશિક ગણિત, લગ્ન હોરા, અભિજિત, ગોરજ ચોઘડિયા વિગેરેનો નિર્ણય કરી આનંદ, શ્રદ્ધા ભક્તિ સાથે પૂજા કરી મહાલક્ષ્મી માંની અનહદ કૃપા સૌ શ્રદ્ધાળુજનો પ્રાપ્ત કરે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. શાસ્ત્રી ડૉ.ગૌતમ જોશી દ્વારા દર્શાવેલ લક્ષ્મીપૂજન-શાસ્ત્રીપૂજનના શુભ મુદ્દતો.

[Click Here](#)

દિવાળી નિમિત્તે અવનવી મીઠાશવાળી વાનગીઓની રેસીપી

માવાના ઘુઘરા

સામગ્રી :- ૫૦૦ ગ્રામ મેદો, ૫૦ ગ્રામ દૂધ, લોટ બાંધવા અને તળવા માટે ઘી, ૪૦૦ ગ્રામ માવો, ૧૦૦ ગ્રામ રવો, ૨ ટે. ૪૦૦ ગ્રામ દળેલી ખાંડ, ઈલાયચી પાવડર બે ચમચી, ૧૦૦ ગ્રામ કાજુ ટુકડી, ૫૦ ગ્રામ કિસમિસ. ૧૦૦ ગ્રામ નારિયળનું ઝીણું છીણ (પસંદ હોય તો)



બનાવવાની રીત :- એક વાસણમાં મેદો ચાળી તેમા ઓગાળેલુ ઘી નું મોણ નાખી તેને સારી રીતે મિક્સ કરો. લોટમાં થોડુ દૂધ નાખી અને જરૂરી પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો. આ લોટને ભીના કપડાંથી ઢાંકી દેવો. અડધો કલાક માટે રાખી મુકો.

પૂરણ બનાવવાની રીત - ભારે તળિયાવાળી કડાઈમાં માવાને ગેસ પર આછો ગુલાબી (બ્રાઉન) થાય ત્યાં સુધી શેકવો અને ત્યારબાદ, એક વાસણમાં કાઢી લેવો. તે જ કડાઈમાં ઘી નાંખી અને રવાને ગુલાબી થાય ત્યાં સુધી શેકવો અને શેકાઈ ગયા બાદ, એક પ્લેટમાં કાઢી લેવો. દળેલી ખાંડ, કાજુના ઝીણા ટુકડા અને ઈલાયચી પાવડર તૈયાર રાખો. હવે માવામાં રવો, ખાંડ એલચી પાઉડર અને સૂકા મેવાને એકસાથે ભેગા કરી પૂરણ તૈયાર કરો.

હવે બાંધીને ઢાકેલા લોટને મસળીને મુલાયમ બનાવો, આ લોટના ૫૦-૬૦ લૂઆ થશે. લૂઆ બનાવીને કપડાથી ઢાંકી મુકવા. હવે વેલણથી સહેજ મોટી પુરી વણીને તેને ઘુઘરાના બીબામાં મુકી પૂરણ ભરવુ અને બીબુ બંધ કરીને વઘારાનો લોટ કાઢી લેવો. આ રીતે દરેક ઘુઘરા બનાવી લેવા. ઘુઘરા ખુલી જતા હોય તો બીબુ બંધ કરતા

પહેલા બીબાના કિનારે સહેજ દૂધ લગાવી બંધ કરો. આ રીતે બધા ઘુઘરા બનાવી સાડી નીચે ઢાંકી મુકો. બધા ઘુઘરા બની જાય કે ગરમ ઘી માં તળી લો. આ ગરમા ગરમ પણ ખાઈ શકો છો. ઠંડા થયા પછી એરટાઈટ ડબ્બામાં ભરી લો.

મૈસૂર પાક

સામગ્રી :- ૧ કપ બેસન, ૨ કપ ઘી, ૨ કપ ખાંડ, ૧ કપ પાણી.

બનાવવાની રીત :- બેસનને ચાળીને જુદું મુકો. પાણી અને ખાંડને ગરમ કરી ઓગળવા દો. જ્યારે એક તારની ચાસણી બની જાય તો તેમાં એક કપ ઘી નાખી દો. હવે ધીમો તાપ કરીને ધીરે ધીરે ચાસણીમાં બેસન મિક્સ કરો અને સતત હલાવતા રહો જેથી ગાંઠ ન પડે.

જ્યારે બેસન થોડું ફુલી જાય ત્યારે અને તેનો રંગ બદલાય ત્યારે તેમાં બચેલું ઘી નાખીને મિક્સ કરો. ઘી થોડું થોડું કરીને નાખતા જજો. બધું ઘી મિક્સ થઈ જાય કે બેસન સતત હલાવો.

જ્યારે બેસનમાં જાળી જાળી દેખાવવા માટે તો મૈસૂર પાક તૈયાર થઈ ગયો છે સમજો. કોઈ પણ ટ્રેમાં ઘી લગાવીને ચિકણી કરી લો. પછી બેસનનું મિશ્રણ નાખીને ફેલાવી દો. જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે ટુકડા કરી લો.

જ્યારે મૈસૂર પાક ઠંડો થઈ જાય ત્યારે તેને ડબ્બામાં ભરી લો. આ મૈસૂર પાક ૧૫-૨૦ દિવસ સુધી સારો રહે છે.

કેસર શાહી ફીરની

સામગ્રી :- અડધો લીટર દૂધ, ૧/૪ કપ ચોખા, બાસમતી હોય તો સારી સુગંધ અને સ્વાદ આવે, ૩/૪ કપ સાકર, કેસર, ૨ ટેબલ

સ્પૂન મીલક મસાલા એવરેસ્ટનું અથવા ઘરે બનાવેલું.

રીત :- ચોખા પહેલા પલાળી રાખવા, દૂધ ગરમ કરવા મુકવું, પલાળેલા ચોખાને પીસી પેસ્ટ બનાવી જેવું દૂધ ઉકાળવા લાગે ત્યારે ચોખાની પેસ્ટ નાંખી હલાવતા રહેવું એમાં ગાંઠા ન પડે પછી એમાં સાકર નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી બોઈલ કરો. સાકર ઓછી વધુ ટેસ્ટ કરી લેવી. નીચે ઉતારી થોડું ઠંડું થવા દો. એક બાઉલમાં નાખી ઉપર કેસર અને મીલક મસાલાથી સજાવોને કેસર શાહી ફીરની ખાવામાં એનજોય કરો. આ મીઠાઈ ક્યારે પણ બનાવી શકાય. ઓચિંતા મહેમાન આવે તો ફટકટ થઈ જાયને રિયલ આઈટમ લાગે.


ડ્રાયફ્રૂટ મીઠાઈ

કાજુ કતરી : સામગ્રી :- ૨ કપ દળેલી સાકર, ૨ કપ કાજુનો ભુક્કો, સાકર ડૂબે તેટલું પાણી, વરખ.


બનાવવાની રીત :- સાકર ડૂબે તેટલું પાણી નાખી સાકર ગરમ કરવી દોઢ થી ૨ તારની ચાસણી બનાવવી. કાજુનો ભુક્કો ઉમેરવો. વ્યવસ્થિત મીક્સ કરવું ગેસ બંદ કરવો. પ્લાર્ટીક પર બંને તરફથી લગાડી વચ્ચે કાજુનું સ્ટર્કીંગ મૂકી હલકા હાથે વણવું. ઠંડુ થવા દેવું. વરખ લગાડી કાપા પાડી સર્વ કરવું. **કાજુ પીઝા : બનાવવાની રીત :-** એક બાઉલમાં ૨ ટે.સ્પ. મીક્સ ડ્રાયફ્રૂટ, ટૂટીફ્રૂટી, ચેરી બંધુ જીણું ચોપ કરી મીક્સ કરવું. કાજુની પૂરી થેપી તેના પર ડ્રાયફ્રૂટ પાથરવું વચ્ચે ચેરી મૂકવી. પીઝાની જેમ કટ કરી સર્વ કરવું.




દિવાળીની ટીપકાથી બનાવેલ વિશેષ રંગોળી




૧૦-૧૦ ટીપકા




૧૮-૧૨ ટીપકા




૧૦-૧૦ ટીપકા




૧૫-૧૫ ટીપકા




૧૯-૧૯ ટીપકા



૧૬-૧૬ ટીપકા



૨૦-૨૦ ટીપકા



૧૮-૧૮ ટીપકા

[Click Here](#)

દિવાળી નિમિત્તે અવનવી મીઠાશવાળી વાનગીઓની રેસીપી

રાજગરા ચીકી

સામગ્રી :

૧ વાટકો રાજગરાની ઘાણી, પોણો વાટકી ગોળ, અધકચરા વાટેલા સીંગદાણા પા વાટકી.

રીત :

ગોળને એક કડાઈમાં ઘીમા તાપે હલાવો. ઘીરે ઘીરે ગોળ નરમ પડશે એને હલાવતા રહેવું ત્યાર બાદ એક વાટકીમાં થોડું પાણી લેવું અને તેમાં પીગબેલા ગોળના એક બે ટીપા નાખવા તપાસવું ચાસણી થઈ છે કે નહીં જો પાણીમાં ગોળી વળે અને કટ એવો અવાજ આવે તો સમજવું ચાસણી બની ગઈ છે. ગેસ બંધ કરી રાજગરાની ઘાણી અને શીંગનો ભૂકો તેમાં ઉમેરીને એક થાળીમાં ઘી લગાડી પાથરી દેવું. થોડા સમય બાદ ગરમમાં જ કાપા પાડી લેવા.



મોહનથાળ

સામગ્રી :-

૪૦૦ ગ્રામ કંડેન્સ મિલ્ક, ૨૦૦ ગ્રામ ખાંડ, ૩ કપ બેસન, ૨ ચમચી દૂધ, કેસર, ૧ કપ ઘી, કતરેલા બદામ અને પિસ્તા.



બનાવવાની રીત :-

સૌ પ્રથમ બેસન અને દૂધને સારી રીતે મિક્સ કરી ચાળીને ૩૦ મિનિટ માટે ઢાંકીને મુકી દો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. ત્યારબાદ તેમાં બેસન નાખીને ૧૦ મિનિટ સુધી શેકો.

મિશ્રણને સતત હલાવતા તેમા કંડેન્સ મિલ્ક અને ખાંડ મિક્સ કરો. આ મિશ્રણને ૧૫ મિનિટ સુધી હલાવતા રહો અને ઘટ્ટ થતા સુધી થવા દો. ત્યારબાદ તેમા કેસર નાખો અને વાસણ ગેસ પરથી ઉતારી લો. આ મિશ્રણને ઘી લગાવેલ થાળીમાં પાથરી દો અને ઉપરથી કતરેલા બદામ અને પિસ્તા નાખી દો. જ્યારે આ ઠંડુ થાય ત્યારે મનપસંદ આકારમાં કાપીને સર્વ કરો.

૭ સ્ટાર સુખડી

સામગ્રી :-

કાબુલી ચણા, રાજમાં, અડદની દાળ, જુવાર, મગ, નાચણી બધું ૧-૧ ટે.સ્પુન, ઓટસ ૨ ચમચી, ૨ ટે.ઘી, ગોળ અડધી વાટકી, મલાઈ ૦૧ વાટકી, સૂંઠ ૧ ટી, પીપરામૂળ ગંઠોડા ૦૧૧ ચમચી, પા ટી એલચી ભૂકો, ૧ ટે. ગુંદરનો પાવડર.



રીત :- ઉપરના ૬ અનાજ કાબુલી ચણા, રાજમાં, અડદની દાળ, જુવાર મગ, નાચણી ભેગા કરી શેકી લો. ઓટસને પણ શેકી લો. પછી બધા અનાજ મિક્સરમાં પીસી લો. કડાઈમાં ૦૧ વાટકી મલાઈ અને ૨ ટે.ઘી લઈ ઉપરનો પીસેલો લોટ નાખી ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. પછી તેમાં શેકેલા ઓટસ, ગુંદર પાવડર, નાખી ગુલાબી રંગ થાય ત્યાં સુધી શેકો ગેસ બંધ કરી તેમાં સૂંઠ, પીપરામૂળ ગંઠોડા પાવડર, એલચી પાવડર, જાયફળનો ભૂકો નાખી. બધું બરાબર હલાવી લો. જરાક નવેસેકું થાય તો તેમાં બારીક સમારેલો ગોળ નાખી બધું બરાબર મિક્સ કરી તેને થાળીમાં પાથરી દો. મનગમતા આકારમાં પીસ કરો.

તૈયાર છે ઝટપટ બની જાય એવું પ્રોટીન, ફાઈબર, આયન, કેલ્શિયમ, હીમોગ્લોબીનથી ભરપૂર માત્ર એક જ પીસમાં બધી એનર્જી મળી જાય તેવી ટેસ્ટી હેલ્થી ૭ સ્ટાર સુખડી.

ગાજર રસગુલા બાઈટ્સ

સામગ્રી :-

૨ ચમચા ગાજરનું છીણ (કેસરી રંગના), ૪ કપ મલાઈવાળું દૂધ, ૨ ચમચા કાજુનો ભૂકો (શેકીને કશ કરવા), દોઢ ચમચો ખાંડ, ૨ ચમચી ઘી.



રસગુલા માટે :-

અડધો લીટર ગાયનું દૂધ, ૧ કપ ખાંડ, ૩ કપ પાણી, ૧ લીંબુનો રસ.

રીત :- લીંબુનો રસ કાઢો, તેમાં ૧ ચમચો પાણી નાખો. ગાયનું દૂધ ઉકાળો, એક ઉભરો આવે પછી ગેસ બંધ કરો, અડધો કપ પાણી ઉમેરો, હવે થોડું થોડું લીંબુપાણી નાખો, દૂધ ફાટી જશે, ફરી અડધો કપ પાણી ઉમેરો, કપડામાં પનીર એક કલાક લટકાવો, પ્લેટમાં પનીર અને ૧ ચમચી ખાંડ ૫ મિનિટ મસળો, બોલ્સ બનાવો, મોટા તપેલામાં ખાંડ અને પાણી ઉકાળો, ૧૦-૧૨ મિનિટ પછી તેમાં પનીર બોલ્સ નાખો, ફાસ્ટ ગેસ પર ૧૨ મિનિટ ઉકાળો, હવે ગેસ બંધ કરો, અડધો કપ ઠંડુ પાણી ઉમેરો, ૨ કલાક પછી થોડી ચાસણી નીતારીને પ્લેટમાં રાખો રસગુલાને.

કડાઈમાં ઘી લો, ગાજર સાંતળો, તેમાં દૂધ, ખાંડ, કાજુનો ભૂકો ઉમેરો, ઘટ્ટ થાય ગેસ બંધ કરો, ઠંડુ પડે પછી ચોરસ આકારની મિઠાઈ બનાવો, વચ્ચે ખાડો કરીને રસગુલા મુકો, શ્રીજીને ધરાવો. સુંદર અને સ્વાદિષ્ટ બને છે.

Maldives

Any 4 NT / 5 Days

₹ 74999/- Per Person

IN PICK SEASON NOV. / DEC. / JAN. / FEB. In Holiday in

All meals & many more complementary Water Sports

Call for special offer on occasion of DIWALI

BOOK NOW ☎ Girish Jasani - 9653378596

*Offer valid till 31st oct.

તંદુરસ્ત શરીર માટે વનસ્પતિ આધારિત આહારનું મહત્વ

ફળો, શાકભાજી, કઠોળ, આખા અનાજ, બદામ અને વિવિધ પ્રકારના બીજથી સમૃદ્ધ વનસ્પતિ આધારિત આહાર તેના ગહન સ્વાસ્થ્ય લાભો માટે વધુ મહત્વના છે. આ આહારમાં બિનઆરોગ્યપ્રદ ચરબી ઓછી હોય છે અને ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટો જેવા જરૂરી પોષક તત્ત્વો વધુ પ્રમાણમાં હોય છે, જે શરીરને સંપૂર્ણપણે તંદુરસ્ત રાખવામાં ફાળો આપે છે.

વનસ્પતિ આધારિત આહારનો સૌથી નોંધપાત્ર ફાયદો છે હૃદયના સ્વાસ્થ્ય પર તેની અસર. અભ્યાસો દર્શાવે છે કે જે વ્યક્તિઓ વનસ્પતિ આધારિત આહારનું સેવન કરે છે તેઓનું બ્લડ પ્રેશર ઓછું હોય છે, કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે અને હૃદયરોગનું જોખમ ઘટે છે. ઉચ્ચ ફાઈબરયુક્ત આહાર બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે ટાઈપ ટુ ડાયાબિટીસને અટકાવી શકે છે અને તેનું મેનેજમેન્ટ કરી શકે છે. વધુમાં, તે વજન ઘટાડવા અને યોગ્ય વજન જાળવવા સાથે સંકળાયેલું છે, કારણ કે વનસ્પતિ આધારિત આહારમાં સામાન્ય રીતે કેલરી ઓછી હોય છે અને પોષક તત્ત્વો વધુ હોય છે.

વનસ્પતિ આધારિત આહાર એન્ટીઓક્સિડન્ટો અને સોજા-બળતરા વિરોધી (એન્ટીઇન્ફ્લેમેટરી)

સ્વાસ્થ્ય સુધા

લેખક રીટા જૈન

DIETICIAN (Msc. In food science and diabetics), specialization in Diabetes educator, yoga and wellness coach.

9819070772

તત્ત્વોથી પણ ભરપૂર હોય છે, જે કેન્સર જેવા લાંબાગાળાના રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે અને એકંદરે આયુષ્યને વધારવામાં પ્રોત્સાહન આપે છે. વધુમાં, વનસ્પતિ આધારિત આહાર પાચન સંબંધી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, કારણ કે ઉચ્ચ ફાઈબર તંદુરસ્ત આંતરડાના માઈક્રોબાયોમને ટેકો આપે છે, પાચન અને પોષક તત્ત્વોના શરીરમાં શોષણને વધારે છે.

વનસ્પતિ-આધારિત આહાર અપનાવવાથી આપના સ્વાસ્થ્યમાં ધરમૂળથી પરિવર્તન આવી શકે છે, વિવિધ રોગોના જોખમને ઘટાડી શકે છે જ્યારે સારી ઊર્જા, પાચનશક્તિમાં સુધારો અને એકંદરે સ્વસ્થ શરીરને પ્રોત્સાહન મળે છે. સંપૂર્ણ, છોડ આધારિત ખોરાક અપનાવીને આપણે લાંબાગાળાના સ્વાસ્થ્ય અને સુખાકારી તરફ અર્થપૂર્ણ પ્રગતિ કરી શકીએ છીએ.

[Click Here](#)

PUBLIC NOTICE

Notice is once again hereby given that our Client, Mr. Chhaganlal Danani, is lawfully entitled to the property being Plot H admeasuring 2270.44 sq. mtrs. and bearing CTS No. 1296 (part) and CTS No. 1295 (part) and part of Plot L (as provided in agreement) bearing CTS No. 1296(part), CTS No. 1297(part), CTS No. 1294 (part), CTS No. 1295 (part) forming part of the Larger Lands, of Village Mulund, Taluka Kurla, Mumbai Suburban District and lying, being and situated at 90 ft. Road, near Kelkar College, Mulund East (T Ward) Mumbai 400 081 by virtue of the Consent Decree dated 6th May 1998, as modified by the Further Consent Terms filed by the parties from time to time, and lastly by the Further Consent Terms dated 21st September 2020.

Public at large is once again hereby notified that our Client, has terminated, the JV Agreement with Prince Enterprises (as modified by Agreement dated 31st August 2019) in respect of the said Plot H and part of Plot L (as provided in Agreement), vide our letter bearing no. RVD/MN/342 dated 11th October 2024 with immediate effect. Despite the said termination, Prince Enterprises has proceeded to put up an illegal and unauthorised signage board at plot H, interalia claiming that Prince Enterprises are in possession of the said Plot H pursuant to the said JV Agreement. By the aforesaid false, illegal and unauthorised representations, Prince Enterprises is trying to mislead public at large.

The public at large, are therefore hereby warned not to deal with the said Prince Enterprises and/or its Partners (including Deepak U. Gandhi) or anyone in respect of the said Plots or any part thereof.

If anyone will still do so, they shall be doing it at their own risk and peril as to cost and consequences thereof and subject to our Client's rights.

Dated this 30th day of October 2024.

Malvi Ranchoddas & Co.

Advocates & Solicitors

18/ABC, Surya Mahal, 4th Floor,

5, Burjorji Bharucha Marg,

Fort, Mumbai - 400 001.

દિવાળીની વિશેષ રંગોળી



Click Here

દિવાળીની સૌને શુભકામના

દિવાળીના શુભ ત્યોહાર પર પાવન બનાવીએ ઘર આંગણું વરસે લક્ષ્મી છમછમ ઘર પર લીલા લહેર થઈ જાય સદૃવ્યવહારમાં નિર્મળ જળ સમાન બની જાય મન-વચન-કર્મ

શુધ્ધ સ્વચ્છ સ્વચ્છ રહો સંસારમાં ભલે પધારે શ્રેષ્ઠ વિચારો, કનિષ્ઠ વિચારો દૂર રહે

કાર્ય સફળ થાયે ત્યારે જીવનમાં મળે સુખ શાંતિ અંતરમાં

નારાજી દૂર થઈ જાય દિલથી, ખુશ રહો પ્રભુ

આવી અનોખી દિવાળીની શુભકામનાઓ સાથે પ્રત્યેકના જીવન દુઃખ, દર્દ, રોગ, શોકથી દૂર રહે અને નૈતિક શિક્ષાનું દીપક અંતર આત્મામાં છવાઈ જાય અને અજ્ઞાન અંધકાર દૂર થઈ જાય એ જ સર્વ પ્રતિ શુભભાવના.

- બ્ર.કુ.ડૉ.ગોદાવરી દીદી, મુલુંડ, મુંબઈ



નવા વિક્રમ સંવત ૨૦૮૧માં પ્રવેશ પ્રસંગે બધાને નૂતન વર્ષની શુભકામના

દિવાળી ભારતનો એક લોકપ્રિય તહેવાર છે. આ તહેવાર ઓક્ટોબર/નવેમ્બર મહિનામાં મનાવવામાં આવે છે. સમગ્ર તહેવાર પાંચ દિવસ સુધી ચાલે છે. દિવાળીના દિવસે લોકો નવા કપડા પહેરે છે અને સ્વાદિષ્ટ પકવાન બનાવે છે. લોકો એકબીજાને દિવાળીની શુભકામનાઓ પાઠવે છે. આ દિવસે ફટકડા પણ ફોડવામાં આવે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે. દિવાળી ભગવાન રામના ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફરવાનો ઉત્સવ છે. દિવાળીને સાંજે વેપારી લોકો ચોપડા પૂજન કરે છે. લોકો પોતાના ઘરોને રંગબેરંગી રોશનીથી અને દીવડા ઓથી ઝળકાવે છે. સ્ત્રીઓ ઘરના આંગણે રંગબેરંગી મનમોહક રંગોળીઓ બનાવે છે. દિવાળી બાળકોનો ખૂબજ પ્રિય તહેવાર છે. રાત્રે ફટકડાની આતશબાજી રચે છે. દિવાળી પછીના દિવસને નૂતન વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. દિવાળીમાં દીવડા ઝગમગ થાય છે. Wish you a happy Diwali to all અને વિક્રમ સંવત ૨૦૮૧ નવા વર્ષની શુભકામના સાથે સાલમુબારક.

- જરમીના જયંત છેડા



ઈનરવ્હીલ ક્લબ ઓફ મુલુંડ તરફથી વૃદ્ધાશ્રમમાં વ્હીલચેર અપાઈ



ઈનરવ્હીલ ક્લબ ઓફ મુલુંડ દ્વારા તાજેતરમાં શ્રી કેર વૃદ્ધાશ્રમ મુલુંડમાં એક વ્હીલચેર ભેટ આપવામાં આવી હતી. જેનાથી ત્યાં રહેતા વૃદ્ધ રહેવાસીઓને આનંદ ગતિશીલતા મળી હતી. વડીલો માટે ફળો પણ આપવામાં આવ્યા હતાં.

વ્હીલચેરથી ખૂબ જરૂરીયાત હતી. ત્યાંના વડીલોની સંભાળ રાખનાર બહેને ઈનરવ્હીલ ક્લબ ઓફ મુલુંડનો આભાર માન્યો હતો. ઈનરવ્હીલ પ્રમુખ શ્રીમતી નૂતન ઘુલ્લાએ આ પ્રોજેક્ટમાં સાથ સહકાર આપવા બદલ જણાવેલ છે.



ઘાટકોપર ભટ્ટવાડીના શ્રી જલારામ મંદિર મઘે પૂ.શ્રી જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવણીનું આયોજન

શ્રી લોહાણા બંધુ મંડળ સંચાલિત ઘાટકોપર વેસ્ટ બર્વેનગર ભટ્ટવાડી વિસ્તારમાં આવેલ શ્રી જલારામ મંદિરમાં દિવાળી પર્વના શુભ અવસરે રવિવાર ૨ નવેમ્બર ૨૦૨૪ કારતક સુદ બીજ સુધી ૭ દિવસ રોજ સવારના ૬ કલાકે દીપ માળા સહિત મંગળા આરતી કરવામાં આવશે.

શુક્રવાર તા.૮ નવે. કારતક સુદ-૭ના શુભ દિવસે રઘુકુળ દીપક સંત શિરોમણિ પ.પૂ.શ્રી જલારામ બાપાની ૨૨૫મી જન્મજયંતિનો ઉત્સવ ભાવિક ભક્તોના સાથ સહકારથી ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવશે. 'આ પ્રસંગે સવારના ૬.૩૦ કલાકે શ્રી જલારામ બાપાની દિવ્યતમ આરતી સ્તુતિ ચાલીસા પાઠ કરવામાં આવશે. સવારના ૭.૩૦



કલાકે નગરના વિસ્તારમાં બેન્ડબાજ સહિત સુશોભિત રથમાં પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની મૂર્તિ સાથે શોભા યાત્રા ફેરવવામાં આવશે. સવારે ૧૧ કલાકે માતૃશ્રી રેખાબેન અશ્વિન ખિલાણી પરિવાર (કચ્છ ગામ અંજર, હાલ ઘાટકોપર)ના શુભ હસ્તે મંદિરના શિખર ઉપર ઘણા ચડાવવામાં આવશે. ત્યાર પછી ભાવિક ભક્તો દ્વારા

સમૂહ આરતી કરવામાં આવશે. ત્યાર બાદ પ.પૂ. ભગવતાચાર્ય શ્રી આશિષભાઈ વ્યાસ આર્શિવચન આપશે. બપોરના ૧૨.૩૦ કલાકે પ્રસાદરૂપી ભોજન, બપોરના ૨.૩૦ કલાકે વિવિધ મહિલા મંડળો દ્વારા ભજનોની સુંદર રમઝટ, સાંજના ૪ કલાકે અનિલાબેન મહેતા (મધુર મિલન) બહેનોના સથવારે ભજન કીર્તન, સાંજના ૬.૩૦ કલાકે સંધ્યા આરતી ત્યાર પછી મહાપ્રસાદ. રાતના ૮ કલાકે નિખિલ દાવડા પ્રસ્તુત ભજન સંધ્યા નીરવ બારોટ, શરદ લક્ષ્મી, રુચિ ભાનુશાલી અને સાથે કલાકારો ભક્તિ સંગીતનો સુંદર કાર્યક્રમ રજૂ કરશે.

આ પ્રસંગે દર્શન મહાપ્રસાદનો સમયસર અવશ્ય લાભ લેશે.

ગોલ્ડન એજ ગ્રુપનો વીસમો પ્રોગ્રામ થયો

ગોલ્ડન એજ ગ્રુપનો વીસમો પ્રોગ્રામ તા.૨૨ ઓક્ટોબર મંગળવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન વિકાસ સેન્ટર આર્થ નિવાસ ટ્રસ્ટ હોલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ૮૦ થી ૮૫ મેમ્બરો એ હાજરી આપી હતી. આખા વર્ષની સમીક્ષા કરવામાં આવી અને પછી હાઉસી રમાડવામાં આવી ગ્રુપના ૨૦૨૪ના વર્ષ માટે ફોર્મ ભરીને મેમ્બરશીપ લેવામાં આવી તેમજ અયોધ્યા ટુરની વિગત વાર ચર્ચા કરવામાં આવી.

ગોલ્ડન એજ ગ્રુપને નિસ્વાર્થ ભાવે સાથ આપવામાં આર્થ નિવાસ ટ્રસ્ટ હોલના ટ્રસ્ટી સંદિપભાઈ પોપટ તેમજ ખુરશી ટેબલ માટે અંકિતા ડેકોરેશનના જીતુભાઈ ઠક્કરનો સહયોગ મળે છે. આજના નાસ્તા અને કોલ્ડ ડ્રીંક માટે પૂર્ણિમા મિસ્ત્રી તેમજ મનિષા બખાઈ સહકારી બન્યા હતા. નવી મેમ્બરશીપ ડિસેમ્બર મહિનામાં આપવામાં આવશે. સંપર્ક : પ્રધુમનભાઈ ગાંધી:૯૮૬૭૬૬૨૩૬૦, મીના ઠક્કર:૯૮૨૧૯૪૬૭૫૮.



[Click Here](#)

રોટરી ક્લબ અને તરૂણ ઉત્કર્ષ મંડળ દ્વારા નિશુલ્ક આરોગ્ય શિબિર અને દવા વિતરણ સંપન્ન



રોટરી ક્લબ ઓફ બોમ્બે પવઈ, એલ એન્ડ ટી રિયાલિટી, તેમજ તરૂણ ઉત્કર્ષ મંડળ, મુલુંડ અને રોટરી ક્લબ ઓફ મુલુંડના સહયોગથી શનિવાર, તા.૨૬મી ઓક્ટોબરના રોજ તરૂણ ઉત્કર્ષ વિદ્યામંદિર ગવાન પાડા, મુલુંડ ઈસ્ટ ખાતે નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મેડિકલ કેમ્પની સેવાનોરરપથી વધુ લોકોએ લાભ લીધો હતો. આંખની તપાસ અને ચક્ષુ, બી.પી., સુગર, શારીરિક બિમારીઓ, તેમજ મહિલાઓના શારીરિક રોગો અંગે પણ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.



વ્યાધિગ્રસ્ત દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં જવાનું સૂચન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ મુલુંડ



ઈસ્ટના પ્રેસિડેન્ટ અનંત લક્ષ્મી અચ્ચર અને તેમના સહકારીઓ દ્વારા આ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં તરૂણ ઉત્કર્ષ મંડળના પ્રમુખ ભાલચંદ્ર વૈતી, સેક્રેટરી કેલાસ પાટીલ, ઉદ્ય વૈતી, ઋષિકેશ વૈતી, વિકાસ વૈતી,



જયેશ વૈતી, નિશિકાંત પાટીલ, રાજન ભોસલેએ જહેમત ઉઠાવી આ તબીબી કેમ્પને સફળ બનાવ્યું હતું.

શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ ડોમ્બીવલી વેસ્ટ દ્વારા સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતી ઉજવણીનું આયોજન

રઘુકુળ દ્વિપક, યુગ પ્રવર્તક, અન્નદાન અને અતિથિ સેવાના અખંડ વ્રતધારી સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૫ મી જન્મજયંતીની ઉજવણી તા.૮ નવેમ્બર શુક્રવારના શ્રી જલારામ ધામ, ઓમ આશીવાંદ બિલ્ડીંગ, સ્વામી વિવેકાનંદ

સ્કૂલની પાસે, મહાત્મા ફૂલે રોડ, ડોમ્બીવલી વેસ્ટ ખાતે ધામધૂમપૂર્વક ઉજવાશે. ઉત્સવ દિવસના કાર્યક્રમમાં સવારે ૦૭.૩૦ કલાકે નવગ્રહ શાંતિ પૂજન, સવારે ૮.૩૦ કલાકે સંગીતમય આરતી, સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ સુધી મહિલા મંડળ દ્વારા ભજન કીર્તન

અને ધૂનની રમઝટ અને સવારના ૯ થી ૧.૩૦ વાગ્યા સુધી પૂજ્ય બાપાને મનગમતી ખીચડી-કઢી-શાકનો મહાપ્રસાદ વિતરણ કરાશે. અવસરે મહારતી દર્શન અને મહાપ્રસાદનો ધન્ય લાભ લેવા સહભાગી ભાઈ બહેનોને ટ્રસ્ટ મંડળ તરફથી હાર્દિક આમંત્રણ છે.

સંગિની ફોરમ મુલુંડનું દિવાળી સેલિબ્રેશન



દિવાળી એક એવું પંચામૃત છે જેમાં જીવન ઉત્થાનના મહાન તત્વો એક તેજપુંજ બનીને ભળી ગયેલા છે એવી રોશનીના ઝગમગાટની સાથે સંગિની ફોરમ મુલુંડે ટીપટોપ પ્લાઝા પરિવાર સાથે દિવાળી સેલિબ્રેટ કરી ત્યોહારના ઉત્સાહને ઉમંગ પૂર્વક વધાવ્યો.



શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ (દરિયાસ્થાન) દ્વારા 'સામૂહિક ચોપડા પૂજન'નું આયોજન

સમસ્ત કચ્છી લોહાણા સમાજને વધુ સંગઠિત કરવાના સાધાર્મિક ભાવથી પ્રથમ વખત આયોજીત 'સામૂહિક ચોપડા પૂજન' આસો વદ અમાસ (દિવાળી) વિ.સ.૨૦૮૦ શુક્રવાર, તા.૧ નવેમ્બરના રોજ સવારે ૯ વાગ્યાથી મુલુંડ ખાતે 'રઘુવીર ફાઉન્ડેશન' ચોઈસ એક્ટીવીટી હોલ, ચોઈસ અંબે સાગર ટાવર, ભક્તિ માર્ગ, વર્ધમાન નગર સામે, જ્ઞાનસરિતા સ્કુલ પાસે, મુલુંડ (વેસ્ટ), સ્થળે યોજવામાં આવેલ છે. ચોપડા પૂજન સવારે ૯ કલાકથી, આરતી સવારે ૧૧ કલાકે, મહાપ્રસાદ ૧૨ વાગ્યાથી

૧.૩૦ ભાગ લેવા ઈચ્છુક જ્ઞાતિજનોએ ફક્ત પોતાના ચોપડા, આસન, નેપકીન તથા છેડા-છેડી લાવવાના રહેશે. પૂજાપો, આરતી તથા અન્ય સામગ્રી અને વ્યવસ્થા મુંબઈ મહાજનશ્રી દ્વારા કરવામાં આવશે.

વધુ વિગત અને નામ નોંધાવવા નીચેના વ્યક્તિઓનો સંપર્ક કરવા વિનંતી. સંજય કોટેયા-૯૮૧૯૯ ૮૫૬૦૯, પંકજ કારીયા-૯૦૨૨૯ ૯૪૫૭૫, દિલીપ સોમૈયા-૯૯૩૦૩ ૬૩૫૧૨, જતીન ચંદે-૯૮૨૦૩ ૮૩૬૩૭,

જીજ્ઞેશ માખેયા-૯૮૨૧૩ ૫૭૯૪૪, વિપુલ ઠક્કર-૯૮૧૯૪ ૯૪૦૪૧. નામ નોંધાવવાની છેલ્લી તારીખ અને સમય ગુરુવાર તા.૩૧ ઓક્ટોબર બપોરે ૧૨ વાગ્યા સુધી. આ પ્રથમ સામૂહિક ચોપડા પૂજનમાં વધારેમાં વધારે જ્ઞાતિ પરિવાર લાભ લે એવી મુંબઈ મહાજન પ્રમુખ નીતિન ગોદાવરીબેન ગંગારામ ઠક્કર (પાંધી) એ સૌ જ્ઞાતિ પરિવારોને વિનંતી કરી છે અને જણાવ્યું છે કે વહેલામાં વહેલી તકે પોતાના નામ નોંધાવી લેવા જેથી વ્યવસ્થાનો ભાગ જાળવી શકાય.

રાઈટ ટૂ શેલ્ટર (RTS) અને વાવીકર આઈ ઈન્સ્ટીટ્યૂટના સંયુક્ત ઉપક્રમથી મફત આંખ તપાસણી સહિત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

રહિવાસીઓની જરૂરિયાત સાથે જાહેર માંગને ધ્યાનમાં લઈ રાઈટ ટૂ શેલ્ટર તરફ તા.૨૬ ઓક્ટોબર (શનિવાર) ના રોજ મહાનગરપાલિકા કામગાર વસાહત પટાંગણ, મુલુંડ(પ.) સ્થળે મફત આંખ તપાસણી અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સંસ્થાના સંસ્થાપક/અધ્યક્ષ એડ.સંતોષ સાંજકર, શ્રી રામદેવપીર સત્સંગ સેવા મંડળ-મુલુંડના અધ્યક્ષ રામજી જેરામભાઈ કોળી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવાર ગટના મુલુંડ તાલુકા અધ્યક્ષ એડ. અમીત પાટીલ, સંતોષ ગાયકવાડ, ધનંજય પવાર,



મકસુદ શેખ, પ્રદીપ દરડો ઉપસ્થિત હતા. કાર્યક્રમને સફળ કરવા સંસ્થાના મુલુંડ તાલુકા સંપર્કપ્રમુખ દિનેશ રામજીભાઈ કોળી અને બાળા શિંદે, વિજયભાઈ કોઠારે એ જહેમત ઉઠાવી હતી.

[Click Here](#)

સંકલન: શાંતિલાલ નાકર

ચાલો કશેક જાત્રાએ જઈએ. સરલાના સૂચનને સૌએ એકી સૂરે વધાવી લીધું. એ તો કદીક જ્યારે વાત વણસે ત્યારે જ સરગમના સાતેય સૂર બેસૂરા થઈ તાલમેલ ભૂલી જેમતેમ વાગવા માટે બાકી તો 'સરગમ સખી સંઘ'ની સાતેય સખીઓ જ્યાં જોઈએ ત્યાં સાથેને સાથે હોય.

મારાં સાસુ જાત્રાએ જવાની ના નહીં પાડે, બાકી ફરવાનું નામ આવે તો એમનું મોહું વાંકુંયું થઈ જાય. વળી અચાનક માંદાય પડી જાય એ નકામો. રમીલાએ ટમકો મૂક્યો. મારે તો શ્રીનાથજી જવું છે. ત્યાં બાંધણી સસ્તી મળે હો. ગીતા ગણગણી. અને ત્યાંના કંદના ભજ્યા સાથે ઠંડાઈ અને મમતાના મોઢામાં પાણી આવ્યું. તો એક દ્રાઈવરવાળી મોટી ગાડી કરી લેઈએ? પદમાએ પૂછ્યું. તેની નાકમાંથી બોલવાની ટેવથી સૌ ટેવાઈ ગયા હતા. હાસ્તો વળી. રસ્તો લાંબો છે. કોણ શું નાસ્તો લેશે એ નક્કી કરી દો. ધ્વનિ બોલી.

દ્રાઈવર સહિત છ જણ સમાય તેવી ગાડીમાં સાતમી પાતળી નિશાએ વારાફરતી સખીઓના ખોળામાં બેસવું તેવું નક્કી થયું. તેના માટે બીજી ગાડી કરવાની જરૂર નહીં. આમ સરગમ સહેલી સંઘ બોલો શ્રીનાથજી બાવાની જય બોલાવી મોટી સુમોમાં જાત્રાએ નીકળ્યો. વડોદરા વટાવ્યું ત્યાં છેક પાછળ બેઠેલી મમતાએ આગળ ઊભેલી પપૈયાની લારી જોઈ બૂમો પાડી, ખડા રખો. ખડા રખો એ દ્રાઈવરભાઈ ગાડી ઊભી રખો. હમરેકું ઝાડના પાકેલા પપૈયા લેવાના હય. બહોત મસ્ત મીઠા દીખતા હય. સવારસે કુછ નહીં ખાયા. અલી, પપૈયા ખાઈખાઈને તું પપૈયું થઈ ગઈ છે. અહીં ચાલતી ગાડીએ વળી પપૈયા ક્યાંથી સમારાય. લે હું ચેવડો લાવી છું તે ફાકી જા. આગળ બ્રેકફાસ્ટનો બ્રેક લઈશું. મમતાનો મોટો અવાજ સાંભળી દ્રાઈવરે મોટી બ્રેક મારી. અંદર બેઠેલા સૌને આંચકો લાગ્યો. ખોળામાં બેઠેલી નિશા એક ફૂટ અધર ઉછળી.

મમતાડી, જ્યાં ને ત્યાં આમ ગાડી ઊભી ન રખાય. લે ત્યારે હવે હું ઘડીક તારા ખોળામાં બેસું. કહી નિશાએ ખોળો બદલ્યો. પેલાં ચેવડો ખાઈ લેવા દે. જો કે નામ મમતાનું અને કામ સહુનું. સૌએ ચેવડો ફાક્યો. થોડો ગાડીનેય ફાક્યો.

અરે, જરા ધીમે ચલાવ ભાઈ, સામેથી ટ્રક આવે છે. ધ્વનિનો તાર સમકે પહોંચેતો સૂર સાંભળી દ્રાઈવર બધવાયો. અરે અરે આવડી મોટી બસને ઓવરટેક ન કરતો. આપણી ગાડી ખાડામાં પડશે તો? ભાઈ, મારા વરની એકની એક છું હો. મને કંઈ થયું તો એ તને નહીં છોડે. સાંભળી દ્રાઈવરે ગંતવ્ય સ્થાને વેળાસર પહોંચવાની આશા છોડી દીધી. તેવામાં, દ્રાઈવર ભેંસ, ભેંસ, બ્રેક માર, બ્રેક માર. ધ્વનિએ છેક દ્રાઈવરના કાન પાસે તીણા સ્વરે પોકારો કર્યાં. શું હું ભેંસ છું? એમ કરો, ગાડી તમે ચલાવો, હું ઉતરી જઈ. દ્રાઈવર ગાડી રસ્તાની વચ્ચેવચ્ચ ઊભી રાખી હેઠે ઉતરી ગયો. પાછળ ટ્રાફિક જામ થવા માંડ્યો. બહાર હોર્નનો ઘોંઘાટ વધ્યો અને ગાડીની અંદર માનુનીઓનો.

અમે પૈસા આપ્યાં છે. તું સમજે છે શું તારા મનમાં હેં? સીધી રીતે ગાડી ચલાવ. જાજરમાન પદમાએ છોકરડા જેવા દ્રાઈવરને ડારો દીધો. પેલો વધુ બગડ્યો, કામના પૈસા લઉં છું. આવી દાદાગીરી નહીં ચાલે. પાછળના ગાડીવાળાએ એની પાછળની ગાડીઓએ કરેલા હોર્નના ઘોંઘાટને અનુલક્ષીને ઘટનાસ્થળે ધસી આવી દ્રાઈવરને માંડ શાંત પાડ્યો. ઝઘડો થાળે પડતાં સંઘ આગળ વધ્યો. વીસેક કિલોમીટર આગળ ગયા ત્યાં સરલાએ ગાડી થોભાવવાનું સૂચન કર્યું, અહીં તાજા પાપડ મઠીયા સરસ મળે છે. વળતાં સમય નહીં

હાસ્યકથા : સરગમ સખી સંઘ

મળે, જેને લેવા હોય તે લઈ લો. આવી રીતે તો રાત્રેય નહીં પહોંચીએ. દ્રાઈવરે બબડાટ કરવા માંડ્યો પણ તેનો બબડાટ સમૂહમાં બોલાયેલ, ગાડી ઊભી રાખના પ્રયંડ નાદમાં દબાઈ ગયો. બધાં નાનામોટા પેકેટો લઈ પરત ફર્યા ત્યાં મમતા ફરી ભૂખી થઈ ગઈ.

દ્રાઈવરભાઈ, આગળ જ્યાં મસ્ત હોટલ આવે ત્યાં ગાડી ઊભી રાખજે. તમારે તો બેલગાડીમાં જવું જોઈએ. કહી દ્રાઈવરે વીસની સ્પીડે કાર હાંકવા માંડી. તે થોડી થોડી વારે પૂછતો, ઊભી રાખું? જાણે તેના કાન ઊભી રાખ સાંભળવા આતુર હતા. અરે જરા ગાડી ભગાવ. આમ ધીમી હાંકે તે નહીં ચાલે. સરલાએ કડક અવાજે કહ્યું. નાસ્તાપાણી પતાવ્યા બાદ સંઘ આગળ વધ્યો. કેવા બેકાર આલુપરાઠા હતા. હું તો એમાં જરીક અજમો નાખું. મારા રમેશને અજમો જરાય ન ભાવે. ચાટ મસાલો નાખી જોજે, ટેસ્ટી લાગે. તે સરલાબેન, તમે બટાકા બાફો કે વધારો? બાફીને પછી વધારવાના. તમારા પતિની ચટણી બનાવવાની રીત કહોને.

વાનગીઓની રેસિપીઓ સતત સાંભળવા નહીં ટેવાયેલ દ્રાઈવર એવો કંટાળ્યો કે ડાબી તરફ ગાડી વાળવાને બદલે તે જમણે વળી ગયો. સરગમ સખી સંઘ બેસૂરા રાગે અંતકડી જમાવી. દ્રાઈવરે કાનમાં ડૂના પુમડાં ઘાલ્યા. તેવામાં સરલાનું ધ્યાન રસ્તા પરના માઈલસ્ટોન તરફ ગયું. આ કયો રસ્તો લીધો? આમાં તો ભાવનગર એકસો દસ કિ.મી. બતાવે છે. આપણે તો રાજસ્થાન બાજુનો રસ્તો પકડવાનો. ઊભી રાખ. ઊભી રાખ. સાંભળીને દ્રાઈવર ચમક્યો. તેનો પગ બ્રેક પર પડ્યો અને ગાડી એક ચીસ મારીને ઊભી રહી.

રસ્તો પૂછ. ફરી સરલાનો હુકમ છૂટે તે પહેલાં ઉતાવળી ગીતાએ રસ્તે ચાલતા રાહદારીને પૂછ્યું, નાથદ્વારા કઈ તરફ? પેલાએ કહ્યું, મને ગાડીમાં બેસાડો. મારેય જવું છે. દ્રાઈવર ગિત્ત્રાયો. એ પોતાની ભૂલ માનવા તૈયાર નહોતો, ગાડી મારે ચલાવવાની કે તમારે? આ શોર્ટકટ છે. બાકી તમે જાણો. ઉપાધિ થઈ પડી. સૌ રસ્તાથી અજાણ હતા માટે હવે વાહન ચાલક જે માર્ગે લઈ જાય તે માર્ગે આગળ વધવું તેવું લાંબી ચર્ચાને અંતે સર્વાનુમતે નક્કી થયું.

ચાલો ત્યારે ભાવનગરી ગાંઠીયાં અને મરચાં ખાઈને જ આગળ જઈએ. પદમાએ સૌના મોઢામાં પાણી લાવી દીધાં. ભાવનગર થઈને જવું છે? દ્રાઈવરે પૂછ્યું. ના ભાઈ ના. એમ કાંઈ મન ફાવે તે દિશામાં ન જવાય. કહી નિશાએ ટમકો મૂક્યો અને સંઘ આગળ વધ્યો. દ્રાઈવરે ચૂપચાપ રસ્તો બદલી પોતાની ભૂલ સુધારી તેવામાં ફરી કોરસમાં, ઊભી રાખ, ઊભી રાખ ગાળ્યું. હવે શું થયું? પૂછીને દ્રાઈવરે પોતાનું કપાળ ફૂટ્યું. અહીં મસ્ત કાઠિયાવાડી ભોજન મળે છે. ચાલો સૌ જમી લઈએ. સૌ ઢાબામાં જમીને એક કલાકે પરત ફર્યા.

પેટભરીને જમ્યા બાદ સૌ ઝોકે ચડ્યા. ગાડીમાં થતા સતત કલબલાટમાં બ્રેક પડવાથી દ્રાઈવરનુંય મગજ શાંત પડ્યું. તેણે ગાફેલપણે ગાડી દોડાવી મૂકી. માર્ગમાં અચાનક સ્પીડ બ્રેકર આવતાં ગાડી ત્રણ ફૂટ ઉછળી. ઓહલ સરગમના સાતેય સૂરોમાંથી એક સરખું સંગીત વાગ્યું. ખોળામાં બેઠેલી નિશાનું માથું ગાડીની છત સાથે ભટકાયું. તેણે ઊહલહલ આહલહલ જેવા આતંકિત સ્વરો રેલાવ્યા. અલ્યા ડોબા દ્રાઈવર, તું અમને ઉપર પહોંચાડીને જ છોડીશ. આવી રીતે ગાડી ચલાવાય? આગળ દેખતો નથી આવડો મોટો બમ્પ છે તે? બધી જ માસીઓ, સોરી બહેનો બીચારા દ્રાઈવર

પર તૂટી પડી. દ્રાઈવર ગભરાઈને ગાડી ખોલીને નીચે ઉતરી પડ્યો, મારાથી ગાડી નહીં ચલાવાય. કોઈ બીજો દ્રાઈવર શોધી લો. લે, એમ અધવચ્ચે તારાથી અમને ન છોડાય. શરમ બરમ છે કે નહીં? સામસામી તડાફડી ફૂટ્યા બાદ સમાધાન થયું અને સંઘ આગળ વધ્યો.

થોડે આગળ જતાં સમજુ દ્રાઈવરે કોઈનાય કીધાં વગર જાતે પોતે ગાડી ઊભી રાખી, અહીં પાણી ભરવાના માટલા સરસ મળે. લઈ લો. હવે દ્રાઈવરે આન્ટીઓની રગ પારખી લીધી હતી. દરેકે માટલા ખરીદ્યા પણ રાખવા ક્યાં? અમુક માટલા પગ નીચે અને અમુક ખોળામાં ગોઠવાયા. પાટલી વેલણ લેવા છે? દ્રાઈવરે પૂછ્યું. સસ્તાય હશે નહીં? દ્રાઈવરનું મોટેથી હાથાઆથા કહેતાં ગાડી આપોઆપ ઊભી રહી ગઈ. ઉતાવળે ઉતરવા જતાં રસીલાનું માટલું અફળાઈને તૂટ્યું. અલી જરી હળવેકથી નથી ઉતરાતું? આ તો ગયું. મારે વળતાં બીજું માટલું લેવું પડશે. રસીલાએ ડૂસકું ભર્યું. નવેનવું માટલું તૂટી ગયું તેના શોકને સરભર કરવા તેણે બે નવી પાટલીઓ ખરીદી લીધી. દ્રાઈવરભાઈ, ઊપર કેરિયર બાંધ. આ પાટલીઓ મૂકવી પડશે. સરલાબેને હુકમ છોડ્યો. કેરિયર નથી. એ માટે તમારે પહેલેથી કહેવું પડે. ઠસોઠસ ભરેલી ગાડી ચલાવતા દ્રાઈવરને થયું, હું જ ઉપર ચડી જઈ અને પછી શાહરૂખની માફક ચલ છૈયાં છૈયાં કરતો નાચું. જો કે તેણે એવું કહેવાની હિંમત ન કરી.

જેમ તેમ કરીને પાટલીઓ માટે જમ્યા કરાઈ. રાત્રે સૌ નાથદ્વારા પહોંચ્યા ત્યારે થાકીને ઠૂસ થયેલાં મંદિરના દ્વાર બંધ થઈ ગયા હોવાથી બીજા દિવસે દર્શન કરવા જવું તેવું વિચારી સૌ પોઢી ગયા.

ઉઠતાંવેત મમતાએ ફુદીનાવાળી મસાલા ચા સાથે ગરમાગરમ જલેબી, પૌઆ આરોગવાની દરખાસ્ત મૂકી. તેને ન્યાય આપ્યા બાદ સૌ હવેલીની બહાર લાઈનમાં ઊભા રહ્યાં. ઓહલ, લાઈન તો ઘણી લાંબી છે. બે કલાકેય વારો નહીં આવે. દર્શન તો પછીયે થશે. ચાલો બજારમાં સહેજ આંટો મારી આવીએ. નિશાના સૂચનને સૌએ સહર્ષ સ્વીકારી લીધું. એક પછી એક સાડીની દુકાનો આ મુલાકાતીઓને આવકારતી રહી. હોંશે હોંશે સાડીઓ, ચણિયાઓ ખરીદાતી રહી. બપોરે જમીને સૌ આડા પડ્યા. ઉઠીને દર્શન માટે મંદિરે જવાનું વિચારેલું પરંતુ

ચા તો પીવી જ પડશે નહીંતર માથું ચડે. કહેતી પદમા ચા સાથે પ્રસરતી રતાળુના ભજ્યાની સુગંધને કેમેય કરીને ટાળી ન શકી. સૌ એની પાછળ ખેંચાયા. ત્યાંતો આ સાડીમાં તો કાણા છે. મમતાને બદલાવવાની તાતી જરૂર ઊભી થઈ. હું એકાદી સાડી મારા સાસુ માટે લઈ લઉં. લીધા વગર જઈશ તો એમનું મોહું ચઢી જશે. રસીલાએ રસ વગર કહ્યું. જો કે, સરગમ સખી સંઘ જ્યાં જાય ત્યાં સાથે જાય માટે સૌ પ્રભુદર્શનના ક્ષણિક લાભને જતો કરી, શાશ્વત સુખ મેળવવા બજારમાં પહોંચ્યા. લાંબી માથાફૂટ, ભાવમાં રકઝક અને નવેસરથી સાડીઓ ઉથલાવ્યા બાદ, એ મહાન કામ પતાવી સખીઓ દુકાનની ઝકઝમાળમાંથી બહાર નીકળી ત્યારે અંધારું ઉતરી આવેલું.

જમી લઈએ. મને તો ભૂખ લાગી છે. મારાથી લાંબી લાઈનમાં ઊભા નહીં રહેવાય. તમે બધા જાઓ. મમતાએ મમરો મૂક્યો.

ના. ના. કાલે વહેલી પરોઢે મંગળાના દર્શન કરીશું. એમ કોઈને એકલું ન મૂકાય. નિશાએ કહ્યું. રાઈટ યુ આર. કહી સૌ ગરમાગરમ ભાણું પીરસાવાની રાહ



જોતા બેઠાં તે પહેલાં સાઈઝ, ભાવ, કલર, ડિઝાઈન વગેરેની માથાફૂટ બાદ, રંગબેરંગી બંગડીઓની ખરીદીના ભગીરથ કાર્યનું પણ સમાપન કરાયું.

કોઈની બેગમાં થોડી જમ્યા છે? પૂછતી નિશાને બધા એવી રીતે તાકી રહ્યા જાણે તેણે મોટું પાપ કર્યું હોય. રસીલા બેગની ઉપર બેસી ગઈ. તેણે બેગમાં દબાવીને સાડીઓ ભરી. અંદર ચૂપચાપ પડી ન રહેવા માંગતા કપડાએ બેગ બહાર ડોકાં કાઢ્યા. તોફાની બાળકોને અંદર પૂરતી હોય તેમ રસીલાએ પરાણે તેમને અંદર ધકેલ્યા. બેગને માહું લાગ્યું અને તેની ચેન પકડ ગુમાવી લટકી પડી. હવે બેગ બંધ થવાને બદલે રિસાઈ અને રસીલા મુંઝાઈ. દ્રાઈવરભાઈ, રસ્સી હોય તો આપો. બેગને બાંધવી પડશે. સાંભળી દ્રાઈવર બોલ્યો, હજુય અંદર જેટલું ડાંસવું હોય તેટલું ડૂંસો પછી જ બાંધું. આમેય રસ્સીઓ હોલસેલમાં લાવવી પડશે. બધાની બેગો ગાડીમાં ગોઠવી આપીશ અને પછી સૌ તેની ઉપર બેસજો.

બીજા દિવસની પ્રભાતે સૌ ઊઠીને પરવાર્યા તે સમયે દર્શન માટેના કમાડ બંધ થઈ ગયા હતાં. ફુદીનો લેવાનો તો રહી જ ગયો. અહીંના ફુદીનામાં સરસ સુગંધ હોય છે. મારે ફૂંડામાં રોપવો છે. નિશા બોલી. એમ? તો તો હુંય લઈ લઉં. ધ્વનિએ સાદ પૂરાવ્યો તેમાં બધા જોડાયા. ફુદીનાની હોલસેલ ખરીદી કરાઈ.

આપણે હવેલી ક્યારે જઈશું? ભગવાનની ઈચ્છા હોય તો જ એ દર્શન આપે. એમ કાંઈ જાત્રા કરવી સહેલી છે? દ્રાઈવરભાઈ બપોરે જમીને પછી નીકળીએ. દર્શન કરવાના તો બાકી છે. તો તમારે વધુ એક દિવસનું ભાડું આપવું પડશે. ડબલ ભાડું ઓછું ચૂકવાય? મેં તો વળી ઘરે કીધું છે કે સાંજ લગીને પાછી આવી જઈશ તો ઘરમાં બધા ચિંતા કરશે. અને મારે તો ઘરે જઈને રાંધવાનું છે. એ તો ભઈ હરિ ઈચ્છા. આવતા વખતે ફરી વધુ સમય લઈને આવીશું. દ્રાઈવરની વાત તો સાચી છે.

છેવટે હવેલી દર્શનનો લાભ મોકૂફ રાખી સૌ ગાડીમાં ગોઠવાયા. ટુવાલ, સાડીઓથી ફાટફાટ થતી બેગો પર માનુનીઓએ બેઠક જમાવી. હાથમાં ફુદીનાની ઝૂડીઓ ઝાલી. પપૈયા ભરેલા માટલા સીટ નીચે ગોઠવાયા તેની પર પગ લાંબા પહોળા કરાયા. પાટલી વેલણ વચ્ચેની જમ્યામાં રખાયા. ગાડીમાં બિરાજમાન સરગમ સખી સંઘે વડોદરા તરફ પ્રસ્થાન કર્યું. આજુબાજુથી પસાર થતા લોકોને, માણસ વગરની ફુદીનો ભરેલી સુમો ગાડી જતી જોઈ નવાઈ લાગી.

સહેજ આગળ વધ્યા ત્યાં તો ટાયરમાં પંકચર પડ્યું. હાય હાય, આના કરતાં દર્શન કરીને નીકળ્યા હોત તો આમ અડધે રસ્તે ખોટી થવું ન પડત. મમતા બોલી. આમ ગાડી વારંવાર જમવા, ચા પીવા, સસ્તા ભીંડા લેવા ડચકા ખાતી ખાતી આગળ વધતી રહી. છેવટે મોડી સાંજે સૌ હાશ કરતા પોતપોતાને ઘરેપહોંચ્યા. કેવી રહી તમારી જાત્રા? રમીલાના સાસુએ ઉલટભેર સવાલ કર્યો. હાય હાય. રજાઈઓ લેવાની તો રહી જ ગઈ. શ્રીનાથજીના દર્શન કરવાનું બાકી રહી ગયું તેનો ફોડ રમીલા સહિત એકેય સખીએ ન પાડ્યો.

(લેખિકા સુષમા શેઠનો આભાર)

Click Here



માપ સૌને
શુભ અને સમૃદ્ધ
દિવાળીની શુભકામનાઓ
અને નૂતન વર્ષામિનંદન



ALAG
Spaces with a difference

અલગ પ્રોપર્ટી
અલગ પ્રોપર્ટીના નિર્માણ હોય સૌથી અલગ

[Click Here](#)

જૈન સોશ્યલ ગ્રુપ-મુલુંડ દ્વારા શરદોત્સવમાં છવાયો આનંદ ઉત્સાહ અને ઉમંગનો રંગ

જૈન સોશ્યલ ગ્રુપ આયોજિત શરદોત્સવ શુક્રવાર તા.૨૫ ઓક્ટોબર સાંજે ૫ થી ૯ વાગ્યા સુધી સારસ્વત વાડી મુલુંડ વેસ્ટ ખાતે સર્વે સભ્ય મિત્રો માટે આયોજન કરવામાં આવ્યું હતું.

કિનાબેન હરિયા તેમજ સાથી કલાકારોએ ગીત સંગીત રાસ-ગરબાની રમઝટથી ધૂમ મચાવી સૌ સભ્યો સુર તાલના સથવારે ઝૂમી ઉઠ્યા હતા જેનાથી શરદ પૂનમની જાણે ચાંદની ખીલી હતી.

સિનિયર સિટીઝન મેમ્બર પણ ખૂબ સજી ઘણને આવ્યા અને રાસ રમ્યા હતા. રાસ ગરબા રાઉન્ડ, મટુકડી રાઉન્ડ, ડાંડિયારાસ રાઉન્ડ સાથે ઘણા બધા બેસ્ટ કપલ, બેસ્ટ ટ્રેસ, બેસ્ટ મેલ ફિમેલ મટુકડી તેમજ જીજ્ઞસ તરફથી સ્પેશિયલ બેસ્ટ ઓલ રાઉન્ડર કપલનું પ્રાઇસ રાખવામાં આવેલ હતું.

આ કાર્યક્રમની પ્રતિયોગિતા માટે માનનીય જીજ્ઞસ શ્રીમતી ચાંદનીબેન લાલકા (વાશી)



તેમજ મુલુંડના યોગેશભાઈ અને ડૉ.ચાંદલબેન શાહ પધાર્યા હતા. આ કાર્યક્રમમાં સોનામાં

સુગંધ રૂપી ભાજપા વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર શ્રી મિહિર કોટેયા જેમણે હંમેશા મુલુંડ

નિવાસીઓનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે તેમની સાથે નગર સેવિકા શ્રીમતી સમીતાબેન કાંબલે કાર્યક્રમમાં હાજરી આપી હતી. બંનેનું સન્માન કરવામાં આવ્યું હતું અને જૈન સોશિયલ ગ્રુપના સર્વે મત તમારી સાથે છે એવી બાંધધરી આપવામાં આવી હતી.

કાર્યક્રમના શુભેચ્છા દાતા (ઇટા ગ્રુપ)ના શ્રીમાન/શ્રીમતી બટુકભાઈ અને મુદ્દલાબેન શાહ તેમજ (પ્રહાન હોલિડેઝ)ના શ્રી પ્રતિકભાઈ દવેનું તેમના સાથ સહકાર બદલ મોમેન્ટો આપીને અભિવાદન કરવામાં આવેલ હતું. શરદ પૂનમના દૂધપૌવા, કેરી પત્રા, ચાટ કાઉન્ટર, ટેસ્ટી ફસ્ટફૂડ તેમજ આઈસક્રીમ અને



આઈસ ગોલા મેલાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ રંગા રંગ કાર્યક્રમને જૈન સોશ્યલ ગ્રુપ મુલુંડના પ્રમુખ જયંતીભાઈ મેશેરી તેમની સમગ્ર ટીમ અને સૌ મેમ્બર્સ એ સાથે મળીને એ યશસ્વી બનાવ્યું.

દિવાળી નિમિત્તે નવા મેમ્બરોને વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જયંતીભાઈ મેશેરી-પ્રમુખ, દિલીપભાઈ શેઠ, ડિમ્પલબેન કોરડિયા માનદ્ મંત્રી, ટીમ JSG મુલુંડ

સરદાર પ્રતાપ સિંહ ગાર્ડનમાં મોર્નિંગ વોક સાથે મિહિર કોટેયાએ તાજગીભર્યું જનસંપર્ક અભિયાન શરૂ કર્યું



મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિના ઉમેદવાર તરીકે પસંદગી થયેલ વિધાનસભ્ય મિહિર કોટેયાએ પ્રચારકાર્ય માટે જનસંપર્ક અભિયાન શરૂ કરી દીધું છે અને મુલુંડના વિવિધ સ્થળોની મુલાકાત લેવાનો

પ્રારંભ કરી દીધો છે. તા.૨૬ ઓક્ટોબર શનિવારે સવારે મિહિર કોટેયાએ મુલુંડ વેસ્ટમાં આવેલા સરદાર પ્રતાપ સિંહ ગાર્ડનની મુલાકાત લીધી હતી અને મોર્નિંગ વોક કરવા



આવેલા અસંખ્ય હેલ્થ કોન્સલ્સ લોકોની સાથે વાર્તાલાપ કર્યો હતો. કે છેલ્લા પાંચ વર્ષો દરમિયાન મેં મોર્નિંગ વોક માટે આવેલા લોકોમાં અબાલવૃદ્ધ અને યુવાનો સહિતના સૌ કોઈ સામેલ હતા. પોતાના ચૂંટણીપ્રચારનો આરંભ કરતાં

મિહિર કોટેયાએ જણાવ્યું હતું મુલુંડ તથા મુંબઈના વિકાસ માટે સતત કામ કર્યું છે. તેમણે કહ્યું હતું કે બર્ડ પાર્ક, મુલુંડ ટર્મિનસ અને સંજય ગાંધી નેશનલ પાર્કના રોપ



વે સહિતના અનેક પ્રોજેક્ટ્સ મારે આગામી સમયમાં પૂરાં કરાવવાના છે. ગાર્ડનમાં ઉપસ્થિત લોકોએ પણ મિહિર કોટેયાની ઉમેદવારીને વધાવી લીધી હતી અને એમને અભિનંદન આપ્યા હતા તેમ જ

ચૂંટણીમાં ભવ્ય વિજય મળે એવી શુભેચ્છા પાઠવી હતી. મિહિર કોટેયાએ એમ પણ કહ્યું હતું કે પ્રજાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેતાગીરીમાં વિશ્વાસ મુક્યો છે અને મને આશીર્વાદ આપ્યા છે.

[Click Here](#)

मुलुंड सेवा संघ आयोजित

सप्तसुरांची

संगीतमय व
प्रकाशमय

गुरुवार नरक चतुर्दशी

३१ ऑक्टोबर २०२४,
सकाळी ६.३० वा.

कालिदास नाट्यमंदिर, मुलुंड (प.)

दिवाळी पहाट

धुंद निर्मित, मराठी वाद्यवृंद

"स्वरतरंग" निवेदन - अनघा मोडक

निमंत्रक - सुशांत बर्वे संगीत संयोजन - अंकुश हाडवळे

गायक - वृशाली घाणेकर, निखिल नेवाळकर, सुवर्णा शेळके, शशी मुंबरे

आयोजक : प्रकाश गंगाधरे (अध्यक्ष - मुलुंड सेवा संघ)

पासेससाठी संपर्क : 1) 'श्री' सोसायटी, गणेश गावडे रोड, मुलुंड (प.), 2) मुलुंड सेवा संघ कार्यालय, गवाणपाडा - फायर ब्रिगेड समोर, मुलुंड (पू.)

संपर्क : 9820026347 [f](#) [t](#) [i](#) GangadhareBJP [w](#) www.prakashgandhare.com

WE WISHES YOU HAPPY DIWALI

SARVSHUBH
ENTERPRISES205/2nd Floor, Datta Vijay - Commercial Wing, Opp. Deshmukh Garden,
Mahatma Phule Marg, Mulund East, Mumbai - 400081.
sarvshubhenterprises@gmail.com

Click Here

SAFT STONE
get stoned on fruits

Diwali Special Offer!



Show us a photo of this ad and get 20% off on ice-cream tubs of 300 gms!!

*Valid from 29th October '24 to 3rd November '24 only in store.

VISIT OUR STORE

Shop no 5, Sai Madhuvan, Next to Mani's Cafe, Junction of S.L Road and R.H.B road, Mulund (W), Mumbai-400080

AVAILABLE ON



For trade inquiries:
Kamlesh Foods (P) Limited
Unit No. 52/53/56, Jamnadas, Indl. Estate, Dr. R.P Road, Mulund (West).
E : info@kamleshnamkeens.com

Premium Namkeen Gift Hampers
Imprint your logo in case of bulk order*
80 9131 9131
www.namkeenhardin.com



DOCTOR KAPOTE
Un-Patient Yourself
NABL Accredited Laboratory

Apollo Clinic
MULUND

એપોલો હેલ્થ ટોટલ ચેક

અમારા સર્વોચ્ચ રેટ કરાયેલા અને ખૂબ જ કિંદાયતી સંપૂર્ણ શારીરિક તપાસ વડે તમારું શ્રેષ્ઠ સ્વાસ્થ્ય જાળવો!

પેથોલોજી પરીક્ષણો

- સીબીસી
- ટ્રાઇગ્લિસેરાઇડ્સ (ખરાબ / બિનઆરોગ્યપ્રદ કોલેસ્ટ્રોલ તપાસવા માટે)
- એસજીઓટી
- એસજીપીટી (લીવરના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવા માટેના પરીક્ષણો)
- થુરિક એસિડ
- વિટામિન B12
- વિટામિન ડી
- Hba1C** (ડાયાબિટીસ માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ. 3 મહિનાનું સરેરાશ બ્લડ સુગર રીકોર્ડિંગ આપે છે)
- TSH (થાઇરોઇડ માટે પરીક્ષણ) - 25

ડાયગ્નોસ્ટિક

- છાતીનો એક્સ-રે (છાતીની સમસ્યાઓ / એલર્જી / હૃદયની સાઈઝ તપાસવા માટે)
- ECG (હૃદયનું મૂલ્યાંકન કરવા માટે)

~~₹6070/-~~

30 પરીક્ષણો અને નિષ્ણાત ફીઝિશિયન સાથે કન્સલ્ટેશન ફક્ત

₹2500/-

અમારી ઓફર્સ

- દર બુધવાર અને શુક્રવારે અમે તમામ ઇનહાઉસ બ્લડ ટેસ્ટ પર ફ્લેટ 25% અને ECG, ટ્રેડમિલ ટેસ્ટ (સ્ટ્રેસ ટેસ્ટ), ફિઝિશિયન કન્સલ્ટેશન પર સવારે 10 થી 12 વાગ્યા વચ્ચે 20% ઓફર કરીએ છીએ.
- 60 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો માટે અમે સોમવારથી શુક્રવાર દરરોજ સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી ઇનહાઉસ બ્લડ ટેસ્ટ + ડાયગ્નોસ્ટિક્સ પર ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ ઓફર કરીએ છીએ.

આ ઓફર્સની વાત તમારું માટે એપોલો કોનિગર-ને મુલાકાત લો

- અમારી સેવાઓ**
- NABL માન્યતા પ્રાપ્ત પેથોલોજી
 - હોમ બ્લડ કલેક્શન
 - ડિજિટલ એક્સ-રે
 - સોનોગ્રાફી
 - ફેકુસાના કાર્યનું પરીક્ષણ
 - મેમોગ્રાફી
 - પલ્મોનરી ફંક્શન ટેસ્ટ
 - સ્તન કેન્સરની તપાસણી માટે
 - સ્ટ્રેસ ટેસ્ટ
 - ઇસીજી
 - 2D ECHO અને કલર ડોપ્લર
 - સંપૂર્ણ આરોગ્યની તપાસણી

- કોપોરિટ ચેક-અપ જનરલ ફિઝિશિયન
- શ્રવણશક્તિની તપાસણી
 - દંત ચિકિત્સા
 - ઓપીજી

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો:

022 - 3196 7276 82914 69999

એફ-વગ, ફર્સ્ટ ફ્લોર, 118, 119, 120, મેરેથોન મોન્ટે 9 પ્લાઝા, મદન મોહન માલવીયા રોડ, અચીજા રેસ્ટોરન્ટની ઉપર મુલુંડ વેસ્ટ, મુંબઈ 400 080



અમારું LOCATION જાણવા માટે QR કોડ સ્કેન કરો

Click Here